


ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના તા.૩૧-૦૩-૨૦૨૩ના રોજ પુરા થયેલ વર્ષ દરમિયાન ની કામગીરી અંગેનો સરકારનો અહેવાલ અને વાર્ષિક હિસાબો ની સમીક્ષા

- (૧) આ નિગમની સ્થાપના ૧૯૫૬ના કંપની ધારાની જોગવાઈઓ હેઠળ તારીખ:- ૧૬-૦૪-૧૯૭૫ના રોજ થયેલ છે અને ધંધાકીય કામકાજ તા.૧૫-૧૧-૧૯૭૫ થી શરૂ કરેલ છે.
- (૨) નિગમની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ તેના મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં દર્શાવ્યા મુજબ ખેડૂતોને સારી ગુણવત્તા ધરાવતું બીજ વ્યાજબી ભાવથી સમયસર અને પૂરતા પ્રમાણમાં આપવાનો ઉદ્દેશ રહેલો છે. તેમજ રાજ્યમાં બીજ ઉદ્યોગનો વિકાસ થાય તેવા પગલાં ભરવાનો મુખ્ય ઉદ્દેશ રહેલ છે.
- (૩) અહેવાલના વર્ષ દરમિયાન નિગમનું અધિકૃત શેર ભંડોળ રૂ.૪૦૦ લાખ છે. જ્યારે ભરપાઈ થયેલી શેરમૂડી રૂ.૩૯૩ લાખની છે જે પૈકી રૂ.૩૭૫ લાખ રાજ્ય સરકારશ્રી અને રૂ.૧૮ લાખનો શેરફાળો કેન્દ્ર સરકારશ્રીએ ધારણ કરેલ છે.
- (૪) નિગમે ૨૦૨૨-૨૩ દરમિયાન જુદી-જુદી જાતના ૨,૪૯,૩૨૨.૯૯ કિલોન્ટલ બિયારણનું વેચાણ કરેલ છે.
- (૫) નિગમે અહેવાલના વર્ષ દરમિયાન રૂ. ૧૯૩૪.૯૯ લાખનો ચોખ્ખો નફો (ટેક્સ પછી) કરેલ છે
- (૬) આ સાથે રજુ કરેલ નિગમના તા.૩૧-૦૩-૨૦૨૩ના રોજ પુરા થતાં સમયના વાર્ષિક અહેવાલમાં સરવૈયું, નફા-નુકશાન ખાતું અને ઓડીટ અહેવાલ વગેરે આપવામાં આવે છે.
- (૭) નિગમના તા. ૩૧-૦૩-૨૦૨૩ના રોજ પુરા થયેલ સમય હિસાબો મેસર્સ મુકેશકુમાર જૈન એન્ડ કંપની, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, અમદાવાદે ઓડીટ કરેલ છે.




Additional Chief Secretary
 Govt. of Gujarat
 Agriculture, Farmers Welfare & Co-Operation Department
 Sachivalay, Gandhinagar

૪૭^{મો}

વાર્ષિક અહેવાલ અને
હિસાબો ૨૦૨૨-૨૩



ગુસાબાંતિ®

ગુજરાત રાજ્ય બીજ
નિગમ લિમિટેડ

વિષય સૂચિ

ક્રમ નં.	વિગત	પેજ નં.
૧	કંપનીની માહિતી	૨
૨	નિયામકોનો અહેવાલ	૩
૩	કોર્પોલર અને ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયાની ટીકા-ટીપ્પણી	૧૨
૪	ઓડિટરનો અહેવાલ	૧૩
૫	સરવૈયું	૨૫
૬	નફા-નુકશાન પત્રક	૨૬
૭	રોકડ પ્રવાહ પત્રક	૨૮
૮	નાણાંકીય પત્રકોને લગતી નોંધ	૩૨

(મૂળ અંગ્રેજી અહેવાલ પરથી ગુજરાતી અનુવાદ)
(અંગ્રેજી સાથે વિસંગતતાના કિસ્સામાં અંગ્રેજી અહેવાલની વિગતો માન્ય રહેશે)

કંપનીની જાણકારી

(તા. ૩૧.૦૩.૨૦૨૩ ના રોજ)

અધ્યક્ષ:

શ્રી મનીષ ભારદ્વાજ, IAS
શ્રી મુકેશ પુરી, IAS

૦૭.૧૧.૨૦૨૦ થી ૨૬.૦૪.૨૦૨૨
૨૬.૦૪.૨૦૨૨ થી અત્યાર સુધી

વહીવટી નિયામક:

શ્રી પી. એસ. રબારી

૦૫.૧૨.૨૦૨૦ થી અત્યાર સુધી

નિયામક:

ડો. પી. એમ. વઘાસિયા
કુ. કાનન એચ. પંડ્યા
શ્રી ડી. બી. નિમાવત
ડૉ. કે. બી. કંથારીયા
શ્રી એસ. જે. સોલંકી
શ્રી ચમલ વ્યાસ (સ્વતંત્ર નિયામક)

૧૨.૦૧.૨૦૧૮ થી અત્યાર સુધી
૧૭.૧૦.૨૦૨૦ થી અત્યાર સુધી
૨૭.૧૦.૨૦૨૦ થી અત્યાર સુધી
૧૮.૧૧.૨૦૨૧ થી અત્યાર સુધી
૨૨.૦૧.૨૦૨૨ થી અત્યાર સુધી
૧૧.૧૦.૨૦૨૨ થી અત્યાર સુધી

મેનેજર (નાણા):

શ્રી એસ.એન.દેવડા

કંપની સેક્રેટરી:

શ્રી કે.એમ.રાવલ

ઓડીટર્સ:

મુકેશકુમાર જૈન એન્ડ કું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ, અમદાવાદ

બેંકર્સ:

પંજાબ નેશનલ બેંક

રજીસ્ટર્ડ ઓફિસ:

“બીજ ભવન”, સેક્ટર- ૧૦-એ.
ગાંધીનગર- ૩૮૨૦૧૦, ગુજરાત

વેબસાઈટ:

www.gurabini.com

કંપનીનો નોંધણી નંબર:

U65410GJ1975SGC002693

નિયામકોનો અહેવાલ

પ્રતિ,
સભ્યશ્રીઓ,

તા. ૩૧મી માર્ચ, ૨૦૨૩ ના રોજ પૂરા થયેલા વર્ષના ઓડિટ કરેલા પત્રકો સાથે ૪૭મો વાર્ષિક અહેવાલ રજૂ કરતાં નિયામકોને આંનદ થાય છે.

શેર મુડી :

૩૧મી માર્ચ, ૨૦૨૩ ના રોજ ભરાયેલી ઇક્વિટી શેરમુડી ₹ ૩૯૩ લાખ હતી, ગુજરાત સરકારે ₹ ૩૭૫ લાખનો ફાળો આપ્યો છે અને ₹ ૧૮ લાખ ભારત સરકાર પાસેથી છે.

નાણાંકીય પરિણામ :

(₹ લાખમાં)

વિગત	૨૦૨૨-૨૦૨૩	૨૦૨૧-૨૦૨૨
બાદ : ઘસારા અને કરવેરા પહેલાનો નફો	૨૭૩૪.૭૮	૩૪૪૪.૬૧
બાદ : ઘસારો	(૧૫૦.૭૧)	(૧૭૬.૫૮)
બાદ : કરવેરા અને ડીવિડંડ પહેલાનો નફો	૨૫૮૪.૦૭	૩૨૬૮.૦૩
બાદ : કરવેરા માટે જોગવાઈ	(૬૪૯.૦૮)	(૮૯૭.૪૦)
બાદ : વિનિયોગ માટે ઉપલબ્ધ પુરાંત	૧૯૩૪.૯૯	૨૩૭૦.૬૩
બાદ : ચુકવેલ ડિવિડંડ અને ડિવિડંડ પર કર	(૩૯.૩૦)	(૩૯.૩૦)
બાદ : નિર્ધારિત લાભ યોજનાનું પુનઃ માપન	૪૮.૩૪	(૪.૮૭)
બાદ : સામાન્ય અનામત ખાતે તબદીલ	૧૯૪૪.૦૩	૨૩૨૬.૪૬

ડિવિડંડ :

નિગમના નિયામક મંડળને તા. ૩૧મી માર્ચ, ૨૦૨૩ ના રોજ પુરા થતાં વર્ષ માટે ₹ ૩૯૩ લાખની ભરાયેલી ઇક્વિટી શેરમુડી ટીઠ ₹ ૧૫૧/- (એટલે કે ૧૫૧%) લેખે ડીવિડંડની ભલામણ કરતાં આંનદ થાય છે.

ઉત્પાદન અને વેચાણ :

નિગમ તેલીબીયાં, અનાજ, રોકડીયા પાક, કથોળ, મસાલા વગેરે માટે આશરે ૧૦૧ જાતોના ૨૪થી વધુ પાકોમાં ખેડૂતોના ખેતર પર ઉત્પાદન કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. નિગમે ગયા વર્ષ દરમિયાન ₹ ૧૬,૦૯૮.૬૨ લાખની રકમના ઉત્પાદન કરેલા/પ્રાપ્ત કરેલા ૨,૯૦,૯૯૧.૪૯ કિલોગ્રામ બિયારણ સામે, અહેવાલના વર્ષ દરમિયાન ₹ ૧૬,૮૬૯.૦૭ લાખની રકમના ૨,૭૧,૨૭૬.૦૨ કિલોગ્રામ બિયારણ ઉત્પાદિત/પ્રાપ્ત કર્યું છે. નિગમે ગયા વર્ષ દરમિયાન વેચેલા ₹ ૨૦,૫૮૧.૪૯ લાખની રકમના ૨,૮૫,૮૮૨.૧૨ કિલોગ્રામ બિયારણ સામે, વર્ષ દરમિયાન ₹ ૧૯,૬૯૦.૫૩ લાખની રકમનું ૨,૪૯,૩૨૨.૯૯ કિલોગ્રામ બિયારણ વેચ્યું છે.

ગુણવત્તા નિયંત્રણ :

આંતરીક ગુણવત્તા તંત્ર - રચના ખાતે બિયારણના નમૂનાની ચકાસણી સરળ બનાવવા માટે ગુજરાત રાજ્ય બીજ નિગમ પાસે ગાંધીનગર ખાતે પોતાની બીજ ચકાસણી પ્રયોગશાળા છે. ખેડૂતોને માત્ર સારી ગુણવત્તાવાળું જ બિયારણ પુરુ પાડવાનું સુનિશ્ચિત કરવા માટે નિગમનો ગુણવત્તા નિયંત્રણ કર્મચારી વર્ગ, ખેતર તબક્કે અને પ્રક્રિયા/પેકિંગ તબક્કે અને સંગ્રહના સમયગાળા દરમિયાન ગુણવત્તા નિયંત્રણ ઉપાયો કરે છે.

બજાર વ્યવસ્થા અને પેકિંગ :-

આગલા વર્ષ દરમિયાનના ₹ ૨૭૬.૪૩ લાખ સામે નિગમે, અહેવાલના સમયગાળા દરમિયાન ₹ ૧.૭૯ લાખની કિંમતનું બિયારણ રાજ્ય બહાર વેચ્યું છે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ૨૯ વિતરકો ઉપરાંત રાજ્યમાં બિયારણના વિતરણ માટે ૧૪૮૧ થી વધુ વેપારીઓનું વ્યવસ્થાતંત્ર છે. તાલુકા અને જિલ્લા સહકારી ખરીદ અને વેચાણ સંઘ, ખાનગી એજન્સીઓનો સમાવેશ થાય છે.

નિયંત્રિત/સંયુક્ત સાહસ / સાથી કંપની અંગેની માહિતી :

નિગમ પાસે કોઈ નિયંત્રિત, સંયુક્ત સાહસ કે સાથી કંપની નથી.

મહત્વના ફેરફાર અને પ્રતિબદ્ધતાઓ :

આ અહેવાલની તારીખે, આ નાણાંકીય પત્રકને સબંધ છે તે નાણાંકીય વર્ષના અંતે વચ્ચે નિગમની નાણાંકીય સ્થિતિને અસર કરનાર કોઈ મહત્વના ફેરફાર કે જવાબદારી થયેલી નથી.

વાર્ષિક નિયત પત્રકની તારીખની :

કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૯૨(૩) અને કંપની (વ્યવસ્થા અને વહીવટ) નિયમો, ૨૦૧૪ના નિયમ ૧૨(૧) હેઠળ જરૂરી છે તે પ્રમાણે, આપના વાંચન અને માહિતી માટે વાર્ષિક નિયત-પત્રકની તારીખ, www.gurabini.com પર મુકેલ છે.

નિયામક મંડળની બેઠક :

નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન, નિગમે કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૭૩ મુજબ નિયામક મંડળની ૪ બોર્ડ બેઠકો યોજી હતી, જે નીચે સંક્ષિપ્ત છે. બે બેઠકો વચ્ચેના સમયના અંતરને ધ્યાનમાં લેતી વખતે કંપની અધિનિયમ-૨૦૧૩ની જોગવાઈનું પાલન કરવામાં આવેલ હતું.

ક્રમ નં.	બેઠકની તારીખ	બોર્ડની સંખ્યા	હાજર રહેલા નિયામકોની સંખ્યા
૦૧	૨૭.૦૪.૨૦૨૨	૭	૬
૦૨	૨૭.૦૭.૨૦૨૨	૭	૭
૦૩	૧૫.૦૯.૨૦૨૨	૭	૫
૦૪	૨૬.૧૨.૨૦૨૨	૮	૭

નિયામકોની જવાબદારીનું નિવેદન

કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૩૪(૫) ને અનુલક્ષીને નિગમનું નિયામક મંડળ સમર્થન આપે છે કે

- (૧) વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં તાત્વિક વિચલન સબંધી યોગ્ય ખુલાસા સાથે લાગુ પડતાં ધોરણોને અનુસરવામાં આવ્યાં છે.
- (૨) નિયામકોને એવી હિસાબી નીતિઓ પસંદ કરી હતી અને એમને સુસંગત રીતે લાગુ પાડી હતી અને યોગ્ય વિવેકપૂર્ણ નિર્ણયો અને અંદાજો કર્યા હતા, જેથી કંપનીના કામકાજની સ્થિતિ અને મુદ્ત માટે નિગમના નફા-નુકશાનનું ચિત્ર આપે.
- (૩) નિગમના અસ્કયામતોની સુરક્ષા કરવા માટે અને અન્ય અનિયમિતતાઓ રોકવા તથા શોધી કાઢવા માટે આ અધિનિયમની જોગવાઈ અનુસાર પુરતું હિસાબી રેકર્ડ રાખવા માટે નિયામકોએ યોગ્ય અને પુરતી કાળજી લીધી છે.
- (૪) નિયામકોએ વાર્ષિક હિસાબો ચાલુ ઉપક્રમના આધારે તૈયાર કર્યા હતા.
- (૫) કંપની સૂચિમાં ન હોઈ, કમ ૧૩૪(૫) ની પેરા-ખંડ લાગુ પડતો નથી.
- (૬) લાગુ પડતા બધા કાયદાઓની જોગવાઈઓનું અનુપાલન સુનિશ્ચિત કરવા નિયામકોએ યોગ્ય પદ્ધતિઓ ઘડી કાઢી છે, અને આવી પદ્ધતિઓ પર્યાપ્ત હતી અને અસરકારક રીતે કાર્યરત હતી.

ઓડીટરના અહેવાલની યોગ્યતા વિશે ખુલાસો :

ઓડિટર્સ રિપોર્ટમાં લાયકાતોની સમજૂતી નીચે મુજબ છે:

૧. ચાલુ વર્ષ દરમિયાન કંપની અધિનિયમની કલમ ૧૩૫ હેઠળ સીએસઆર ખર્ચ માટે નિગમની ₹ ૮૪.૧૭ લાખની જવાબદારી હતી. ૩૧ માર્ચ ૨૦૨૩ ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષમાં નિગમ માત્ર ₹ ૬૭.૪૩ લાખ ખર્ચી શકી હતી, આમ ₹ ૧૬.૭૪ લાખની અછત રહેવા પામેલ છે.

સમજૂતી :

નિગમે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે ₹ ૮૪.૧૭ લાખ ફાળવ્યા હતા, જેમાંથી નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ₹ ૧૬.૭૪ લાખની રકમ ચાલુ પ્રોજેક્ટ માટે મંજૂર કરવામાં આવી હતી. આથી, તે ૩૧.૦૩.૨૦૨૩ સુધી ચૂકવવામાં આવી ન હતી. તે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં ચૂકવવામાં આવશે. ઉપરાંત, પ્રોજેક્ટ માટે રકમ પહેલેથી જ ફાળવવામાં આવી હોવાથી અને ભંડોળ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં સિલીઝ કરવાનું હોવાથી, તે અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવેલ નથી.

૨. નિગમે નફા-નુકશાન ખાતામાં વિવિધ યોજનાઓ માટે સરકાર પાસેથી મેળવેલા ભંડોળ પર વ્યાજની બુકિંગ માટેની નીતિ અપનાવી છે. ચાલુ વર્ષ દરમિયાન નિગમે કમાયેલા વ્યાજને નફા અને નુકસાન ખાતામાં જમા કરવાની સમાન નીતિ અપનાવી છે. મેનેજમેન્ટ દ્વારા સમજાવ્યા મુજબ નિગમ ગ્રાન્ટ વિતરણ અને વ્યાજના ટ્રાન્સફર માટે પીએફએમએસ નો ઉપયોગ કરી રહી છે, પરંતુ અગાઉના સંચિત બેલેન્સ પર વ્યાજના પ્રમાણની ગેરહાજરીમાં શક્ય નથી તેથી નફા અને નુકસાનના નિવેદન પર અસર નક્કી કરી શકાઈ નથી.

સમજૂતી :

નિગમ ખેતી નિયામકની વિવિધ યોજનાઓ માટે લાભાર્થીઓને સબસિડીનું વિતરણ કરવા માટે નોડલ એજન્સી તરીકે કામ કરે છે. છેલ્લા બે વર્ષથી, પીએફએમએસ પ્લેટફોર્મનો ઉપયોગ કેન્દ્રીય ક્ષેત્રની વિવિધ યોજનાઓ માટે એસએનએ દ્વારા સબસિડીના વિતરણ માટે થાય છે. ઉપરાંત, યોગદાનના પ્રમાણમાં વ્યાજની ક્રેડિટ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પાછી આપવામાં આવે છે. રાજ્ય સરકારની અન્ય યોજનાઓમાં ભંડોળ ચાલુ વર્ષની જવાબદારીઓ માટે છે, જે ખેતી નિયામકની ક્ષેત્રીય કચેરીઓ તરફથી ચૂકવણીની સૂચનાઓ પ્રાપ્ત થવા પર ચૂકવવામાં આવે છે. બેલેન્સ એ બિનખર્ચિત સ્કીમ બેલેન્સ નથી. વર્ષના અંતે વણખર્ચાયેલી સિલકની જાણ ખેતી નિયામકને કરવામાં આવે છે. આગામી વર્ષના સ્કીમ બેલેન્સને સમર્પણ અથવા પુનઃપ્રમાણિત કરવાનો નિર્ણય ખેતી નિયામક દ્વારા લેવામાં આવે છે. બાકીનું ભંડોળ કોર્પોરેશનના પોતાના ભંડોળ સાથે ગુજરાત સ્ટેટ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડમાં જમા રહે છે. કુલ ભંડોળ પર મેળવેલ વ્યાજને વ્યાજની આવક તરીકે ઓળખવામાં આવે છે. નિગમ દ્વારા આ પ્રથાનું સતત પાલન કરવામાં આવે છે.

તેમજ નિગમ દ્વારા સબસિડી ભંડોળ વિતરણની પ્રવૃત્તિ કરવા માટે કોઈ વહીવટી ચાર્જ લેવામાં આવતો નથી. નિગમના હાલના કર્મચારીઓએ નિગમના તેમના નિયમિત કામ સિવાય સબસિડી વિતરણની કામગીરી કરવાની હોય છે. જો કોઈ ચાર્જ વસૂલ કરવામાં આવે તો તે સ્કીમ બેલેન્સમાંથી સીધો જ ઓછો કરવાનો થાય છે.

લોન, ગેરંટીઓ અને મૂડી-રોકણો :

સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન, કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૧૮૬ હેઠળ નિગમે આપેલ લોનો, ગેરંટીઓ અથવા કરેલ મૂડી રોકાણ નથી અને તેથી ઉક્ત જોગવાઈઓ લાગુ પડતી નથી.

સંબંધિત પક્ષકાર લેવડદેવડો :

નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન, નિગમે કોઈ સંબંધિત પક્ષકાર સાથે લેવડદેવડ કરવામાં આવેલ નથી, જે કંપની અધિનિયમ ૨૦૧૩ હેઠળ જણાવવી જરૂરી બને છે.

લાભ :

રાજ્યમાં નિગમની પ્રવૃત્તિઓએ બિયારણ ઉગાડનારા ખેડૂતોને વ્યાજબી મળતર અને બિયારણ વાપરનારા ખેડૂતોને હંમેશા અને સમગ્ર રાજ્યમાં ઉચિત દરે ગુણવત્તાવાળા બિયારણની પ્રાપ્તિ સુનિશ્ચિત કરી છે.

ઉર્જા સંરક્ષણ, ટેકનોલોજી સમાવેશન અને વિદેશી હુંડિયામણ જાવક

(ક) ઉર્જા સંરક્ષણ અને ટેકનોલોજી સમાવેશન

નિગમે ઉર્જા બચાવવા માટે વડી કચેરી, ગાંધીનગર ખાતે સોલાર રૂફટોપ અને ગોધરા અને નડિયાદ ગોડાઉન ખાતે સોલાર સ્ટ્રીટ લાઈટ સ્થાપિત કરી છે. નિગમે નડિયાદ ગોડાઉન કોમ્પ્લેક્સમાં અદ્યતન બીજ પ્રક્રિયા મશીનરી પણ સ્થાપિત કરી છે જેથી નવી ટેકનોલોજી અપનાવીને પ્રક્રિયા દરમિયાન બીજની ગુણવત્તામાં સુધારો થાય.

(ખ) વિદેશી હુંડિયામણ આવક અને જાવક

સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન વિદેશી હુંડિયામણ આવક અને જાવક ન હતી.

જોખમ વ્યવસ્થાપન

નિગમ પાસે કોઈ જોખમ વ્યવસ્થાપન નીતી નથી કેમ કે નિગમના અસ્તિત્વને ભયમાં મૂકે એવા જોખમના તત્વો નજીવાં છે.

નિયામકો :

સમીક્ષાના વર્ષ દરમિયાન, નિગમનું નિયામક મંડળ નીચેના નિયામકોનું બનેલું હતું.

ક્રમ નં.	નિયામકનું નામ	હોદ્દા	તારીખથી	તારીખ સુધી
૧	શ્રી મનીષ ભારદ્વાજ (IAS)	અધ્યક્ષ	૦૭.૧૧.૨૦૨૦	૨૬.૦૪.૨૦૨૨
૨	શ્રી મુકેશ પુરી (IAS)	અધ્યક્ષ	૨૬.૦૪.૨૦૨૨	આજ સુધી
૩	ડો. પી.એમ. વઘાસિયા	નિયામક	૧૨.૦૧.૨૦૧૮	આજ સુધી
૪	કુ. કાનન એચ. પંડ્યા	નિયામક	૧૭.૧૦.૨૦૨૦	આજ સુધી
૫	શ્રી ડી.બી. નિમાવત	નિયામક	૨૭.૧૦.૨૦૨૦	આજ સુધી
૬	શ્રી પી. એસ. રબારી	વહીવટી નિયામક	૦૫.૧૨.૨૦૨૦	આજ સુધી
૭	ડૉ કે. બી. કંથારીયા	નિયામક	૧૮.૧૧.૨૦૨૧	આજ સુધી
૮	શ્રી એસ. જે. સોલંકી	નિયામક	૨૨.૦૧.૨૦૨૨	આજ સુધી
૯	શ્રી યમલ વ્યાસ	સ્વતંત્ર નિયામક	૧૧.૧૦.૨૦૨૨	આજ સુધી

(તા.૩૧.૦૩.૨૦૨૩ની સ્થિતિએ)

થાપણો :

વર્ષ દરમિયાન નિગમે કોઈ થાપણ સ્વીકારી નથી.

કોર્પોરેટ સામાજિક જવાબદારી :

કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૩૫(૫) અને કંપનીઝ (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પોલિસી) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૮ અને કંપની એક્ટ, ૨૦૧૩ ના શેડ્યૂલ VII મુજબ, નિગમે સીએસઆર કમિટીની રચના કરી છે અને સીએસઆર નીતિ ઘડી છે. સીએસઆર સમિતિએ ૨૮.૧૧.૨૦૨૨ ના રોજ યોજાયેલી તેની બેઠકમાં સીએસઆર પ્રવૃત્તિઓ માટે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે ₹ ૮૪.૧૭ લાખની ભલામણ કરી છે. નિયામક મંડળે તેની ૨૬.૧૨.૨૦૨૨ ના રોજ યોજાયેલી બેઠકમાં ₹ ૮૪.૧૭ લાખના ભંડોળને પણ મંજૂરી આપી છે અને સીએસઆર સમિતિને સીએસઆર પ્રવૃત્તિઓ પર ભંડોળ ખર્ચવા માટે અધિકૃત કર્યું છે. સીએસઆર સમિતિએ તેની તા. ૧૬.૦૧.૨૦૨૩ બેઠકમાં (૧) રાજકોટ જિલ્લાના જસદણ અને વિછીયા ખાતે ડાયાલિસિસ સેન્ટરની સ્થાપના માટે ઇન્વિસ્ટમેન્ટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરને ₹ ૪૦.૦૦ લાખ (૨) માનસિક રીતે અસ્વસ્થ વિદ્યાર્થીઓ માટે પુનર્વસન પ્રોજેક્ટ માટે બી.એમ. ઇન્વિસ્ટમેન્ટ ઓફ મેન્ટલ હેલ્થને ₹ ૫.૦૦ લાખ કાર્યક્રમ (૩) ₹ ૩૩.૫૫ લાખ એન.એમ. સદગુરુ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, દાહોદને હાઇડ્રોપોનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઘાસચારા ઉત્પાદન કાર્યક્રમ માટે (૪) મોરબી જિલ્લા હોસ્પિટલ ખાતે વિશેષ નવજાત સંભાળ એકમની સ્થાપના માટે આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ કમિશ્નરને ₹ ૫.૬૨ લાખ મંજૂર કર્યા છે. બોર્ડના અહેવાલમાં સમાવિષ્ટ કરવામાં આવનાર સીએસઆર પ્રવૃત્તિઓ પરનો વાર્ષિક અહેવાલ ડિરેક્ટર્સ રિપોર્ટના પરિશિષ્ટ ૨ તરીકે મૂકવામાં આવ્યો છે જે આ અહેવાલનો ભાગ છે.

કાર્યસ્થળ પર મહિલાઓની જાતિય સતામણી :

નાણાકીય વર્ષ દરમિયાન આવો કોઈ બનાવ બનેલ નથી.

વાર્ષિક મૂલ્યાંકન :

બોર્ડ મૂલ્યાંકન સંબંધી કલમ ૧૩૪(૩)(પી) ની જોગવાઈ નિગમને લાગુ પડતી નથી.

સ્વતંત્ર નિયામકો :

શ્રી યમલ વ્યાસ અને શ્રી વિજય પોલ શર્માની કંપનીના બોર્ડમાં સતત ૫ વર્ષની મુદત માટે ૧૧.૧૦.૨૦૨૨ના રોજ કંપની એક્ટ, ૨૦૧૩ની કલમ ૧૪૯(૧૦) મુજબ નિગમના સ્વતંત્ર નિયામક તરીકે નિમણૂક કરવામાં આવી છે. જે કે, શ્રી વિજય પોલ શર્માએ સીએસીપીના ચેરમેન હોવાને કારણે નિગમના બોર્ડમાં નિમણૂક સ્વીકારી નથી. નિગમને નવી નિમણૂક માટે ગુજરાત સરકારનો સંપર્ક કર્યો છે, જેની રાહ જોવાઈ રહી છે.

નિગમના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આથી પુષ્ટિ કરે છે કે કંપની દ્વારા વિધિવત રીતે નિયુક્ત કરાયેલા શ્રી યમલ વ્યાસે ઘોષણા કરી છે અને તેઓ કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૪૯(૬) હેઠળ પૂરી પાડવામાં આવેલ સ્વતંત્રતાના માપદંડોને પૂર્ણ કરે છે.

નામ નિયુક્તિ અને પારિશ્રમિક સમિતિ :

કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૭૮(૧) અનુસાર, નિગમની નામ નિયુક્તિ અને પારિશ્રમિક સમિતિ ત્રણ બિન-કારોબારી નિયામકની બનેલી છે. કોઠામાં સમિતિની રચના નિર્દિષ્ટ કરવામાં આવી છે.

નિયામકનું નામ	સમિતિમાં હોદ્દો	નિયામકનો પ્રકાર
શ્રી પી. એસ. રબારી	અધ્યક્ષ	વહીવટી નિયામક
શ્રી ડી. બી. નિમાવત	સભ્ય	બિન- કારોબારી નિયામક
શ્રી યમલ વ્યાસ	સભ્ય	બિન- કારોબારી સ્વતંત્ર નિયામક
કુ. કાનન એચ. પંડ્યા	સભ્ય	બિન- કારોબારી નિયામક

નિયમના સંદર્ભ

નામાનિયુક્ત અને પારિશ્રમિક સમિતિએ વિચારવાના મુદ્દાઓ, નિગમને વખતોવખત લાગુ પડે તે પ્રમાણે કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૭૮માં નિર્ધારિત કરેલ અનુસાર રહેશે.

પારિશ્રમિક નીતિ

કારોબારી નિયામકને પારિશ્રમિક :

નિગમ, ગુજરાત સરકારનો ઉપક્રમ હોઈ, કારોબારી નિયામક એટલે કે વહીવટી નિયામકનું પારિશ્રમિક સરકારી ધોરણ અનુસાર છે.

બિન-કારોબારી નિયામકને પારિશ્રમિક :

નિગમ, ગુજરાત સરકારનો ઉપક્રમ હોઈ, બિન-કારોબારી નિયામકને પારિશ્રમિક બેઠક ફીના સ્વરૂપે ચુકવવામાં આવે છે. જેને સરકાર દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવે છે. બિન-કારોબારી નિયામકને બેઠક ફી બોર્ડની દરેક બેઠક માટે અને નિયામકની સમિતિમાં એમની હાજરી પ્રમાણે ચુકવાય છે. સરકારી નામનિયુક્ત, બિન-કારોબારી નિયામકની બેઠક ફી સરકારી હુકમ અનુસાર તિબેરીમાં જમા કરવામાં આવે છે.

ઓડીટ સમિતિ :

કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૭૭ અનુસાર નિગમની ઓડીટ સમિતિ ૩ નિયામકની બનેલી છે. બોર્ડ ઓડીટ સમિતિની ભલામણો સ્વીકારી છે. કોઠામાં સમિતિની રચના નિર્દિષ્ટ કરી છે.

નિયામકનું નામ	સમિતિમાં હોદ્દો	નિયામકનો પ્રકાર
શ્રી યમલ વ્યાસ	અધ્યક્ષ	બિન-કારોબારી સ્વતંત્ર નિયામક
શ્રી એસ. જે. સોલંકી	સભ્ય	બિન-કારોબારી નિયામક
શ્રી ડી. બી. નિમાવત	સભ્ય	બિન-કારોબારી નિયામક

કર્મચારી કલ્યાણ અને સંબંધો :

નિગમે કર્મચારીઓની જરૂરીયાતોને પહોંચી વળવા માટે એમને મકાન બાંધકામ, વાહન અને અન્ય પેશગીઓ આપવાનું ચાલુ રાખ્યું છે.

સમીક્ષાના વર્ષ દરમિયાન નિગમની કામગીરી તમામ કક્ષાએ કર્મચારીઓના સમર્પિત અને સંનિષ્ઠ પ્રયાસોને પરિણામે છે અને વર્ષ દરમિયાન કર્મચારીઓ સાથે ઘણાં સુમેળભર્યાં સંબંધો રહ્યા હતા. નિગમની પ્રગતિ કર્મચારીઓના સંનિષ્ઠ પ્રયાસોને કારણે છે.

ઓડીટરો :

ચાલુ વર્ષના હિસાબોનું ઓડીટ મે. મુકેશકુમાર જૈન એન્ડ કું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, અમદાવાદે કર્યું છે. ભારતના કોમ્પ્રોલર અને ઓડીટર જનરલ સાથે પરામર્શ કરીને ભારત સરકારે એમની વૈધાનિક ઓડીટર તરીકે નિમણૂક કરી હતી.

આભાર દર્શન :

આપના નિયામકો, હાર્દિક સહકાર અને પ્રોત્સાહન બદલ ભારત સરકાર, ગુજરાત સરકાર, ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ નિયામક, બાગાયાત નિયામક, નિયામક, ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી, ભારતીય કૃષિ સંશોધન પરિષદ, ગુજરાત જૈવ પ્રોદ્યોગિક અનુસંધાન કેન્દ્ર, ગુજરાત કૃષિ ઉદ્યોગો, રાષ્ટ્રીય બીજ નિગમ લિ., મહારાષ્ટ્ર રાજ્ય બીજ નિગમ લિ., વિવિધ સહકારી મંડળીઓ, ખેડૂતો અને કોન્ટ્રક્ટ બીજ ઉગાડનારાઓ તથા બીજના ગ્રાહકોના આભારી છે. સમગ્ર વર્ષ દરમિયાન નિગમના કર્મચારીઓના તમામ સભ્યોએ ખતાવેલી અવિરત અને સંનિષ્ઠ તથા સમર્પિત સેવાઓનો સ્વીકાર કરતા આપના નિયામકોને અત્યંત આનંદ થાય છે.

સ્થળ : ગાંધીનગર
તારીખ : ૨૬/૦૯/૨૦૨૩

નિયામક મંડળ વતી

સહી/-
એ. કે. રાકેશ, IAS
અધ્યક્ષ

[પરિશિષ્ટ - ૨]

૧લી એપ્રિલ, ૨૦૨૦ ના રોજ અથવા તે પછી શરૂ થતા નાણાકીય વર્ષ માટે બોર્ડના અહેવાલમાં સીએસઆર પ્રવૃત્તિઓ પરના વાર્ષિક અહેવાલનું ફોર્મટ

૧. નિગમની સીએસઆર નીતિની સંક્ષિપ્ત રૂપરેખા.

ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ (ગુરાબીની) ખેડૂતોને વ્યાજબી દરે ગુણવત્તાયુક્ત બિયારણના ઉત્પાદન, પ્રક્રિયા અને વિતરણના ક્ષેત્રમાં રોકાયેલ છે. ગુરાબીની ગુજરાતના ખેડૂતોના સામાજિક-આર્થિક વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ગુરાબીની કંપની અધિનિયમ ૨૦૧૩ ની અનુસૂચિ ૭ આઇટમ નંબર ૧ થી ૧૦ માં ઉલ્લેખિત વિસ્તારોમાં ખાસ કરીને રાજ્યના ગ્રામીણ સમુદાય માટે તેની સામાજિક જવાબદારી પૂરી કરવા માટે પ્રતિબદ્ધ છે. નિગમની સીએસઆર નીતિ તેની વેબ સાઇટ www.gurabini.com પર પણ ઉપલબ્ધ છે.

૨. સીએસઆર સમિતિની રચના::

ક્ર.નં.	ડિરેક્ટરનું નામ	ડિરેક્ટરશિપનો હોદ્દો / પ્રકૃતિ	વર્ષ દરમિયાન યોજાયેલી સીએસઆર સમિતિની બેઠકોની સંખ્યા	વર્ષ દરમિયાન યોજાયેલી સીએસઆર સમિતિની બેઠકોની સંખ્યામાં ભાગ લીધો હતો
૧	શ્રી મુકેશ પુરી, IAS	અધ્યક્ષ	૨	૨
૨	શ્રી પી.એસ.રબારી	વહીવટી નિયામક	૨	૨
૩	શ્રી ડી.બી. નિમાવત	નિયામક	૨	૨
૪	શ્રી ચમલ વ્યાસ	સ્વતંત્ર નિયામક	૧	૦

૩. વેબ-લિંક પ્રદાન કરો જ્યાં સીએસઆર સમિતિની રચના, સીએસઆર નીતિ અને બોર્ડ દ્વારા માન્ય સીએસઆર પ્રોજેક્ટ્સ નિગમની વેબસાઇટ પર જાહેર કરવામાં આવે. www.gurabini.com

૪. કંપનીઝ (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પોલિસી) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૮ ના પેટા-નિયમ (૩) ના અનુસંધાનમાં હાથ ધરવામાં આવેલા સીએસઆર પ્રોજેક્ટ્સની અસર આકારણીની વિગતો પ્રદાન કરો, જે લાગુ હોય તો (રિપોર્ટ જોડો). - લાગુ પડતું નથી

૫. કંપનીઝ (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પોલિસી) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૭ ના પેટા-નિયમ (૩) ને અનુસરીને સેટ-ઓફ માટે ઉપલબ્ધ રકમની વિગતો અને નાણાકીય વર્ષ માટે સેટ-ઓફ કરવાની આવશ્યક રકમ, જે કોઈ હોય તો

ક્ર.નં.	નાણાકીય વર્ષ	પાછલા નાણાકીય વર્ષથી એડજસ્ટમેન્ટ માટે ઉપલબ્ધ રકમ (₹ માં)	નાણાકીય વર્ષ માટે એડજસ્ટ કરવાની આવશ્યક રકમ, જે કોઈ હોય તો (₹ માં)
૧.	૨૦૨૧-૨૦૨૨	૦.૦૦	૦.૦૦
૨.	૨૦૨૦-૨૦૨૧	૦.૦૦	૦.૦૦
૩.	૨૦૧૯-૨૦૨૦	૦.૦૦	૦.૦૦
	કુલ	૦.૦૦	૦.૦૦

૬. કલમ ૧૩૫(૫) મુજબ કંપનીનો સરેરાશ ચોખ્ખો નફો. ₹ ૪૨.૦૮ કરોડ

૭ (ક) કલમ ૧૩૫(૫) મુજબ કંપનીના સરેરાશ ચોખ્ખા નફાના બે ટકા. ₹ ૮૪.૧૭ લાખ

(ખ) સીએસઆર પ્રોજેક્ટ્સ અથવા પ્રોગ્રામ્સ અથવા પાછલા નાણાકીય વર્ષોની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતા સરપ્લસ. ₹ ૦૦.૦૦

(ગ) રકમ, જે કોઈ હોય તો, નાણાકીય વર્ષ માટે સેટ ઓફ કરવાની જરૂર છે: ₹ ૦૦.૦૦

(ઘ) નાણાકીય વર્ષ (૭૫+૭૫+૭૫) માટે કુલ સીએસઆર જવાબદારી. ₹ ૮૪.૧૭ લાખ

૮. (ક) નાણાકીય વર્ષ માટે સીએસઆર ની રકમ ખર્ચવામાં આવેલ અથવા બિનખર્ચાયેલી:

(₹ લાખમાં)

નાણાકીય વર્ષ માટે ખર્ચવામાં આવેલ કુલ રકમ.	બિનખર્ચિત રકમ				
	કલમ ૧૩૫(૬) મુજબ બિનખર્ચિત સીએસઆર ખાતામાં ચોખ્ખી રકમ ટ્રાન્સફર થઈ.		કલમ ૧૩૫(૫)ની બીજી જોગવાઈ અનુસાર અનુસૂચિ VII હેઠળ ઉલ્લેખિત કોઈપણ ફંડમાં ટ્રાન્સફર કરાયેલ રકમ.		
	રકમ	ટ્રાન્સફરની તારીખ	ફંડનું નામ	રકમ	ટ્રાન્સફરની તારીખ
૬૭.૪૩*	૦.૦૦	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ₹ ૧૬.૭૪ લાખની રકમ નીચેના કોષ્ટકમાં અનુક્રમ નંબર ૩ પર ઉલ્લેખ કરેલ ચાલુ પ્રોજેક્ટ માટે મંજૂર કરવામાં આવી હતી. આથી, તે ૩૧.૦૩.૨૦૨૩ સુધી ચૂકવવામાં આવી ન હતી. તે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં ચૂકવવામાં આવશે.

(ખ) નાણાકીય વર્ષ માટે ચાલુ પ્રોજેક્ટ્સ સામે ખર્ચવામાં આવેલી સીએસઆર રકમની વિગતો:

(₹ લાખમાં)

(૧)	(૨)	(૩)	(૪)	(૫)		(૬)	(૭)	(૮)	(૯)	(૧૦)	(૧૧)	
				રાજ્ય	જિલ્લો						નામ	સીએસઆર નોંધણી નંબર
ક્ર. નં.	પ્રોજેક્ટનું નામ	અનુસૂચિ VII માંની પ્રવૃત્તિઓની સૂચિમાંથી અધિનિયમની આઇટમ	સ્થાનિક વિસ્તાર (હા/ના)	પ્રોજેક્ટનું સ્થાન.	પ્રોજેક્ટ સમય-ગાળો	પ્રોજેક્ટ માટે ફાળવેલ રકમ	વર્તમાન નાણાકીય વર્ષમાં ખર્ચવામાં આવેલી રકમ	કલમ ૧૩૫(૬) મુજબ પ્રોજેક્ટ માટે બિનખર્ચિત સીએસઆર ખાતામાં ટ્રાન્સફર કરાયેલી રકમ	અમલીકરણની રીત પ્રત્યક્ષ (હા/ના).	અમલીકરણની પદ્ધતિ - અમલીકરણ એજન્સી દ્વારા		
૧.	ડાયાલિસિસ કેન્દ્રની સ્થાપના	પોઈન્ટ નં. ૧	હા	રાજકોટ / ગુજરાત	૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪	૪૦.૦૦	૪૦.૦૦	૦.૦૦	ના	ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર	-	
૨.	માનસિક રીતે અસ્વસ્થ વિદ્યાર્થીઓ માટે પુનર્વસન પ્રોજેક્ટ	પોઈન્ટ નં. ૧	હા	અમદાવાદ / ગુજરાત	૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪	૫.૦૦	૦૦.૦૦*	૦.૦૦	ના	બી. એમ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ	-	
૩.	હાઇડ્રોપોનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘાસચારો ઉત્પાદન કાર્યક્રમ	પોઈન્ટ નં. ૪	હા	દાહોદ / ગુજરાત	૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪	૩૩.૫૫	૦૦.૦૦*	૦.૦૦	ના	એન.એમ. સદગુરુ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, દાહોદ	-	
૪.	ખાસ નવખત કેર યુનિટની સ્થાપના	પોઈન્ટ નં. ૧	હા	મોરબી / ગુજરાત	૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪	૫.૬૨	૦૦.૦૦*	૦.૦૦	ના	આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ કમિશ્નર	-	
	કુલ					૮૪.૧૭	૪૦.૦૦	૦.૦૦				

* ભંડોળ અમલીકરણ એજન્સીઓને ફાળવવામાં આવ્યું હતું, જો કે ૩૧.૦૩.૨૦૨૩ ના રોજ એજન્સીઓ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

(ગ) નાણાકીય વર્ષ માટે ચાલુ પ્રોજેક્ટ સિવાયના અન્ય ખર્ચમાં સીએસઆર રકમની વિગતો:

૧	૨	૩	૪	૫	૬	૭	૮	
							નામ	સીએસઆર નોંધણી નંબર
ક્ર. નં.	પ્રોજેક્ટનું નામ	અનુસૂચિ VII માંની પ્રવૃત્તિઓની સૂચિમાંથી અધિનિયમની આઇટમ	સ્થાનિક વિસ્તાર (હા/ના)	પ્રોજેક્ટનું સ્થાન રાજ્ય / જિલ્લો	વર્તમાન નાણાકીય વર્ષમાં ખર્ચવામાં આવેલી રકમ (₹ માં)	અમલીકરણની રીત પ્રત્યક્ષ (હા/ના)	અમલીકરણની પદ્ધતિ - અમલીકરણ એજન્સી દ્વારા	
૧.	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય		
૨.	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય		
	કુલ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય		

(ચ) વહીવટી ઓવરહેડ્સમાં ખર્ચવામાં આવેલી રકમ : ₹ ૦.૦૦

(છ) અસર આકારણી પર ખર્ચવામાં આવેલ રકમ, જો લાગુ હોય તો : લાગુ પડતું નથી

(જ) નાણાકીય વર્ષ માટે ખર્ચવામાં આવેલી કુલ રકમ (૮ખ+૮ગ+૮ઘ+૮ચ) : ₹ ૮૪.૧૭ લાખ

(ઝ) વધારાની રકમ જો કોઈ હોય તો સેટ ઓફ કરવાની રહેશે

(₹ લાખમાં)

ક્ર.નં.	વિગત	રકમ
(i)	કલમ ૧૩૫(૫) મુજબ નિગમના સરેરાશ ચોખ્ખા નફાના બે ટકા	૮૪.૧૭
(ii)	નાણાકીય વર્ષ માટે ખર્ચવામાં આવેલી કુલ રકમ	૬૭.૪૩
(iii)	નાણાકીય વર્ષ માટે ખર્ચવામાં આવેલ વધારાની રકમ [(ii)-(I)]	૦૦.૦૦
(iv)	સરપ્લસ, જો કોઈ હોય તો, સીએસઆર પ્રોજેક્ટ્સ અથવા પ્રોગ્રામ્સ અથવા પાછલા નાણાકીય વર્ષોની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવે છે	૦૦.૦૦
(v)	અનુગામી નાણાકીય વર્ષોમાં સેટ ઓફ માટે ઉપલબ્ધ રકમ [(iii)-(iv)]	૦૦.૦૦

૯. (ક) છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ માટે બિનખર્ચાયેલી સીએસઆર રકમની વિગતો:

(₹ લાખમાં)

ક્ર.નં.	અગાઉના નાણાકીય વર્ષ	કલમ ૧૩૫(૬) હેઠળ બિનખર્ચાયેલી સીએસઆર ખાતામાં ટ્રાન્સફર કરેલ રકમ (₹ માં)	રિપોર્ટિંગ નાણાકીય વર્ષમાં ખર્ચવામાં આવેલી રકમ (₹ માં).	રકમ, જો કોઈ હોય તો, કલમ ૧૩૫(૬) મુજબ અનુસૂચિ VII હેઠળ ઉલ્લેખિત ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.			બાકીની રકમ આગામી નાણાકીય વર્ષમાં ખર્ચ કરવાની છે. (₹ માં)
				ફંડનું નામ	રકમ (₹ માં)	ટ્રાન્સફરની તારીખ	
૧.	૨૦૨૧-૨૦૨૨	૦.૦૦	૦.૦૦	લાગુ પડતું નથી	૦.૦૦	લાગુ પડતું નથી	૦.૦૦
૨.	૨૦૨૦-૨૦૨૧	૦.૦૦	૦.૦૦	લાગુ પડતું નથી	૦.૦૦	લાગુ પડતું નથી	૦.૦૦
૩.	૨૦૧૯-૨૦૨૦	૦.૦૦	૦.૦૦	લાગુ પડતું નથી	૦.૦૦	લાગુ પડતું નથી	૦.૦૦
	કુલ	૦.૦૦	૦.૦૦	લાગુ પડતું નથી	૦.૦૦	લાગુ પડતું નથી	૦.૦૦

(ખ) અગાઉના નાણાકીય વર્ષ(ના)ના ચાલુ પ્રોજેક્ટ્સ માટે નાણાકીય વર્ષમાં ખર્ચવામાં આવેલી સીએસઆર રકમની વિગતો:

(૧)	(૨)	(૩)	(૪)	(૫)	(૬)	(૭)	(૮)	(૯)
ક્ર.નં.	પ્રોજેક્ટ આઈડી	પ્રોજેક્ટનું નામ	નાણાકીય વર્ષ કે જેમાં પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો	પ્રોજેક્ટ સમયગાળો	પ્રોજેક્ટ માટે ફાળવેલ કુલ રકમ (₹ માં)	રિપોર્ટિંગ વર્ષમાં પ્રોજેક્ટ પર ખર્ચવામાં આવેલી રકમ (₹ માં)	રિપોર્ટિંગ નાણાકીય વર્ષના અંતે ખર્ચવામાં આવેલી સંચિત રકમ (₹ માં)	પ્રોજેક્ટની સ્થિતિ પૂર્ણ થયેલ/ ચાલુ
૧.	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી
૨.	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી
૩.	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી
	કુલ	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી

૧૦. મૂડી સંપત્તિના નિર્માણ અથવા સંપાદનના કિસ્સામાં, નાણાકીય વર્ષમાં ખર્ચવામાં આવેલા સીએસઆર દ્વારા આ રીતે બનાવેલ અથવા હસ્તગત કરેલી સંપત્તિ સંબંધિત વિગતો પ્રદાન કરો: **લાગુ પડતું નથી.**

(સંપત્તિ મુજબની વિગતો)

(ક) બાંધકામ અથવા મૂડી સંપત્તિના સંપાદનની તારીખ: **લાગુ પડતું નથી**

(ખ) બાંધકામ અથવા મૂડી સંપત્તિના સંપાદન માટે ખર્ચવામાં આવેલ સીએસઆર ની રકમ : **લાગુ પડતું નથી**

(ગ) સંસ્થા અથવા જાહેર સત્તા અથવા લાભાર્થીની વિગતો કે જેના નામે આવી મૂડી સંપત્તિ નોંધાયેલ છે, તેનું સરનામું વગેરે : **લાગુ પડતું નથી**

(દ) મૂડી અસ્કયામતો (મૂડી અસ્કયામતો) ની વિગતો પ્રદાન કરે છે (મૂડી અસ્કયામતનું સંપૂર્ણ સરનામું અને સ્થાન સહિત). **લાગુ પડતું નથી**

૧૧. જો કંપની કલમ ૧૩૫(૫) મુજબ સરેરાશ ચોખ્ખા નફાના બે ટકા ખર્ચ કરવામાં નિષ્ફળ ગઈ હોય તો કારણો જણાવો - નિગમે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે ₹ ૮૪.૧૭ લાખ ફાળવ્યા હતા, જેમાંથી નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ₹ ૧૬.૭૪ લાખની રકમ ચાલુ પ્રોજેક્ટ માટે મંજૂર કરવામાં આવી હતી. આથી, તે ૩૧.૦૩.૨૦૨૩ સુધી ચૂકવવામાં આવી ન હતી. તે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં ચૂકવવામાં આવશે.

૩૧ માર્ચ ૨૦૨૩ ના રોજ પૂરા થયેલા વર્ષ માટે ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ, ગાંધીનગરના નાણાકીય નિવેદનો પર કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૪૩(૬)(ખ) હેઠળ ભારતના કોમ્પ્રોલર અને ઓડિટર જનરલની ટિપ્પણીઓ

કંપની અધિનિયમ, ૨૦૧૩ (અધિનિયમ) હેઠળ નિર્ધારિત નાણાકીય રિપોર્ટિંગ ફ્રેમવર્ક અનુસાર ૩૧ માર્ચ ૨૦૨૩ ના રોજ પૂરા થયેલા વર્ષ માટે ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ, ગાંધીનગરના નાણાકીય નિવેદનો તૈયાર કરવાની કંપનીના મેનેજમેન્ટની જવાબદારી છે. અધિનિયમની કલમ ૧૩૯(૫) હેઠળ ભારતના કોમ્પ્રોલર અને ઓડિટર જનરલ દ્વારા નિયુક્ત કરાયેલ વૈધાનિક ઓડિટર, અધિનિયમની કલમ ૧૪૩(૧૦) હેઠળ નિર્ધારિત ઓડિટ ધોરણો અનુસાર સ્વતંત્ર ઓડિટના આધારે અધિનિયમની કલમ ૧૪૩ હેઠળ નાણાકીય નિવેદનો પર અભિપ્રાય વ્યક્ત કરવા માટે જવાબદાર છે. આ તેમના દ્વારા ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૩ ના ઓડિટ રિપોર્ટ દ્વારા કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

મેં, ભારતના કોમ્પ્રોલર અને ઓડિટર જનરલ વતી, અધિનિયમની કલમ ૧૪૩(૬)(ક) હેઠળ ૩૧ માર્ચ ૨૦૨૩ નારોજ પૂરા થયેલા વર્ષ માટે ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ, ગાંધીનગરના નાણાકીય નિવેદનોનું પૂરક ઓડિટ કર્યું છે. આ પૂરક ઓડિટ વૈધાનિક ઓડિટર્સના કાર્યકારી કાગળોની એક્સેસ વિના સ્વતંત્ર રીતે હાથ ધરવામાં આવે છે અને તે મુખ્યત્વે વૈધાનિક ઓડિટર અને કંપનીના કર્મચારીઓની પૂછપરછ અને ચોક્કસ એકાઉન્ટિંગ રેકોર્ડ્સની પસંદગીની પરીક્ષા સુધી મર્યાદિત છે.

મારા પૂરક ઓડિટના આધારે મારી જાણમાં એવું કંઈપણ નોંધપાત્ર આવ્યું નથી કે જે અધિનિયમની કલમ ૧૪૩(૬)(ખ) હેઠળ વૈધાનિક ઓડિટર્સના અહેવાલ પર કોઈ ટિપ્પણી અથવા પૂરકને જન્મ આપે.

ભારતના કોમ્પ્રોલર અને ઓડિટર જનરલ માટે અને વતી

સ્થળ :- રાજકોટ
તારીખ :- ૦૧/૧૨/૨૦૨૩

(આર. કે. સોલંકી)
એકાઉન્ટન્ટ જનરલ(ઓડિટ-૧)
રાજકોટ, ગુજરાત.

સ્વતંત્ર ઓડીટરોનો અહેવાલ

પ્રતિ,

સભ્યશ્રીઓ

ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ,

ઈન્ડ એએસ નાણાંકીય પત્રક અંગે અહેવાલ :

અભિપ્રાય

અમે, ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ(કંપની) ના આ સાથે સામેલ ઈન્ડ એએસ નાણાંકીય પત્રકનું ઓડીટ કર્યું છે. જેમાં ૩૧મી માર્ચ, ૨૦૨૩ ના રોજ સરવૈયાનો અને ત્યારે પુરા થયેલા વર્ષના નફા-નુકશાન પત્રકનો અને રોકડ પ્રવાહ પત્રકનો અને મહત્વની હિસાબી નીતિઓના સારાંશ તથા અન્ય સ્પષ્ટીકરણાત્મક માહિતીનો સમાવેશ થાય છે. (હવે પછી તેને " ઈન્ડ એએસ નાણાંકીય નિવેદનો" તરીકે ઓળખવામાં આવશે.)

અમારા મતે અને અમારી શ્રેષ્ઠ માહિતી મુજબ અને અમને આપેલા ખુલાસા મુજબ, ઉપરોક્ત ઈન્ડ એએસ નાણાંકીય નિવેદનો કંપની અધિનિયમ, ૨૦૧૩ ("અધિનિયમ") દ્વારા જરૂરી માહિતી જરૂરી રીતે આપે છે અને સુધારેલા કંપનીઝ (ભારતીય એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ) નિયમો, ૨૦૧૫ ("ઈન્ડ એએસ") સાથે વાંચવામાં આવતી અધિનિયમ ની કલમ ૧૩૩ હેઠળ નિર્ધારિત ભારતીય એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ અને સામાન્ય રીતે ભારતમાં સ્વીકારવામાં આવતા અન્ય એકાઉન્ટિંગ સિદ્ધાંતો ને અનુરૂપ ૩૧મી માર્ચ ૨૦૨૩ ના રોજ કંપનીની સ્થિતિ અને તેનો નફો અને અન્ય વ્યાપક આવક, તે તારીખે પૂરા થયેલા વર્ષ માટે ઇક્વિટી અને તેના રોકડ પ્રવાહમાં ફેરફાર અંગે સાચો અને વ્યાજબી દૃષ્ટિકોણ આપે છે.

અભિપ્રાયનો આધાર :

અમે કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૪૩(૧૦) હેઠળ ઉલ્લેખિત ઓડિટીંગ (એસએએસ) ના ધોરણો અનુસાર અમારાં ઓડિટ હાથ ધર્યું છે. તે ધોરણો હેઠળની અમારી જવાબદારીઓ અમારા અહેવાલના નાણાંકીય નિવેદનોના ઓડિટ માટેની ઓડિટરની જવાબદારીઓમાં વધુ વર્ણવવામાં આવી છે. ભારતની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલ નૈતિકતાની સંહિતા અને કંપની અધિનિયમ, ૨૦૧૩ અને નિયમોની જોગવાઈ અનુસાર નાણાંકીય નિવેદનોના અમારા ઓડિટ માટે સ્વતંત્રતા સંબંધી જરૂરીયાતો અનુસાર અમે કંપનીથી સ્વતંત્ર છે અને અમે આ જરૂરીયાત અને આઈસીએઆઈની નૈતિકતા સંહિતા અનુસાર અમારી અન્ય જવાબદારીઓ પુરી કરી છે. અમે માનીએ છીએ કે અમે જે ઓડિટ પ્રમાણ મેળવ્યા છે, તે નાણાંકીય નિવેદનો પર અમારા ઓડિટ અભિપ્રાય માટે આધાર પુરા પાડવા પુરતા અને જરૂરી છે.

લાયક અભિપ્રાય માટેનો આધાર :

ચાલુ વર્ષ દરમિયાન કંપની અધિનિયમની કલમ ૧૩૫ હેઠળ સીએસઆર ખર્ચ માટે કંપનીની ₹ ૮૪.૧૭ લાખની જવાબદારી હતી. ૩૧ માર્ચ ૨૦૨૩ ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષમાં કંપની માત્ર ₹ ૬૭.૪૩ લાખ ખર્ચી શકી હતી, આમ ₹ ૧૬.૭૪ લાખની અછત રહેવા પામેલ છે.

કંપનીએ નફા-નુકશાન ખાતામાં વિવિધ યોજનાઓ માટે સરકાર પાસેથી મેળવેલા ભંડોળ પર વ્યાજની બુકિંગ માટેની નીતિ અપનાવી છે. ચાલુ વર્ષ દરમિયાન કંપનીએ કમાયેલા વ્યાજને નફા અને નુકસાન ખાતામાં જમા કરવાની સમાન નીતિ અપનાવી છે. મેનેજમેન્ટ દ્વારા સમજાવ્યા મુજબ કંપની ગ્રાન્ટ વિતરણ અને વ્યાજના ટ્રાન્સફર માટે પીએફએમએસ નો ઉપયોગ કરી રહી છે, પરંતુ અગાઉના સંચિત બેલેન્સ પર વ્યાજના પ્રમાણની ગેરહાજરીમાં શક્ય નથી તેથી નફા અને નુકસાનના નિવેદન પર અસર નક્કી કરી શકાય નથી.

મહત્વની બાબત :

અમારા અભિપ્રાયને યોગ્યતા આપ્યા વિના, અમે આ તરફ ધ્યાન દોરીએ છીએ:

૧. ડુપ્લિકેટ ચેકની ચૂકવણીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની કથિત બેદરકારીને લગતા કોર્પોરેશનના કર્મચારી દ્વારા ભંડોળના ગેરઉપયોગના સંદર્ભમાં ખાતાનો ભાગ બનતી નોંધોની નોંધ નં. ૩૬(૭). આ બાબતની હજુ પણ યોગ્ય સતાધિકારી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અંતિમ પરિણામો ન આવે ત્યાં સુધી કોર્પોરેશને હેરાફેરીથી થયેલા નુકસાન માટે હિસાબી ચોપડામાં કોઈ જોગવાઈ કરી નથી.
૨. જે યોજનાઓ માટે કંપનીને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે તે યોજનાઓના લાભાર્થીઓને કરવામાં આવેલી ચૂકવણી, ચેકની માન્યતા સમાપ્ત થવાને કારણે અથવા ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફરની નિષ્ફળતાને કારણે નિષ્ફળ ગઈ છે, કંપની એકધારી નીતિ તરીકે આવી રકમ સ્કીમ ખાતામાં પાછા જમા કરવાને બદલે ચેકમાં/ આરટીજીએસ રિટર્ન એકાઉન્ટ જમા કરી રહી છે. ચુકવણી જ્યારે કરવામાં આવે ત્યારે તે ચેક/આરટીજીએસ રિટર્ન એકાઉન્ટમાં ડેબિટ કરવામાં આવે છે. ખાતામાં કુલ બાકી બેલેન્સ ₹ ૫૪૩.૯૬ લાખ છે.

૩. વર્ષના અંતે લાંબા સમયથી બાકી રહેલ ડેબિટ અને ક્રેડિટ બેલેન્સ સહિતના બેલેન્સ, પુષ્ટિકરણ અને સમાધાનને આધીન છે, વધુ ખાસ કરીને નાણાકીય નિવેદનના નોંધ નંબર ૭, ૧૧, ૨૧, ૨૨ અને ૨૩માં વર્ણવેલ છે. નફા અને નુકસાન પત્રક અને સંબંધિત ખાતાઓ પર અસંયમિત રકમની અસર, જે કોઈ હોય તો, અનિશ્ચિત છે. માનનીય C&AG દ્વારા જારી કરાયેલ મેનેજમેન્ટ પત્ર તરફ ધ્યાન દોરવામાં આવે છે; ઉપરોક્ત બાબતોના સંદર્ભમાં અમારો અભિપ્રાય સુધારેલ નથી.

આ બાબતોના સંદર્ભમાં અમારો અભિપ્રાય બદલાયો નથી.

અન્ય માહિતી :

કંપનીનું નિયામક મંડળ માહિતીની તૈયારી માટે જવાબદાર છે. અન્ય માહિતીમાં બાર્ડના અહેવાલમાં સમાવિષ્ટ માહિતીનો સમાવેશ થાય છે. પરંતુ તેમાં ઈન્ડ એએસ નાણાકીય નિવેદનો અને તેના પરના અમારા ઓડીટરના અહેવાલમાં સામેલ નથી.

ઈન્ડ એએસ નાણાકીય નિવેદનો અંગેનો અમારો અભિપ્રાય અન્ય માહિતીને આવરી લેતો નથી અને અમે તેના પર કોઈ પણ પ્રકારની ખાતરીના નિષ્કર્ષને વ્યક્ત કરતા નથી.

ઈન્ડ એએસ નાણાકીય નિવેદનોના અમારા ઓડીટના સંબંધમાં, અમારી જવાબદારી અન્ય માહિતી વાંચવાની છે અને આમ કરવાથી ધ્યાનમાં લેવું કે શું અન્ય માહિતી ઈન્ડ એએસ નાણાકીય નિવેદનોથી અથવા ઓડીટમાં પ્રાપ્ત થયેલ અમારી જાણકારી સાથે વાસ્તવિક રીતે અસંગત છે અથવા તો તે વાસ્તવિક રીતે ખોટી દેખાય છે. જે અમે કરેલા કાર્યના આધારે અમે તે તારણ કરીએ છીએ કે આ અન્ય માહિતીમાં મહત્વપૂર્ણ ખોટું નિવેદન, તો અમારે તે ઠીકઠી જાણ કરવી જરૂરી છે. અમારી પાસે આ અંગે જાણ કરવા કંઈ નથી.

નાણાકીય નિવેદનો માટે સંચાલકો અને નાણાકીય નિવેદનોના નિયમનકારોની જવાબદારીઓ :

અધિનિયમની કલમ ૧૩૩ હેઠળ નિર્દિષ્ટ કરેલા હિસાબી ધોરણો સહિત સામાન્ય રીતે ભારતમાં સ્વીકૃત હિસાબી સિદ્ધાંતો અનુસાર, કંપનીની નાણાકીય સ્થિતિ, નાણાકીય કામગીરીનું સાચું અને ઉચિત ચિત્ર આપે એવા નાણાકીય પત્રકો તૈયાર કરવાની બાબતમાં કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૧૩૪(૫) માં જણાવેલ બાબતો માટે કંપનીનું નિયામક મંડળ જવાબદાર છે. આ જવાબદારીમાં કપટ અને અન્ય અનિયમિતતાઓ રોકવા, યોગ્ય હિસાબી નીતિઓ પસંદ કરવા અને લાગુ પાડવા અને શોધી કાઢવા રેકર્ડની નિભાવ, ઉચિત અને વિવેકપૂર્ણ નિર્ણયો અને અંદાજો કરવા, અને યોગ્ય તથા કપટ કે ભુલને તાત્વિક ખોટા નિવેદનોથી મુક્ત હોય એવું ચિત્ર આપે એવા નાણાકીય પત્રકોની તૈયારી અને તે રજૂ કરવા સાથે સુસંગત હોય એવા હિસાબી રેકર્ડની ચોક્કસાઈ અને સંપૂર્ણતા સુનિશ્ચિત કરવા, અસરકારક રીતે કામમાં આવતા પર્યાપ્ત આંતરિક નાણાકીય રેકર્ડની ડિઝાઇન, અમલ અને નિભાવનો પણ સમાવેશ થાય છે.

નાણાકીય નિવેદનો તૈયાર કરવામાં, નિયામક મંડળ કંપનીની સંચાલિત રહેવાની ક્ષમતા અને તેને જાહેર કરવાની અને સંબંધિત એકાઉન્ટિંગ કરવા માટે જવાબદાર છે, સિવાય કે જે નિયામક મંડળ કંપનીને બંધ કરવા અથવા કામગીરી બંધ કરવા માંગતા હોય અથવા આવું કરવા સિવાય કોઈ અન્ય વાસ્તવિક પસંદગીના હોય. નિયામક મંડળ કંપનીની નાણાકીય અહેવાલ પ્રક્રિયાની દેખરેખ માટે પણ જવાબદાર છે.

ઈન્ડ એએસ નાણાકીય નિવેદનોના ઓડિટ માટે ઓડીટરની જવાબદારીઓ :

અમારો ઉદ્દેશ્ય તે અંગે વ્યાજબી ખાતરી મેળવવાનો છે કે નાણાકીય નિવેદનો છેતરપિંડી અથવા ભુલને કારણે મહત્વપૂર્ણ ખોટા નિવેદનથી સંપૂર્ણપણે મુક્ત છે કે કેમ, અને અમારા અભિપ્રાય સહીત ઓડીટરનો રીપોર્ટ જારી કરવો. વ્યાજબી ખાતરી એ ઉચ્ચ સ્તરની ખાતરી છે. પરંતુ તે ખાંદેધરી નથી કે એસ.એ.એસ અનુસાર હાથ ધરવામાં આવેલ ઓડિટ હંમેશા કોઈ નોંધપાત્ર ખામી અસ્તિત્વમાં હોવાનું શોધી કાઢશે. અચોક્કસ નિવેદનો છેતરપિંડી અથવા ભુલથી પરિણમી શકે છે અને જે તેઓ નાણાકીય નિવેદનોના આધારે વ્યક્તિગત રીતે અથવા એકંદરમાં વપરાશકર્તાઓના આર્થિક નિર્ણયોને અસર કરે તેવી અપેક્ષા રાખવામાં આવે તો તે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

SAs મુજબના ઓડિટના ભાગરૂપે, અમે વ્યાવસાયિક નિર્ણયો લઈએ છીએ અને સમગ્ર ઓડિટમાં વ્યાવસાયિક સંશય જાળવીએ છીએ અમે:

- નાણાકીય નિવેદનોમાં ગેરસમજણના નોંધપાત્ર જોખમો ઓળખો અને આકારણી કરીએ છીએ પછી ભલે તે છેતરપિંડી અથવા ભુલને લીધે, તે જોખમો માટે ઓડિટ પ્રક્રિયાઓ ડિઝાઇન કરવી અને ચલાવવી અને ઓડિટ પુરાવા મેળવીએ છીએ જે અમારા મંતવ્ય માટેનો આધાર પુરો પાડવા માટે પુરતા અને યોગ્ય છે. છેતરપિંડીના પરિણામે મહત્વપૂર્ણ ખોટા નિવેદન ખબર ન પડવાનું જોખમ એ ભુલથી પરિણામેલા કરતા વધારે છે, કારણ કે છેતરપિંડીમાં જોડાણ, બનાવટી, ઈરાદાપૂર્વકની ભુલ, ખોટી રજૂઆત અથવા આંતરિક નિયંત્રણની ઓવરરાઈડ સામેલ હોઈ શકે છે.
- ઓડિટ કાર્યવાહીની રચના કરવા માટે ઓડિટ પ્રક્રિયા દરમિયાન આંતરિક નિયંત્રણને લગતી સમજ મેળવી કંપની અધિનિયમ, ૨૦૧૩

ની કલમ ૧૪૩(૩)(આઈ) હેઠળ, કંપની પાસે આર્થિક નાણાકીય નિયંત્રણની પુરતી વ્યવસ્થા છે કે કેમ અને આ પ્રકારના, નિયંત્રણોની અસરકારતા વિશે પણ અમારો મત વ્યક્ત કરવા માટે અમે જવાબદાર છીએ.

- ઉપયોગમાં લેવામાં આવતી હિસાબી નીતિઓની યોગ્યતા અને હિસાબોના અંદાજોની વ્યાજબીતા અને વ્યવસ્થાપકો દ્વારા સંબંધિત જાહેરાતોનું મૂલ્યાંકન કરીએ છીએ.
- મેનેજમેન્ટના ચાલુ રહેવાની ક્ષમતાની હિસાબી નીતિના ઉપયોગની યોગ્યતા પર નિષ્કર્ષ આપવો અને પ્રાપ્ત કરેલા ઓડિટ પુરાવાના આધારે પર શું કોઈ ઘટના અથવા શરતોથી સંબંધિત નોંધપાત્ર અનિશ્ચિતતા છે કે જે કંપનીની ચાલુ રહેવાની ક્ષમતા પર શંકા વ્યક્ત કરી શકે છે. જો અમે કોઈ તારણ કાઢીએ કે કોઈ નોંધપાત્ર અનિશ્ચિતતા અસ્તિત્વમાં છે, તો અમારે અમારા ઓડિટરન અહેવાલમાં નાણાકીય નિવેદનોમાં સંબંધિત ખુલાસા તરફ ધ્યાન આપવું આવશ્યક છે અથવા જો આવા ખુલાસા અપુરતા હોય, તો અમારો અભિપ્રાય સુધારવો પડશે. અમારા તારણો અમારા ઓડિટરના અહેવાલની તારીખ સુધી પ્રાપ્ત ઓડિટ પુરાવા પર આધારિત છે, જો કે ભાવિ ઘટનાઓ પરિસ્થિતિઓને કારણે કંપની ચાલુ રહેવાની સ્થિતિમાં ના પણ રહે.
- ખુલાસાઓ સહિતના નાણાકીય નિવેદનોની એકંદર પ્રસ્તુતિ, માળખું અને વિગતનું મૂલ્યાંકન કરીએ છીએ અને નાણાકીય નિવેદનો, અંતર્ગત વ્યવહારો અને પ્રસંગોને એવી રીતે રજૂ કરે છે કે જે યોગ્ય રજૂઆત પ્રાપ્ત કરે.

મહત્વપૂર્ણ વસ્તુ એ ઇન્ડ એએસ નાણાકીય નિવેદનોમાં ખોટી નિવેદનોની તીવ્રતા છે જે વ્યક્તિગત રીતે અથવા એકંદરે, તે સંભવિત બનાવે છે કે ઇન્ડ એએસ નાણાકીય નિવેદનોના વ્યાજબી જાણકાર વપરાશકર્તાના આર્થિક નિર્ણયો પ્રભાવિત થઈ શકે છે. (i) અમારા ઓડિટ કાર્યના અવકાશનું આયોજન કરવામાં અને અમારા કાર્યના પરિણામોનું મૂલ્યાંકન કરવામાં અને (ii) ઇન્ડ એએસ નાણાકીય નિવેદનોમાં ઓળખાયેલ કોઈપણ ખોટા નિવેદનોની અસરનું મૂલ્યાંકન કરવા માટે, અમે માત્રાત્મક ભૌતિકતા અને ગુણાત્મક પરિબલોને ધ્યાનમાં લઈએ છીએ;

અમે શાસનના નિરીક્ષકો સાથે ઓડિટના આયોજિત અવકાશ અને સમય અને આંતરીક નિયંત્રણમાં કોઈ નોંધપાત્ર ખામીઓ વિશે જે ઓડિટ દરમિયાન અમારા ધ્યાન પર આવેલ હોય બાબતે વાતચીત કરીએ છીએ.

અમે શાસનના નિરીક્ષકોને નિવેદન પણ આપીએ છીએ કે અમે સ્વતંત્રતા સંબંધિત નૈતિક આવશ્યકતાઓનું પાલન કર્યું છે અને તમામ સંબંધો અને અન્ય લગતી બાબતો જે અમારી સ્વતંત્રતાને અસર કરવા માટે યોગ્ય રીતે માનવામાં આવે છે, અને જ્યાં લાગુ હોય તો સંબંધિત સુરક્ષા પગલાં વિશે માહિતી આપીએ છીએ.

અમે તે બાબતોને નિર્ધારિત કરવા માટે શાસનના નિરીક્ષકો સાથે વાતચીત કરીએ છીએ જે વર્તમાન સમયગાળાના ઇન્ડ એએસ નાણાકીય નિવેદનોના ઓડિટમાં સૌથી મહત્વપૂર્ણ હતા અને તેથી તે મુખ્ય ઓડિટ બાબતો છે. અમે અમારા ઓડિટરના અહેવાલમાં આ બાબતોનું વર્ણન કરીએ છીએ સિવાય કે કાયદો અથવા નિયમન આ બાબતે જાહેર કરતા અટકાવે છે અથવા જ્યારે, ખુબ જ દુર્લભ સંજોગોમાં, અમે નિર્ધારિત કરીએ છીએ કે કોઈ બાબત અમારા અહેવાલમાં જણાવવા યોગ્ય નથી, કારણ કે આમ કરવાથી યથા દુષ્પ્રભાવોની આવા સંદેશાવ્યવહારના જાહેર હિતના લાભોને વટાવી દેવાની અપેક્ષા રાખી શકાય.

અન્ય કાનૂની અને નિયમનકારી જરૂરિયાતો પર રિપોર્ટ

૧. અધિનિયમની કલમ ૧૪૩(૧૧)ના સંદર્ભમાં કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા કંપનીઝ (ઓડિટરોનો અહેવાલ) હુકમ, ૨૦૨૦ ("હુકમ") ની જરૂરિયાત અનુસાર, અમે ફકરા ૩ અને ૪ માં ઉલ્લેખિત બાબતો પર અમારો અહેવાલ "જોડાણ ૬" માં રજૂ કરીએ છીએ.
૨. કોમ્પ્રોલર અને ઓડિટર જનરલે કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૪૩ ની પેટા-કલમ (૫) હેઠળ તપાસ કરવાના વિસ્તારને સૂચવતી સૂચનાઓ અને પેટા-સૂચનો જારી કર્યા છે. જેનું પાલન "જોડાણ ૫" માં સૂચવવામાં આવ્યું છે.
૩. અધિનિયમની કલમ ૧૪૩(૩) મુજબ, અમારા ઓડિટના આધારે અમે જાણ કરીએ છીએ કે:
 - ક. અમે તમામ માહિતી અને સ્પષ્ટતાઓ માંગી છે અને મેળવી છે જે, અમારી શ્રેષ્ઠ જાણકારી અને માન્યતા મુજબ, અમારા ઓડિટના હેતુઓ માટે જરૂરી હતા.
 - ખ. અમારા મતે, જ્યાં સુધી તે પુસ્તકોની અમારી તપાસ દર્શાવે છે, કંપની દ્વારા કાયદાની જરૂરિયાત મુજબ યોગ્ય હિસાબી પુસ્તકો જાળવવામાં આવ્યા છે.
 - ગ. આ અહેવાલમાં ધ્યાનમાં લેવામાં આવેલા સરવૈયું, નફા અને નુકસાનનું પત્રક (અન્ય વ્યાપક આવક સહિત), ઇક્વિટીમાં ફેરફારનું નિવેદન અને રોકડ પ્રવાહનું નિવેદન હિસાબી ચોપડા સાથે સુસંગત છે.
 - ઘ. અમારા મતે, ઉપરોક્ત ઇન્ડ એએસ નાણાકીય નિવેદનો અધિનિયમની કલમ ૧૩૩ હેઠળ નિર્ધારિત ભારતીય હિસાબી ધોરણોનું પાલન કરે છે.

- ચ. ૩૧ માર્ચ, ૨૦૨૩ ના રોજ કંપનીના નિયામકો તરફથી મળેલી લેખિત રજૂઆતોને નિયામક મંડળ દ્વારા રેકોર્ડ પર લેવાના આધારે, કોર્પોરેટ નિયામક, અધિનિયમની કલમ ૧૬૪(૨) ના સંદર્ભ માં નિયામક તરીકે નિમણૂક કરવા માટે ગેરલાયક ઠરાવ નથી.
- છ. નાણાકીય રિપોર્ટિંગ પર કંપનીના આંતરિક નાણાકીય નિયંત્રણોની પર્યાપ્તતા અને આવા નિયંત્રણોની કાર્યકારી અસરકારકતાના સંદર્ભમાં, “જોડાણ ગ” માં અમારો અલગ અહેવાલ જુઓ. અમારો અહેવાલ ઈન્ડ એએસ ના નાણાકીય નિવેદનોના સંદર્ભમાં કંપનીના આંતરિક નાણાકીય નિયંત્રણોની પર્યાપ્તતા અને કાર્યકારી અસરકારકતા પર અસંશોધિત અભિપ્રાય વ્યક્ત કરે છે.
- જ. સુધારેલા અધિનિયમની કલમ ૧૯૭(૧૬) દ્વારા આવશ્યકતા મુજબ ઓડિટરના અહેવાલમાં સમાવિષ્ટ અન્ય બાબતોના સંદર્ભમાં: કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા ૫ જૂન, ૨૦૧૫ના રોજ જારી કરાયેલ નોટિફિકેશન નંબર જીએસઆર ૪૬૩ (ઈ) મુજબ, ડિરેક્ટરના મહેનતાણા સંબંધિત કાયદાની કલમ ૧૯૭ કંપનીને લાગુ પડતી નથી, કારણ કે તે સરકારી કંપની છે.
- ઝ. કંપનીઝ (ઓડિટ અને ઓડિટર્સ) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૧૧ અનુસાર ઓડિટરના અહેવાલમાં સમાવિષ્ટ અન્ય બાબતોના સંદર્ભમાં, અમારા મતે અને અમારી શ્રેષ્ઠ જાણ મુજબ અને આપેલા ખુલાસા અનુસાર:
૧. કંપનીએ નોંધ ૩૬(૨) માં તેની નાણાકીય સ્થિતિ પર બાકી મુકદ્દમાની અસર તેના ઈન્ડ એએસ નાણાકીય નિવેદનોમાં જાહેર કરી છે.
 ૨. કંપની પાસે ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સ સહિત લાંબા ગાળાના કોઈ કોન્ટ્રાક્ટ્સ નહોતા, જેના માટે નોંધપાત્ર અપેક્ષિત નુકસાન થયું હતું.
 ૩. કંપની દ્વારા ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડમાં કોઈ રકમ તબદિલ કરવી જરૂરી ન હતી.
૪. (i) મેનેજમેન્ટે રજૂઆત કરી છે કે, તેની શ્રેષ્ઠ જાણકારી અને માન્યતા પ્રમાણે, નાણાકીય નિવેદનો નો ભાગ બનતી નોંધોમાં દર્શાવ્યા સિવાય, કંપની દ્વારા વિદેશી સંસ્થાઓ (વરેટીયાર્સ) સહિત અન્ય કોર્પોરેટ વ્યક્તિ(ઓ) અથવા એન્ટિટી(ઓ)ને અથવા તેમાં, કોઈ ફંડ (જે વ્યક્તિગત રીતે અથવા એકંદરે મહત્વપૂર્ણ છે) એડવાન્સ કે લોન્ડ કે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું નથી (કાં તો ઉધાર લીધેલું ફંડ અથવા શેર પ્રીમિયમ અથવા અન્ય કોઈ સ્ત્રોત અથવા પ્રકારના ફંડ્સ), એ સમજણ સાથે, લેખિતમાં નોંધાયેલ હોય અથવા અન્યથા, કે મધ્યસ્થીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, કંપની (અંતિમ લાભાર્થીઓ) દ્વારા અથવા તેના વતી કોર્પોરેટ રીતે ઓળખાયેલી અન્ય વ્યક્તિઓ અથવા સંસ્થાઓ માં ધિરાણ અથવા રોકાણ કરશે અથવા અંતિમ લાભાર્થીઓ વતી કોર્પોરેટ ગેરંટી, સુરક્ષા અથવા તેના જેવા પ્રદાન કરશે;
- (ii) મેનેજમેન્ટે રજૂઆત કરી છે કે, તેની શ્રેષ્ઠ જાણકારી અને માન્યતા પ્રમાણે, નાણાકીય નિવેદનો નો ભાગ બનતી નોંધોમાં દર્શાવ્યા સિવાય, કંપની દ્વારા કોર્પોરેટ વ્યક્તિ(ઓ) અથવા એન્ટિટી(ઓ) વિદેશી સંસ્થાઓ સહિત (ફંડિંગ પાર્ટીઓ) પાસેથી કોઈ ભંડોળ પ્રાપ્ત થયું નથી, એ સમજણ સાથે, લેખિતમાં નોંધાયેલ હોય અથવા અન્યથા, કે કંપની, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, ભંડોળ આપનાર પક્ષ (અંતિમ લાભાર્થીઓ) દ્વારા અથવા તેના વતી કોર્પોરેટ રીતે ઓળખાયેલી અન્ય વ્યક્તિઓ અથવા સંસ્થાઓમાં ધિરાણ અથવા રોકાણ કરશે અથવા અંતિમ લાભાર્થીઓની વતી કોર્પોરેટ ગેરંટી, સુરક્ષા અથવા તેના જેવા પ્રદાન કરશે;
- (iii) આવી ઓડિટ પ્રક્રિયાઓના આધારે કે જેને અમે સંજોગોમાં વ્યાજબી અને યોગ્ય માની છે, એવું કંઈ અમારા ધ્યાન પર આવ્યું નથી કે જે અમને એવું માનવા દોરી જાય કે પેટા-કલમ (i) અને (ii) હેઠળની રજૂઆતોમાં ભૌતિક ખોટા નિવેદનો છે.
૫. કંપની દ્વારા વર્ષ દરમિયાન જાહેર કરાયેલ અને ચૂકવવામાં આવેલ ડિવિડન્ડ કંપની અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૧૨૩ નું પાલન કરે છે.

મુકેશકુમાર જૈન એન્ડ કું. વતી
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ
(પેટી રજી. નં. ૧૦૬૬૧૯W)

રાજુત તીલ્લાની
(ભાગીદાર)
સભ્યપદ નં. : ૪૦૫૬૬૨
ચુડીઆઈએન : ૨૩૪૦૫૬૬૨BGUNPQ૨૨૦૦

સ્થળ : અમદાવાદ
તારીખ : ૨૬/૦૯/૨૦૨૩

સ્વતંત્ર ઓડિટરના અહેવાલનું જોડાણ “ક”

(સમાન તારીખના ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ ના સભ્યો પ્રતિ અમારા અન્ય કાનૂની અને નિયમનકારી જરૂરિયાતો પર રિપોર્ટ ના ફકરા ૧ માં ઉલ્લેખિત)

કંપની દ્વારા અમને આપવામાં આવેલા ખુલાસાઓ અને ઓડિટ મુજબ ના જનરલ કમમાં અમારા દ્વારા તપાસવામાં આવેલ એકાઉન્ટ બુક્સ અને રેકોર્ડ્સ અનુસાર , અમે જણાવીએ છીએ કે :

- (i) કંપનીના વિકાસ હેઠળ મિલકત, પ્લાન્ટ અને સાધનો અને અમૂર્ત સંપત્તિના સંદર્ભમાં:
 - (ક) કંપનીએ તેની મિલકત, પ્લાન્ટ અને સાધનોની સંપૂર્ણ વિગતો દર્શાવતો યોગ્ય રેકોર્ડ જાળવી રાખ્યો છે જેમાં માત્રાત્મક વિગતો અને મિલકતના ઉપયોગની સ્થિતિ અને અધિકારોની સંબંધિત વિગતોનો સમાવેશ થાય છે.
 - (ખ) અમને જાણ કરવામાં આવી હતી કે સ્થાયી અસ્કયામતોની તમામ મુખ્ય વસ્તુઓની ભૌતિક ચકાસણી વર્ષના અંતે મેનેજમેન્ટ દ્વારા હાથ ધરવામાં આવી હતી અને આવી ચકાસણીમાં કોઈ વિસંગતતા જોવામાં આવી ન હતી, જે સંકલન હેઠળના યોગ્ય રેકોર્ડને કારણે ચકાસી શકાયું નથી.
 - (ગ) અમને આપેલી માહિતી અને સ્પષ્ટતા મુજબ અને કંપનીના રેકોર્ડની અમારી તપાસના આધારે, સ્થાવર મિલકતોના ટાઈટલ ડીટ્સ કંપનીના નામે છે .
 - (ઘ) કંપનીએ વર્ષ દરમિયાન તેની કોઈપણ મિલકત, પ્લાન્ટ અને સાધનો (ઉપયોગના અધિકારની સંપત્તિ સહિત)નું પુનઃમૂલ્યાંકન કર્યું નથી.
 - (ચ) બેનામી ટ્રાન્ઝેક્શન્સ (પ્રોહિબિશન) અધિનિયમ, ૧૯૮૮ (૨૦૨૦ માં સુધારેલ) અને તેના હેઠળ બનાવેલા નિયમો હેઠળ કોઈપણ બેનામી મિલકત રાખવા માટે ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધીના વર્ષ દરમિયાન કંપની સામે કોઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી અથવા બાકી છે.
- (ii) (ક) અમને આપવામાં આવેલી માહિતી અને સમજૂતીઓ અનુસાર, કંપનીના મેનેજમેન્ટે યોગ્ય સમયાંતરે ઇન્વેન્ટરીની ભૌતિક ચકાસણી હાથ ધરી છે અને વર્ષ દરમિયાન આવી ભૌતિક ચકાસણીમાં કોઈ નોંધપાત્ર વિસંગતતા જોવા મળી નથી.
- (ખ) કંપનીને વર્તમાન અસ્કયામતોની સુરક્ષાના આધારે વર્ષ દરમિયાન કોઈપણ સમયે બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ પાસેથી કોઈપણ કાર્યકારી મૂડી મંજૂર કરવામાં આવી નથી, આમ, કંપનીઓ (ઓડિટરનો રિપોર્ટ) ઓર્ડર, ૨૦૨૦ ની કલમ ૩ (ii) (b) લાગુ પડતી નથી.
- (iii) વર્ષ દરમિયાન કંપનીએ કંપનીઓ, પેટીઓ, મર્યાદિત જવાબદારી ભાગીદારી અથવા અન્ય કોઈપણ પક્ષોમાં કોઈ રોકાણ કર્યું નથી, કોઈ ગેરંટી અથવા સુરક્ષા પ્રદાન કરી નથી અથવા સુરક્ષિત અથવા અસુરક્ષિત લોન દ્વારા કોઈપણ લોન અથવા એડવાન્સ મંજૂર કર્યા નથી. તેથી ઉપરોક્ત ઓર્ડર ના વિભાગો ૩(iii)(a), ૩(iii)(b), ૩(iii)(c), ૩(iii)(d), ૩(iii)(e), ૩(iii)(f) ની જોગવાઈઓ કંપનીને લાગુ પડતી નથી.
- (iv) કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૮૫ અને ૧૮૬ ની જોગવાઈઓ લોન, રોકાણ, ગેરંટી અને સુરક્ષાના સંદર્ભમાં પાલન કરવામાં આવી છે.
- (v) અમારા મતે અને અમને આપવામાં આવેલી માહિતી અને સ્પષ્ટતાઓ અનુસાર, કંપનીએ કંપનીઝ (થાપણોની સ્વીકૃતિ) નિયમો, ૨૦૧૪ ની જોગવાઈઓનું પાલન કર્યું છે. નિર્ધારિત ડિપોઝિટ સ્વીકારવામાં આવી નથી, તે મુજબ, ઓર્ડરની કલમ ૩(૬) ની જોગવાઈઓ કંપનીને લાગુ પડતી નથી.
- (vi) અમને આપવામાં આવેલી માહિતી અને ખુલાસાઓ અનુસાર, કેન્દ્ર સરકારે કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૪૮ ની કલમ (૧) હેઠળ અર્ચના રેકોર્ડની જાળવણી કરવાનું નિર્ધારિત કર્યું નથી .
- (vii) વૈધાનિક લેણાં અંગે અમને આપવામાં આવેલી માહિતી અને સ્પષ્ટતાઓ અનુસાર:
 - (ક) કંપની સામાન્ય રીતે યોગ્ય સત્તાવાળાઓ પાસે તેના નિર્વિવાદ વૈધાનિક લેણાં જમા કરાવવામાં નિયમિત રહી છે જેમકે પ્રોવિડન્ટ ફંડ, એમ્પ્લોયર્સ સ્ટેટ ઇન્સ્યુરન્સ, ઇક્કમ ટેક્સ, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ અને તેના પર લાગુ થતા અન્ય નોંધપાત્ર વૈધાનિક લેણાં અને માર્ચ ૩૧, ૨૦૨૩ ના રોજ આના સંદર્ભમાં ચૂકવવાપાત્ર કોઈ નિર્વિવાદ રકમ નથી કે જે તે બાકીની તારીખથી છ મહિના કરતાં વધુ સમયગાળા માટે બાકી રહે છે .
 - (ખ) અમને આપવામાં આવેલી માહિતી અને સ્પષ્ટતાઓ અનુસાર, કંપની પાસે ૩૧ માર્ચ, ૨૦૨૩ ના રોજ નીચે આપેલા સિવાય કોઈ વિવાદિત વૈધાનિક લેણાં નથી. રિપોર્ટની તારીખે કંપનીના રિફંડની સામે આ એડજસ્ટ કરવામાં આવ્યું હતું, તેથી રિપોર્ટની તારીખ પ્રમાણે કોઈ વિવાદિત રકમ બાકી નથી.

કાયદાનું નામ	ચુકવવાપાત્ર રકમની પ્રકૃતિ	રકમ (₹ લાખમાં)	સમયગાળો કે જેની સાથે રકમ સંબંધિત છે (આ.વ.)	ફોરમ જ્યાં વિવાદ બાકી છે
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧	આવકવેરા	૨૨.૫૪	આ.વ. ૨૦૧૬-૧૭	સી.આઈ.ટી. (અપીલ)
	કુલ	૨૨.૫૪		

- (viii) આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ (૧૯૬૧ ના ૪૩) હેઠળ કરની આકારણીમાં વર્ષ દરમિયાન આવક તરીકે સરન્ડર કરવામાં અથવા જાહેર કરવામાં આવી હોય તેવી આવક સાથે સંબંધિત કોઈ વ્યવહારો અગાઉ નોંધાયેલ ન હતા.
- (ix) ક. કંપનીએ વર્ષ દરમિયાન બેંકો અને નાણાકીય સંસ્થાઓને આપવામાં આવેલી લોન અથવા ઉધારની ચુકવણીમાં કોઈ ડિફોલ્ટ કર્યું નથી.
ખ. કંપનીને કોઈપણ બેંક અથવા નાણાકીય સંસ્થા દ્વારા અથવા સરકાર દ્વારા અથવા કોઈપણ સરકારી સત્તા દ્વારા વિલક્ષણ ડિફોલ્ટર જાહેર કરવામાં આવી નથી.
ગ. કંપનીએ વર્ષ દરમિયાન કોઈપણ બેંક અને નાણાકીય સંસ્થા પાસેથી ટર્મ લોન લીધી નથી, તેથી ઓર્ડરની કલમ ૩(ix)(c) હેઠળ રિપોર્ટિંગ લાગુ પડતું નથી.
ઘ. કંપનીના નાણાકીય નિવેદનોની એકંદર તપાસ પર, અમે અહેવાલ આપીએ છીએ કે કંપની દ્વારા ટૂંકા ગાળાના ધોરણે કોઈ ભંડોળ ઊભું કરવામાં આવ્યું નથી. તદનુસાર, ઓર્ડરની કલમ ૩(ix)(d) હેઠળ રિપોર્ટિંગ લાગુ પડતું નથી.
ચ. કંપનીના નાણાકીય નિવેદનોની એકંદર તપાસ પર, કંપનીએ તેની પેટાકંપનીઓ, સહયોગીઓ અથવા સંયુક્ત સાહસોની જવાબદારીઓને પૂર્ણ કરવા માટે કોઈપણ એન્ટિટી અથવા વ્યક્તિ પાસેથી કોઈ નાણાં પ્રાપ્ત કર્યાં નથી.
છ. કંપનીએ સિક્યોરિટીઝના ગીરવેથી વર્ષ દરમિયાન કોઈ લોન લીધી નથી અને તેથી ઓર્ડરની કલમ ૩(ix)(f) પર રિપોર્ટિંગ લાગુ પડતું નથી.
- (x) ક. કંપનીએ વર્ષ દરમિયાન પ્રારંભિક જાહેર ઓફર અથવા વધુ જાહેર ઓફર (ડેટ સાધનો સહિત) દ્વારા ભંડોળ એકત્ર કર્યું નથી અને તેથી ઓર્ડરની કલમ ૩(x)(a) હેઠળ જાણ કરવી લાગુ પડતી નથી.
ખ. વર્ષ દરમિયાન, કંપનીએ શેર અથવા કન્વર્ટિબલ ડિબેન્ટ્સ (સંપૂર્ણ અથવા આંશિક રીતે અથવા વૈકલ્પિક રીતે) ની કોઈ પ્રેફરન્શિયલ ફાળવણી અથવા ખાનગી પ્લેસમેન્ટ કર્યું નથી અને તેથી ઓર્ડરની કલમ ૩(x)(b) હેઠળ રિપોર્ટિંગ લાગુ પડતું નથી.
- (xi) ક. કંપની દ્વારા કોઈ છેતરપિંડી કરવામાં આવી નથી અને વર્ષ દરમિયાન કંપની પર કોઈ સામગ્રીની છેતરપિંડી નોંધવામાં આવી નથી અથવા તેની જાણ કરવામાં આવી નથી.
ખ. વર્ષ દરમિયાન અને આ અહેવાલની તારીખ સુધી કંપની અધિનિયમની કલમ ૧૪૩ ની પેટા કલમ (૧૨) હેઠળનો કોઈ અહેવાલ કંપનીઝ (ઓડિટ અને ઓડિટર્સ) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૧૩ હેઠળ નિર્ધારિત ફોર્મ ADT-૪ માં કેન્દ્ર સરકાર સમક્ષ દાખલ કરવામાં આવ્યો નથી.
ગ. અમને આપવામાં આવેલી માહિતી અને ખુલાસાઓ અનુસાર, કંપનીને વર્ષ દરમિયાન કોઈ વ્હિસલબ્લોઅર ફરિયાદ મળી નથી.
- (xii) અમારા મતે અને અમને આપવામાં આવેલી માહિતી અને સ્પષ્ટતાઓ અનુસાર, કંપની નિધિ કંપની નથી અને તેથી ઓર્ડરની કલમ ૩(xii) હેઠળ રિપોર્ટિંગ કંપનીને લાગુ પડતી નથી.
- (xiii) અમારા મતે અને અમને આપવામાં આવેલી માહિતી અને સમજૂતીઓ અનુસાર, કંપની સંબંધિત પક્ષો સાથેના તમામ વ્યવહારો માટે, જ્યાં લાગુ પડતું હોય, કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૭૭ અને ૧૮૮નું પાલન કરે છે અને સંબંધિત પક્ષના વ્યવહારોની વિગતો લાગુ ભારતીય એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ (એએસ) ૨૪, સંબંધિત પક્ષ જાહેરાતો દ્વારા આવશ્યકતા મુજબ ઇન્ડએએસ નાણાકીય નિવેદનોની નોંધોમાં જાહેર કરવામાં આવે છે.
- (xiv) ક. અમારા મતે કંપની પાસે તેના વ્યવસાયના કદ અને પ્રકૃતિને અનુરૂપ પર્યાપ્ત આંતરિક ઓડિટ સિસ્ટમ છે.
ખ. અમારી ઓડિટ પ્રક્રિયાઓની પ્રકૃતિ, સમય અને હદ નક્કી કરવા માટે, અમે ઓડિટ હેઠળના વર્ષ માટે કંપનીને વર્ષ દરમિયાન અને આજ સુધી જારી કરાયેલા આંતરિક ઓડિટ અહેવાલોને ધ્યાનમાં લીધા છે. કૃપા કરીને આંતરિક નાણાકીય નિયંત્રણ માટે સ્વતંત્ર ઓડિટરના અહેવાલ પરના અમારા અહેવાલનું “જોડાણ-ગ” જુઓ.
- (xv) અમારા મતે અને અમને આપવામાં આવેલી માહિતી અને સ્પષ્ટતાઓ અનુસાર, કંપનીએ વર્ષ દરમિયાન તેના ડિરેક્ટરો અથવા તેના ડિરેક્ટરો સાથે જોડાયેલ વ્યક્તિઓ સાથે કોઈપણ બિન-રોકડ વ્યવહારો કર્યાં નથી, તેથી કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૯૨ ની જોગવાઈઓ લાગુ પડતી નથી.
- (xvi) ક. કંપનીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અધિનિયમ, ૧૯૩૪ ની કલમ ૪૫-IA હેઠળ નોંધણી કરાવવી જરૂરી નથી. તેથી કલમ ૩(xvi)(a) હેઠળ

રિપોર્ટિંગ લાગુ પડવું નથી.

- ખ. અમારા મતે અને અમને આપવામાં આવેલી માહિતી અને સ્પષ્ટતા મુજબ, કલમ ૩(xvi)(b) કંપનીને લાગુ પડતી નથી.
- ગ. અમારા મતે અને અમને આપવામાં આવેલી માહિતી અને સ્પષ્ટતાઓ અનુસાર, કંપની ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિર્ધારિત નિયમોમાં નિર્ધારિત કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની (CIC) નથી.
- ઘ. ઓડિટ દરમિયાન અમને આપવામાં આવેલી માહિતી અને ખુલાસાઓ અનુસાર, ગ્રુપ પાસે કોઈ કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની (CIC) નથી. તદનુસાર, કલમ ૩(xvi)(d) ની જરૂરિયાતો લાગુ પડતી નથી
- (xvii) અમારા ઓડિટ દ્વારા આવરી લેવામાં આવેલા નાણાકીય વર્ષ દરમિયાન અને તેના તુરંત અગાઉના નાણાકીય વર્ષ દરમિયાન કંપનીને કોઈ રોકડ નુકસાન થયું નથી.
- (xviii) વર્ષ દરમિયાન કંપનીના સ્ટેચ્યુટરી ઓડિટરોએ કોઈ રાજીનામું આપ્યું નથી.
- (xix) નાણાકીય ગુણોત્તરનું અમારું મૂલ્યાંકન, જૂની પુરાણી નાણાકીય અસ્કયામતોની પ્રાપ્તિ અને નાણાકીય જવાબદારીઓની ચૂકવણીની અપેક્ષિત તારીખો, નાણાકીય નિવેદનો સાથેની અન્ય માહિતી અને નિયામક મંડળ અને મેનેજમેન્ટ પ્લાન વિશે અમારા જ્ઞાન અને ધારણાઓને સમર્થન આપતા પુરાવાના તપાસના આધારે, અમારા ધ્યાન પર એવું કંઈ આવ્યું નથી કે જેનાથી અમને એવું માનવામાં આવે કે ઓડિટ રિપોર્ટની તારીખે કોઈપણ ભૌતિક અનિશ્ચિતતા અસ્તિત્વમાં છે જે સૂચવે છે કે કંપની બેલેન્સ શીટની તારીખની તેની જવાબદારીઓને જ્યારે પણ તે બેલેન્સ શીટની તારીખથી એક વર્ષના સમયગાળાની અંદર ચૂકવવાપાત્ર હોય પૂર્ણ કરવામાં સક્ષમ નથી. જો કે, અમે ઉમેરીએ છીએ કે આ કંપનીની ભાવિ સફરતા વિશેની ખાતરી નથી. અમે વધુમાં જણાવીએ છીએ કે અમારો રિપોર્ટિંગ ઓડિટ રિપોર્ટની તારીખના તથ્યો પર આધારિત છે અને અમે ન તો બાંહેધરી આપીએ છીએ કે ન તો કોઈ ખાતરી આપીએ છીએ કે બાકી પડતી તમામ જવાબદારીઓ જે બેલેન્સશીટ ની તારીખથી એક વર્ષના સમય ગાળામાં ચૂકવવા પાત્ર થશે તે કંપની દ્વારા ચૂકવવામાં આવશે.
- (xx) ક. ચાલુ પ્રોજેક્ટ્સ સિવાય કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) માટે કંપની અધિનિયમની કલમ ૧૩૫ ની પેટા-કલમ (૫)ની બીજી જોગવાઈના અનુપાલનમાં આ અધિનિયમની અનુસૂચિ VII માં નિર્દિષ્ટ ફંડમાં ટ્રાન્સફરની આવશ્યકતા માટે કોઈ બિનખર્ચિત રકમ નથી, તદનુસાર, કલમ ૩(xx)(a) હેઠળનો આદેશ રિપોર્ટિંગ વર્ષ માટે લાગુ પડતો નથી. નોંધ ૩૬(૧) જુઓ. અમારા લાયક અભિપ્રાયોનો આધાર પણ જુઓ.
- ખ. ચાલુ પ્રોજેક્ટ્સના સંદર્ભમાં, કંપનીએ કંપની અધિનિયમની કલમ ૧૩૫(૬)ના પાલનમાં બેલેન્સ શીટની તારીખે બિનખર્ચિત કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર)ની રકમ નાણાકીય વર્ષના અંતથી ત્રીસ દિવસના સમયગાળાની અંદર ખાસ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવેલ નથી. નોંધ ૩૬(૧) જુઓ. અમારા લાયક અભિપ્રાયોનો આધાર પણ જુઓ.

મુકેશકુમાર જેન એન્ડ કું. વતી
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ
(પેટી રજી. નં. ૧૦૬૬૧૯W)

રાજીત તીલ્લાની
(ભાગીદાર)
સભ્યપદ નં. : ૪૦૫૬૬૨
યુડીઆઈએન : ૨૩૪૦૫૬૬૨BGUNPQ૨૨૦૦

સ્થળ : અમદાવાદ
તારીખ : ૨૬/૦૯/૨૦૨૩

સ્વતંત્ર ઓડિટરના રિપોર્ટ નું જોડાણ - “ખ”
(સમાન તારીખના ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ ના રિપોર્ટમાં ઉલ્લેખિત)
કંપની અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૧૪૩(૫) હેઠળ સી એન્ડ એજુ કચેરી દ્વારા આપેલ સૂચનાઓ મુજબ રિપોર્ટ

ક. સૂચનાઓ:

ક્રમ નં.	વિગત	ટીકા-ટીપ્પણ
૧.	શું કંપની પાસે તમામ હિસાબી વ્યવહારોની કામગીરી કરવા માટે કોઈ આઈટી સિસ્ટમ છે કેમ? જો ના હોય તો નાણાંકીય અસરો સાથે જો કોઈ હોય તો, હિસાબોની અખંડિતતા પર આઈટી સિસ્ટમની બહાર હિસાબોના વ્યવહાર માટે સૂચનો, સૂચિત કરી શકાય છે.	હા, વર્ષના અંતે બંધ સ્ટોકના વેલ્યુએશન સિવાય, કંપની તેના તમામ હિસાબી વ્યવહારો ટેલી સોફ્ટવેર દ્વારા કરવામાં આવે, સ્ટોકના વેલ્યુએશન ટેલી અંકાઉન્ટિંગ સોફ્ટવેર સાથે એકીકૃત નથી અને તે એમએસ ઓફિસ- એક્સલ ફાઇલમાં જાળવવામાં આવેલી માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. આર્થિક અસરો જો કોઈ હોય તો તે માટે ચોક્કસ કરી શકાતી નથી. વધુમાં કંપની ભૌતિક સ્વરૂપમાં સ્ટોક રેકોર્ડ જાળવી રહી છે. અમે આ સંદર્ભમાં "આંતરિક નાણાકીય નિયંત્રણો પર નાણાકીય અહેવાલ" ના અમારા અહેવાલ તરફ ધ્યાન દોરીએ છીએ.
૨.	હાલની લોનનું કોઈ પુર્નગઠન નથી લોન ભરપાઈ કરવામાં કંપનીની અસમર્થતાને લીધે કોઈ લેણદાર દ્વારા કંપનીના દેવુ/લોનવ્યાજ વગેરે જતું/ માંડવાળ કરવા વિગેરેના કિસ્સાઓ છે કે કેમ? જો હા, તો તેની નાણાંકીય અસર જણાવો.	ઓડિટ હેઠળ અમને આપેલ માહિતી મુજબ વર્ષ દરમિયાન હાલની લોનનું કોઈ પુર્નગઠન નથી લોન ભરપાઈ કરવામાં કંપનીની અસમર્થતાને લીધે કોઈ લેણદાર દ્વારા કંપનીના દેવુ/લોનવ્યાજ વગેરે જતું/ માંડવાળ કરવા વિગેરેના કિસ્સાઓ નથી.
૩.	રાજ્ય/કેન્દ્ર એજન્સીઓ તરફથી વિશિષ્ટ યોજનાઓ પ્રાપ્ત/પ્રાપ્ત કરવા યોગ્ય ભંડોળની શરતો અનુસાર યોગ્ય રીતે હિસાબી રાખવામાં/ઉપયોગ કરવામાં આવી?વિચલનનાકેસોની સૂચિ બનાવો.	ઓડિટ હેઠળ અમને આપેલ માહિતી મુજબ વર્ષ દરમિયાન રાજ્ય/કેન્દ્ર એજન્સીઓ તરફથી વિશિષ્ટ યોજનાઓ પ્રાપ્ત/પ્રાપ્ત કરવા યોગ્ય ભંડોળની શરતો અનુસાર યોગ્ય રીતે હિસાબી રાખવામાં/ઉપયોગ કરવામાં આવે છે.

ખ. પેટા સૂચનાઓ

૧. સામાન્ય

ક્રમ નં.	વિગત	ટીકા-ટીપ્પણ
૧.	કંપનીની માલિકીની જમીન પર દબાણ છે, દાવાકામ હેઠળ છે, ઉપયોગમાં નથી લેવાઈ અથવા ફાજલ જાહેર થઈ છે.	અમને આપેલ ખુલાસા અનુસાર કંપનીની માલિકીની જમીન પર દબાણ અને દાવાકામ નથી.કંપનીની માલિકીની અને ઉપયોગમાં નહીં લીધેલી જમીનની વિગત. (૧) સેક્ટર-૧૩ ખાતે ૫૫૦૦ ચો.મી. નો પ્લોટ. કોઈ જમીન ફાજલ નથી.
૨.	ધોરણોસરની ઔદ્યોગિક પ્રથાઓ અનુસાર નાણાંકીય વર્ષના અંતે ઉભા પાક/ઝાડની ભૌતિક ખરાઈ અને મૂલ્યાંકન કરવામાં આવ્યું છે કે કેમ ?	લાગુ પડતું નથી.
૩.	ભૌતિક ખરાઈ કરતાં માલૂમ પડેલ તંગી / વધારાના સમાયોજન પછી બિચારણના જથ્થાનું પેકીંગ/પ્રમાણન સામગ્રી અને અન્ય બાબતો જથ્થા રેકર્ડના આધારે લેવામાં આવી છે કે કેમ અને સ્ટોકના વધુ મૂલ્યાંકનમાં પરિણામે એવા જુના સ્ટોકનો ગુણવત્તાના બગાડને યોગ્ય બિચારણમાં લેવામાં આવેલ છે કે કેમ?	અમને આપેલ ખુલાસા અનુસાર બીજ પેકિંગ /પ્રમાણન સામગ્રીનો સ્ટોક, આંતરીક ઓડિટરે/બાહ્ય મેનેજરે ખરાઈ કરેલા રેકર્ડના આધારે લેવામાં આવેલ છે અને સંબંધિત સમાયોજનને યોગ્ય વિચારણમાં લેવામાં આવેલ છે.

ક્રમનં.	વિગત	ટીકા-ટીપ્પણ
૪.	તમામ ખેતી વિષયક ઉત્પાદનનો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવ્યા છે અને પૂરતો વીમા લેવામાં આવ્યો છે કે કેમ? કોઈ વીમો હક-દાવો નકારવામાં આવ્યો હોય તો વિગતોની જાણ કરવામાં આવે.	અમે તપાસેલા રેકર્ડ પર આધારીત, પ્રાપ્ત કરેલ કૃષિ ઉત્પાદન યોગ્ય રીતે સંગ્રહવામાં આવ્યું છે અને વીમા યોગ્ય રીતે લેવામાં આવ્યા છે.
૫.	લોન/સબસીડી/કૃષિ સામગ્રી લાભાર્થીઓને આપવા માટે અને કોઈ હોય તો વ્યાજ સાથે અને વસુલાત (લોન) લાભાર્થી પાસેથી કરવા કંપની પાસે અસરકારક યંત્ર રચના છે કે કેમ?	લાગુ પડતું નથી.
૬.	યોજનાઓના અમલ માટે સરકારી અનુદાન /સબસીડીઓને હિસાબી ધોરણો અનુસાર હિસાબે લેવામાં આવે છે. અને અભિપ્રેત હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.	અમને આપેલી માહિતી મુજબ અને અમારી શ્રેષ્ઠ જાણકારી પ્રમાણે સરકાર પાસેથી લેવામાં આવેલ અનુદાન/સબસીડીઓની વર્ષ સંપૂર્ણ ઉપયોગ અભિપ્રેત માટે કરવામાં આવ્યો હતો.
૭.	છોડી દીઘેલી પરિયોજનાઓ પર કરેલ ખર્ચની માંડવાળ કરી છે કે કેમ?	કૃપા કરીને લાયક અભિપ્રાય માટેના આધાર હેઠળ મુખ્ય ઓડિટ રિપોર્ટનો સંદર્ભ લો.

૨. કૃષિ આધારીત ઉદ્યોગો

ક્રમ નં.	વિગત	ટીકા-ટીપ્પણ
૧.	કેટલીક પ્રવૃત્તિ કરવા માટે કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર અથવા એમની સંસ્થાઓ પાસેથી મેળવેલ અનુદાન/સબસીડીઓ બીજે વાળવાના કેસોની જાણ કરો.	બીજે વાળવાના કેસ માલુમ પડ્યા ન હતા.
૨.	કેટલીક પરિયોજનાઓ / યોજનાઓ માટે મળેલી રકમોના બિન-ઉપયોગને લીધે મળેલ વ્યાજને ખોટી રીતે હિસાબમાં લેવાના કેસ	કૃપા કરીને મુખ્ય ઓડિટ રિપોર્ટમાં લાયક અભિપ્રાય માટેનો આધાર હેઠળ પેરા (a) નો સંદર્ભ લો.

ક્રમ.નં.	વિગત	ટીકા-ટીપ્પણ
૩.	તમામ ખર્ચ અંગભૂત ભાગ આવરી લેવાયાનું સુનિશ્ચિત કરવા કંપનીએ ઘડેલી ભાવ નીતિ તપાસો	અમને સમજાવ્યા મુજબ વ્યવસ્થાપકો અને યોગ્ય સત્તાધિકારીઓની મંજૂરીથી ભાવ નીતિ ઘડવા માટે કંપનીનો માર્કેટિંગ વિભાગ જવાબદાર છે. ઓડિટ દરમિયાન, અમને જાણ કરવામાં આવી છે કે નિગમ પાસે ઉત્પાદનોની કિંમતો અંગે કોઈ ઓપચારિક લેખિત નીતિ નથી, જે કે ઉત્પાદનોની કિંમતોની ચકાસણી કરતી વખતે એવું જોવામાં આવ્યું છે કે નિગમ સામાન્ય રીતે ઉત્પાદનોની કિંમત નિર્ધારણમાં તમામ ખર્ચ ઘટકોને આવરી લે છે જેથી તે પુનઃપ્રાપ્ત થાય.
૪.	પ્લાન્ટ અને યંત્ર સામગ્રીના ઉપયોગ અને જો લાગુ પડે તો એના લુપ્તપ્રાયની મર્યાદા અંગે અહેવાલ આપો.	અમને જણાવ્યા પ્રમાણે તમામ પ્રક્રિયા પ્લાન્ટ અને યંત્રસામગ્રીનો વર્ષ દરમિયાન ઉપયોગ થયો છે.

મુકેશકુમાર જૈન એન્ડ કું. વતી
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ
(પેટી રજી. નં. ૧૦૬૬૧૯W)

રાજીત તીલ્લાની
(ભાગીદાર)
સભ્યપદ નં. : ૪૦૫૬૬૨
યુડીઆઈએન : ૨૩૪૦૫૬૬૨BGUNPQ૨૨૦૭

સ્થળ : અમદાવાદ
તારીખ : ૨૬/૦૯/૨૦૨૩

સ્વતંત્ર ઓડિટરના રિપોર્ટ નું જોડાણ - “ગ”

(સમાન તારીખના ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ ના સભ્યો પ્રતિ અમારા અન્ય કાનૂની અને નિયમનકારી જરૂરિયાતો પર રિપોર્ટ ના ફકરા ૩(છ) માં ઉલ્લેખિત)

કંપની અધિનિયમ, ૨૦૧૩ (“અધિનિયમ”) ની કલમ ૧૪૩ ની પેટા કલમ ૩ ની કલમ (i) હેઠળ નાણાકીય અહેવાલ પર આંતરિક નાણાકીય નિયંત્રણો પર અહેવાલ

ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ (કંપની) ના તા.૩૧મી માર્ચ, ૨૦૨૩ ના નાણાકીય નિવેદનો પરના આંતરિક નાણાકીય નિયંત્રણો અમે ઓડિટ કર્યું છે તે જે વર્ષ અને તે તારીખના સંદર્ભ અમારા ઓડિટ કરેલા નાણાકીય વિવરણો સાથે જોડાણમાં છે.

આંતરીકી નાણાકીય નિયંત્રણ માટે પ્રબંધનની જવાબદારી :

કંપનીનું સંચાલન, ઇ ઇન્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા જરી કરવામાં આવતી નાણાકીય રીપોર્ટિંગ અંગેના આંતરીક નાણાકીય નિયંત્રણના ઓડિટ અંગેના માર્ગદર્શિકા નોંધમાં ઉલ્લેખિત આંતરીક નિયંત્રણના આવશ્યક ઘટકો ધ્યાનમાં લેતા કંપની દ્વારા સ્થાપિત નાણાકીય અહેવાલના માપદંડ પર આંતરીક નિયંત્રણના આધારે આંતરીક નાણાકીય નિયંત્રણો સ્થાપિત કરવા અને જાળવવા માટે જવાબદાર છે. આ જવાબદારીઓમાં કંપનીની નીતિઓ, તેની સંપત્તિની સલામતી, તેના વ્યવસાયની વ્યવસ્થિત અને કાર્યક્ષમ વ્યવહાર અને વિશ્વસનીય નાણાકીય માહિતીની સમયસર તૈયારી, કંપની અધિનિયમ, ૨૦૧૩ હેઠળ હિસાબી રેકોર્ડની ચોકસાઈ અને સંપૂર્ણતાની ખાતરી કરવા માટે અસરકારક આંતરીક નાણાકીય નિયંત્રણોની રચના, અમલ અને જાળવણી સામેલ છે.

ઓડિટર્સની જવાબદારી :

નાણાકીય રીપોર્ટિંગમાં નિગમના આંતરીક નાણાકીય નિયંત્રણ પર અમારી અભિપ્રાય વ્યક્ત કરવાની જવાબદારી અમારી છે. અમે કાયદાની કલમ ૧૪૩(૧૦) અંતર્ગત અને નિદર્શક નોંધ મુજબ આંતરીક નાણાકીય નિયંત્રણ પુરતા ઓડિટ ધોરણો સાથે ઓડિટ કાર્ય પૂર્ણ કર્યું છે. તેવા ધોરણોમાં અને નિદર્શક નોંધની આવશ્યકતાઓની નૈતિકતાની જરૂરિયાતો સહિત પરિપાલન કરી ઓડિટનું આયોજન અને કામગીરી થકી અમે એવી વ્યાજબી ખાત્રી મેળવવા કે નાણાકીય અહેવાલમાં નાણાકીય નિયંત્રણની પર્યાપ્ત પધ્ધતિનું સ્થાપન અને નિભાવ થયાં છે કે નહીં? વળી આવા નિયંત્રણો બધાજ મહત્વપૂર્ણ સંચાલનમાં અસરકારક રહેવાં છે કે કેમ? નાણાકીય રીપોર્ટિંગ ઉપર અને સંચાલન પ્રભાવિતામાં આંતરીક નાણાકીય નિયંત્રણની તપાસવા ઓડિટ પુરાવા મેળવવાનું અમારી ઓડિટ પ્રક્રિયા અને કામગીરીમાં સામેલ છે.

નાણાકીય રીપોર્ટિંગ ઉપર આંતરીક નાણાકીય નિયંત્રણના ઓડિટમાં, એ બાબત પણ સામેલ છે કે કોઈ મહત્વપૂર્ણ નબળાઈ જો હયાત હોય તેવા જોખમનું આકલન કરવું, તેની ચકાસણી અને મૂલ્યાંકન કરી પધ્ધતિના સ્વરૂપ અને સંચાલન વ્યવસ્થાની અસરકારકતાનું ઓડિટ કરવું. આ માટે પંસદ કરેલી પધ્ધતિનો આધાર ઓડિટરના નિર્ણય પર રહેલો છે. જેમાં નાણાકીય વિવરણોમાં ધોખાખડી કે ભુલને કારણ કોઈ મહત્વપૂર્ણ બાબતે ખોટું રીપોર્ટિંગ ન થાય તે બાબતનો પણ સમાવેશ હોય છે.

અમે માનીએ છીએ કે અમે જે ઓડિટ પુરાવા મેળવ્યા છે તે પુરતા અને પર્યાપ્ત છે અમારી ઓડિટ અભિપ્રાય બાંધવા તે યોગ્ય આધાર પુરો પાડે છે કે નિગમના નાણાકીય રીપોર્ટિંગ પર તેનો આંતરિક નાણાકીય નિયંત્રણની પધ્ધતિ અસરકારક છે.

નાણાકીય રીપોર્ટિંગ પર આંતરીક નાણાકીય નિયંત્રણોનો મતલબ :

નાણાકીય અહેવાલ ઉપર કંપનીના આંતરીક નિયંત્રણની બાબત એ નાણાકીય અહેવાલ અંગે વ્યાજબી ખાત્રી કરી પુરી પાડનારા સ્વરૂપ માટેની પ્રક્રિયા છે તેમજ એ નાણાકીય વિવરણો, બહારના હેતુ માટે, સામાન્ય રીતે સ્વીકૃત એવા હિસાબી સિધ્ધાંતો મુજબ તૈયાર કરવાની પ્રક્રિયા છે કંપની નાણાકીય અહેવાલ ઉપરના આંતરિક નિયંત્રણ અંતર્ગત એવી નીતિનો અને પ્રક્રિયાનો સમાવેશ થાય છે કે જે

- (૧) વ્યાજબી વિગતો, ચોક્કસાઈ અને ન્યાયી રીતે રેકર્ડ નિભાવનું પ્રતિબિંબ પાડતી હોય જેમાં કંપનીની અસકચામતોનો નિકાલ અને અહેવાલનો સમાવેશ થયો હોય.
- (૨) એવી વ્યાજબી ખાત્રી પુરાં પાડતા હોય કે જે વ્યવહારોની નોંધણી, એવા હિસાબી સિધ્ધાંતો અનુસાર થઈ હોય જે સામાન્ય રીતે સ્વીકૃત એવા અને તૈયાર કરવાની મંજૂરી પ્રાપ્ત અધિકૃત વિવરણો તથા કંપનીની આવક અને ખર્ચના વ્યવહારો, પ્રબંધનની અધિકૃત મુજબ તથા કંપનીના નિયામકોની મંજૂરી કર્યાં હોય.
- (૩) નાણાકીય વિવરણો પર જેની નોંધપાત્ર અસર કે પ્રભાવ વર્તાતો હોય તેવી અસ્કચામતોના અનઅધિકૃત સંપાદન, ઉપયોગ કે નિકાલ અંગે સમયસરનાં નિરોધ અથવા તે અંગેની શોધ માટે વ્યાજબી ખાત્રી પુરી પાડવી.

નાણાંકીય નિવેદનો ઉપર આંતરિક નાણાંકીય નિયંત્રણોની સ્વાભાવિક મર્યાદાઓ :

નાણાંકીય રીપોર્ટિંગ પર આંતરિક નિયંત્રણોની સ્વાભાવિક મર્યાદાઓને જેમાં પ્રબંધન દ્વારા વહીવટ, ગુપ્ત પ્રપંચ કે નિયંત્રણોનો આંતરિક, નોંધપાત્ર ગેરઅહેવાલ, ભુલ કે ધોખાધડીને કારણે શોધી ન શકાયા હોય તેવી બાબતનો સમાવેશ હોય છે. વળી નાણાંકીય નિવેદનો પર આંતરિક નાણાંકીય નિયંત્રણોનો ભાવિ સમયગાળા માટેના મૂલ્યાંકનના આલેખને એવા જોખમને અધિન હોય છે જેને કારણે નાણાંકીય નિવેદન અપર્યાપ્ત પ્રક્રિયાને અનુસરવાની બાબત નિમ્ન સ્તરે જતી જણાય.

મહત્વની બાબત :

નીચેના તરફ ભાર મૂકવામાં આવે છે

૧. ઓડિટ દરમિયાન એ નોંધવામાં આવ્યું હતું કે સ્ટોક વસ્તુઓને એકાઉન્ટિંગ સોફ્ટવેર દ્વારા નિયમિત રીતે રૂટ કરવામાં આવતી નથી. ભૌતિક રેકોર્ડ્સમાં સ્ટોક પર નિયંત્રણ જાળવવામાં આવે છે. આવા નિયંત્રણોની નાણાકીય નિવેદનો પર અસર થઈ શકે છે.
૨. ઓડિટ દરમિયાન એ નોંધવામાં આવ્યું હતું કે સમયસર સમાધાન અને વર્ષના અંતે બેલેન્સની પુષ્ટિના સંદર્ભમાં આંતરિક નિયંત્રણ મજબૂત થઈ શકે છે. અસંયમિત રકમ નાણાકીય નિવેદનો પર સંભવિત અસર કરી શકે છે.

ઉપરોક્ત બાબતોનો સંદર્ભમાં અમારો અભિપ્રાય સુધારેલ નથી.

અભિપ્રાય :

અમારા મતે, નિયંત્રણ માપદંડના ઉદ્દેશ્યોની સિદ્ધિ પર ઉપર વર્ણવેલ મહત્વની નબળાઈઓની અસરો/સંભવિત અસરો સિવાય, કંપની પાસે તમામ મહત્વની બાબતોમાં, નાણાકીય રિપોર્ટિંગ પર પર્યાપ્ત આંતરિક નાણાકીય નિયંત્રણ સિસ્ટમ છે અને ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલ નાણાકીય રિપોર્ટિંગ પર આંતરિક નાણાકીય નિયંત્રણોના ઓડિટ પર માર્ગદર્શિકા નોંધમાં જણાવેલ આંતરિક નિયંત્રણના આવશ્યક ઘટકોને ધ્યાનમાં લઈને કંપની દ્વારા સ્થાપિત નાણાકીય રિપોર્ટિંગ માપદંડો પરના આંતરિક નિયંત્રણના આધારે, નાણાકીય રિપોર્ટિંગ પર આવા આંતરિક નાણાકીય નિયંત્રણો ૩૧મી માર્ચ, ૨૦૨૩ ના દિવસે અસરકારક રીતે કાર્યરત હતા.

મુકેશકુમાર જૈન એન્ડ કું. વતી
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ
(પેટી રજી. નં. ૧૦૬૬૧૯W)

રાજીત તીલ્લાની
(ભાગીદાર)
સભ્યપદ નં. : ૪૦૫૬૬૨
યુડીઆઈએન : ૨૩૪૦૫૬૬૨BGUNPQ૨૨૦૭

સ્થળ : અમદાવાદ
તારીખ : ૨૬/૦૯/૨૦૨૩

તા.૩૧મી માર્ચ, ૨૦૨૩ ના રોજનું સરવૈયું

(₹ લાખમાં)

	વિગત	નોંધ નં.	તા.૩૧મી માર્ચ, ૨૦૨૩ ના રોજ	તા.૩૧મી માર્ચ, ૨૦૨૨ ના રોજ
I	અસ્કયામતો			
૧	બિન-વર્તમાન અસ્કયામતો			
	(ક) મિલકત, પ્લાન્ટ અને સાધનો	૩	૪,૪૭૦.૯૭	૪,૭૨૧.૨૫
	(ખ) પ્રગતિ હેઠળના મૂડી કાર્યો	૪	-	૨૩.૪૪
	(ગ) રોકાણ મિલકત	૫	૪.૪૧	૪.૬૩
	(ઘ) અન્ય અમૂર્ત અસ્કયામતો	૬	૭.૦૯	૭.૦૯
	(ચ) નાણાકીય અસ્કયામતો			
	(i) અન્ય નાણાકીય અસ્કયામતો	૭	૧૧.૬૫	૯.૫૦
	(છ) વિલંબીત કર અસ્કયામતો (નેટ)	૮	-	૧૩.૯૩
૨	વર્તમાન અસ્કયામતો			
	(ક) માલ સામાનની યાદી	૯	૬,૬૬૪.૫૦	૫,૪૩૮.૦૫
	(ખ) નાણાકીય અસ્કયામતો			
	(i) રોકાણ	૧૦	૨૫,૩૦૭.૪૮	૨૩,૩૦૦.૦૦
	(ii) વ્યાપારિક લેણાં	૧૧	૪,૩૬૭.૬૪	૩,૭૪૫.૩૩
	(iii) રોકડ અને રોકડ સમકક્ષ	૧૨	૬,૬૧૫.૧૪	૧૦,૭૦૧.૦૩
	(iv) અન્ય નાણાકીય અસ્કયામતો	૧૩	૪૩૪.૮૪	૬૮૫.૧૭
	(ગ) વર્તમાન કર અસ્કયામતો (નેટ)	૧૪	૧૯.૫૯	૭૦.૪૭
	(ઘ) અન્ય વર્તમાન અસ્કયામતો	૧૫	૩૩૫.૧૬	૩૭૪.૧૮
	કુલ અસ્કયામતો		૪૮,૨૩૮.૪૭	૪૯,૦૯૪.૦૭
II	ઘડિવટી અને જવાબદારીઓ			
૧	ઘડિવટી			
	(ક) ઘડિવટી શેર મૂડી	૧૬	૩૯૩.૦૦	૩૯૩.૦૦
	(ખ) અન્ય ઘડિવટી	૧૭	૩૩,૪૫૭.૦૯	૩૧,૫૨૦.૧૪
૨	જવાબદારીઓ			
(I)	બિન વર્તમાન જવાબદારીઓ			
	(ક) સરકાર તરફથી મળેલ મૂડી અનુદાન	૧૮	૨,૫૪૬.૮૭	૨,૬૯૦.૧૦
	(ખ) નાણાકીય જવાબદારીઓ			
	(i) લીઝ જવાબદારીઓ		૧૧.૦૪	૭.૭૪
	(ii) અન્ય નાણાકીય જવાબદારીઓ	૧૯	૨૯૭.૪૧	૨૯૦.૨૯
	(ગ) અન્ય બિન વર્તમાન જવાબદારીઓ	૨૦	૧૩૨.૭૨	૧૮૫.૩૮
	(ઘ) વિલંબિત કર જવાબદારીઓ (નેટ)	૮	૬.૪૧	-
(II)	વર્તમાન જવાબદારીઓ			
	(ક) નાણાકીય જવાબદારીઓ			
	(i) વ્યાપારિક દેણાં	૨૧		
	માઇક્રો અને લઘુ સાહસોને કુલ બાકી દેણાં		-	-
	માઇક્રો અને લઘુ સાહસો સિવાયના કુલ બાકી દેણાં		૧,૯૫૪.૫૯	૨,૧૦૦.૩૨
	(ii) લીઝ જવાબદારીઓ		૧૦.૬૯	૧.૮૫
	(i) અન્ય નાણાકીય જવાબદારીઓ	૨૨	૧૨૪.૭૫	૯૩.૦૦
	(ક) અન્ય વર્તમાન જવાબદારીઓ	૨૩	૯,૨૨૮.૪૮	૧૧,૫૮૯.૮૧
	(ખ) જોગવાઈઓ	૨૪	૭૫.૪૧	૨૨૨.૪૩
	કુલ ઘડિવટિ અને જવાબદારીઓ		૪૮,૨૩૮.૪૭	૪૯,૦૯૪.૦૭
-	નોંધપાત્ર હિસાબી નીતિઓ	૧-૨		
-	નાણાકીય નિવેદનોનો ભાગ બનતી નોંધો	૩૬		

આ સાથે જોડેલા સમાન તારીખના અમારા અહેવાલ મુજબ

મુકેશકુમાર જેન એન્ડ કું. વતી
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ
(પેટી રજી. નં. ૧૦૬૬૧૯૫)

રાજીત તીલ્લાની
(ભાગીદાર)
સભ્યપદ નં. : ૪૦૫૬૬૨
યુડીઆઈએન : ૨૩૪૦૫૬૬૨BGUNPQ૨૨૦૭

સ્થળ : અમદાવાદ
તારીખ : ૨૬-૦૯-૨૦૨૩

નિયામક મંડળ અને એમના વતી

એ. કે. રાકેશ, IAS
અધ્યક્ષ
(DIN:૦૦૬૩૮૧૯)

એસ. એન. દેવડા
(મેનેજર નાણા)

પી. એસ. રબારી
વહીવટી નિયામક
(DIN:૮૯૯૬૭૬૫)

કે. એમ. રાવલ
(કંપની સેક્રેટરી)

સ્થળ : ગાંધીનગર
તારીખ : ૨૬-૦૯-૨૦૨૩

તા.૩૧મી માર્ચ, ૨૦૨૩ ના રોજ પુરા થયેલા વર્ષનું નફા-નુકશાન પત્રક

(₹ લાખમાં)

	વિગત	નોંધ નં.	તા.૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ પુરા થયેલ વર્ષ	તા.૩૧મી માર્ચ, ૨૦૨૨ના રોજ પુરા થયેલ વર્ષ
	આવક :			
I	સંચાલન દ્વારા આવક	૨૫	૧૯,૬૯૦.૫૩	૨૦,૫૮૧.૪૮
II	અન્ય આવક	૨૬	૧,૪૬૧.૪૬	૧,૬૨૩.૦૫
III	કુલ આવક : (I+II)		૨૧,૧૫૧.૯૯	૨૨,૨૦૪.૫૩
	ખર્ચ :			
IV	વપરાયેલી સામગ્રીની કિંમત	૨૭	૫૫૪.૮૬	૪૧૭.૫૫
	સ્ટોક-ઇન-ટ્રેડમાં ખરીદી	૨૮	૧૬,૮૬૯.૦૭	૧૬,૦૯૮.૬૨
	તૈયાર માલ, કામમાં પ્રગતિ અને સ્ટોક-ઇન-ટ્રેડની યાદીમાં ફેરફાર	૨૯	(૧,૫૨૨.૬૮)	(૪૧૩.૬૫)
	કર્મચારી લાભ ખર્ચ	૩૦	૧,૦૨૮.૦૬	૯૬૭.૧૭
	નાણાકીય ખર્ચ	૩૧	૨૮.૫૭	૨૫.૦૨
	અવમૂલ્યન અને ઋણમુક્તિ ખર્ચ	૩૨	૧૫૦.૭૧	૧૭૬.૫૮
	અન્ય ખર્ચ	૩૩	૧.૪૫૯.૩૩	૧,૬૬૫.૨૧
	કુલ ખર્ચ (IV)		૧૮,૫૬૭.૯૨	૧૮,૯૩૬.૫૦
V	અપવાદરૂપ વસ્તુઓ અને કર પહેલાનો નફો (III-IV)		૨,૫૮૪.૦૭	૩,૨૬૮.૦૩
VI	અપવાદરૂપ વસ્તુઓ (આવક / ખર્ચ)	-	-	-
VII	નફો / નુકશાન (કર પહેલા) (V + VI)		૨,૫૮૪.૦૭	૩,૨૬૮.૦૩
VIII	કર ખર્ચ : -			
	૧ વર્તમાન કર			
	- વર્ષ માટે		૬૪૫.૦૦	૯૧૧.૦૦
	- પહેલાનાં વર્ષો માટે (નેટ)		-	-
	૨ વિલંબિત કર (નેટ)		૪.૦૮	(૧૩.૬૦)
	કુલ કર ખર્ચ:		૬૪૯.૦૮	૮૯૭.૪૦
IX	ચાલુ કામગીરી થી સમયગાળા માટે નફો/(નુકશાન) (VII-VIII)		૧,૯૩૪.૯૯	૨,૩૭૦.૬૩
X	બંધ કામગીરીમાંથી નફો / (નુકશાન)		-	-
XI	બંધ કરેલી કામગીરીનો કર ખર્ચ		-	-
XII	બંધ કરાયેલ કામગીરી (ટેક્સ પછી) માંથી નફો/(નુકશાન) (X-XI)		-	-
XIII	સમયગાળા માટે નફો/(નુકશાન) (IX+XIII)		૧,૯૩૪.૯૯	૨,૩૭૦.૬૩
XIV	અન્ય વ્યાપક આવક			
	ક આઇટમ્સ કે જે નફા અને નુકશાન માટે ફરીથી વગીકૃત કરવામાં આવશે નહીં.			
	- વ્યાખ્યાયિત લાભ યોજનાઓ પર ફરીથી માપન નુકશાન	૩૪	૬૪.૬૦	(૬.૫૧)
	વ્યાખ્યાયિત લાભ યોજનાઓ પર પુનઃ માપન નુકશાન પર આવકવેરો		(૧૬.૨૬)	૧.૬૪
	ખ આઇટમ્સ કે જે નફા અને નુકશાન માટે ફરીથી વગીકૃત કરવામાં આવશે.		-	-
			૪૮.૩૪	(૪.૮૭)
	સમયગાળા માટે કુલ વ્યાપક આવક (XIII+XIV)		૧,૯૮૩.૩૩	૨,૩૬૫.૭૫
XV	(સમયગાળા માટે વ્યાપક નફો અને અન્ય વ્યાપક આવક)			
	ઇક્વિટી શેર દીઠ કમાણી: કામગીરી ચાલુ રાખવા માટે)			
	૧ મૂળભૂત (ફેસ વેલ્યુ ૧૦૦ રૂપિયા પ્રતિ શેર)	૩૫	૫૦૫.૦૦	૬૦૨.૦૦
	૨ મંદિત (ફેસ વેલ્યુ ૧૦૦ રૂપિયા પ્રતિ શેર)	૩૫	૫૦૫.૦૦	૬૦૨.૦૦

XVI	ઇકિવટી શેર ટીક કમાણી: બંધ કામગીરી દરમ્યાન)			
	૧ મૂળભૂત (ફેસ વેલ્યુ ૧૦૦ રૂપિયા પ્રતિ શેર)	-	-	-
	૨ મંદિત (ફેસ વેલ્યુ ૧૦૦ રૂપિયા પ્રતિ શેર)	-	-	-
XVII	ઇકિવટી શેર ટીક કમાણી: બંધ અને ચાલુ કામગીરી દરમ્યાન)			
	૧ મૂળભૂત (ફેસ વેલ્યુ ૧૦૦ રૂપિયા પ્રતિ શેર)	૩૫	૫૦૫.૦૦	૬૦૨.૦૦
	૨ મંદિત (ફેસ વેલ્યુ ૧૦૦ રૂપિયા પ્રતિ શેર)	૩૫	૫૦૫.૦૦	૬૦૨.૦૦
-	નોંધપાત્ર હિસાબી નીતિઓ	૧-૨		
-	નાણાંકીય નિવેદનોનો ભાગ બનતી નોંધો	૩૬		

આ સાથે જોડેલા સમાન તારીખના અમારા અહેવાલ મુજબ

મુકેશકુમાર જૈન એન્ડ કું. વતી
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ
(પેટી રજુ. નં. ૧૦૬૬૧૯W)

રાજીત તીલ્લાની
(ભાગીદાર)
સભ્યપદ નં. : ૪૦૫૬૬૨
ચુડીઆઈએન : ૨૩૪૦૫૬૬૨BGUNPQ૨૨૦૭

સ્થળ : અમદાવાદ
તારીખ : ૨૬-૦૯-૨૦૨૩

નિયામક મંડળ અને એમના વતી

એ. કે. રાકેશ, IAS
અધ્યક્ષ
(DIN:૦૦૬૩૮૧૯)

પી. એસ. રબારી
વહીવટી નિયામક
(DIN:૮૯૯૬૭૬૫)

એસ. એન. દેવડા
(મેનેજર નાણા)

કે. એમ. રાયલ
(કંપની સેક્રેટરી)

સ્થળ : ગાંધીનગર
તારીખ : ૨૬-૦૯-૨૦૨૩

તા. ૩૧મી માર્ચ, ૨૦૨૩ ના રોજ પુરા થયેલા વર્ષ માટે રોકડ પ્રવાહ પત્રક

(₹ લાખમાં)

વિગત	નોંધ નં.	તા.૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ પુરા થયેલ વર્ષ	તા.૩૧મી માર્ચ, ૨૦૨૨ના રોજ પુરા થયેલ વર્ષ
ક ઓપરેટિંગ પ્રવૃત્તિઓમાંથી રોકડ પ્રવાહ			
વર્ષ માટે કર પહેલા નફો		૨,૫૮૪.૦૭	૩,૨૬૮.૦૩
માટે ગોઠવણો:-			
અવમૂલ્યન		૧૫૦.૭૧	૧૭૬.૫૮
વ્યાજની આવક		(૧,૩૨૩.૪૩)	(૧,૨૦૨.૦૦)
પરત શંકાસ્પદ દેવા માટે વધારાની જોગવાઈ		(૪.૪૫)	(૩.૮૨)
કર્મચારી લાભ ખર્ચ		૬૪.૬૦	(૬.૫૧)
પરચુરણ બેલેન્સ પરત લખ્યું		(૨૮.૮૭)	(૦.૧૦)
પરચુરણ બેલેન્સ માંડી વાળ્યું		૦.૦૧	૦.૦૧
જમીન માટે લીઝ ભાડે		૦.૦૧	૦.૦૧
ભાડાની આવક - રોકાણની મિલકત		(૨.૬૩)	(૨.૬૩)
શંકાસ્પદ દેવાની જોગવાઈ		૨૫.૦૪	૦.૧૪
સ્થિર સંપત્તિના વેચાણ પર (નફો)/ નુકસાન		(૧.૭૪)	(૦.૧૫)
વ્યાજબી મૂલ્યાંકનના ખાતા પર ગોઠવણ (આઈએનડી એએસ)		૨૬.૧૮	૨૬.૧૮
નાણાકીય ખર્ચ		૨૮.૫૭	૨૫.૦૨
કાર્યકારી મૂડીમાં ફેરફાર પહેલાં ઓપરેટિંગ પ્રોફિટ	(૧)	૧,૫૧૭.૮૬	૨,૨૮૦.૭૬
માટે ગોઠવણ:			
ઇન્વેન્ટરીમાં ઘટાડો/(વધારો)		(૧,૨૨૬.૪૫)	(૮૪૬.૭૪)
વેપાર પ્રાપ્તિમાં ઘટાડો/(વધારો)		(૬૪૬.૪૪)	૫૧૮.૭૧
અન્ય સંપત્તિઓમાં ઘટાડો/(વધારો)		૨૭૦.૦૧	૩૫.૨૩
(ઘટાડો)/ચૂકવવાપાત્રમાં વધારો		(૧૧૬.૭૭)	૫૪૫.૬૧
(ઘટાડો)/જોગવાઈઓમાં વધારો		(૧૪૭.૦૨)	૧૪.૫૪
(ઘટાડો)/અન્ય વર્તમાન જવાબદારીઓમાં વધારો		(૨,૩૧૮.૫૦)	૩૮૧૬.૮૩
(ઘટાડો)/અન્ય બિન વર્તમાન જવાબદારીઓમાં વધારો		(૬૧.૫૦)	૨૪.૮૫
	(૨)	(૪,૨૪૭.૬૬)	૪,૧૦૮.૧૩
ઓપરેશન્સમાં (વપરાયેલ)/પેદા થયેલ રોકડ	(૧+૨)	(૨,૭૨૯.૭૦)	૬,૩૮૯.૮૯
બાદ: ચૂકવવામાં આવેલ આવકવેરો		(૫૮૪.૧૨)	(૮૩૭.૦૭)
ઓપરેશન્સમાં (વપરાયેલ)/પેદા થયેલ કુલ રોકડ		(૩,૩૧૩.૮૨)	૫,૫૫૨.૮૨
ખ રોકાણ પ્રવૃત્તિઓમાંથી રોકડ પ્રવાહ			
મિલકત, પ્લાન્ટ અને સાધનો અને અન્ય અમૂર્ત સંપત્તિનું વેચાણ/નિકાલ		૮.૧૦	૦.૭૨
મિલકત, પ્લાન્ટ અને સાધનો અને અન્ય અમૂર્ત સંપત્તિઓની ખરીદી (CWIP સહિત)		(૩૮.૦૭)	(૨૩૭.૮૭)
ભાડાની આવક - રોકાણની મિલકત		૨.૬૩	૨.૬૩
વ્યાજ પ્રાપ્ય		૧,૩૪૦.૬૨	૧,૩૧૮.૮૧
ડિપોઝિટમાં રોકાણ (GSFS)		(૨,૦૦૭.૪૮)	(૧,૨૦૦.૦૦)
રોકાણ પ્રવૃત્તિઓમાંથી (વપરાયેલ)/ ઉપાર્જિત પેદા નેટ રોકડ		(૬૮૪.૨૦)	(૧૧૫.૭૧)
ગ ધિરાણ પ્રવૃત્તિઓમાંથી રોકડ પ્રવાહ			
ડિવિડન્ડ ચૂકવ્યું (ડિવિડન્ડ પર ટેક્સ સહિત)		(૩૮.૩૦)	(૩૮.૩૦)
નાણાકીય ખર્ચ		(૨૮.૫૭)	(૨૫.૦૨)
નાણાકીય પ્રવૃત્તિઓમાંથી (વપરાયેલ)/ ઉપાર્જિત પેદા નેટ રોકડ		(૬૭.૮૭)	(૬૪.૩૨)
રોકડ અને રોકડ સમકક્ષમાં નેટ વધારો/(ઘટાડો) (ક+ખ+ગ)		(૪,૦૮૫.૮૮)	૫,૨૭૨.૮૦

શરૂઆતી રોકડ અને રોકડ સમકક્ષ		૧૦,૭૦૧.૦૩	૫,૪૨૮.૨૫
બંધ રોકડ અને રોકડ સમકક્ષ		૬,૬૧૫.૧૪	૧૦,૭૦૧.૦૩
રોકડ અને રોકડ સમકક્ષોનું સમાધાન			
રોકડ અને રોકડ સમકક્ષ હાથ ઉપરની રોકડ સહિત			
બેન્કમાં જમા રકમ			
ચાલુ ખાતામાં		૬,૬૧૪.૬૭	૧૦,૭૦૦.૬૩
હાથ ઉપરના ચેક, ડ્રાફ્ટ અને સ્ટેમ્પ્સ		૦.૪૭	૦.૪૦
		૬,૬૧૫.૧૪	૧૦,૭૦૧.૦૩

નોંધ :

૧. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા કેશ ફ્લો સ્ટેટમેન્ટ પર ઇન્ડ-એએસ ૭ માં દર્શાવ્યા મુજબ પરોક્ષ પદ્ધતિ હેઠળ રોકડ પ્રવાહનું નિવેદન તૈયાર કરવામાં આવ્યું છે.
૨. પાછલા વર્ષના આંકડાઓની પુષ્ટિ કરવા અને તેમને ચાલુ વર્ષના આંકડા સાથે તુલનાત્મક બનાવવા માટે ફરીથી વર્ગીકૃત/ પુનઃ જૂથ કરવામાં આવેલ છે.

આ સાથે જોડેલા સમાન તારીખના અમારા અહેવાલ મુજબ

મુકેશકુમાર જૈન એન્ડ કું. વતી
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ
(પેટી રજી. નં. ૧૦૬૬૧૯W)

રાજીત તીલ્લાની
(ભાગીદાર)
સભ્યપદ નં. : ૪૦૫૬૬૨
યુડીઆઈએન : ૨૩૪૦૫૬૬૨BGUNPQ૨૨૦૭

સ્થળ : અમદાવાદ
તારીખ : ૨૬-૦૯-૨૦૨૩

નિયામક મંડળ અને એમના વતી

એ. કે. રાકેશ, IAS
અધ્યક્ષ
(DIN:૦૦૬૩૮૧૯)

એસ. એન. દેવડા
(મેનેજર નાણા)

પી. એસ. રબારી
વહીવટી નિયામક
(DIN:૮૯૯૬૭૬૫)

કે. એમ. રાવલ
(કંપની સેક્રેટરી)

સ્થળ : ગાંધીનગર
તારીખ : ૨૬-૦૯-૨૦૨૩

તા. ૩૧મી માર્ચ, ૨૦૨૩ ના રોજ પુરા થયેલા વર્ષ માટે ઇકિવટીમાં ફેરફારોનો અહેવાલ

ક. ઇકિવટી શેર મૂડી

(₹ લાખમાં)

વિગત	શેરની સંખ્યા	રકમ
૧લી એપ્રિલ, ૨૦૨૧ નું બેલેન્સ	૩૯૩,૦૦૦.૦૦	૩૯૩.૦૦
વર્ષ દરમિયાન ઇકિવટી શેર મૂડીમાં ફેરફાર	-	-
૧લી એપ્રિલ, ૨૦૨૧ ના રોજ પુનઃસ્થાપિત બેલેન્સ	૩૯૩,૦૦૦.૦૦	૩૯૩.૦૦
વર્ષ દરમિયાન ઇકિવટી શેર મૂડીમાં ફેરફાર	-	-
૩૧ મી માર્ચ, ૨૦૨૨ નું બેલેન્સ	૩૯૩,૦૦૦.૦૦	૩૯૩.૦૦
વર્ષ દરમિયાન ઇકિવટી શેર મૂડીમાં ફેરફાર	-	-
૧લી એપ્રિલ, ૨૦૨૨ ના રોજ પુનઃસ્થાપિત બેલેન્સ	૩૯૩,૦૦૦.૦૦	૩૯૩.૦૦
વર્ષ દરમિયાન ઇકિવટી શેર મૂડીમાં ફેરફાર	-	-
૩૧ મી માર્ચ, ૨૦૨૩ નું બેલેન્સ	૩૯૩,૦૦૦.૦૦	૩૯૩.૦૦

ખ. અન્ય ઇકિવટી

(₹ લાખમાં)

વિગત	મૂડી સબસિડી ઊનિ -અવમૂલ્ય સંપત્તિ સામે	અનામત અને વધારાની		કુલ
		જાળવી રાખેલી કમાણી	અન્ય વ્યાપક આવકની અન્ય વસ્તુઓ (વ્યાખ્યાયિત લાભ યોજનાનું ફરીથી માપ)	
૧ એપ્રિલ, ૨૦૨૧ ના રોજ બેલેન્સ	૭.૦૮	૨૯,૧૮૨.૩૧	-	૨૯,૧૮૯.૩૯
હિસાબી નીતિમાં ફેરફાર અથવા અગાઉના સમયગાળાની ભૂલો		૪.૩૦	-	૪.૩૦
૧ લી એપ્રિલ, ૨૦૨૧ ની શરૂઆતમાં પુનઃસ્થાપિત બેલેન્સ		૨૯,૧૮૬.૬૧		૨૯,૧૯૦.૯૧
વર્ષ માટે નફો		૨,૩૭૦.૬૩		૨,૩૭૦.૬૩
ડિવિડન્ડ અને ડિવિડન્ડ વિતરણ કર		(૩૯.૩૦)		(૩૯.૩૦)
વ્યાખ્યાયિત લાભ યોજનાનું ફરીથી માપ		(૪.૮૭)		(૪.૮૭)
જાળવી રાખેલી કમાણીમાં / થી ટ્રાન્સફર		-		-
વર્ષ દરમિયાન ઉમેરો / (નેટ) (કપાત)		-	(૪.૮૭)	(૪.૮૭)
જાળવી રાખેલી કમાણીમાં ટ્રાન્સફર		-	૪.૮૭	૪.૮૭
૩૧ મી માર્ચ, ૨૦૨૨ ના રોજ બેલેન્સ	૭.૦૮	૩૧,૫૧૩.૦૬		૩૧,૫૨૦.૧૪
હિસાબી નીતિમાં ફેરફાર અથવા અગાઉના સમયગાળાની ભૂલો		-	-	૪.૩૦
૧ લી એપ્રિલ, ૨૦૨૨ ની શરૂઆતમાં પુનઃસ્થાપિત બેલેન્સ	૭.૦૮	૩૧,૫૧૩.૦૬		૩૧,૫૨૦.૧૪
વર્ષ માટે નફો	-	૧,૯૩૪.૯૯		૧,૯૩૪.૯૯
ડિવિડન્ડ અને ડિવિડન્ડ વિતરણ કર	-	(૩૯.૩૦)		(૩૯.૩૦)
વ્યાખ્યાયિત લાભ યોજનાનું ફરીથી માપ		૪૮.૩૪		૪૮.૩૪
જાળવી રાખેલી કમાણીમાં / તેમાંથી ટ્રાન્સફર	(૭.૦૮)	-		(૭.૦૮)
વર્ષ દરમિયાન (નેટ) ઉમેરો/(કપાત)	-	-	૪૮.૩૪	૪૮.૩૪
જાળવી રાખેલી કમાણીમાં ટ્રાન્સફર	-	-	(૪૮.૩૪)	(૪૮.૩૪)
૩૧ મી માર્ચ, ૨૦૨૩ ના રોજ બેલેન્સ	-	૩૩,૪૫૭.૦૯		૩૩,૪૫૭.૦૯

અનામતનો હેતુ અને પ્રકૃતિ

(i) જાળવી રાખેલી કમાણી

જાળવી રાખેલી કમાણી બેલેન્સ શીટની તારીખ મુજબ કંપનીની અવિતરિત સંચિત કમાણીનું પ્રતિનિધિત્વ કરે છે.

(ii) નિર્ધારિત લાભ યોજનાનું પુનઃ માપન

યોજનાની અસ્કયામતો પર વ્યાજની આવક અને વાસ્તવમાં પ્રાપ્ત થયેલ વળતર વચ્ચેનો તફાવત, અને એક્ઝ્યુટિવલ ધારણાઓ અથવા યોજનાઓમાં અનુભવાયેલા એડજસ્ટમેન્ટમાં ફેરફારને કારણે વર્ષ દરમિયાન જવાબદારીઓમાં કોઈપણ ફેરફાર, અન્ય વ્યાપક આવક અને જાળવી રાખેલી કમાણીઓમાં ઓળખવામાં આવે છે.

(iii) મૂડી સબસિડી (અમૂલ્ય અસ્કયામતો માટે અનુદાન)

કોર્પોરેશનને આ સબસિડી સાધટના સંપાદન અને તેના વિકાસના હેતુ માટે મળી હતી. આ ગ્રાન્ટમાંથી મળેલી સાધટને નોંધ 3 હેઠળ મિલકત, પ્લાન્ટ અને સાધનોની અલગ આધટમ તરીકે જાહેર કરવામાં આવે છે.

આ સાથે જોડેલા સમાન તારીખના અમારા અહેવાલ મુજબ

મુકેશકુમાર જેલ એન્ડ કું. વતી
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ
(પેટી રજી. નં. ૧૦૬૬૧૯W)

રાજીત તીલ્લાની
(ભાગીદાર)
સભ્યપદ નં. : ૪૦૫૬૬૨
યુડીઆઈએન : ૨૩૪૦૫૬૬૨BGUNPQ૨૨૦૭

સ્થળ : અમદાવાદ
તારીખ : ૨૬-૦૬-૨૦૨૩

નિયામક મંડળ અને એમના વતી

એ. કે. રાકેશ, IAS
અધ્યક્ષ
(DIN:૦૦૬૩૮૧૯)

પી. એસ. રબારી
વહીવટી નિયામક
(DIN:૮૯૬૬૭૬૫)

એસ. એન. દેવડા
(મેનેજર નાણા)

કે. એમ. રાવલ
(કંપની સેક્રેટરી)

સ્થળ : ગાંધીનગર
તારીખ : ૨૬-૦૬-૨૦૨૩

નાણાકીય પત્રકની નોંધ

નોંધ ૧: કંપનીની માહિતી:

ગુજરાત રાજ્ય બીજ નિગમ લિ. ની સ્થાપના એપ્રિલ, ૧૯૭૫ માં કરવામાં આવી હતી અને તેના બ્રાન્ડ નામ “ગુરાબિની” (હવે પછી “નિગમ” તરીકે ઓળખવામાં આવશે.) દ્વારા જાણીતી છે. ખેડૂતોનો વિશ્વાસ, બ્રાન્ડ પ્રત્યેની વફાદારી, ગુણવત્તા ખાતરી, સમર્પિત સેવા અને ગૌરવપૂર્ણ સિદ્ધિઓ ધરાવતા ખેડૂતોના ઉત્થાન માટે સાતત્યપૂર્ણ યોગદાન સાથે નિગમ ત્રણ દાયકાથી વધુ સમયથી ખેડૂતોના વિશાળ હિતમાં સેવા આપી રહ્યું છે.

નિગમ મુખ્યત્વે ૨૪ થી વધુ પાકો અને ૧૦૧ જાતો અને શંકર જાતોના લગભગ તમામ કેટેગરીમાં અનાજ, કઠોળ, તેલીબિયાં, ફાઈબર પાક, ઘાસચારો, લીલા ખાતર પાક વગેરેના ઉત્પાદન, પ્રક્રિયા અને માર્કેટિંગમાં રોકાયેલું છે.

નિગમનું મુખ્ય કાર્યાલય ગાંધીનગર ખાતે છે, અને સમગ્ર ગુજરાતમાં ૧૪ શાખાઓ અને એક વેચાણ કેન્દ્ર છે. નિગમના ચેરમેન ગુજરાત સરકારના સચિવ (કૃષિ) છે અને મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત સરકારના અધિક નિયામક (કૃષિ) છે.

સમાપ્ત થયેલા વર્ષમાં નિગમની અધિકૃત શેર મૂડી રૂ. ૪ કરોડ, ૧૦૦ રૂપિયાના શેરમાં સમાન રૂપે વહેંચાયેલી છે. તેની સામે, ચૂકવેલ શેર મૂડી રૂ. ૩.૬૩ કરોડ છે. શેરધારકોની નીચેની કેટેગરી દ્વારા શેર રાખવામાં આવ્યા છે:

ગુજરાત સરકાર: ૯૫.૪૨% શેર

ભારત સરકાર: ૪.૫૮% શેર

નોંધ ૨: નોંધપાત્ર હિસાબી નીતિઓ

૨.૧ તૈયારીનો આધાર: -

i) પાલન નિવેદન :-

આ નાણાકીય નિવેદનો કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૩૩ હેઠળ નિર્ધારિત ભારતીય એકાઉન્ટિંગ ધોરણો (ઇન્ડ એએસ તરીકે ઓળખવામાં આવે છે) અનુસાર તૈયાર કરવામાં આવ્યા છે, જે કંપનીઝ (ભારતીય એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ) નિયમો સાથે વાંચવામાં આવે છે, જેમ કે સમય સમય પર સુધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા જારી કરાયેલ માર્ગદર્શન નોંધો/ઘોષણાઓ પણ જ્યાં લાગુ હોય ત્યાં ધ્યાનમાં લેવામાં આવે છે. કોર્પોરેશને પ્રસ્તુત સમયગાળા દરમિયાન સાતત્યપૂર્ણ હિસાબી નીતિઓ લાગુ કરી છે.

ii) તૈયારીનો આધાર :-

નાણાકીય નિવેદનો ઐતિહાસિક ખર્ચ સંમેલનના આધારે તૈયાર કરવામાં આવ્યા છે, નીચેની અસ્કયામતો અને જવાબદારીઓ સિવાય, જે તેમના વાજબી મૂલ્યની રકમ પર માપવામાં આવે છે:

- ચોક્કસ નાણાકીય અસ્કયામતો અને જવાબદારીઓ વાજબી મૂલ્ય પર માપવામાં આવે છે
- નિર્ધારિત લાભ યોજનાઓ - યોજના અસ્કયામતો વાજબી મૂલ્ય પર માપવામાં આવે છે

ઐતિહાસિક કિંમત સામાન્ય રીતે સામાન અને સેવાઓના બદલામાં આપવામાં આવેલ વિચારણાના મૂલ્ય પર આધારિત હોય છે. વાજબી મૂલ્ય એ કિંમત છે જે સંપત્તિ વેચવા માટે પ્રાપ્ત થશે અથવા માપન તારીખે બજારના સહભાગીઓ વચ્ચે ગોઠવાયેલા વ્યવહારમાં જવાબદારી ટ્રાન્સફર કરવા માટે ચૂકવવામાં આવશે. તમામ અસ્કયામતો અને જવાબદારીઓને વર્તમાન અને બિન-વર્તમાન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, ૧૨-મહિનાના સંચાલન ચક્રને ધ્યાનમાં લેતા.

આ નાણાકીય નિવેદનો ભારતીય રૂપિયા (INR/₹) માં તૈયાર કરવામાં આવ્યા છે, જે કોર્પોરેશનનું કાર્યકારી ચલણ છે અને તમામ મૂલ્યોને નજીકના લાખ (₹ ૧,૦૦,૦૦૦) સુધી રાઉન્ડ ઓફ કરવામાં આવ્યા છે, સિવાય કે અન્યથા સૂચવવામાં આવે.

એકાઉન્ટિંગ નીતિઓ સતત લાગુ કરવામાં આવી છે, સિવાય કે નવા જારી કરાયેલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સના પ્રારંભિક દત્તક અથવા હાલના એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સના પુનરાવર્તન માટે ઉપયોગમાં લેવાતી એકાઉન્ટિંગ નીતિમાં ફેરફારની જરૂર હોય. કોર્પોરેશન સામાન્ય રીતે ઉદ્યોગમાં પ્રચલિત નીતિઓ અને શ્રેષ્ઠ પ્રથાઓનું પાલન કરે છે.

નાણાકીય નિવેદનોની તૈયારીમાં ઉપયોગમાં લેવાતી નોંધપાત્ર હિસાબી નીતિઓની ચર્ચા સંબંધિત નોંધોમાં કરવામાં આવી છે.

૨૬-૦૯-૨૦૨૩ ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકના ઠરાવ મુજબ, તેને નાણાકીય નિવેદનો જારી કરવા માટે અધિકૃત કરવામાં આવી હતી.

iii) અનુમાન અને નિર્ણયનો ઉપયોગ: -

નાણાકીય નિવેદનોની તૈયારી ઇન્ડ એએસ ને અનુરૂપ છે જેમાં મેનેજમેન્ટને અંદાજો, ચુકાદાઓ અને ધારણાઓ કરવાની જરૂર છે જે અહેવાલ કરેલ સમયગાળા દરમિયાન આવક અને ખર્ચની નોંધાયેલ રકમ અને અસ્કયામતો અને જવાબદારીઓ (આકસ્મિક જવાબદારીઓ સહિત)ની નોંધાયેલ રકમને અસર કરે છે. સહિત). નાણાકીય નિવેદનોની તારીખે.

મેનેજમેન્ટ માને છે કે નાણાકીય નિવેદનોની તૈયારીમાં વપરાતા અંદાજો વ્યાજબી અને યોગ્ય છે. ભાવિ પરિણામો આ અંદાજોથી ભૌતિક રીતે અલગ હોઈ શકે છે. વાસ્તવિક પરિણામો અને અંદાજો વચ્ચેનો તફાવત તે સમયગાળામાં ઓળખવામાં આવે છે જેમાં પરિણામો સ્ફટિકીકરણ થાય છે.

અનુમાન અને અંતર્ગત ધારણાઓની સમીક્ષા ચાલુ ધોરણે કરવામાં આવે છે. હિસાબી અંદાજોના પુનરાવર્તનોને તે સમયગાળામાં ઓળખવામાં આવે છે જેમાં અંદાજો સુધારવામાં આવે છે અને ભવિષ્યના કોઈપણ સમયગાળામાં અસરકારક હોય છે.

આ નોંધ એવા ક્ષેત્રોનું વિહંગાવલોકન પ્રદાન કરે છે જેમાં ઉચ્ચ સ્તરનો નિર્ણય અથવા જટિલતા હોય છે, અને એવી વસ્તુઓની કે જેમાં અંદાજો અને ધારણાઓને કારણે સામગ્રી ગોઠવણની અપેક્ષા રાખવામાં આવે છે જે મૂળ મૂલ્યાંકન કરતા અલગ હોય છે. એક શક્યતા છે. આ દરેક અંદાજો અને ચુકાદાઓ વિશે વિગતવાર માહિતી સંબંધિત નોંધોમાં સમાવવામાં આવેલ છે, સાથે નાણાકીય નિવેદનોમાં દરેક અસરગ્રસ્ત લાઘન આદ્ય માટે ગણતરીના આધાર વિશેની માહિતીનો સમાવેશ થાય છે.

અનુમાન અને અનુમાનોની અનિશ્ચિતતાઓ વિશેની માહિતી, જે આગામી નાણાકીય વર્ષમાં સામગ્રી ગોઠવણના નોંધપાત્ર જોખમમાં પરિણમે છે, તે નીચેની નોંધમાં શામેલ છે:

- નોંધો ૮ અને ૧૪ વર્તમાન/વિલંબિત કર ખર્ચ
- નોંધ ૩૬(૩) આકસ્મિક જવાબદારીઓ અને અસ્કયામતો
- નોંધ ૩૬(૧૪) નિર્ધારિત લાભની જવાબદારીઓનું માપન

૨.૨ નોંધપાત્ર હિસાબી નીતિઓનો સારાંશ: -

i) રોકડ પ્રવાહનો અહેવાલ: -

રોકડ પ્રવાહનું નિવેદન પરોક્ષ પદ્ધતિનો ઉપયોગ કરીને ભારતીય હિસાબી ધોરણ ૭ મુજબ તૈયાર કરવામાં આવે છે, જેમાં બિન-રોકડ પ્રકારના વ્યવહારોની અસરો અને ભૂતકાળ અથવા ભવિષ્યની રોકડ રસીદોના કોઈપણ સ્થગિત અથવા ઉપાર્જન માટે કર પહેલાં નફો/(નુકસાન) અથવા ચૂકવણીને સમાયોજિત કરવામાં આવે છે. નિગમની કામગીરી, રોકાણ અને ધિરાણ પ્રવૃત્તિઓમાંથી રોકડ પ્રવાહ ઉપલબ્ધ માહિતીના આધારે અલગ પાડવામાં આવે છે.

રોકડ પ્રવાહના નિવેદન માટે, રોકડ અને રોકડ સમકક્ષમાં રોકડ, બેંકો અને હાથ પરની રોકડ અને ત્રણ મહિનાની મૂળ પાકતી મુદતની ડિમાન્ડ ડિપોઝિટનો સમાવેશ થાય છે અને અત્યંત પ્રવાહી રોકાણો કે જે રકમ સરળતાથી રૂપાંતરિત થાય છે અને જે બાકી બેન્ક ઓવરડ્રાફ્ટના મૂલ્યમાં ફેરફારના નજીવા જોખમને આધીન છે કારણ કે, તે નિગમના રોકડ વ્યવસ્થાપનનો અભિન્ન ભાગ ગણાય છે.

ii) કાર્યાત્મક અને પ્રસ્તુતિ ચલણ:

નાણાકીય અહેવાલો ભારતીય રૂપિયા (INR) માં રજૂ કરવામાં આવે છે, જે નિગમનું કાર્યકારી તેમજ પ્રસ્તુતિ ચલણ છે.

ક. વિદેશી ચલણમાં વ્યવહારો પ્રભાવિત થતા સમયે પ્રવર્તમાન વિનિમય દરે નોંધાય છે. વિદેશી ચલણના વ્યવહારોના સમાધાન પર ઉદ્ભવતા વિનિમય તફાવતો નફા અને નુકસાનના નિવેદનમાં માન્ય રાખવામાં આવેલ છે.

ખ. વિદેશી ચલણમાં દર્શાવેલ નાણાકીય વસ્તુઓ બેલેન્સ શીટની તારીખે પ્રવર્તમાન વિનિમય દરનો ઉપયોગ કરીને ભારતીય રૂપિયામાં રૂપાંતરિત થાય છે અને પરિણામી વિનિમય તફાવત નફો અને નુકસાનના નિવેદનમાં માન્ય રાખવામાં આવેલ છે.

iii) મિલકત, પ્લાન્ટ અને સાધનો:

- ક. મિલકત, પ્લાન્ટ અને સાધનો કિંમત, ઓછા સંચિત અવમૂલ્યન/ઋણમુક્તિ અને ક્ષતિ નુકશાન, જો કોઈ હોય તો જણાવવામાં આવે છે.
- ખ. અસ્કયામતોમાં ઉમેરા અથવા કાઢી નાંખવાના કિસ્સામાં, અવમૂલ્યન ઉપયોગની તારીખથી અથવા નિકાલની તારીખથી દરેક કેસમાં રૂ. ૫૦૦૦/- અથવા ઓછું, જ્યાં સંપાદનના વર્ષમાં સંપૂર્ણ વર્ષ માટે અવમૂલ્યન ૧૦૦% ના દરે આપવામાં આવે છે.
- ગ. નિગમને સરકાર પાસેથી અનુદાન મેળવ્યું હોય તેવા અસ્કયામતોના કિસ્સામાં, “સરકારી અનુદાનમાંથી પ્રાપ્ત મૂડી અનુદાન” માંથી

અવમૂલ્યન પ્રમાણસર સમયોજિત કરવામાં આવે છે અને નિગમ દ્વારા ધિરાણ આપવામાં આવેલી સંપત્તિના પ્રમાણમાં ઘસારાની બાકી રકમ જ નફા અને નુકસાનના ખાતામાં ઉધારવામાં થાય છે..

ઘ. મિલકત, પ્લાન્ટ અને સાધનોની વસ્તુની કિંમતમાં નીચેનાનો સમાવેશ થાય છે :

- ટ્રેડ ડિસ્કાઉન્ટ અને રિબેટ્સ કર્યા બાદ તેની ખરીદી કિંમત, આયાત કર અને પરત ન કરી શકાય તેવી ખરીદી કર સહિત.
- મેનેજમેન્ટ દ્વારા નિર્ધારિત રીતે સંચાલન કરવા માટે સક્ષમ થવા માટે સંપત્તિને જરૂરી સ્થાન અને સ્થિતિમાં લાવવા માટે લાગતો કોઈપણ ખર્ચ.
- વસ્તુને તોડવા અને તેને દૂર કરવા અને તે જે સ્થળે સ્થિત છે તેને પુનઃસ્થાપિત કરવાના ખર્ચનો પ્રારંભિક અંદાજ, જે જવાબદારી સંસ્થાને જ્યારે કોઈ વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે અથવા કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન આઘટમનો તે સમયગાળા દરમિયાન ઇન્વેન્ટરી બનાવવા સિવાયના હેતુઓ માટે ઉપયોગ કર્યાના પરિણામ સ્વરૂપે થાય છે.

ચ. લીઝ હોલ્ડ જમીન સંપાદન પર ચૂકવવામાં આવેલ પ્રીમિયમ, ખર્ચ તરીકે ગણવામાં આવે છે.

છ. પ્રગતિ હેઠળના મૂડી કાર્યો - ખર્ચ મુજબ હાથ ધરવામાં આવે છે, જેમાં સીધો ખર્ચ, સંબંધિત આકસ્મિક ખર્ચ અને ઉધારની રકમ પરનું વ્યાજ સામેલ છે.

જ. પ્રોજેક્ટના બાંધકામ/અમલીકરણના તબક્કા દરમિયાન કરવામાં આવેલ તમામ ખર્ચ પ્રોજેક્ટ અને ઓપરેટિવ પહેલાના ખર્ચે દર્શાવ્યા મુજબ પ્રોજેક્ટના કમિશનિંગ પર વિવિધ સ્થિર સંપત્તિના ખર્ચને પ્રો-રેટા ધોરણે મૂડીકૃત કરવામાં આવ્યા છે.

ઝ. જો માન્યતાના માપદંડને પૂર્ણ કરવામાં આવે તો લાંબા ગાળાના બાંધકામ પ્રોજેક્ટ્સ માટે બદલાવ, મુખ્ય નિરીક્ષણ, નોંધપાત્ર ભાગોની મરામત અને ઉધાર ખર્ચનું મૂડીકરણ થાય છે.

ટ. પ્રોપર્ટી, પ્લાન્ટ અને સાધનસામગ્રીની ગેર માન્યતાના કારણે ઉદ્ભવતા નફા અથવા નુકશાનને નફા અથવા નુકસાનમાં સમાવવામાં આવશે જ્યારે આઘટમની માન્યતા રદ કરવામાં આવશે. (સિવાય કે ૧૧૬ એએસ- ભાડાપટ્ટે વેચાણ અને લીઝબેક પર અન્યથા જરૂરી ન હોય).

iv) અમૂર્ત સંપત્તિ :-

એક અમૂર્ત સંપત્તિ માન્ય રાખવામાં આવે છે જ્યારે અસ્કયામતોને કારણે ભાવિ આર્થિક લાભો નિગમને મળવાની અને સંપત્તિની કિંમત વિશ્વસનીય રીતે માપી શકવાની સંભાવનાઓ જણાય. અમૂર્ત સંપત્તિ ભુતપૂર્વ કિંમતમાંથી સંચિત ઋણમુક્તિ અને ક્ષતિ નુકશાન, જો કોઈ હોય તો બાદ કરીને ગણવામાં આવે છે.

v) રોકાણવાળી મિલકત :-

ક. ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટીમાં સંપૂર્ણ સંપત્તિ, બાંધકામ હેઠળની મિલકત, ફાઇનાન્સ લીઝ હેઠળ રાખવામાં આવેલી મિલકત જે, સામાન્ય વ્યવસાયમાં વેચાણ માટે અથવા ઉત્પાદન અથવા વહીવટી કાર્યોમાં ઉપયોગ કરવાને બદલે ભાડા અથવા મૂડી વધારા અથવા બંને મેળવવા માટે રાખવામાં આવે છે તેનો સમાવેશ થાય છે.

ખ. રોકાણની મિલકતો તેની મૂળ કિંમત પર, સંચિત અવમૂલ્યનની ચોખ્ખી અને સંચિત ક્ષતિ નુકશાન, જો કોઈ હોય તો તે જણાવવામાં આવે છે.

ગ. નિગમે મૂળ ખરીદીની તારીખથી ૬૦ વર્ષથી રોકાણની મિલકતના બિલ્ડિંગ ઘટકનું અવમૂલ્યન કરે છે.

ઘ. રોકાણની મિલકતોની માન્યતા, ક્યાં તો નિકાલ કરવામાં આવે છે અથવા જ્યારે તેઓ કાયમી ધોરણે ઉપયોગમાંથી પાછી ખેંચી લેવામાં આવે છે અને નિકાલથી ભવિષ્યમાં કોઈ ફાયદાની અપેક્ષા રાખવામાં આવતી ન હોય ત્યારે રદ કરવામાં આવે સીએચઆર. નિકાલની પ્રક્રિયા અને સંપત્તિની વહન રકમ વચ્ચેનો તફાવત ગેર-માન્યતાના સમયગાળામાં નફા અને નુકસાનના ખાતામાં માન્ય રાખવામાં આવે છે.

vi) જોગવાઈઓ :

જોગવાઈઓ જવાબદારીઓના સંદર્ભમાં માન્ય રાખવામાં આવે છે જેને માત્ર અંદાજની નોંધપાત્ર માત્રાનો ઉપયોગ કરીને માપી શકાય છે જ્યારે:

ક. ભૂતકાળની ઘટનાના પરિણામે નિગમની વર્તમાન જવાબદારી બનતી હોય.

ખ. આર્થિક લાભોનો સમાવેશ કરતા સંસાધનોના સંભવિત પ્રવાહને જવાબદારી પતાવવા માટે જરૂરી હોય; અને

ગ. જવાબદારીની રકમનો વિશ્વસનીય અંદાજ લગાવી શકાય. દરેક બેલેન્સ શીટની તારીખે જોગવાઈઓની સમીક્ષા કરવામાં આવે છે.

જોગવાઈઓમાં છૂટ :-

જોગવાઈઓ કે જે ૧૨ મહિનાથી વધુ સમય પછી પતાવટ થવાની અપેક્ષા છે, તે વર્તમાન મૂલ્ય પર કર-પૂર્વ ડિસ્કાઉન્ટ દરનો ઉપયોગ કરીને માપવામાં આવે છે, જે જવાબદારી માટે ચોક્કસ જોખમ દર્શાવે છે. સમય પસાર થવાને કારણે જોગવાઈમાં વધારો વ્યાજ ખર્ચ તરીકે માન્ય

રાખવામા આવે છે.

vii) આવક :

ગ્રાહકો સાથેના કરારોથી આવક : -

- ક. વેચાણમાંથી આવકને માન્ય કરવામાં આવે છે જ્યારે સેવાપૂર્તિ સમયે તે માપવા યોગ્ય હોય છે અને સેવાઓના વેચાણ અથવા પૂર્તતામાં આવતી વિચારણાની રકમ અંગે કોઈ નોંધપાત્ર અનિશ્ચિતતા અસ્તિત્વમાં ન હોય.
- ખ. વેચાણ સાથે સંકળાયેલા વ્યવહારો તમામ નોંધપાત્ર જોખમો અને માલમાં માલિકીના પુરસ્કાર અને, સેવા પ્રદાન કરવાના કિસ્સામાં, યોગ્ય કામગીરી ખરીદદારને ટ્રાન્સફર કરવા પર આધારિત છે.
- ગ. અંતિમ સંગ્રહની અનિશ્ચિતતાઓની અસરને કારણે આવકની માન્યતા મુલતવી રાખવામાં આવે છે, અને આવી અનિશ્ચિતતાઓનું અસ્તિત્વ બંધ થઈ જાય ત્યારે આવકને માન્યતા આપવામાં આવે છે.

અન્ય માન્યતાપાત્ર આવક : -

વ્યાજ આવક લાગુ પડતા વ્યાજ દરે અને જ્યાં જરૂર હોય ત્યાં ઇન્ડ-એએસ અનુસાર અસરકારક વ્યાજ દર પદ્ધતિનો ઉપયોગ કરીને સમયના પ્રમાણને આધારે માન્ય કરવામાં આવે છે,.

viii) લીઝ

ક. લીઝ ધારણકર્તા તરીકે :

- I. કંપની લીઝ શરૂ થવાની તારીખે રાઈટ ઓફ યુઝ (ROU) એસેટ અને લીઝ જવાબદારીને માન્ય કરે છે. ઉપયોગના અધિકાર ધરાવતી સંપત્તિ શરૂઆતમાં મૂળ કિંમત પર ગણવામાં આવે છે, જેમાં શરૂઆતની તારીખે અથવા તે પહેલાં કરવામાં આવેલી કોઈપણ લીઝ ચૂકવણી માટે સમયોચિત કરાયેલી લીઝ જવાબદારીની પ્રારંભિક રકમ વત્તા કોઈપણ પ્રારંભિક ખર્ચ અને બિન વપરાશી સંપત્તિને તોડવાનો અથવા દૂર કરવા માટેના ખર્ચના અંદાજનો અથવા તે જ્યાં સ્થિત છે તે સાઈટને પુનઃસ્થાપિત કરવા માટેના ખર્ચમાંથી મેળવવામાં આવેલ કોઈ લીઝ પ્રોત્સાહનો બાદ કર્યા પછીની રકમનો સમાવેશ થાય છે.
- II. રાઈટ ઓફ યુઝ (ROU) એસેટ પછીથી સીધી રેખા પદ્ધતિનો ઉપયોગ કરીને શરૂઆતની તારીખથી રાઈટ ઓફ યુઝ (ROU) સંપત્તિના ઉપયોગી જીવનના અંત સુધી અથવા લીઝની મુદતના અંત સુધીનું અવમૂલ્યન કરવામાં આવે છે. રાઈટ ઓફ યુઝ (ROU) સંપત્તિનું અંદાજિત ઉપયોગી જીવન મિલકત, પ્લાન્ટ અને સાધનોના આધારે જ નક્કી કરવામાં આવે છે. વધુમાં, રાઈટ ઓફ યુઝ (ROU) સંપત્તિ સમયાંતરે ક્ષતિ માટે ચકાસવામાં આવે છે અને જો કોઈ નુકશાન હોય તો તેની કિંમત ઘટાડવામાં આવે છે, અને લીઝ જવાબદારીની ચોક્કસ પુનઃમાપણી માટે ગોઠવવામાં આવે છે.
- III. લીઝની જવાબદારી શરૂઆતમાં લીઝ ચૂકવણીના વર્તમાન મૂલ્ય પર માપવામાં આવે છે જે શરૂઆતની તારીખે ચૂકવવામાં આવતી નથી, લીઝમાં સમાવિષ્ટ વ્યાજ દરનો ઉપયોગ કરીને અથવા, જો તે દર સરળતાથી નક્કી કરી ન શકાય, તો નિગમના વૃદ્ધિશીલ ઉદ્યોગ દર ઉપર ડિસ્કાઉન્ટ કરવામાં આવે છે.
- IV. લીઝની જવાબદારી અસરકારક વ્યાજની પદ્ધતિનો ઉપયોગ કરીને ઋણમુક્ત ખર્ચ પર માપવામાં આવે છે, જ્યારે ઇન્ડેક્સ અથવા દરમાં ફેરફારથી ભાવિ લીઝ ચૂકવણીમાં ફેરફાર થાય ત્યારે તે ફરીથી માપવામાં આવે છે. જ્યારે લીઝની જવાબદારી આ રીતે ફરીથી માપવામાં આવે છે, ત્યારે રાઈટ ઓફ યુઝ (ROU) સંપત્તિની વહન રકમ સાથે અનુરૂપ ગોઠવણ કરવામાં આવે છે, અથવા જો રાઈટ ઓફ યુઝ (ROU) સંપત્તિની વહન રકમ ઘટીને શૂન્ય થઈ ગઈ હોય તો નફા અને નુકસાનમાં નોંધાય છે.
- V. નિગમ રાઈટ-ઓફ-યુઝ એસેટ જે “પ્રોપર્ટી, પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટ” માં રોકાણની મિલકતની વ્યાખ્યાને પૂરી કરતી નથી અને બેલેન્સ શીટમાં “નાણાકીય જવાબદારીઓ” માં લીઝની જવાબદારીઓ તરીકે રજૂ કરે છે.
- VI. ટૂંકા ગાળાની લીઝ અને ઓછી કિંમતની અસ્કયામતોની લીઝ: -નિગમને ૧૨ મહિના કે તેથી ઓછા સમયગાળાની લીઝ મુદત અને ઓછી કિંમતની અસ્કયામતોની ભાડાપટ્ટો ધરાવતા ટૂંકા ગાળાના ભાડાપટ્ટાઓ માટે રાઈટ-ઓફ-યુઝ મિલકત અને લીઝની જવાબદારીઓને માન્યતા ન આપવાનું નક્કી કર્યું છે. નિગમ આ લીઝ સાથે સંકળાયેલ લીઝ ચૂકવણીને લીઝની મુદત પર સીધી રેખાના આધારે ખર્ચ તરીકે માન્ય કરે છે.

ખ. લીઝ આપનાર તરીકે : -

જ્યારે નિગમ એક લીઝર તરીકે કામ કરે છે, ત્યારે તે લીઝની શરૂઆતમાં નક્કી કરે છે કે, શું દરેક લીઝ ફાઇનાન્સ લીઝ અથવા ઓપરેટિંગ લીઝ છે. દરેક લીઝને વર્ગીકૃત કરવા માટે, નિગમનો એકંદર આકારણી કરે છે કે શું લીઝ સ્થાનાંતરિત રીતે તમામ જોખમો અને તે હેઠળની અસ્કયામતો માલિકી માટે આકસ્મિક તમામ જોખમોને નોંધપાત્ર રીતે સ્થાનાંતરિત કરે છે. જો આમ હોય, તો લીઝ એ ફાઇનાન્સ લીઝ છે, જો નહીં તો તે ઓપરેટિંગ લીઝ છે. આકારણીના ભાગરૂપે, કંપની ચોક્કસ સૂચકાંકો માને છે જેમ કે ભાડાપટ્ટો એ સંપત્તિના આર્થિક જીવનના મુખ્ય ભાગ માટે છે. કંપની “અન્ય આવક” ના ભાગ રૂપે લીઝ ટર્મ પર સીધી-લાઇન આધારે ઓપરેટિંગ લીઝ હેઠળ પ્રાપ્ત લીઝ ચૂકવણીઓને માન્ય કરે છે.

ix) અવમૂલ્યન અને ઋણીકરણ: -

મિલકત, પ્લાન્ટ અને સાધનો : -

- ક. પ્રોપર્ટી, પ્લાન્ટ અને સાધનો પર અવમૂલ્યન, (સંપત્તિનો ઉપયોગ કરવાનો અધિકાર સિવાય) કંપની એક્ટ, ૨૦૧૩ ના શેડ્યુલ્ડ માં ઉલ્લેખિત અસ્કયામતોના ઉપયોગી જીવન પર લેખિત ડાઉન વેલ્યુ મેથડ (ડબલ્યુડીવી) પર પ્રદાન કરવામાં આવે છે.
- ખ. વર્ષ દરમિયાન ખરીદેલ / વેચાયેલી સંપત્તિ પરના અવમૂલ્યન દર કંપની અધિનિયમ, ૨૦૧૩ મુજબ પ્રોટેટાના આધારે વસૂલવામાં આવે છે.

વર્તમાન અને તુલનાત્મક સમયગાળા માટે અસ્કયામતોનું અંદાજિત ઉપયોગી જીવન, સંપત્તિ અને સાધનસામગ્રીની નોંધપાત્ર વસ્તુઓ નીચે મુજબ છે -

વિગત	ઉપયોગી જીવન
બિલ્ડીંગ	૬૦ વર્ષ સુધી
પ્લાન્ટ અને મશીનરી	૧૫ વર્ષ
કમ્પ્યુટર	૩ વર્ષ
ઓફિસ ઉપકરણો	૫ વર્ષ
ફર્નિચર અને ફિક્સર્સ	૧૦ વર્ષ
વાહનો	૮ વર્ષ
રાઇટ-ઓફ-યુઝ એસેટ	લીઝના સમયગાળા સુધી

- ગ. લીઝ સુધારણા અને જે વર્ષથી લીઝ ટર્મ હોય તેમાં આવા સુધારાઓનું મૂડીકરણ કરવામાં આવે છે શિડ્યુલ-૨ હેઠળ ગણતરી કરી અંદાજિત ઉપયોગી જીવનના નીચલા સ્તર પર અમલ કરવામાં આવે છે.
- ઘ. દરેક રિપોર્ટિંગ તારીખે અવમૂલ્યન પદ્ધતિઓ, ઉપયોગી જીવન અને અવશેષ મૂલ્યોની સમીક્ષા કરવામાં આવે છે.
- ચ. લીઝહોલ્ડ લેન્ડ પર પ્રીમિયમ, શાશ્વત ભાડાપટ્ટા સિવાય, લીઝના સમયગાળા દરમિયાન ઋણીકરણ કરવામાં આવે છે.

અમૂર્ત સંપત્તિ

અમૂર્ત અસ્કયામતો તેમના અનુમાનિત ઉપયોગી જીવન પર સીધી રેખાના આધારે તેઓ ઉપયોગ માટે ઉપલબ્ધ હોય તે તારીખથી ઋણમુક્ત કરવામાં આવે છે.

અમૂર્ત સંપત્તિનું અંદાજિત ઉપયોગી જીવન નીચે મુજબ છે :-

અમૂર્ત સંપત્તિ	ઉપયોગી જીવન
સોફ્ટવેર	૫ વર્ષ
બીટી કોટન લાઇસેન્સ	૧૦ વર્ષ

ઋણમુક્તિ પદ્ધતિઓ, ઉપયોગી જીવન અને શેષ મૂલ્યોની દરેક રિપોર્ટિંગ તારીખે સમીક્ષા કરવામાં આવે છે.

x) બિન-નાણાકીય સંપત્તિની ક્ષતિ

- ક. ઇન્ડ એએસ -૩૬ અસ્કયામતોની ક્ષતિઓ અનુસાર, નિગમની સંપત્તિની વહન રકમ દરેક બેલેન્સ શીટની તારીખે સમીક્ષા કરવામાં આવે છે કે શું કોઈ ક્ષતિના સંકેત છે.
- ખ. અસ્કયામતોને ક્ષતિગ્રસ્ત ગણવામાં આવે છે જ્યારે અસ્કયામતોની વહન કિંમત તેની વસૂલાતપાત્ર મૂલ્ય કરતાં વધી જાય છે અને જે વર્ષમાં સંપત્તિને ક્ષતિગ્રસ્ત તરીકે ઓળખવામાં આવે છે તે વર્ષમાં નફા અને નુકશાનના અહેવાલમાં નુકસાન તરીકે દર્શાવવામાં આવે છે.
- ગ. દરેક રિપોર્ટિંગ તારીખે નિગમ ક્ષતિના અંદાજની રકમનું મૂલ્યાંકન કરે છે. જો વસૂલાતપાત્ર રકમના અંદાજમાં ફેરફાર થયો હોય અને આવા નુકશાન કાં તો અસ્તિત્વમાં ન હોય અથવા ઘટ્યા હોય તો અગાઉના હિસાબી સમયગાળા (ઓ) માં ઓળખાતી ક્ષતિ નુકશાન ઉલટાવી દેવામાં આવે છે, નફા અને નુકસાનના નિવેદનમાં ક્ષતિગ્રસ્ત નુકસાનને માન્ય રાખી શકાય છે.

xi) માલસામાનની યાદી :-

- ક. બિયારણ, પેકિંગ સામગ્રી અને અન્ય સામગ્રીનો સ્ટોક, ભૌતિક ચકાસણીના આધારે અને મેનેજમેન્ટ દ્વારા પ્રમાણિત કર્યા બાદ ધ્યાનમાં લેવામાં આવે છે.
- ખ. બિયારણનો સ્ટોક કિંમત અથવા બજાર કિંમત જે પણ ઓછી હોય તે મુજબ મૂલ્યાંકન કરવામાં આવે છે. ખર્ચમાં રૂપાંતરણનો ખર્ચ અને ઈન્વેન્ટરીઓને તેમના વર્તમાન સ્થાન અને સ્થિતિમાં લાવવા પાછળ થતા અન્ય ખર્ચનો સમાવેશ થાય છે.
- ગ. બિયારણના મિશ્રણનો સ્ટોકનું અંદાજિત વસૂલાત મૂલ્ય પર મૂલ્યાંકન કરવામાં આવે છે.
- ઘ. બીજ ઉત્પાદન કાર્યક્રમો હેઠળ ખેડૂતોને આપવામાં આવેલી પેકિંગ સામગ્રીને વપરાશ તરીકે ગણવામાં આવી છે અને ઈન્વેન્ટરી મૂલ્યાંકન માટે ધ્યાનમાં લેવામાં આવી નથી. નિગમ દ્વારા અનુસરવામાં આવતી સતત પ્રેક્ટિસ મુજબ વેચાણના વર્ષમાં પરચુરણ/સ્કેપ મૂલ્ય પરચુરણ રસીદમાં જમા થાય છે.

- ચ. સ્ટોર્સ, પેકિંગ અને પ્રોસેસિંગ મટિરિયલ્સના સ્ટોકનું મૂલ્ય રિસાયકલ ગની બેગ્સ સિવાયના મૂલ્યમાં થાય છે, જેનું મૂલ્ય અંદાજિત વાસ્તવિક મૂલ્યનું હોય છે.
- છ. ડેડ સ્ટોકની ઓછી કિંમતની વસ્તુઓ જેમ કે કેલ્ચુલેટર વગેરે, જે ગૌણ પ્રકૃતિની હોય છે, ખરીદીના વર્ષમાં નફા અને નુકસાનના ખાતામાં સીધા ખર્ચ તરીકે દર્શાવવામાં આવે છે.

xii) ઉદ્યોગ ખર્ચ : -

- ક. યોગ્ય અસ્કયામતોના હસ્તાંતરણ અથવા બાંધકામ માટે ઉદ્યોગ લેવાની કિંમત આવી સંપત્તિની કિંમતના ભાગ રૂપે મૂડીકૃત કરવામાં આવે છે. યોગ્યસ એસેટ તે છે જે તેના હેતુપૂર્ણ ઉપયોગ અથવા વેચાણ માટે તૈયાર થવા માટે નોંધપાત્ર સમય લે છે.
- ખ. અન્ય તમામ ઉદ્યોગ ખર્ચ, ખર્ચ તરીકે, નફા અને નુકસાનના અહેવાલ માટે લેવામાં આવે છે.

xiii) સરકારી અનુદાન : -

સામાન્ય : -

- ક. વિવિધ યોજનાઓ અંતર્ગત તમામ સબસિડી, ભલે મૂડી હોય કે મહેસૂલ, ઉપાર્જિત ધોરણે ગણવામાં આવે છે જ્યારે નિગમ ગ્રાન્ટ સાથે જોડાયેલ શરતોનું પાલન કરશે અને જ્યાં આવા લાભો નિગમ દ્વારા મેળવવામાં આવ્યા છે અને ગ્રાન્ટનો અંતિમ સંગ્રહ વ્યાજબી રીતે ચોક્કસ હોય.
- ખ. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સમયાંતરે જાહેર કરાયેલી યોજનાઓ હેઠળ વિવિધ પ્રકારની સબસિડી વિતરણ માટે નિગમને નોડલ એજન્સી તરીકે સરકારી અનુદાન પણ પ્રાપ્ત થયું છે. આવા કિસ્સાઓમાં, નિગમ સબસિડી માટે અગાઉથી નક્કી કરવામાં આવેલ રકમ મેળવે છે, જે જવાબદારી તરીકે ગણવામાં આવે છે અને “વર્તમાન જવાબદારીઓ” હેઠળ અલગથી જાહેર કરવામાં આવે છે. આ ભંડોળમાંથી વિતરણ કરવામાં આવેલી રકમ આ હેડ ડેબિટ કરીને અને નાણાકીય વર્ષના અંત સુધી સક્ષમ સત્તાધિકારી દ્વારા કરવામાં આવેલા પ્રતિબંધોના આધારે બિન ચુકવણી સબસિડીમાં જમા કરવામાં આવે છે. જો કે, વિવિધ યોજના હેઠળ નિગમ દ્વારા મળવાપાત્ર સબસિડીની રકમ, જે આવા અનુદાનની સામે એડજસ્ટ થવાને પાત્ર છે, નિગમ દ્વારા કરવામાં આવેલા દાવાઓના આધારે એડજસ્ટ કરવામાં આવે છે, જે વર્ષના અંત સુધીની યોજનાઓ સામે એડજસ્ટમેન્ટને પાત્ર છે. જો મંજૂરીની વાસ્તવિક પ્રાપ્તિ પર કોઈ પરિણામ આવે તો અને જ્યારે મંજૂરી મળે ત્યારે ગોઠવણો. જો કે, સામાન્ય રીતે આવી કોઈ ગોઠવણો કરવાની જરૂર રહેતી નથી.

મૂડી અનુદાન : -

નિશ્ચિત અસ્કયામતો બનાવવા સામે મળેલ અનુદાન “અનામત અને સરપ્લસ” શીર્ષક હેઠળ અલગથી જાહેર કરવામાં આવે છે. મૂડી અનુદાન જે બિન-અવમૂલ્ય મિલકતો સામે છે તેને અનામત તરીકે ગણવામાં આવે છે અને અલગથી જાહેર કરવામાં આવે છે, જ્યારે અવમૂલ્યનક્ષમ નિશ્ચિત સંપત્તિ સામે પ્રાપ્ત થયેલ અનુદાન “સરકાર તરફથી પ્રાપ્ત મૂડી ગ્રાન્ટ” અને સમગ્ર ગ્રોસ બ્લોક અને નિશ્ચિત સંપત્તિના નેટ બ્લોકને ધ્યાનમાં લીધા વગર જમા કરવામાં આવે છે. તેમની સામે મેળવેલ અનુદાનની માત્રા, નિશ્ચિત સંપત્તિના સમયપત્રકમાં એકંદર મૂલ્યો પર દર્શાવવામાં આવે છે. દર વર્ષે, “સરકાર તરફથી પ્રાપ્ત મૂડી ગ્રાન્ટ” માંથી નિશ્ચિત સંપત્તિના અનુદાનિત ઘટકના પ્રમાણમાં, વર્તમાન ઘસારાના આધારે પ્રો-રેટા ધોરણે રકમ ઉપાડવામાં આવે છે, અને નફા અને નુકસાન ખાતામાં ડેબિટ કરાયેલા વર્તમાન ઘસારા ચાર્જ સામે એડજસ્ટ કરવામાં આવે છે. અને આ હિસાબી પદ્ધતિ ભારતીય હિસાબી ધોરણ ૧૬ –પ્રોપર્ટી, પ્લાન્ટ અને સાધનો અને ભારતીય હિસાબી ધોરણ ૨૦ –સરકારી અનુદાન માટે એકાઉન્ટિંગની જરૂરિયાતોને અનુરૂપ છે.

મહેસૂલ અનુદાન : -

ઉપર જણાવ્યા મુજબ, નિગમ અનુદાન મેળવવા માટે લાયક બને ત્યારે, ઉપાર્જનના આધારે મહેસૂલી અનુદાન માન્ય કરવામાં આવે છે. નફો અને નુકસાન ખાતામાં “અન્ય ઓપરેટિંગ રેવન્યુ” શીર્ષક હેઠળ અલગથી જાહેર કરવામાં આવે છે.

xiv) કર્મચારી લાભો : -

પશ્ચાત કર્મચારી લાભો અને અન્ય લાંબા ગાળાની લાભ યોજનાઓ : -

ગ્રેચ્યુઇટી :

ઈન્ડ-એએસ ૧૯ કર્મચારી લાભોના અનુસરણ તરીકે લાયક કર્મચારીને આવરી લેતી ગ્રેચ્યુઇટી પ્રત્યેની તેની જવાબદારી પૂરી કરવા માટે, નિગમે સમયાંતરે સુધારેલ ગ્રેચ્યુઇટી એક્ટ ૧૯૭૨ હેઠળ નિગમ દ્વારા તૈયાર ગ્રેચ્યુઇટી નિયમોનુસાર ગ્રેચ્યુઇટીની સંપૂર્ણ ઉપાર્જિત જવાબદારીને આવરી લેવા માટે અપરિવર્તનશીલ ટ્રસ્ટ દ્વારા ભારતીય જીવન વીમા નિગમ સાથે રોકડ સંચય યોજના હેઠળ ગ્રુપ ગ્રેચ્યુઇટી પોલિસી લીધી છે.

રજાઓનું રોકડમાં રૂપાંતરણ : -

નિગમે જીવન વીમા કોર્પોરેશન (LIC) સાથે ગ્રુપ લીવ એન્કેશમેન્ટ સ્કીમ પોલિસી લીધી છે, જે કમાણીની રજાના વેલ્યુએશન પર સંપૂર્ણ ઉપાર્જિત જવાબદારીને આવરી લે છે, જે LIC ના સ્ટેટમેન્ટ મુજબ ઈન્ડ-એએસ ૧૯ મુજબ ગણવામાં આવે છે.

પ્રોવિડન્ટ ફંડ : -

કર્મચારી ભવિષ્ય નિધિ અને પરચુરણ જોગવાઈ અધિનિયમ, ૧૯૫૨ મુજબ, નિગમ વૈધાનિક ભવિષ્ય નિધિમાં યોગદાન આપે છે. ભવિષ્ય

નિધિમાં નિગમોના યોગદાનને વ્યાખ્યાયિત યોગદાન યોજના તરીકે ગણવામાં આવે છે અને નફા અને નુકશાન પત્રકમાં યોગદાનની રકમ અને જ્યારે કર્મચારીઓ દ્વારા સેવા આપવામાં આવે ત્યારે ખર્ચ તરીકે વસુલવામાં આવે છે.

ટૂંકા ગાળાના કર્મચારી લાભો : -

કર્મચારીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓના બદલામાં અપેક્ષિત ટૂંકા ગાળાના કર્મચારી લાભોની રકમ, કર્મચારીઓ તે સેવાઓ પ્રદાન કરે છે તે સમયગાળા દરમિયાન ખર્ચ તરીકે ઓળખાય છે.

xv) કર : -

વર્તમાન આવકવેરો

ક. વર્ષ માટેના કર ખર્ચમાં વર્તમાન આવકવેરો અને વિલંબિત કરનો સમાવેશ થાય છે.

ખ. વર્તમાન કરને લાગુ કરના દરોનો ઉપયોગ કરીને કર સત્તાવાળાઓને ચૂકવવાની અપેક્ષિત રકમ પર માપવામાં આવે છે.

ગ. જે દેશોમાં નિગમ કાર્યરત છે અને કરપાત્ર આવક પેદા કરે છે ત્યાં રિપોર્ટિંગ તારીખે રકમની ગણતરી કરવા માટે કરના દર અને કર કાયદા ઉપયોગમાં લેવામાં આવે છે.

ઘ. OCI વસ્તુઓ સંબંધિત વર્તમાન કર અન્ય વ્યાપક આવક (OCI) માં માન્ય છે.

વિલંબિત કર

ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા ઈન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ (ઈન્ડ-એએસ ૧૨) “આવકવેરા” અનુસાર.

ક. સ્થગિત આવકવેરાની સંપત્તિઓ અને જવાબદારીઓ અસ્થાયી તફાવતો માટે માન્ય છે, જે કરવેરાના દરો અને કરવેરા કાયદાનો ઉપયોગ કરીને ગણવામાં આવે છે, જે રિપોર્ટિંગ તારીખે ઘડવામાં આવ્યા છે અથવા નોંધપાત્ર રીતે ઘડવામાં આવ્યા છે.

ખ. વિલંબિત આવકવેરાની અસ્કયામતો એ હદ સુધી માન્ય છે કે તે સંભવિત છે કે કરપાત્ર નફો ઉપલબ્ધ થશે જેની સામે કપાતપાત્ર અસ્થાયી તફાવતો, અને વણવપરાયેલ ટેક્સ ક્રેડિટ્સ અને વણવપરાયેલ ટેક્સ નુકશાનનો ઉપયોગ કરી શકાય છે.

ગ. વિલંબિત આવકવેરાની અસ્કયામતોની વહન રકમની દરેક રિપોર્ટિંગ તારીખે સમીક્ષા કરવામાં આવે છે અને તે હદ સુધી ઘટાડવામાં આવે છે કે, હવે તે સંભવિત નથી કે વિલંબિત આવકવેરા સંપત્તિના તમામ અથવા ભાગનો ઉપયોગ કરવા માટે પૂરતો કરપાત્ર નફો ઉપલબ્ધ થશે.

ઘ. OCI આદરમ સંબંધિત વિલંબિત કર અન્ય વ્યાપક આવક (OCI) માં માન્ય છે.

xvi) શેર દીઠ કમાણી

ક. શેર દીઠ મૂળ કમાણીની ગણતરી સમયગાળા દરમિયાન બાકી ઇક્વિટી શેરની ભારિત સરેરાશ સંખ્યા દ્વારા ઇક્વિટી શેરહોલ્ડરોને આભારી સમયગાળા માટે ચોખ્ખો નફો અથવા નુકસાન વહેંચીને કરવામાં આવે છે. સમયગાળા દરમિયાન બાકી રહેલા ઇક્વિટી શેરની ભારિત સરેરાશ સંખ્યા બોનસ ઇસ્યૂ અને શેર વિભાજનની ઘટનાઓ માટે ગોઠવવામાં આવે છે.

ખ. શેર દીઠ મંદિત કમાણીની ગણતરીના હેતુ માટે, ઇક્વિટી શેરધારકોને આભારી સમયગાળા માટે ચોખ્ખો નફો અથવા નુકશાન અને આ સમયગાળા દરમિયાન બાકી શેરોની ભારિત સરેરાશ સંખ્યા તમામ મંદિત સંભવિત ઇક્વિટી શેરની અસરો માટે ગોઠવવામાં આવે છે.

xvii) જોગવાઈ, આકસ્મિક જવાબદારીઓ અને આકસ્મિક સંપત્તિ

ક. ભૂતકાળની ઘટનાઓના પરિણામે વર્તમાન જવાબદારી માટે એક જોગવાઈ માન્ય છે અને તે સંભવિત છે કે જવાબદારીનું સમાધાન કરવા માટે સંસાધનોના પ્રવાહની જરૂર પડશે, જેના સંદર્ભમાં વિશ્વસનીય અંદાજ લગાવી શકાય. જોગવાઈઓ તેના વર્તમાન મૂલ્યમાં ઘટાડવામાં આવતી નથી અને બેલેન્સ શીટની તારીખે જવાબદારીનું સમાધાન કરવા માટે જરૂરી મેનેજમેન્ટ અંદાજોના આધારે નક્કી કરવામાં આવે છે.

ખ. આકસ્મિક જવાબદારીઓ નીચેનામાંથી કોઈ એક કિસ્સામાં જાહેર કરવામાં આવે છે:

૧. ભૂતકાળની ઘટનામાંથી ઉદ્ભવેલી વર્તમાન જવાબદારી, જ્યારે તે સંભવિત ન હોય કે જવાબદારીનું સમાધાન કરવા માટે સંસાધનોના પ્રવાહની જરૂર પડશે; અથવા
૨. હાલની જવાબદારીનો વિશ્વસનીય અંદાજ લગાવી શકાતો નથી; અથવા
૩. સંભવિત જવાબદારી, સિવાય કે સંસાધનોના પ્રવાહની સંભાવના દૂરસ્થ હોય.

ગ. આકસ્મિક સંપત્તિ જાહેર કરવામાં આવે છે જ્યાં આર્થિક લાભોનો પ્રવાહ સંભવિત છે.

ઘ. જોગવાઈઓ, આકસ્મિક જવાબદારી અને આકસ્મિક સંપત્તિની દરેક રિપોર્ટિંગ તારીખે સમીક્ષા કરવામાં આવે છે અને વર્તમાન વ્યવસ્થાપન અંદાજને પ્રતિબિંબિત કરવા માટે ગોઠવવામાં આવે છે.

ચ. સમાધાન પર સંભવિત આઉટફલોને ધ્યાનમાં રાખીને આકસ્મિક જવાબદારી અંદાજિત જોગવાઈઓની નેટ છે.

xviii) વ્યાજબી મૂલ્ય માપન

કોર્પોરેશન દરેક બેલેન્સ શીટ તારીખે વ્યાજબી મૂલ્ય પર ચોક્કસ નાણાકીય સાધનોને માપે છે.

વ્યાજબી મૂલ્ય એ કિંમત છે જે સંપત્તિ વેચવા માટે પ્રાપ્ત થશે અથવા માપન તારીખે બજારના સહભાગીઓ વચ્ચે ગોઠવાયેલા વ્યવહારમાં જવાબદારી ટ્રાન્સફર કરવા માટે ચૂકવવામાં આવશે. વાજબી મૂલ્ય માપન એ ધારણા પર આધારિત છે કે સંપત્તિ વેચવા અથવા જવાબદારીને સ્થાનાંતરિત કરવા માટેનો વ્યવહાર ક્યાં થાય છે :

- સંપત્તિ અથવા જવાબદારી માટે મુખ્ય બજારમાં અથવા
- પ્રબળ બજારની ગેરહાજરીમાં, સંપત્તિ અથવા જવાબદારી માટે સૌથી નફાકારક બજાર.

મુખ્ય અથવા સૌથી નફાકારક બજાર કોર્પોરેશન દ્વારા સુલભ હોવું જોઈએ. સંપત્તિ અથવા જવાબદારીનું વાજબી મૂલ્ય એ ધારણાઓનો ઉપયોગ કરીને માપવામાં આવે છે કે બજારના સહભાગીઓ સંપત્તિ અથવા જવાબદારીનું મૂલ્યાંકન કરતી વખતે ઉપયોગ કરશે, એમ ધારીને કે બજારના સહભાગીઓ તેમના પોતાના આર્થિક શ્રેષ્ઠ હિતમાં કાર્ય કરે છે.

બિન-નાણાકીય સંપત્તિનું વ્યાજબી મૂલ્ય માપન બજાર સહભાગીની સંપત્તિનો તેના ઉચ્ચતમ અને શ્રેષ્ઠ ઉપયોગ દ્વારા અથવા અન્ય બજાર સહભાગીને વેચાણ કરીને આર્થિક લાભો ઉત્પન્ન કરવાની ક્ષમતાને ધ્યાનમાં લે છે જે સંપત્તિને તેના ઉચ્ચતમ અને શ્રેષ્ઠ ઉપયોગ માટે મૂકશે.

કોર્પોરેશન મૂલ્યાંકન તકનીકોનો ઉપયોગ કરે છે જે સંજોગોમાં યોગ્ય છે અને જેના માટે વ્યાજબી મૂલ્યને માપવા માટે પૂરતો ડેટા ઉપલબ્ધ છે, સંબંધિત અવલોકનક્ષમ ઇનપુટ્સનો મહત્તમ ઉપયોગ કરે છે અને અવલોકનક્ષમ ઇનપુટ્સનો ઉપયોગ ઓછો કરે છે.

તમામ અસ્કયામતો અને જવાબદારીઓ કે જેના માટે વ્યાજબી મૂલ્ય માપવામાં આવે છે અથવા નાણાકીય નિવેદનોમાં જાહેર કરવામાં આવે છે તે વ્યાજબી મૂલ્યના વંશવેલોમાં વર્ગીકૃત કરવામાં આવે છે, જેનું વર્ણન વ્યાજબી મૂલ્ય માપન માટે મહત્વપૂર્ણ એવા ઇનપુટ્સના સૌથી નીચા સ્તરના આધારે કરવામાં આવે છે. :

- સ્તર ૧ – સમાન અસ્કયામતો અથવા જવાબદારીઓ માટે સક્રિય બજારોમાં અવતરિત (અવ્યવસ્થિત) બજાર કિંમત.
- સ્તર ૨ – મૂલ્યાંકન તકનીકો કે જેના માટે ઇનપુટ્સનું સૌથી નીચું સ્તર જે વ્યાજબી મૂલ્ય માપન માટે નોંધપાત્ર છે તે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે અવલોકનક્ષમ છે.
- સ્તર ૩ – મૂલ્યાંકન તકનીકો કે જેના માટે ઇનપુટ્સનું સૌથી નીચું સ્તર જે વ્યાજબી મૂલ્ય માપન માટે મહત્વપૂર્ણ છે તે અગમ્ય છે.

રિફરિંગ ધોરણે નાણાકીય નિવેદનોમાં માન્યતા પ્રાપ્ત અસ્કયામતો અને જવાબદારીઓ માટે, કોર્પોરેશન વર્ગીકરણના પુનઃમૂલ્યાંકન દ્વારા વંશવેલો સ્તરો વચ્ચે સ્થાનાંતરણ થયું છે કે કેમ તે નક્કી કરે છે (ઇનપુટના સૌથી નીચા સ્તરના આધારે જે વ્યાજબી મૂલ્ય માપન માટે નોંધપાત્ર છે.) સમગ્ર દરેક રિપોર્ટિંગ સમયગાળાના અંતે.

xix) ઇકિવટી ધારકોને ડિવિડન્ડ

ચૂકવેલ/ચૂકવવાપાત્ર ડિવિડન્ડ તે વર્ષમાં માન્ય છે જેમાં સંબંધિત ડિવિડન્ડ શેરહોલ્ડરો અથવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા યોગ્ય તરીકે મંજૂર કરવામાં આવે છે.

xx) નાણાકીય સાધનો : -

પ્રારંભિક માન્યતા : -

નાણાકીય સંપત્તિઓ અને જવાબદારીઓ માન્ય કરવામાં આવે છે જ્યારે નિગમ સાધનની કરારની જોગવાઈઓનો પક્ષ બને છે. નાણાકીય સંપત્તિઓ અને જવાબદારીઓ શરૂઆતમાં વ્યાજબી મૂલ્ય પર માપવામાં આવે છે. નાણાકીય અસ્કયામતો અને નાણાકીય જવાબદારીઓ (નાણાકીય અસ્કયામતો અને નફા અથવા નુકશાન દ્વારા વ્યાજબીમૂલ્ય પર નાણાકીય જવાબદારીઓ સિવાય) ના સંપાદન અથવા ઇસ્ત્યૂને સીધા આભારી લેવડદેવડ ખર્ચ નાણાકીય સંપત્તિની પ્રારંભિક માન્યતા પર માપવામાં આવેલા વ્યાજબી મૂલ્યમાં અથવા નાણાકીય જવાબદારીમાં ઉમેરવામાં આવે છે અથવા કાપવામાં આવે છે.

અનુગામી માપ

ક. નાણાકીય સંપત્તિ

નાણાકીય સંપત્તિને નીચેની કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવી છે : -

I. ઋણમુક્ત ખર્ચ પર

નાણાકીય અસ્કયામતો બાદમાં ઋણમુક્ત ખર્ચમાં માપવામાં આવે છે, જો આ નાણાકીય સંપત્તિઓ ધંધામાં રાખવામાં આવે, જેનો ઉદ્દેશ કરાર આધારિત રોકડ પ્રવાહ એકત્ર કરવા માટે આ સંપત્તિઓ રાખવાનો છે અને નાણાકીય સંપત્તિની કરારની શરતો નિર્દિષ્ટ તારીખે બાકી રકમ પર મૂળ અને વ્યાજની ચુકવણી રોકડ પ્રવાહમાં વધારો કરે છે.

II. અન્ય વ્યાપક આવક દ્વારા યોગ્ય મૂલ્ય પર

i. નાણાકીય અસ્કયામતો અન્ય વ્યાપક આવક દ્વારા વાજબી મૂલ્ય પર માપવામાં આવે છે, જો આ નાણાકીય અસ્કયામતો એવા વ્યવસાયની અંદર રાખવામાં આવે છે જેનો ઉદ્દેશ કરાર આધારિત રોકડ પ્રવાહ એકત્રિત કરીને અને નાણાકીય સંપત્તિ વેચીને અને નાણાકીય સંપત્તિની કરારની શરતો ચોક્કસ તારીખે રોકડ પ્રવાહમાં વધારો આપે છે. કે જે માત્ર મુખ્ય ચુકવણી અને બાકી રહેલી મુખ્ય રકમ પર વ્યાજ છે.

ii. નિગમે અન્ય વ્યાપક આવકમાં રજૂઆત કરવા માટે એક અટલ ચૂંટણી કરી છે ત્યારબાદ વેપાર માટે રાખવામાં ન આવતા ઇક્વિટીના વ્યાજબી મૂલ્યમાં અનુગામી ફેરફારો.

III. નફા અને નુકસાન દ્વારા વ્યાજબી મૂલ્ય પર

નાણાકીય અસ્કયામતો નફા અથવા નુકશાન દ્વારા વ્યાજબી મૂલ્ય પર માપવામાં આવે છે, સિવાય કે તે પ્રારંભિક માન્યતા પર અન્ય વ્યાપક આવક દ્વારા અમૂર્ત ખર્ચ અથવા વ્યાજબી મૂલ્ય પર માપવામાં આવે. નફા અથવા નુકશાન દ્વારા વ્યાજબી મૂલ્ય પર નાણાકીય સંપત્તિઓ અને જવાબદારીઓના હસ્તાંતરણને કારણે સીધો જવાબદાર વ્યવહારનો ખર્ચ નફો અથવા નુકશાનમાં તરત જ માન્ય કરવામાં આવે છે.

ખ. નાણાકીય જવાબદારીઓ : -

નાણાકીય જવાબદારીઓ નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવી છે : -

I. ઋણમુક્ત ખર્ચ પર : -

વેપાર અને અન્ય ચૂકવવાપાત્ર, ડીલર ડિપોઝિટ વગેરે દ્વારા રજૂ કરાયેલા ઋણમુક્ત ખર્ચમાં નાણાકીય જવાબદારીઓને શરૂઆતમાં વ્યાજબી મૂલ્ય પર માન્યતા પ્રાપ્ત થાય છે, અને બાદમાં અસરકારક વ્યાજ દર પદ્ધતિનો ઉપયોગ કરીને ઋણમુક્ત ખર્ચ પર વહન કરવામાં આવે છે.

II. નફા અને નુકશાન દ્વારા યોગ્ય મૂલ્ય પર (FVTPL) : -

નિગમે નફા અને નુકશાન થકી વ્યાજબી મૂલ્ય (FVTPL) પર કોઈ નાણાકીય જવાબદારીઓ નક્કી કરી નથી.

ગેર-માન્યતા:

ક. નાણાકીય અસ્કયામતો : -

નાણાકીય સંપત્તિ (અથવા, જ્યાં લાગુ પડે છે, નાણાકીય સંપત્તિનો એક ભાગ અથવા સમાન નાણાકીય સંપત્તિના જૂથનો ભાગ) ત્યારે જ માન્યતા આપવામાં આવે છે જ્યારે સંપત્તિમાંથી રોકડ પ્રવાહના કરારના અધિકારો સમાપ્ત થાય છે અથવા તે નાણાકીય સંપત્તિને અને નોંધપાત્ર રીતે તમામ જોખમો અને સંપત્તિની માલિકીના પુરસ્કારોને સ્થાનાંતરિત કરે છે

ખ. નાણાકીય જવાબદારીઓ : -

જ્યારે જવાબદારી હેઠળની જવાબદારી છૂટી થાય છે અથવા રદ થાય છે અથવા સમાપ્ત થાય છે ત્યારે નાણાકીય જવાબદારીને માન્યતા આપવામાં આવતી નથી. જ્યારે હાલની નાણાકીય જવાબદારી એક જ લેણદાર પાસેથી નોંધપાત્ર રીતે અલગ શરતો પર બદલવામાં આવે છે, અથવા હાલની જવાબદારીની શરતોમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવે છે, ત્યારે આવા વિનિમય અથવા ફેરફારને મૂળ જવાબદારીની માન્યતા અને નવી જવાબદારીની માન્યતા તરીકે ગણવામાં આવે છે. અને સંબંધિત વહન રકમમાં તફાવત નફો અને નુકસાનના નિવેદનમાં માન્ય રાખવામાં આવે છે.

નાણાકીય સંપત્તિની ક્ષતિ: -

નિગમ અપેક્ષિત ક્રેડિટ લોસ (ECL) મોડેલને માપવા અને ક્ષતિ નુકશાનની માન્યતા માટે લાગુ કરે છે. નિગમ વેપાર પ્રાપ્ય અને અન્ય નાણાકીય અસ્કયામતો પર ક્ષતિ નુકશાન ઉપર છૂટની માન્યતા માટે સરળ અભિગમને અનુસરે છે. સરળ અભિગમનો ઉપયોગ નિગમે ક્રેડિટ રિસ્કમાં થતા ફેરફારો ઉપર દેખરેખ રાખવાની જરૂર રહેતી નથી. તેના બદલે, તે દરેક રિપોર્ટિંગ તારીખે તેની આજીવન ઇસીએલ પર આધારિત ક્ષતિ નુકશાન ભથ્થાને તેની પ્રારંભિક ઓળખથી જ નક્કી કરે છે.

નિગમ અપેક્ષિત ધોરણે તેની અસ્કયામતો સાથે સંકળાયેલ અપેક્ષિત ધિરાણ નુકસાનોનું મૂલ્યાંકન કરે છે જે ઋણમુક્ત કિંમત અને એફવીટીઓસીઆઇ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર કરવામાં આવે છે. ક્રેડિટ રિસ્કમાં નોંધપાત્ર વધારો થયો છે કે કેમ તેના પર ક્ષતિ પદ્ધતિ લાગુ પડે છે.

સમયગાળા દરમિયાન માન્ય ECL ક્ષતિ નુકશાન છૂટ (અથવા રિવર્સલ) નફા અને નુકસાનના નિવેદનમાં આવક/ખર્ચ તરીકે માન્ય છે. વેપારની પ્રાપ્તિ, લોન અને એડવાન્સ અને અન્ય વર્તમાન સંપત્તિઓ હેઠળની રકમ પક્ષકારો સામે ત્રણ વર્ષ કરતા ઓછા અથવા ઓછા સમયગાળા માટે સારી ગણવામાં આવે છે અને તે મુજબ જોગવાઈ શંકાસ્પદ દેવા માટેની પદ્ધતિ છે.

નાણાકીય આસકયામતોનું પુનઃ વર્ગીકરણ : -

કંપની પ્રારંભિક માન્યતા પર નાણાકીય સંપત્તિ અને જવાબદારીઓનું વર્ગીકરણ નક્કી કરે છે. પ્રારંભિક માન્યતા પછી, નાણાકીય સંપત્તિઓ કે જે ઇકિવટી ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને નાણાકીય જવાબદારીઓ છે તેના માટે કોઈ પુનઃવર્ગીકરણ કરવામાં આવતું નથી. નાણાકીય અસ્કયામતો કે જે દેવા માટેના સાધનો છે, પુનઃવર્ગીકરણ ત્યારે જ કરવામાં આવે છે, જ્યારે તે અસ્કયામતોના સંચાલન માટે બિઝનેસ મોડેલમાં ફેરફાર થાય. બિઝનેસ મોડેલમાં ફેરફાર ભાગ્યે જ થવાની ધારણા છે. કંપનીના વરિષ્ઠ મેનેજમેન્ટ બાહ્ય અથવા આંતરિક ફેરફારોના પરિણામે બિઝનેસ મોડેલમાં ફેરફાર નક્કી કરે છે, જે કંપનીની કામગીરી માટે નોંધપાત્ર છે. જો કંપની નાણાકીય અસ્કયામતોને ફરીથી વર્ગીકૃત કરે છે, તો તે પુનઃવર્ગીકરણ તારીખથી સંભવિત રૂપે પુનઃવર્ગીકરણ લાગુ કરે છે જે ઇન્ડ એએસ - ૧૦૯ મુજબ ઇન્ડરટ્ટી મોડેલમાં ફેરફાર બાદ તરત જ આગામી રિપોર્ટિંગ અવધિનો પ્રથમ દિવસ છે.

નાણાકીય સાધનો સરભર કરવા : -

નાણાકીય અસ્કયામતો અને નાણાકીય જવાબદારીઓ સરભર કરવામાં આવે છે અને ચોખ્ખી રકમની જાણ બેલેન્સ શીટમાં કરવામાં આવે છે, જો હાલમાં માન્ય રકમને સરભર કરવાનો કાયદાકીય અધિકાર હોય અને ચોખ્ખા ધોરણે પતાવટ કરવાનો, સંપત્તિનો ખ્યાલ લાવવા અને જવાબદારીઓનું સમાધાન કરવાનો ઇરાદો હોય.

xxi) વર્તમાન વિ. બિન-વર્તમાન વર્ગીકરણ

નાણાકીય અસ્કયામતો અને નાણાકીય જવાબદારીઓ સરભર કરવામાં આવે છે

સંપત્તિ વર્તમાન હોય છે જ્યારે તે હોય છે:

- સામાન્ય ઓપરેટિંગ સાયકલમાં પ્રાપ્ત થવાની અથવા વેચવા અથવા ખાવાના હેતુથી અપેક્ષિત;
- મુખ્યત્વે વેપારના હેતુ માટે રાખવામાં આવે છે;
- રિપોર્ટિંગ સમયગાળાના બાર મહિનાની અંદર અપેક્ષિત પુનઃપ્રાપ્તિ; અથવા
- રોકડ અથવા રોકડ સમકક્ષ, સિવાય કે રિપોર્ટિંગ સમયગાળા પછી ઓછામાં ઓછા બાર મહિના માટે જવાબદારીની પતાવટ કરવા અથવા તેનો ઉપયોગ કરવા માટે વિનિમય કરવા પર પ્રતિબંધ ન હોય.

અન્ય તમામ અસ્કયામતો બિન-વર્તમાન તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.

જવાબદારી હાજર છે જ્યારે:

- તે સામાન્ય ઓપરેટિંગ ચક્રમાં સ્થાયી થવાની અપેક્ષા છે;
- તે મુખ્યત્વે વેપારના હેતુ માટે ગોઠવવામાં આવે છે;
- તે રિપોર્ટિંગ સમયગાળા પછી બાર મહિનામાં પતાવટ કરવાની છે; અથવા
- રિપોર્ટિંગ અવધિ પછી ઓછામાં ઓછા બાર મહિના સુધી જવાબદારીની પતાવટને મુલતવી રાખવાનો કોઈ બિનશરતી અધિકાર નથી.

કોર્પોરેશનનું સંચાલન ચક્ર એ પ્રોસેસિંગ માટે અસ્કયામતોના સંપાદન અને રોકડ અથવા રોકડ સમકક્ષમાં તેમની રસીદ વચ્ચેનો સમય છે. કોર્પોરેશનનું લાક્ષણિક ઓપરેટિંગ ચક્ર સ્પષ્ટ રીતે ઓળખી શકાતું ન હોવાથી, તે બાર મહિનાનું માનવામાં આવે છે.

કોર્પોરેશન અન્ય તમામ જવાબદારીઓને બિન-વર્તમાન તરીકે વર્ગીકૃત કરે છે.

xxii) ૧ એપ્રિલ, ૨૦૨૩ થી કોર્પોરેશન દ્વારા અપનાવવામાં આવેલા નવા એકાઉન્ટિંગ ધોરણો, સુધારા અને અર્થઘટન :

કોર્પોરેટ બાબતોનું મંત્રાલય ("MCA") સમયાંતરે જારી કરાયેલા કંપનીઝ (ભારતીય એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ) નિયમો હેઠળ નવા ધોરણો અથવા વર્તમાન ધોરણોમાં સુધારાને સૂચિત કરે છે. ૩૧ માર્ચ, ૨૦૨૩ના રોજ, એમસીએએ ૧ એપ્રિલ, ૨૦૨૩થી કંપનીઝ (ભારતીય એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ) સુધારા નિયમો, ૨૦૨૩માં સુધારો કર્યો, જે નીચે મુજબ છે:

ક. IndAS 1 - નાણાકીય નિવેદનોની રજુઆત

સુધારા અનુસાર કંપનીઓને તેમની મહત્વની હિસાબી નીતિઓ નહીં કે નોંધપાત્ર હિસાબી નીતિઓ જાહેર કરવાની જરૂરિયાત છે. હિસાબી નીતિઓ અન્ય માહિતીની સાથે મહત્વની ગણી શકાય જ્યારે તેના દ્વારા નાણાકીય નિવેદનોના પ્રાથમિક વપરાશકર્તાઓના નિર્ણયોને પ્રભાવિત કરવાની વ્યાજબી રીતે અપેક્ષા રાખી શકાય છે. કંપનીને અપેક્ષા નથી કે આ સુધારાથી તેના નાણાકીય નિવેદનોમાં કોઈ નોંધપાત્ર અસર થશે.

ખ. IndAS 12 - આવકવેરા

આ સુધારા સ્પષ્ટ કરે છે કે લીઝ અને ડિકમિશનિંગ જવાબદારીઓ જેવા વ્યવહારો પર કંપનીઓ વિલંબિત કર ની હિસાબી અસર કેવી રીતે આપે છે. સુધારાઓએ IndAS 12 (માન્યતા મુક્તિ) ના ફક્ત ૧૫ અને ૨૪ માં માન્યતા મુક્તિનો અવકાશ સંકુચિત કર્યો છે જેથી તે હવે એવા વ્યવહારો પર લાગુ ન થાય કે જે પ્રારંભિક માન્યતા પર, સમાન કરપાત્ર અને કપાતપાત્ર અસ્થાયી તફાવતોને જન્મ આપે છે. કંપની તેના નાણાકીય નિવેદનોમાં અસર, જો કોઈ હોય તો તેનું મૂલ્યાંકન કરી રહી છે.

ગ. IndAS 8

આ સુધારાઓ હિસાબી નીતિઓ અને હિસાબી અંદાજો વચ્ચે તફાવત કરવામાં સંસ્થાઓને મદદ કરશે. હિસાબી અંદાજમાં ફેરફારની વ્યાખ્યાને હિસાબી અંદાજની વ્યાખ્યા સાથે બદલવામાં આવી છે. નવી વ્યાખ્યા હેઠળ, હિસાબી અંદાજો ને "નાણાકીય નિવેદનોમાં નાણાકીય રકમો છે જે માપનની અનિશ્ચિતતાને આધીન છે" તરીકે વ્યાખ્યાયિત કરેલ છે. જો હિસાબી નીતિ મુજબ નાણાકીય નિવેદનોમાં સમાવિષ્ટ કોઈ બાબત ના માપનમાં અનિશ્ચિતતા રહેલ હોય તો એકમો દ્વારા હિસાબી અંદાજો વિકસાવવામાં આવે છે. કંપનીને અપેક્ષા નથી કે આ સુધારાથી તેના નાણાકીય નિવેદનોમાં કોઈ નોંધપાત્ર અસર થશે.

xxxii) નિગમ દ્વારા હજુ સુધી નવા સુધારા અપનાવવામાં આવ્યા નથી:

સામાજિક સુરક્ષા કોડ, ૨૦૨૦:

ભારતીય સંસદે સામાજિક સુરક્ષા સંહિતા, ૨૦૨૦ને મંજૂરી આપી છે જે કોર્પોરેશન દ્વારા પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેયુટી તરફના યોગદાનને અસર કરશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે ૧૩ નવેમ્બર, ૨૦૨૦ ના રોજ સામાજિક સુરક્ષા સંહિતા, ૨૦૨૦ માટેના નિયમોનો મુસદ્દો બહાર પાડ્યો હતો અને હિતધારકો પાસેથી સૂચનો આમંત્રિત કર્યા હતા, જે મંત્રાલયની વિચારણા હેઠળ છે. વિષય નિયમો સૂચિત થયા પછી, કોર્પોરેશન અસરનું મૂલ્યાંકન કરશે અને તેનું મૂલ્યાંકન કરશે. સંહિતા અમલમાં હોય અને નાણાકીય અસર નક્કી કરવા સંબંધિત નિયમો પ્રકાશિત થાય તે સમયગાળા માટે, કોર્પોરેશન તેના નાણાકીય નિવેદનોમાં યોગ્ય અસર આપશે.

૩૧મી માર્ચ ૨૦૨૩ ના રોજ પૂરા થયેલા વર્ષ માટે નાણાકીય નિવેદન પર નોંધ

નોંધ :- ૩
મિલકત, પ્લાન્ટ અને સાધનો

(₹ લાખમાં)

વિગત	ફીલ્ડ જમીન	સાઈટ ડેવલપ મેન્ટ	લીઝહોલ્ડ જમીન	રાજકોટ ખાતે ગોડાઉન	મકાન	પ્લાન્ટ અને મશીનરી	ફર્નિચર અને ફિક્ચર	ઓફિસ સાધનો	કોમ્પ્યુટર	વાહનો	લેબોરેટરી ના સાધનો	સાઈટ ઓફ યુગ્મ એસેટ્સ (મિલ્કિત)	કુલ
ગ્રોસ ડ્બલેક													
૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ	૫૨.૦૪	૭.૦૮	૦.૩૧	૮૫૦.૦૧	૪,૭૧૬.૩૨	૬૩૫.૩૪	૨૫૩.૦૨	૨૩૩.૪૦	૧૧૭.૬૦	૧૫૨.૨૯	૬.૧૨	૩૨.૪૪	૭,૦૫૮.૯૭
ઉમેરો	-	-	-	-	૩૪૫.૮૮	૦.૨૩	-	૨૯.૬૩	૫.૯૪	-	-	૧૦.૬૦	૩૯૨.૩૮
નિકાલ / ગોઠવણો	-	-	(૦.૦૧)	-	-	-	-	-	(૮.૧૧)	(૩.૦૬)	-	(૩૨.૪૪)	(૪૩.૬૨)
૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ	૫૨.૦૪	૭.૦૮	૦.૩૦	૮૫૦.૦૧	૫,૦૬૫.૩૦	૬૩૫.૫૭	૨૫૩.૦૨	૨૬૩.૦૩	૧૧૫.૪૩	૧૪૯.૨૩	૬.૧૨	૧૦.૬૦	૭,૪૦૭.૭૩
ઉમેરો	-	-	-	-	૭.૦૮	૦.૭૭	૧૬.૩૦	૩.૧૩	-	૮.૬૯	-	૨૧.૯૧	૫૭.૮૮
નિકાલ / ગોઠવણો	-	(૭.૦૮)	(૦.૦૧)	-	-	-	-	-	-	(૫.૪૪)	-	-	(૧૨.૫૩)
૩૧મી માર્ચ ૨૦૨૩ના રોજ	૫૨.૦૪	-	૦.૨૯	૮૫૦.૦૧	૫,૦૭૨.૩૮	૬૩૬.૩૪	૨૬૯.૩૨	૨૬૬.૧૬	૧૧૫.૪૩	૧૫૨.૪૮	૬.૧૨	૩૨.૫૧	૭,૪૫૩.૦૮
સંચિત અવમૂલ્યન અને ક્ષતિ	-	-	-	-	-	-	-	-	-	-	-	-	-
૩૧મી માર્ચ, ૨૦૨૧ના રોજ	-	-	-	-	૧,૩૬૭.૧૦	૫૦૭.૧૬	૧૨૦.૫૩	૧૪૭.૪૬	૧૦૮.૯૧	૧૧૮.૨૦	૫.૮૮	૨૧.૮૯	૨,૩૯૭.૧૩
સંચિત અવમૂલ્યન અને ક્ષતિ	-	-	-	-	૨૦૨.૦૨	૨૨.૧૨	૩૩.૯૧	૪૯.૭૧	૪.૦૨	૮.૮૩	-	૧૧.૭૯	૩૩૨.૪૦
નિકાલ / ગોઠવણો	-	-	-	-	-	-	-	-	(૭.૭૦)	(૨.૯૧)	-	(૩૨.૪૪)	(૪૩.૦૫)
૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ	-	-	-	-	૧,૫૬૯.૧૨	૫૨૯.૨૮	૧૫૪.૪૪	૧૯૭.૧૭	૧૦૫.૨૩	૧૨૪.૧૨	૫.૮૮	૧.૨૪	૨,૬૮૬.૪૮
વર્ષ માટે અવમૂલ્યન ચાર્જ	-	-	-	-	૧૯૬.૮૯	૨૩.૪૮	૨૮.૯૩	૩૪.૧૫	-	૬.૭૧	-	૧૦.૬૪	૩૦૦.૮૦
નિકાલ / ગોઠવણો	-	-	-	-	-	-	-	-	-	(૫.૧૭)	-	-	(૫.૧૭)
૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ	-	-	-	-	૧,૭૬૬.૦૧	૫૫૨.૭૬	૧૮૩.૩૭	૨૩૧.૩૨	૧૦૫.૨૩	૧૨૫.૬૬	૫.૮૮	૧૧.૮૮	૨,૯૮૨.૧૧
નેટ વહન કિંમત													
૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ	૫૨.૦૪	-	૦.૨૯	૮૫૦.૦૧	૩,૩૦૬.૩૭	૮૩.૫૮	૮૫.૯૫	૩૪.૮૪	૧૦.૨૦	૨૬.૮૨	૦.૨૪	૨૦.૬૩	૪,૪૭૦.૯૭
૩૧માર્ચ, ૨૦૨૨ના રોજ	૫૨.૦૪	૭.૦૮	૦.૩૦	૮૫૦.૦૧	૩,૪૯૬.૧૮	૧૦૬.૨૯	૯૮.૫૮	૬૫.૮૬	૧૦.૨૦	૨૫.૧૧	૦.૨૪	૯.૩૬	૪,૭૨૧.૨૫

નોંધ :-

- ૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ નિગમની માલિકીની તમામ સ્થાવર મિલકતો તેના પોતાના નામે છે.
- નાણાકીય વર્ષ દરમિયાન ૨૦૨૨-૨૩, વ્યવસાય સંયોજનના પરિણામે મિલકત, પ્લાન્ટ અને સાધનસામગ્રીની કોઈપણ વસ્તુનું સંપાદન નથી.
- નિગમ મિલકત, પ્લાન્ટ અને સાધનોની તમામ વસ્તુઓ માટે માન્યતાના ખર્ચ મોડેલને અનુસરે છે અને તેથી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન કોઈ પુનઃમૂલ્યાંકન હાથ ધરવામાં આવતું નથી.

નોંધ નં. ૪ : પ્રગતિ હેઠળના મૂડી કાર્યો :

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૨ના ના રોજ
વર્ષની શરૂઆતમાં બેલેન્સ	૨૩.૪૪	૧૮૨.૨૫
ઉમેરો	૫.૮૧	૧૮૨.૮૭
કપાત	(૪.૬૩)	(૪.૩૦)
મૂડીકૃત	(૨૪.૬૨)	(૩૩૭.૩૮)
વર્ષના અંતે બેલેન્સ	-	૨૩.૪૪
કુલ:	-	૨૩.૪૪

નોંધ ૪.૧ પ્રગતિ હેઠળના મૂડી કાર્યોનું એજિંગ

(ક) ચાલુ પ્રોજેક્ટ્સ અને અસ્થાયી રૂપે સ્થગિત પ્રોજેક્ટ્સ માટે

૩૧ માર્ચ, ૨૦૨૩ ના રોજ પ્રગતિ હેઠળના મૂડી કાર્યો માટે એજિંગ નીચે મુજબ છે:

(₹ લાખમાં)

વિગત	સમયગાળા માટે મૂડી કાર્ય-પ્રગતિમાં રકમ				કુલ
	એક વર્ષથી ઓછા	૧-૨ વર્ષ	૨-૩ વર્ષ	૩ વર્ષથી વધુ	
પ્રોજેક્ટ ચાલુ છે	-	-	-	-	-
પ્રોજેક્ટ અસ્થાયી રૂપે સ્થગિત	-	-	-	-	-
કુલ મૂડી કાર્ય ચાલુ છે	-	-	-	-	-

૩૧ માર્ચ, ૨૦૨૨ ના રોજ પ્રગતિ હેઠળના મૂડી કાર્યો માટે એજિંગ નીચે મુજબ છે:

(₹ લાખમાં)

વિગત	સમયગાળા માટે મૂડી કાર્ય-પ્રગતિમાં રકમ				કુલ
	એક વર્ષથી ઓછા	૧-૨ વર્ષ	૨-૩ વર્ષ	૩ વર્ષથી વધુ	
પ્રોજેક્ટ ચાલુ છે	૧૮.૮૧	-	૪.૬૩	-	૨૩.૪૪
પ્રોજેક્ટ અસ્થાયી રૂપે સ્થગિત	-	-	-	-	-
કુલ મૂડી કાર્ય ચાલુ છે	૧૮.૮૧	-	૪.૬૩	-	૨૩.૪૪

(ખ) એવા પ્રોજેક્ટ્સ માટે કે જેમની સમાપ્તિ મુદત વીતી છે અથવા તેની મૂળ યોજના કરતાં વધુ ખર્ચ છે

૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં

(₹ લાખમાં)

વિગત	માં પૂર્ણ થવાનું છે				કુલ
	એક વર્ષથી ઓછા	૧-૨ વર્ષ	૨-૩ વર્ષ	૩ વર્ષથી વધુ	
પ્રોજેક્ટ જેની પૂર્ણતા મુદત વીતી છે	-	-	-	-	-
પ્રોજેક્ટ જેની કિંમત તેની મૂળ યોજનાની વુલનામાં વધી ગઈ છે	-	-	-	-	-

૩૧ માર્ચ ૨૦૨૨ સુધીમાં

(₹ લાખમાં)

વિગત	માં પૂર્ણ થવાનું છે				કુલ
	એક વર્ષથી ઓછા	૧-૨ વર્ષ	૨-૩ વર્ષ	૩ વર્ષથી વધુ	
પ્રોજેક્ટ જેની પૂર્ણતા મુદત વીતી છે	-	-	-	-	-
પ્રોજેક્ટ જેની કિંમત તેની મૂળ યોજનાની વુલનામાં વધી ગઈ છે	-	-	-	-	-

નોંધ: પ : રોકાણ મિલકત

(₹ લાખમાં)

વિગત	મકાન	કુલ
ગ્રોસ બ્લોક		
૧ એપ્રિલ, ૨૦૨૧ ના રોજ	૧૫.૭૦	૧૫.૭૦
ઉમેરો	-	-
નિકાલ	-	-
૩૧ મી માર્ચ, ૨૦૨૨ ના રોજ	૧૫.૭૦	૧૫.૭૦
ઉમેરો	-	-
નિકાલ	-	-
૩૧ માર્ચ, ૨૦૨૩ ના રોજ	૧૫.૭૦	૧૫.૭૦
સંચિત અવમૂલ્યન અને ક્ષતિ		
૧ એપ્રિલ, ૨૦૨૧ ના રોજ	૧૦.૮૨	૧૦.૮૨
વર્ષ દરમિયાન અવમૂલ્યન ચાર્જ	૦.૨૫	૦.૨૫
નિકાલ	-	-
૩૧ મી માર્ચ, ૨૦૨૨ ના રોજ	૧૧.૦૭	૧૧.૦૭
વર્ષ દરમિયાન અવમૂલ્યન ચાર્જ	૦.૨૨	૦.૨૨
નિકાલ	-	-
૩૧ માર્ચ, ૨૦૨૩ ના રોજ	૧૧.૨૯	૧૧.૨૯
નેટ વહન રકમ		
૩૧મી માર્ચ, ૨૦૨૩	૪.૪૧	૪.૪૧
૩૧મી માર્ચ, ૨૦૨૨	૪.૬૩	૪.૬૩

રોકાણ મિલકતની આવક અને ખર્ચ સંબંધિત માહિતી

(₹ લાખમાં)

વિગત	વર્ષ ૩૧મી માર્ચ, ૨૦૨૩ના અંત સુધી	વર્ષ ૩૧મી માર્ચ, ૨૦૨૨ના અંત સુધી
રોકાણની મિલકતમાંથી મળેલ ભાડાની આવક	૨.૬૩	૨.૬૩
સીધા ઓપરેટિંગ ખર્ચ (સમારકામ અને જાળવણી સહિત) જે ભાડાની આવક પેદા કરે છે.	-	-
સીધા ઓપરેટિંગ ખર્ચ (સમારકામ અને જાળવણી સહિત) જે ભાડાની આવક પેદા કરતાં નથી.	-	-
અવમૂલ્યન પહેલાં રોકાણની મિલકતોમાંથી ઉભો થતો નફો	૨.૬૩	૨.૬૩
બાદ : અવમૂલ્યન	(૦.૨૨)	(૦.૨૫)
રોકાણની મિલકતોમાંથી ઉભો થતો નફો	૨.૪૧	૨.૩૮

નોંધ : -

રોકાણ સંપત્તિની ખરીદી, બાંધકામ અથવા વિકાસ માટે અથવા તેના સમારકામની જાળવણી અથવા વૃદ્ધિ માટે કરારબદ્ધતા શૂન્ય છે.

વ્યાજબી મૂલ્યનો અંદાજ

નિગમે તેની રોકાણની મિલકતો માટે સ્વતંત્ર મૂલ્યાંકન મેળવ્યું નથી. વ્યાજબી મૂલ્યનો શ્રેષ્ઠ પુરાવો સમાન મિલકતો માટે સક્રિય બજારમાં વર્તમાન ભાવ છે.

નોંધ : ૬ : અન્ય અમૂર્ત અસ્કયામતો

(₹ લાખમાં)

વિગત	કોમ્પ્યુટર સોફ્ટવેર	બી.ટી. કોટન લાઇસેન્સ ફી	કુલ
ગ્રોસ બ્લોક			
૧લી એપ્રિલ, ૨૦૨૧ ના રોજ	૬.૩૧	૫૫.૬૭	૬૧.૯૮
ઉમેરો	-	-	-
નિકાલ/ગોઠવણો	-	-	-
૩૧મી માર્ચ, ૨૦૨૨ ના રોજ	૬.૩૧	૫૫.૬૭	૬૧.૯૮
ઉમેરો	-	-	-
નિકાલ/ગોઠવણો	-	-	-
૩૧મી માર્ચ, ૨૦૨૩ ના રોજ	૬.૩૧	૫૫.૬૭	૬૧.૯૮
સંચિત અવમૂલ્યન અને ક્ષતિ			
૧લી માર્ચ, ૨૦૨૧ ના રોજ	૫.૯૮	૪૩.૩૪	૪૯.૩૨
વર્ષ માટે અવમૂલ્યન ચાર્જ	-	૫.૫૭	૫.૫૭
નિકાલ/ગોઠવણો	-	-	-
૩૧મી માર્ચ, ૨૦૨૨ ના રોજ	૫.૯૮	૪૮.૯૧	૫૪.૮૯
વર્ષ માટે અવમૂલ્યન ચાર્જ	-	-	-
નિકાલ/ગોઠવણો	-	-	-
૩૧મી માર્ચ, ૨૦૨૩ ના રોજ	૫.૯૮	૪૮.૯૧	૫૪.૮૯
નેટ વહન કિંમત			
૩૧મી માર્ચ, ૨૦૨૨ ના રોજ	૦.૩૩	૬.૭૬	૭.૦૯
૩૧મી માર્ચ, ૨૦૨૩ ના રોજ	૦.૩૩	૬.૭૬	૭.૦૯

નોંધ : ૭ : અન્ય નાણાકીય અસ્કયામતો - બિન વર્તમાન

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ	૩૧મી માર્ચ, ૨૦૨૨ના રોજ
સુરક્ષા થાપણ		
અસુરક્ષિત, સારું માનવામાં આવે છે	૧૧.૬૫	૯.૫૦
કુલ :	૧૧.૬૫	૯.૫૦

નોંધ :- ૮ : વિલંબિત કર અસ્કયામતો / (જવાબદારીઓ) (નેટ)

બેલેન્સ નીચે મુજબના હંગામી તફાવતોને સમાવે છે :

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ	૩૧મી માર્ચ, ૨૦૨૨ના રોજ
વિલંબિત કર જવાબદારીઓ		
આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ ની કલમ ૪૩બી હેઠળ નામંજૂરી	(૨૬.૮૨)	(૬.૦૩)
કુલ :	(૨૬.૮૨)	(૬.૦૩)
વિલંબિત કર અસ્કયામતો :		
શંકાસ્પદ દેવા અને એડવાન્સ માટે જોગવાઈ	૧૨.૧૪	૬.૯૬
ઇન્ડ એએસ ૧૧૬ ની અસર	૦.૨૭	૦.૦૬
સંપત્તિ પ્લાન્ટ અને સાધનો સંબંધિત	૮.૦૦	૧૨.૯૪
કુલ :	૨૦.૪૧	૧૯.૯૬
વિલંબિત કર અસ્કયામતો / (જવાબદારીઓ) :	(૬.૪૧)	૧૩.૯૩

નોંધ : ૮.૧ : વિલંબિત કર અસ્કયામતો / જવાબદારીઓમાં ફેરફાર :

(₹ લાખમાં)

વિગત	પીપીઈ અને અમૂર્ત અસ્કયામતો	જોગવાઈ u/s 43B	ઈન્ડએએસ ૧૧૬ની અસર	શંકાસ્પદ દેવા માટેની જોગવાઈ	કુલ
૧મી એપ્રિલ, ૨૦૨૧	૧૦.૯૩	(૨૦.૩૬)	૦.૨૨	૭.૮૮	(૧.૩૨)
ચાર્જ/ (કેડિટ)	-	-	-	-	-
નફો અને નુકસાન માટે	૨.૦૦	૧૨.૬૯	(૦.૧૬)	(૦.૯૩)	૧૩.૬૦
અન્ય વ્યાપક આવક માટે	-	૧.૬૪	-	-	૧.૬૪
૩૧મી માર્ચ, ૨૦૨૨	૧૨.૯૩	(૬.૦૩)	૦.૦૬	૬.૯૬	૧૩.૯૨
ચાર્જ/ (કેડિટ)	-	-	-	-	-
નફો અને નુકસાન માટે	(૪.૯૪)	(૪.૫૩)	૦.૨૨	૫.૧૮	(૪.૦૮)
અન્ય વ્યાપક આવક માટે	-	(૧૬.૨૬)	-	-	(૧૬.૨૬)
૩૧મી માર્ચ, ૨૦૨૩ ના રોજ	૭.૯૯	(૨૬.૮૨)	૦.૨૭	૧૨.૧૪	(૬.૪૨)

આવક વેરો અને સ્થગિત કર

ક) આવક વેરા ખર્ચ

(₹ લાખમાં)

વિગત	વર્ષ ૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ	૩૧મી માર્ચ, ૨૦૨૨ના રોજ
વર્ષોના નફા પર વર્તમાન કર	૬૪૫.૦૦	૯૧૧.૦૦
પાછલા વર્ષના વર્તમાન આવકવેરાના સંદર્ભમાં ગોઠવણો	-	-
કુલ વર્તમાન કર ખર્ચ	૬૪૫.૦૦	૯૧૧.૦૦

ખ) વિલંબિત કર

(₹ લાખમાં)

વિગત	વર્ષ ૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ	૩૧મી માર્ચ, ૨૦૨૨ના રોજ
વિલંબિત માન્ય કર	૪.૦૮	(૧૩.૬૦)
કુલ વિલંબિત માન્ય કર	૪.૦૮	(૧૩.૬૦)
ચાલુ કામગીરીને કારણે આવકવેરા ખર્ચ	૬૪૯.૦૮	૮૯૭.૪૦

નોંધ : ૮.૨ : વર્ષ દરમિયાન OCI માં માન્ય વસ્તુઓ સાથે સંબંધિત કર:

(₹ લાખમાં)

વિગત	વર્ષ ૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ	૩૧મી માર્ચ, ૨૦૨૨ના રોજ
વ્યાખ્યાયિત લાભ યોજનાનું પુનઃમાપ	(૧૬.૨૬)	૧.૬૪
OCI થી વસૂલવામાં આવેલો આવકવેરો	(૧૬.૨૬)	૧.૬૪

નોંધ : ૮.૩ : કર ખર્ચના સમાધાન અને હિસાબી નફો ભારતના સ્થાનિક કર દરથી ગુણાકાર
૩૧મી માર્ચ, ૨૦૨૩ અને ૩૧મી માર્ચ ૨૦૨૨ માટે :

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ
ચાલુ કામગીરીથી ટેક્સ પહેલા હિસાબી નફો	૨,૫૮૪.૦૭	૩,૨૬૮.૦૩
બંધ કરેલી કામગીરીમાંથી કર પહેલાં નફો/(નુકસાન)	-	-
આવકવેરા પહેલા હિસાબી નફો	૨,૫૮૪.૦૭	૩,૨૬૮.૦૩
૨૫.૧૭% (૩૧ માર્ચ ૨૦૨૨: ૨૫.૧૭%) ના ભારતીય વૈધાનિક આવકવેરા દર પર	૬૫૦.૩૬	૮૨૨.૫૦
	-	-
બિન કરપાત્ર આવક / અન્ય કપાતપાત્ર ખર્ચને કારણે કર અસર		
અવમૂલ્યન	(૩૬.૯૧)	(૩૯.૪૪)
અન્ય સ્વીકાર્ય કપાત	(૧૧.૨૨)	(૧૦.૯૫)
પ્રકરણ VI-A હેઠળ કપાત	(૧૫.૯૪)	-
બિન કપાતપાત્ર ખર્ચને કારણે કર અસર		
અવમૂલ્યન	૩૭.૯૩	૪૪.૪૪
નિવૃત્ત કર્મચારી કલ્યાણ	૨૦.૭૯	૧૪.૩૩
ટેક્સ જોગવાઈને બંધ કરવા સહિત અન્ય વસ્તુઓ	-	૮૦.૧૨
દર અને અન્ય વસ્તુઓમાં ફેરફારની અસર	-	-
	૬૪૫.૦૦	૯૧૧.૦૦
અસરકારક આવકવેરા દર પર	૨૪.૯૬%	૨૭.૮૮%

નોંધ :- ૮.૪ : ચાલુ વર્ષ માટે કર ખર્ચ નફો અને નુકસાનના અહેવાલમાં જણાવ્યા મુજબ

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ
વર્ષના નફા પર વર્તમાન કર	૬૪૫.૦૦	૯૧૧.૦૦
વિલંબિત કર	૪.૦૮	(૧૩.૬૦)
OCI માં પુનઃ માપ માટે વિલંબિત કર	(૧૬.૨૬)	૧.૬૪
ચાલુ વર્ષ માટે નફા અને નુકસાનના અહેવાલમાં સમાવવામાં આવેલ કુલ કર ખર્ચ	૬૩૨.૮૨	૮૯૮.૦૪

નોંધ : ૯ : માલ સામાનની ચાદી

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ
તૈયાર માલ (નોંધ ૯.૧ નો સંદર્ભ લો)	૬,૦૦૫.૪૧	૪,૪૮૨.૭૩
પ્રમાણપત્ર, પેકિંગ અને ટ્રીટમેન્ટ સામગ્રી (મૂળ કિંમત પર)	૬૫૯.૦૯	૯૫૫.૩૨
કુલ :	૬,૬૬૪.૫૦	૫,૪૩૮.૦૫

નોંધ: મેનેજમેન્ટ દ્વારા લેવાયેલ અને પ્રમાણિત કર્યા મુજબ મૂલ્ય છે.

નોંધ : ૯.૧ : તૈયાર માલ

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ
૧. સંવર્ધક બીજ (મૂળ કિંમત અથવા નેટ વેચાણ મૂલ્ય માંથી જે ઓછું હોય)	૦.૨૭	૪.૧૨
૨. બીજ ફાઉન્ડેશન (મૂળ કિંમત અથવા નેટ વેચાણ મૂલ્ય માંથી જે ઓછું હોય)	૨,૨૪૩.૭૮	૮૧૧.૨૦
૩. પ્રમાણિત અને મૂળ કિંમત અથવા નેટ વેચાણ મૂલ્ય માંથી જે ઓછું હોય	૩,૭૩૦.૩૭	૩,૬૨૮.૯૨
૪. બીજ મિશ્રણ (ચોખ્ખા મૂલ્ય પર)	૩૦.૯૯	૩૮.૫૦
કુલ:	૬,૦૦૫.૪૧	૪,૪૮૨.૭૩

નોંધ : ૧૦ વર્તમાન રોકાણ :

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ
ઋણમુક્ત કિંમતે માન્ય થાપણોમાં રોકાણ		
GSFS સાથે થાપણો*	૨૫,૩૦૭.૪૮	૨૩,૩૦૦.૦૦
વર્તમાન રોકાણનું કુલ	૨૫,૩૦૭.૪૮	૨૩,૩૦૦.૦૦

* નોંધ : સંબંધિત પક્ષો સાથેના વ્યવહારો માટે નોંધ : ૩૬ (૧૧ ઘ) જુઓ.

નોંધ : ૧૧ : વ્યાપારિક લેણાં

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ
અન્યો પાસેથી લેણાં		
છ મહિનાથી વધુના સમયગાળા માટે બાકી	૮૦૫.૯૦	૨,૦૪૩.૮૨
છ મહિનાથી ઓછા સમયગાળા માટે બાકી	૩,૬૦૯.૯૭	૧,૭૨૯.૧૫
બાદ : લેણાં - નુકસાન	(૪૮.૨૩)	(૨૭.૬૪)
અસુરક્ષિત, સારું માનવામાં આવે છે	૪,૩૬૭.૬૪	૩,૭૪૫.૩૩
અસુરક્ષિત, શંકાસ્પદ ગણવામાં આવે છે	૪૮.૨૩	૨૭.૬૪
બાદ : લેણાં - નુકસાન	(૪૮.૨૩)	(૨૭.૬૪)
કુલ વ્યાપારિક લેણાં	૪,૩૬૭.૬૪	૩,૭૪૫.૩૩

નોંધ: ૧૧.૧ વ્યાપારિક લેણાંનું એજુંગ

વ્યાપારિક લેણાંનું એજુંગ - ૩૧ માર્ચ, ૨૦૨૩ ના રોજની વર્તમાન બાકી નીચે મુજબ છે:

(₹ લાખમાં)

વિગત	ચુકવણીની નિયત તારીખથી નીચેના સમયગાળા માટે બાકી					
	૬ મહિના કરતાં ઓછા	૬ મહિના - ૧ વર્ષ	૧ - ૨ વર્ષ	૨-૩ વર્ષ	૩ વર્ષથી વધુ	કુલ
ક) નિર્વિવાદ વ્યાપારિક લેણાં						
(ક) સારું માનવામાં આવે છે	૩,૫૩૪.૧૧	૪૬૨.૧૦	૩૫૯.૬૧	૧૨.૦૮	-	૪,૩૬૭.૯૦
(ખ) જેમાં ધિરાણ જોખમમાં નોંધપાત્ર વધારો થયો છે	-	-	-	-	૪૮.૨૩	૪૮.૨૩
(ગ) ધિરાણ અશક્ત	-	-	-	-	-	-
ખ) વિવાદિત વ્યાપારિક લેણાં						
(ક) સારું માનવામાં આવે છે	-	-	-	-	-	-
(ખ) જેમાં ધિરાણ જોખમમાં નોંધપાત્ર વધારો થયો છે	-	-	-	-	-	-
(ગ) ધિરાણ અશક્ત	-	-	-	-	-	-
ઓછું : શંકાસ્પદ દેવા માટે ભથ્થું	૩,૫૩૪.૧૧	૪૬૨.૧૦	૩૫૯.૬૧	૧૨.૦૮	૪૮.૨૩	૪,૪૧૬.૧૩
	-	-	-	-	(૪૮.૨૩)	(૪૮.૨૩)
કુલ	૩,૫૩૪.૧૧	૪૬૨.૧૦	૩૫૯.૬૧	૧૨.૦૮	-	૪,૩૬૭.૯૦

વ્યાપારિક લેણાંનું એજુંગ - ૩૧ માર્ચ, ૨૦૨૨ ના રોજની વર્તમાન બાકી નીચે મુજબ છે:

(₹ લાખમાં)

વિગત	ચુકવણીની નિયત તારીખથી નીચેના સમયગાળા માટે બાકી					
	૬ મહિના કરતાં ઓછા	૬ મહિના - ૧ વર્ષ	૧ - ૨ વર્ષ	૨-૩ વર્ષ	૩ વર્ષથી વધુ	કુલ
ક) નિર્વિવાદ વ્યાપારિક લેણાં						
(ક) સારું માનવામાં આવે છે	૧૯૪૬.૫૩	૧૫૧૩.૫૦	૨૮૨.૪૯	૨.૮૧	-	૩,૭૪૫.૩૩
(ખ) જેમાં ધિરાણ જોખમમાં નોંધપાત્ર વધારો થયો છે	-	-	-	-	૨૭.૬૪	૨૭.૬૪
(ગ) ધિરાણ અશક્ત	-	-	-	-	-	-
ખ) વિવાદિત વ્યાપારિક લેણાં						
(ક) સારું માનવામાં આવે છે	-	-	-	-	-	-
(ખ) જેમાં ધિરાણ જોખમમાં નોંધપાત્ર વધારો થયો છે	-	-	-	-	-	-
(ગ) ધિરાણ અશક્ત	-	-	-	-	-	-
ઓછું : શંકાસ્પદ દેવા માટે ભથ્થું	૧૯૪૬.૫૩	૧૫૧૩.૫૦	૨૮૨.૪૯	૨.૮૧	૨૭.૬૪	૩,૭૭૨.૯૭
	-	-	-	-	(૨૭.૬૪)	(૨૭.૬૪)
કુલ	૧૯૪૬.૫૩	૧૫૧૩.૫૦	૨૮૨.૪૯	૨.૮૧	-	૩,૭૪૫.૩૩

નોંધ : ૧૨ : રોકડ અને રોકડ સમકક્ષ

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ
(ક) બેન્ક ખાતે ચાલુ ખાતામાં જમા	૬,૬૧૪.૬૭	૧૦,૭૦૦.૬૩
(ખ) હાથ ઉપર રોકડ	૦.૪૭	૦.૪૦
કુલ :	૬,૬૧૫.૧૪	૧૦,૭૦૧.૦૩

નોંધ : ૧૩ : અન્ય નાણાકીય અસ્કયામતો :

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ
ક) સંચિત ડિપોઝીટ ઉપર જમા વ્યાજ	૪૨૫.૬૭	૪૪૨.૮૭
ખ) અન્ય લેણાં (ગુજરાત સરકાર પાસેથી સબસીડી સામે વસૂલ લેવા પાત્ર) અસુરક્ષિત, સારું માનવામાં આવે છે.	૯.૫૨	૨૪૨.૧૯
ગ) કર્મચારીઓ પાસે લેણાં અસુરક્ષિત, સારું માનવામાં આવે છે	(૦.૩૫)	૦.૧૨
પેટા કુલ (ક)	(૦.૩૫)	૦.૧૨
અસુરક્ષિત, શંકાસ્પદ માનવામાં આવે છે.	૦.૯૮	૦.૯૮
બાદ : શંકાસ્પદ દાવાઓ માટે જોગવાઈ	(૦.૯૮)	(૦.૯૮)
પેટા કુલ (ખ)	-	-
કુલ (ક+ખ)	(૦.૩૫)	૦.૧૨
કુલ :	૪૩૪.૮૪	૬૮૫.૧૭

નોંધ : ૧૪ : વર્તમાન કર અસ્કયામતો (નેટ)

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ
એડવાન્સ ટેક્સ અને સ્ત્રોત ઉપર ટેક્સ કપાત (ક)	૪,૦૧૮.૫૯	૩,૪૨૪.૪૭
બાદ:		
વર્ષની શરૂઆતનું બેલેન્સ	૩,૩૫૪.૦૦	૨,૪૪૩.૦૦
વર્ષ માટે ઉમેરો	૬૪૫.૦૦	૯૧૧.૦૦
વર્ષ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ રકમ	-	-
વર્તમાન કર જવાબદારી (ખ)	(૩,૯૯૯.૦૦)	(૩,૩૫૪.૦૦)
કુલ : (ક - ખ)	૧૯.૫૯	૭૦.૪૭

નોંધ : ૧૫ : અન્ય વર્તમાન અસ્કયામતો

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ
ક) અન્ય એડવાન્સીસ ઉત્પાદકોને એડવાન્સ અસુરક્ષિત, સારું માનવામાં આવે છે અન્યોને એડવાન્સ અસુરક્ષિત, સારું માનવામાં આવે છે	૪૦.૮૦ ૫૭.૨૧	૧૪૬.૧૬ ૩૫.૦૯
ખ) અન્ય : પૂર્વ ચુકવણી ખર્ચ : ગ્રેચ્યુઇટી અને લીવ એન્કેશમેન્ટની પ્લાન એસેટ્સ માટે એડવાન્સ પેમેન્ટ અન્ય લેણાં (હિસાબના ભાગની નોંધમાં બિંદુ ૩૬ (૮) નો સંદર્ભ લો)	૧૯.૩૨ ૧૪૦.૨૫ ૭૭.૫૮	૨૨.૫૬ ૯૨.૮૦ ૭૭.૫૮
ગ) કર્મચારીઓને એડવાન્સ અસુરક્ષિત, શંકાસ્પદ માનવામાં આવે છે (નોંધ ૩૬ (૫) નો સંદર્ભ લો) બાદ : શંકાસ્પદ એડવાન્સ માટે જોગવાઈ	૬.૧૫ (૬.૧૫)	૬.૧૫ (૬.૧૫)
પેટા કુલ (ખ)	-	-
કુલ :	૩૩૫.૧૬	૩૭૪.૧૮

નોંધ : ૧૬ : ઇક્વિટી શેર મૂડી

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ
અધિકૃત શેર મૂડી ૪૦૦૦૦૦ (ગત વર્ષે ૪૦૦૦૦૦) ઇક્વિટી શેર ₹ ૧૦૦ પ્રતિ શેર	૪૦૦.૦૦ ૪૦૦.૦૦	૪૦૦.૦૦ ૪૦૦.૦૦
જારી/સબસ્ક્રાઇબ અને ચૂકવેલ મૂડી ૩૯૩૦૦૦ (પાછલા વર્ષે ૩૯૩૦૦૦) ₹ ૧૦૦ ના ઇક્વિટી શેર	૩૯૩.૦૦ ૩૯૩.૦૦	૩૯૩.૦૦ ૩૯૩.૦૦

ઇક્વિટી શેરની સંખ્યા અને બાકી શેર મૂડીનું સમાધાન

(₹ લાખમાં)

વિગત	૩૧ માર્ચ ૨૦૨૩ ના રોજ		૩૧ માર્ચ ૨૦૨૨ ના રોજ	
	શેરની સંખ્યા	રકમ	શેરની સંખ્યા	રકમ
વર્ષની શરૂઆતમાં બાકી શેર્સ	૩,૯૩,૦૦૦	૩૯૩.૦૦	૩,૯૩,૦૦૦	૩૯૩.૦૦
ઉમેરો: વર્ષ દરમિયાન જારી કરાયેલા શેર	-	-	-	-
વર્ષના અંતે બાકી જારી/ સબસ્ક્રાઇબ અને પેઇડ અપ ઇક્વિટી મૂડી	૩,૯૩,૦૦૦	૩૯૩.૦૦	૩,૯૩,૦૦૦	૩૯૩.૦૦

(ક) ઇક્વિટી શેર સાથેની શરતો / અધિકારો

નિગમ પાસે એક વર્ગના ઇક્વિટી શેર છે જેનું પ્રતિ શેર રૂ. ૧૦૦ નું મૂલ્ય છે. દરેક શેરધારક તેની પાસેના દરેક શેર દીઠ એક મત માટે પાત્ર છે. નિયામક મંડળ દ્વારા પ્રસ્તાવિત ડિવિડન્ડ વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોની મંજૂરીને આધીન છે.

(ખ) પ્રમોટર હોલ્ડિંગ નો ખુલાસો

પ્રમોટરનું નામ	૩૧ માર્ચ ૨૦૨૩ ના રોજ		
	શેરની સંખ્યા	ટકા	વર્ષ દરમિયાન બદલાવ
ગુજરાત સરકાર	૩,૭૫,૦૦૦	૯૫.૪૨%	-
કુલ	૩,૭૫,૦૦૦	૯૫.૪૨%	-

પ્રમોટરનું નામ	૩૧ માર્ચ ૨૦૨૨ ના રોજ		
	શેરની સંખ્યા	ટકા	વર્ષ દરમિયાન બદલાવ
ગુજરાત સરકાર	૩,૭૫,૦૦૦	૯૫.૪૨%	-
કુલ	૩,૭૫,૦૦૦	૯૫.૪૨%	-

(ગ) કંપનીમાં ૫% થી વધુ શેર ધરાવતા દરેક શેરહોલ્ડર દ્વારા રાખવામાં આવેલા શેરની વિગતો

વિગત	૩૧ માર્ચ ૨૦૨૩ ના રોજ		૩૧ માર્ચ ૨૦૨૨ ના રોજ	
	શેરની સંખ્યા	ટકા	શેરની સંખ્યા	ટકા
ગુજરાત સરકાર	૩૭૫,૦૦૦	૯૫.૪૨%	૩૭૫,૦૦૦	૯૫.૪૨%
કુલ :	૩૭૫,૦૦૦	૯૫.૪૨%	૩૭૫,૦૦૦	૯૫.૪૨%

- (દ) ક. નિગમ દ્વારા ૧૦૦/- ની ફેસ વેલ્યુ સાથે ઇક્વિટી શેર જારી કર્યા છે જે દરેક સંપૂર્ણ ભરપાઈ કરેલ છે.
ખ. નિગમ દ્વારા કોઈ પ્રેફરન્સ શેર જારી કરવામાં આવ્યા નથી.
ગ. નિગમ દ્વારા કોઈ કન્વર્ટિબલ ડિબેન્ચર્સ, બોન્ડ્સ, કન્વર્ટિબલ ટર્મ લોન, શેર વોરંટ જારી કરવામાં આવ્યા નથી.
ઘ. નિગમ દ્વારા શેરોની કોઈ જમ્પી કરવામાં આવી નથી અને પરિણામે જમ્પ કરાયેલા શેરને ફરીથી જારી કરવામાં આવ્યા નથી.
ચ. નિગમ દ્વારા અત્યાર સુધી તેના પોતાના શેર પાછા ખરીદ્યા નથી.

(ચ) રોકડ સિવાય અન્ય ચુકવણા માટે જારી કરાયેલા ઇક્વિટી શેર્સ, જારી કરેલ બોનસ શેર્સ, ઇક્વિટી પાછી ખરીદી ની કુલ સંખ્યા

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ
રોકડ સિવાય અન્ય ચુકવણા માટે જારી કરાયેલા ઇક્વિટી શેર્સ	-	-
સંપૂર્ણ ભરપાઈ બોનસ શેર્સ તરીકે જારી કરવામાં આવેલ ઇક્વિટી શેર્સ	-	-
ઇક્વિટી પાછી ખરીદી	-	-

નોંધ : ૧૭ : અન્ય ઇક્વિટી

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ
(ક) સામાન્ય અનામત		
વર્ષની શરૂઆતમાં બેલેન્સ	૩૧,૫૧૩.૦૬	૨૯,૧૮૨.૩૧
ઉમેરો: અગાઉના સમયગાળાની ગોઠવણ	-	૪.૩૦
વર્ષની શરૂઆતમાં બેલેન્સ પુનઃસ્થાપિત કર્યું	૩૧,૫૧૩.૦૬	૨૯,૧૮૬.૬૧
ઉમેરો: વર્ષ માટે ચોખ્ખો નફો/(નુકસાન)	૧,૯૩૪.૯૯	૨,૩૭૦.૬૩
બાદ : ચૂકવેલ ડિવિડન્ડ	(૩૯.૩૦)	(૩૯.૩૦)
ઉમેરો/બાદ: નિર્ધારિત લાભ યોજનાઓનું પુનઃ માપન (કરની અસર બાદ)	૪૮.૩૪	(૪.૮૭)
વર્ષના અંતમાં બેલેન્સ	૩૩,૪૫૭.૦૯	૩૧,૫૧૩.૦૬
(ખ) નિર્ધારિત લાભ યોજનાઓનું માપન		
વર્ષની શરૂઆતમાં બેલેન્સ	-	-
ઉમેરો/બાદ : વર્ષ દરમિયાન મુવમેન્ટ	૪૮.૩૪	(૪.૮૭)
બાદ : જાળવી રાખેલી કમાણી પર સ્થાનાંતરિત કરો	(૪૮.૩૪)	૪.૮૭
વર્ષના અંતમાં બેલેન્સ	-	-
(ગ) અન્ય અનામતો :		
(i) મૂડી સહસિડી (ડિન મૂલ્યવાન સંપત્તિ સામે ગ્રાન્ટ) :		
વર્ષની શરૂઆતમાં બેલેન્સ	૭.૦૮	૭.૦૮
ઉમેરો: વર્ષ દરમિયાન ઉમેરો	-	-
બાદ: વર્ષ દરમિયાન વપરાયેલ	(૭.૦૮)	-
વર્ષના અંતમાં બેલેન્સ	૦.૦૦	૭.૦૮
કુલ (ક+ખ+ગ)	૩૩,૪૫૭.૦૯	૩૧,૫૨૦.૧૪

નોંધ : ૧૮ સરકાર તરફથી મળેલ મૂડી અનુદાન

(₹ લાખમાં)

વિગત	અનુદાન હેઠળ					એનયોસપી - III				વધવપસાયેલ અનુદાન	કુલ	
	મકાનો	પ્લાન્ટ અને ચંપ્ર સામગ્રી	કચેરી સાધન સામગ્રી	કોમ્પ્યુટર	પ્રયોગશાળા સાધન સામગ્રી	ફર્નિચર અને જડાણ	મકાનો	પ્લાન્ટ અને ચંપ્ર સામગ્રી	કચેરી સામન સામગ્રી			ગુણવત્તા નિયંત્રણ પ્રયોગશાળા
૧લી એપ્રિલ, ૨૦૨૧ના રોજ બેલેન્સ ઉમેરો	૨,૭૨૭.૦૦	૨૮.૦૭	૦.૨૩	૧.૧૪	૦.૨૪	૦.૦૬	૬.૬૨	૦.૭૬	૦.૦૯	૦.૧૫	૮૭.૬૩	૨,૮૫૧.૯૯
નિકાલ/ગોઠવણો	-	-	-	(૦.૨૫)	-	-	-	-	-	-	-	-
પેટા કુલ	૨,૭૨૭.૦૦	૨૮.૦૭	૦.૨૩	૦.૮૯	૦.૨૪	૦.૦૬	૬.૬૨	૦.૭૬	૦.૦૯	૦.૧૫	૮૭.૬૩	૨,૮૫૧.૭૪
અવમૂલ્યન સામે સમાયોજિત	(૧૫૬.૬૩)	(૪.૧૪)	-	-	-	-	(૦.૮૭)	-	-	-	-	(૧૬૧.૬૪)
૩૧ મી માર્ચ, ૨૦૨૨ ના રોજ બેલેન્સ ઉમેરો	૨,૫૭૦.૩૭	૨૩.૯૩	૦.૨૩	૦.૮૯	૦.૨૪	૦.૦૬	૫.૭૫	૦.૭૬	૦.૦૯	૦.૧૫	૮૭.૬૩	૨,૬૯૦.૧૦
નિકાલ/ગોઠવણો	-	-	-	-	-	-	૭.૦૮	-	-	-	-	૭.૦૮
પેટા કુલ	૨,૫૭૦.૩૭	૨૩.૯૩	૦.૨૩	૦.૮૯	૦.૨૪	૦.૦૬	૧૨.૮૩	૦.૭૬	૦.૦૯	૦.૧૫	૮૭.૬૩	૨,૬૯૭.૧૮
અવમૂલ્યન સામે સમાયોજિત	(૧૪૭.૨૫)	(૩.૦૬)	-	-	-	-	-	-	-	-	-	(૧૫૦.૩૧)
૩૧ મી માર્ચ, ૨૦૨૩ ના રોજ બેલેન્સ	૨,૪૨૩.૧૨	૨૦.૮૭	૦.૨૩	૦.૮૯	૦.૨૪	૦.૦૬	૧૨.૮૩	૦.૭૬	૦.૦૯	૦.૧૫	૮૭.૬૩	૨,૫૪૬.૮૭

નોંધ : ૧૯ : અન્ય નાણાકીય જવાબદારીઓ - બિન - વર્તમાન

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ
ડીલરશીપ ડિપોઝિટ*	૨૯૭.૪૧	૨૯૦.૨૯
કુલ :	૨૯૭.૪૧	૨૯૦.૨૯

*નોંધ: ઉપરોક્ત ડીલરશીપ ડિપોઝિટ એવી ડિપોઝિટનું પ્રતિનિધિત્વ કરે છે જે નાણાકીય નિવેદનોની મંજૂરીની તારીખે ૩ વર્ષ માટે નવીકરણ કરવામાં આવેલ છે. આવી થાપણોને ઇન્ડ એએસ ૧૦૯ ના સિદ્ધાંતો અનુસાર તેના વ્યાજખી મૂલ્ય પર યોગ્ય રીતે માન્યતા આપવામાં આવી છે.

નોંધ : ૨૦ : અન્ય બિન - વર્તમાન જવાબદારીઓ

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ
નિગમને સુદૃઢ બનાવવા માટે ફરતું ફંડ	૯૦.૦૦	૯૦.૦૦
અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ	૪૨.૭૨	૬૦.૪૭
ગ્રાન્ટ / સબસિડી રિફંડપાત્ર	-	૮.૭૨
વિલંબિત ડીલરશીપ ડિપોઝિટ	-	૨૬.૧૯
કુલ:	૧૩૨.૭૨	૧૮૫.૩૮

નોંધ : ૨૧ : વ્યાપારિક દેણાં :

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ
માઇક્રો અને લઘુ સાહસોને કુલ બાકી દેણાં	-	-
માઇક્રો અને લઘુ સાહસોને સિવાયના બાકીના બાકી દેણાં	૧,૯૫૪.૫૯	૨,૧૦૦.૩૨
કુલ :	૧,૯૫૪.૫૯	૨,૧૦૦.૩૨

નોંધ : ૨૧.૧ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ (MSMED) એક્ટ, ૨૦૦૬ ની કલમ ૨૨ હેઠળ જહેરાત.

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ
(ક) મુખ્ય રકમ અને તેના પરનું વ્યાજ એકાઉન્ટિંગ વર્ષના અંત સુધી કોઈપણ સપ્લાયર્સને ચૂકવવાનું બાકી છે;	-	-
(ખ) વર્ષ દરમિયાન ચૂકવેલ વ્યાજ	-	-
(ગ) હિસાબી વર્ષ દરમિયાન નિયત દિવસની બહાર સપ્લાયર્સને ચૂકવણીની રકમ;	-	-
(ઘ) ચુકવણી કરવામાં વિલંબના સમયગાળા માટે દેવું અને ચૂકવવાપાત્ર વ્યાજ;	-	-
(ચ) હિસાબી વર્ષના અંતે ઉપાર્જિત અને ચૂકવવાનું બાકી વ્યાજ; અને	-	-
(છ) બાકીના વ્યાજ બાકીના વર્ષોમાં પણ ચૂકવવાપાત્ર છે, જ્યારે ઉપરના વ્યાજની રકમ ખરેખર નાના ઉદ્યોગોને ચૂકવવામાં આવે છે તે તારીખ સુધી;	-	-

નોંધ ૨૧.૨ : વ્યાપારિક દેશાનું એજુંગ

વ્યાપારિક દેશાનું એજુંગ - ૩૧ માર્ચ, ૨૦૨૩ ના રોજની વર્તમાન બાકી નીચે મુજબ છે:

(₹ લાખમાં)

વિગત	બાકી નથી	ચુકવણીની નિયત તારીખથી નીચેના સમયગાળાની બાકી				કુલ
		એક વર્ષથી ઓછા	૧-૨ વર્ષ	૨-૩ વર્ષ	૩ વર્ષથી વધુ	
વ્યાપારિક દેશા						
એમએસએમઈ*	-	-	-	-	-	-
અન્ય	-	૧,૮૨૩.૬૦	૭૬.૪૯	૧૧.૨૧	૪૩.૨૯	૧,૯૫૪.૫૯
વિવાદિત બાકી - એમએસએમઈ*	-	-	-	-	-	-
વિવાદિત બાકી - અન્ય	-	-	-	-	-	-
સંચિત ખર્ચ						
કુલ	-	૧,૮૨૩.૬૦	૭૬.૪૯	૧૧.૨૧	૪૩.૨૯	૧,૯૫૪.૫૯

*સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો વિકાસ અધિનિયમ, ૨૦૦૬ મુજબ એમએસએમઈ

વ્યાપારિક દેશાનું એજુંગ - ૩૧ માર્ચ, ૨૦૨૨ ના રોજની વર્તમાન બાકી નીચે મુજબ છે:

(₹ લાખમાં)

વિગત	બાકી નથી	ચુકવણીની નિયત તારીખથી નીચેના સમયગાળાની બાકી				કુલ
		એક વર્ષથી ઓછા	૧-૨ વર્ષ	૨-૩ વર્ષ	૩ વર્ષથી વધુ	
વ્યાપારિક દેશા						
એમએસએમઈ*	-	-	-	-	-	-
અન્ય	-	૨,૦૦૦.૫૯	૨૧.૫૫	૧૩.૨૬	૬૪.૯૨	૨,૧૦૦.૩૨
વિવાદિત બાકી - એમએસએમઈ*	-	-	-	-	-	-
વિવાદિત બાકી - અન્ય	-	-	-	-	-	-
સંચિત ખર્ચ						
કુલ	-	૨,૦૦૦.૫૯	૨૧.૫૫	૧૩.૨૬	૬૪.૯૨	૨,૧૦૦.૩૨

*સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો વિકાસ અધિનિયમ, ૨૦૦૬ મુજબ એમએસએમઈ

નોંધ : ૨૨ : અન્ય નાણાકીય જવાબદારીઓ - વર્તમાન

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ
ડીલરશીપ ડિપોઝિટ*	૧૨૪.૭૫	૯૩.૦૦
કુલ :	૧૨૪.૭૫	૯૩.૦૦

* નોંધ: ઉપરની ડીલરશીપ ડિપોઝિટ એવી ડિપોઝિટનું પ્રતિનિધિત્વ કરે છે જે નાણાકીય નિવેદનોની મંજૂરીની તારીખે નવીકરણ કરવામાં આવેલ નથી.

નોંધ: ૨૩: અન્ય વર્તમાન જવાબદારીઓ

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ
વૈધાનિક લેણા	૧૭.૭૧	૧૭.૬૨
કર્મચારીઓને ન ચૂકવવામાં આવેલ રકમ	૨.૦૦	૩૧.૩૪
ખર્ચ માટે બાકી જવાબદારીઓ	૨૪.૧૯	૫૪.૦૩
ટેન્ડર ડિપોઝિટ	૧૭.૨૨	૧૯.૭૧
રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના સેલ	૪.૫૪	૧૩.૦૨
સરકારી સબસિડી (નોડલ એજન્સી તરીકે ગ્રાન્ટ ફંડ પ્રાપ્ત થયું)	૪,૪૯૦.૫૭	૮,૬૪૩.૭૩
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય માટે અન્ય સબસિડી	૧૯.૨૭	૩૩.૪૬
વણચૂકવણી સબસિડી (નોડલ એજન્સી તરીકે ગ્રાન્ટ)	૨,૮૮૨.૮૦	૧,૪૯૪.૬૫
અન્ય ચૂકવણીપાત્ર જવાબદારીઓ	૧,૨૦૫.૦૪	૮૨૩.૮૦
અન્ય ચૂકવણીપાત્ર (ચેક, ડીડી અને આરટીજીએસ સિટર્ન)	૫૪૩.૯૬	૪૧૨.૩૮
સુરક્ષા થાપણ	-	૧૯.૮૯
વિલંબિત ડીલરશિપ ડિપોઝિટ	૨૬.૧૯	૨૬.૧૯
કુલ :	૯,૨૨૮.૪૮	૧૧,૫૮૯.૮૧

નોંધ : ૨૪ : જોગવાઈઓ

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ
કર્મચારીઓના લાભો માટેની જોગવાઈ		
પગાર માટે જોગવાઈ*	૪૭.૭૧	૧૫૩.૫૮
રજાઓના રોકડ રૂપાંતરણ માટેની જોગવાઈ	૩૩.૭૧	૬૮.૮૫
	૮૧.૪૨	૨૨૨.૪૩

* નોંધ: પગાર માટેની જોગવાઈમાં કર્મચારીને ચૂકવણીપાત્ર પગાર માટે ₹ ૧૯.૫૮ લાખની રકમ સામેલ છે જે મુકદ્દમાને આધીન છે. નિગમ પાસે આ ચુકવણીને સ્થગિત કરવાનો કોઈ અધિકાર નથી અને કોર્ટના આદેશ મુજબ ચુકવણીપાત્ર હોવાને કારણે, તેને વર્તમાન તરીકે વગીકૃત કરવામાં આવ્યો છે.

નોંધ: ૨૫: સંચાલન દ્વારા આવક

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ પુરા થયેલ વર્ષ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ પુરા થયેલ વર્ષ
કામગીરીમાંથી આવક		
ઉત્પાદનોનું વેચાણ (બીજાનું વેચાણ)	૧૯,૬૯૦.૫૩	૨૦,૫૮૧.૪૮
કુલ:	૧૯,૬૯૦.૫૩	૨૦,૫૮૧.૪૮

નોંધ: ૨૬: અન્ય આવક

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ પુરા થયેલ વર્ષ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ પુરા થયેલ વર્ષ
વ્યાજની આવક	૧,૩૨૩.૪૩	૧,૨૦૨.૦૦
ગ્રાન્ટ આવક	૪૬.૯૯	૩૨૦.૮૬
અન્ય નોન-ઓપરેટિંગ આવક		
ડીલરશીપ અરજી ફોર્મ ફી	૦.૮૭	૦.૬૭
ટેન્ડર અરજી ફોર્મ ફી	૦.૧૫	૦.૬૮
પરચુરણ આવક	૨૬.૦૩	૩૧.૭૩
ઓફિસ ભાડું - નડીયાદ	૨.૬૩	૨.૬૩
સ્થાયી સંપત્તિના વેચાણ પર નફો	૧.૭૪	૦.૨૫
અન્ય વેચાણ	-	૩૪.૧૨
પરચુરણ બેલેન્સ પરત લખ્યું	૨૮.૯૭	૦.૧૦
વ્યાજબી મૂલ્યાંકનના ખાતા પર ગોઠવણ (Ind AS)	૨૬.૧૯	૨૬.૧૯
માટે ભથ્થાં / જોગવાઈ:		
શંકાસ્પદ દેવા માટે જોગવાઈ પરત લખી	૪.૪૫	૩.૮૨
કુલ :	૧,૪૬૧.૪૬	૧,૬૨૩.૦૫

નોંધ : ૨૭ : વપરાયેલ સામગ્રીની કિંમત

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ પુરા થયેલ વર્ષ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ પુરા થયેલ વર્ષ
ખૂલતો સ્ટોક		
પેકેજિંગ પ્રોસેસિંગ મટિરિયલ્સ	૯૫૫.૩૨	૪૨૨.૨૩
ઉમેરો: ખરીદીઓ		
પેકેજિંગ પ્રોસેસિંગ મટિરિયલ્સ	૨૫૮.૬૪	૯૫૦.૬૪
બાદ: બંધ સ્ટોક		
પેકેજિંગ પ્રોસેસિંગ મટિરિયલ્સ	(૬૫૯.૦૯)	(૯૫૫.૩૨)
કુલ:	૫૫૪.૮૬	૪૧૭.૫૫

નોંધ: ૨૮ : સ્ટોક-ઇન-ટ્રેડમાં ખરીદી

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ પુરા થયેલ વર્ષ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ પુરા થયેલ વર્ષ
સંવર્ધક બીજ	૭૮૮.૫૨	૨૦૨.૬૩
ફાઉન્ડેશન બીજ	૨,૮૧૦.૧૧	૧,૫૫૨.૭૩
પ્રમાણિત બીજ	૧૩,૦૧૬.૩૦	૧૩,૬૪૦.૦૧
સામાન્ય / લેબલ / વ્યાજબી બીજ	૨૫૪.૧૪	૩૩૩.૨૫
સૂચિત બીજ	-	૩૭૦.૦૧
કુલ :	૧૬,૮૬૯.૦૭	૧૬,૦૯૮.૬૨

નોંધ: ૨૯: તેયાર માલ કામમાં પ્રગતિ અને સ્ટોક-ઇન-ટ્રેડની યાદીમાં ફેરફાર

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ પુરા થયેલ વર્ષ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ પુરા થયેલ વર્ષ
બિયારણનો ખૂલતો સ્ટોક	૪,૪૮૨.૭૩	૪,૦૬૯.૦૮
બાદ:		
બિયારણનો બંધ સ્ટોક	૬,૦૦૫.૪૧	૪,૪૮૨.૭૩
કુલ:	(૧,૫૨૨.૬૮)	(૪૧૩.૬૫)

નોંધ : ૩૦: કર્મચારી લાભ ખર્ચ

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ પુરા થયેલ વર્ષ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ પુરા થયેલ વર્ષ
પગાર અને વેતન	૮૬૬.૧૮	૭૭૭.૫૮
પ્રોવિડન્ટ ફંડ અને અન્ય ફંડ	૧૧૧.૯૩	૯૮.૪૦
ગ્રેયુદ્ધટી ખર્ચ	૩૫.૫૬	૩૫.૮૭
રજાઓનું રોકડમાં રૂપાંતરણનો ખર્ચ	૬.૭૨	૪૯.૮૭
સ્ટાફ કલ્યાણ ખર્ચ	૭.૬૬	૫.૪૪
કુલ:	૧,૦૨૮.૦૬	૯૬૭.૧૭

નોંધ: ૩૧: નાણાકીય ખર્ચ

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ પુરા થયેલ વર્ષ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ પુરા થયેલ વર્ષ
અન્ય :		
લીઝ જવાબદારીઓ પર વ્યાજ ખર્ચ (Ind AS)	૨.૪૪	૧.૦૫
ડીલરશીપ ડિપોઝીટ પર વ્યાજ ખર્ચ (Ind AS)	૨૬.૧૩	૨૩.૯૭
કુલ:	૨૮.૫૭	૨૫.૦૨

નોંધ: ૩૨: અવમૂલ્યન અને ઋણમુક્તિ ખર્ચ

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ પુરા થયેલ વર્ષ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ પુરા થયેલ વર્ષ
કુલ અવમૂલ્યન	૩૦૧.૦૨	૩૩૮.૨૨
ખાદ : સ્થગિત આવક સરકારી અનુદાન સામે અવમૂલ્યનનું સમાયોજન	(૧૫૦.૩૧)	(૧૬૧.૬૪)
કુલ :	૧૫૦.૭૧	૧૭૬.૫૮

નોંધ: ૩૩: અન્ય ખર્ચ

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ પુરા થયેલ વર્ષ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ પુરા થયેલ વર્ષ
ક. કામગીરીનો ખર્ચ		
આંતર ગોડાઉન ટ્રાન્સફર અને અન્ય સહિત કેટેગોરી ઇનવર્ડ	૨૧૫.૪૯	૨૦૫.૯૦
પ્રક્રિયા નિરીક્ષણ અને બીજી પરીક્ષણ	૧૪૨.૭૫	૨૨૨.૩૬
કરાર આધારિત શ્રમ (કેઝ્યુઅલ લેબર)	૧૧૯.૮૦	૧૧૮.૯૭
ઉત્પાદન પ્રમોશન ખર્ચ	૧૨૭.૫૫	૨.૨૩
ગોડાઉન માટેનું ભાડું	૪૬.૩૧	૫૨.૨૧
ઓફિસ અને સેલ ડેપો માટે ભાડું, જમીન માટે લીઝ ભાડું	૦.૦૩	૦.૫૧
વીમા ખર્ચ - બીજી	૪૪.૩૨	૫૩.૭૪
કુલ (ક)	૬૯૬.૨૪	૬૫૫.૯૨

ખ. વહીવટી ખર્ચ		
દર અને કર	૫.૩૬	૫.૪૨
વીમા ખર્ચ - અન્ય	૧૪.૮૯	૨.૪૫
મુસાફરી ખર્ચ	૪.૭૮	૫.૧૫
સમારકામ અને જાળવણી		
બિલ્ડીંગ	૩૧.૯૯	૬૪.૭૧
પ્લાન્ટ અને મશીનરી	૯.૪૪	૨.૩૫
અન્ય	૨૦.૦૩	૮.૪૯
વાહન ખર્ચ (વાહન ભાડે, વીમા અને સમારકામ સહિત)	૩૯.૮૬	૪૬.૭૨
ડિરેક્ટર બેઠક ફી	૩.૩૬	૩.૨૭
વીજળી ખર્ચ	૨૩.૫૭	૧૯.૪૮
સુરક્ષા ખર્ચ	૮૩.૨૩	૯૭.૯૩
આઉટસોર્સ (મેનપાવર સપ્લાય ખર્ચ)	૧૭૯.૫૦	૧૬૪.૩૮
સ્થિર સંપત્તિના વેચાણ પર નુકસાન	-	૦.૧૦
દાન	-	-
ઓડિટર્સને મહેનતાણું (GST સહિત)		
ઓડિટર ફી	૨.૧૦	૨.૧૦
આઉટ ઓફ પોકેટ ખર્ચ	-	-
આંતરિક ઓડિટ ફી (આઉટ ઓફ પોકેટ ખર્ચ સહિત)	૨.૩૬	૨.૦૦
પ્રી ઓડિટ ફી (આઉટ ઓફ પોકેટ ખર્ચ સહિત)	૦.૦૨	૦.૨૮
બેંક ચાર્જીસ	૦.૩૬	-
એગ્રી પ્રી-વાઈબ્રન્ટ ગુજરાત ઇવેન્ટમાં યોગદાન	-	૨૦૦.૦૦
પરચુરણ	૯૯.૧૦	૧૧૧.૪૩
કુલ (ખ)	૫૧૯.૯૩	૭૩૬.૨૭
ગ. વેચાણ ખર્ચ :		
નૂર શુલ્ક (જાવક)	૧૪૮.૪૩	૧૬૨.૫૫
જાહેરાત અને પ્રચાર ખર્ચ	૨.૨૫	૨.૯૨
અન્ય વેચાણ ખર્ચ	-	૧૮.૫૧
રોયલ્ટી ખર્ચ	-	-
ટીડીએસ ખર્ચ	-	૦.૧૯
જીએસટી ખર્ચ	-	-
કુલ (ગ)	૧૫૦.૬૮	૧૮૪.૧૮
ઘ. છૂટ અને માંડી વાળવું		
ખરાબ અને શંકાસ્પદ માટેની જોગવાઈ		
વેપાર લેણાં	૨૫.૦૪	૦.૧૪
કુલ (ઘ)	૨૫.૦૪	૦.૧૪
ચ. કોર્પોરેટ સામાજિક જવાબદારી પર ખર્ચ		
એસઆર ખર્ચ	૬૭.૪૩	૮૮.૬૯
કુલ (ચ)	૬૭.૪૩	૮૮.૬૯
કુલ : (ક + ખ + ગ + ઘ + ચ)	૧,૪૫૯.૩૩	૧,૬૬૫.૨૧

નોંધ : ૩૪: વ્યાખ્યાયિત લાભ યોજનાનું પુનઃ માપ - અન્ય વ્યાપક આવક (OCI)

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ પુરા થયેલ વર્ષ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ પુરા થયેલ વર્ષ
વસ્તુઓ કે જે નફા અને નુકસાનમાં ફરીથી વર્ગીકૃત કરવામાં આવશે નહીં વ્યાખ્યાયિત લાભ યોજનાઓ પર ફરીથી નુકસાન માપન વ્યાખ્યાયિત લાભ યોજનાઓ પર પુનઃ માપન નુકસાન પર આવકવેરો	૬૪.૬૦ (૧૬.૨૬)	(૬.૫૧) ૧.૬૪
કુલ:	૪૮.૩૪	(૪.૮૭)

નોંધ: ૩૫: શેર દીઠ કમાણી (EPS)

શેર દીઠ કમાણી નક્કી કરવા માટે, કંપની કર પછીના ચોખ્ખા નફાને ધ્યાનમાં લે છે. શેર દીઠ મૂળભૂત કમાણીની ગણતરીમાં ઉપયોગમાં લેવાતા શેરની સંખ્યા એ વર્ષ દરમિયાન બાકી રહેલા ઇક્વિટી શેરની ભારાંકિત સરેરાશ સંખ્યા છે. વર્ષ દરમિયાન સંભવિત ઇક્વિટી શેર સામેલ હોય તેવા કિસ્સામાં શેર દીઠ ડિલ્યુટિવ અર્નિંગ્સની ગણતરી કરવામાં આવે છે.

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ પુરા થયેલ વર્ષ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ પુરા થયેલ વર્ષ
મૂળભૂત EPS (₹ માં)	૫૦૫.૦૦	૬૦૨.૦૦
મંદિત EPS (₹ માં)	૫૦૫.૦૦	૬૦૨.૦૦

મૂળભૂત EPS ગણતરીમાં વપરાયેલી આવક અને શેર ડેટાને નીચે મુજબ પ્રતિબિંબિત કરે છે:

(₹ લાખમાં)

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ પુરા થયેલ વર્ષ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ પુરા થયેલ વર્ષ
નિગમના ઇક્વિટી ધારકોને વહેંચવામાં આવેલ નફો:		
સતત કામગીરી	૧,૯૮૩.૩૩	૨,૩૬૫.૭૫
બંધ કામગીરી	-	-
શેર દીઠ મૂળભૂત કમાણી માટે ઇક્વિટી ધારકોને વહેંચવામાં આવેલ નફો	૧,૯૮૩.૩૩	૨,૩૬૫.૭૫
કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર પર વ્યાજ	-	-
મંદીની અસર માટે ઇક્વિટી ધારકોને વહેંચવામાં આવેલ નફો	૧,૯૮૩.૩૩	૨,૩૬૫.૭૫

નીચેની મૂળભૂત EPS ગણતરીમાં વપરાયેલા શેરની ભારિત સરેરાશ સંખ્યાને પ્રતિબિંબિત કરે છે

વિગત	૩૧મી માર્ચ, ૨૦૨૩ના રોજ પુરા થયેલ વર્ષ	૩૧મી માર્ચ ૨૦૨૨ના રોજ પુરા થયેલ વર્ષ
મૂળભૂત ઇપીએસ માટે ઇક્વિટી શેરની ભારિત સરેરાશ સંખ્યા	૩,૯૩,૦૦૦	૩,૯૩,૦૦૦
મંદીની અસર:	-	-
શેર વિકલ્પો	-	-
કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર	-	-
મંદીની અસરના કારણે ઇક્વિટી શેરની ભારિત સરેરાશ સંખ્યા	૩,૯૩,૦૦૦	૩,૯૩,૦૦૦

નોંધ: ૩૬ : હિસાબના ભાગરૂપે નોંધ ૨૦૨૨-૨૩

૧. સીએસઆર ખર્ચ : -

- i) વર્ષ દરમિયાન નિગમ દ્વારા ખર્ચવામાં આવનારી કુલ રકમ. ૮૪.૧૭ લાખ (અગાઉના વર્ષે ₹ ૮૮.૬૯ લાખ).
ii) વર્ષ દરમિયાન ખર્ચવામાં આવેલી રકમ : -

(₹ લાખમાં)

વિગત	રોકડેથી કરવામાં આવેલ ખર્ચ					
	૨૦૨૨-૨૩			૨૦૨૧-૨૨		
	રોકડ	બાકી ચૂકવણું	કુલ	રોકડ	બાકી ચૂકવણું	કુલ
(ક) કોઈ મિલકતનું ખાંધકામ / સંપાદન	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦
(ખ) ઉપરોક્ત (ક) સિવાય અન્ય હેતુઓ માટે	૬૭.૪૩*	૦.૦૦	૬૭.૪૩	૮૮.૬૯	૦.૦૦	૮૮.૬૯
કુલ	૬૭.૪૩	૦.૦૦	૬૭.૪૩	૮૮.૬૯	૦.૦૦	૮૮.૬૯

* નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ₹ ૧૬.૭૪ લાખની રકમ નીચેના કોષ્ટકમાં અનુક્રમ નંબર ૩ પર ઉલ્લેખ કરેલ ચાલુ પ્રોજેક્ટ માટે મંજૂર કરવામાં આવી હતી. આથી, તે ૩૧.૦૩.૨૦૨૩ સુધી ચૂકવવામાં આવી ન હતી. તે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં ચૂકવવામાં આવશે.

(₹ લાખમાં)

(૧)	(૨)	(૩)	(૪)	(૫)	(૬)	(૭)	(૮)	(૯)	(૧૦)	(૧૧)	
ક્ર. નં.	પ્રોજેક્ટનું નામ	અનુસૂચિ VII માંની પ્રવૃત્તિઓની સૂચિમાંથી અધિનિયમ ની આઠટમ	સ્થાનિક વિસ્તાર (હા/ના)	પ્રોજેક્ટનું સ્થાન. રાજ્ય જિલ્લો	પ્રોજેક્ટ સમય-ગાળો	પ્રોજેક્ટ માટે ફાળવેલ રકમ	વર્તમાન નાણાકીય વર્ષમાં ખર્ચવામાં આવેલી રકમ	કલમ ૧૩૫(૬) મુજબ પ્રોજેક્ટ માટે બિનખર્ચિત સીએસઆર ખાતામાં ટ્રાન્સફર કરાયેલી રકમ	અમલીકરણ ની રીત પ્રત્યક્ષ (હા/ના).	અમલીકરણની પદ્ધતિ - અમલીકરણ એજન્સી દ્વારા નામ સીએસઆર નોંધણી નંબર	
૧.	ડાયાલિસિસ કેન્દ્રની સ્થાપના	પોઈન્ટ નં. ૧	હા	રાજકોટ / ગુજરાત	૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪	૪૦.૦૦	૪૦.૦૦	૦.૦૦	ના	ઈન્ડિટટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર	-
૨.	માનસિક રીતે અસ્વસ્થ વિદ્યાર્થીઓ માટે પુનર્વસન પ્રોજેક્ટ	પોઈન્ટ નં. ૧	હા	અમદાવાદ / ગુજરાત	૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪	૫.૦૦	૦૦.૦૦*	૦.૦૦	ના	બી. એમ. ઈન્ડિટટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ	-
૩.	હાઇડ્રોપોનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘાસચારો ઉત્પાદન કાર્યક્રમ	પોઈન્ટ નં. ૪	હા	દાહોદ / ગુજરાત	૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪	૩૩.૫૫	૦૦.૦૦*	૦.૦૦	ના	એન.એમ. સદગુરુ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, દાહોદ	-
૪.	ખાસ નવજાત કેર યુનિટની સ્થાપના	પોઈન્ટ નં. ૧	હા	મોરબી / ગુજરાત	૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪	૫.૬૨	૦૦.૦૦*	૦.૦૦	ના	આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ કમિશ્નર	-
	કુલ					૮૪.૧૭	૪૦.૦૦	૦.૦૦			

* ભંડોળ અમલીકરણ એજન્સીઓને ફાળવવામાં આવ્યું હતું, જે કે ૩૧.૦૩.૨૦૨૩ ના રોજ એજન્સીઓ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

૨. માપન અને મુકદ્દમાના પરિણામની અનિશ્ચિતતાને કારણે આકસ્મિક જવાબદારીઓ પૂરી પાડવામાં આવતી નથી:

(₹ લાખમાં)

ક્રમાંક	વિગત	૨૦૨૨-૨૩	૨૦૨૧-૨૨
૧	આપવામાં આવેલ કેપિટલ એકાઉન્ટ કોન્ટ્રાક્ટ કરારની અંદાજિત રકમ (ચૂકવવામાં આવેલ એડવાન્સ રકમ બાદ)	-	૩.૬૯
૨	સપ્લાયર્સ અને અન્ય ઘટકો દ્વારા નિગમ સામે દાવા	૬૯.૧૯	૬૯.૧૯
૩	આવકવેરાની વિવાદાસ્પદ માંગ જેમાં કંપની અપીલમાં સફળ થવાની અપેક્ષા રાખે છે.	૨૨.૫૪*	૨૨.૫૪
૪	નિગમ સામે પુનઃસ્થાપન, પાછલા વેતન અને ભથ્થા વગેરેના કેટલાક કર્મચારીઓના દાવા પેન્ડિંગ છે.	નોંધ ૪ જુઓ	

* ₹ ૨૨.૫૪ લાખની વિવાદિત માંગની રકમ આવકવેરા વિભાગ દ્વારા અનુગામી આકારણી વર્ષોના રિફંડમાંથી એડવર્સ્ટ કરવામાં આવી છે.

૩. કર્મચારીઓ / ભૂતપૂર્વ કર્મચારીઓ દ્વારા નિગમ સામે અમુક કોર્ટ કેસ દાખલ કરવામાં આવ્યા છે. બાકી રકમ, જો હોય તો, કોર્ટ કેસના અંતિમ પરિણામ પછી જ જાણી શકાય તેમ છે. ખાતાઓમાં જરૂરી ગોઠવણો, જો જરૂરી હોય તો, સંબંધિત વર્ષમાં આવા કેસોના પરિણામના આધારે કરવામાં આવશે.
૪. અન્ય વર્તમાન સંપત્તિઓ - કર્મચારીઓને એડવાન્સ આપવા માટે નાણાકીય વર્ષ ૨૦૦૧-૨૦૦૨માં નિગમ (૧૮.૦૬.૨૦૦૧)ના કર્મચારી દ્વારા દુરુપયોગ કરેલ ₹ ૬.૦૦ લાખ (ગ.વ. ૬.૦૦ લાખ) ની રકમ સહિત, જેના માટે કેસ કોર્ટ પેન્ડિંગ છે. સદર રકમ માટે સંપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે.
૫. મેનેજમેન્ટના મતે, ધી ઈન્સ્ટીટ્યુટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલ સંપત્તિના નુકશાન પર ઇન્ડ. એએસ ૩૬ ની જોગવાઈઓ અનુસાર સંપત્તિના નુકશાન માટે કોઈ જોગવાઈ કરવાની જરૂર નથી.
૬. નિગમ પાસે માત્ર એક જ વ્યવસાય અને ભૌગોલિક વિભાગ છે. તેથી, ધી ઈન્સ્ટીટ્યુટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલ સેગમેન્ટલ રિપોર્ટિંગ પર ઇન્ડ. એએસ ૧૦૮ અનુસાર સેગમેન્ટલ આંકડા જાહેર કરવાનું લાગુ પડતું નથી.
૭. કેટલાક વ્યક્તિઓએ ૨૧.૦૮.૨૦૦૯ થી ૨૯.૦૮.૨૦૦૯ દરમિયાન નિગમના અધિકારીઓની બનાવટી સહીઓ સાથે ૮ અલગ અલગ ડુપ્લિકેટ ચેક આપીને નિગમના સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ગાંધીનગર, ના સ્ટેટ બેન્ક એકાઉન્ટ પૈદર૨૨૮૦૪૯૧૬૯ માંથી ₹ ૯૬.૭૮ લાખની રકમ ઉપાડી લીધી હતી. નિગમને અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર ૪૮૧/૦૯ તારીખ ૦૨.૦૯.૨૦૦૯ નોંધાવી છે. કાઠમ બ્રાંચ, અમદાવાદએ આ કેસની તપાસ શરૂ કરી છે. જે ખાતામાં પૈસા જમા કરવામાં આવ્યા હતા તેમાંથી ₹ ૧૯.૨૦ લાખની વસૂલાત કરવામાં આવી છે અને આ મામલે હજુ તપાસ ચાલુ છે. નિગમને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સામે પૈસાની વસૂલાત માટે દાવો કર્યો છે એટલે કે ₹ ૯૬.૭૮ લાખની વસૂલાત માટે. કારણ કે પ્રથમ ટ્રસ્ટિએ એવું જોવા મળ્યું છે કે, ડુપ્લિકેટ ચેકને રોકડ કરવામાં બેંક તરફથી બેદરકારી દાખવવામાં આવી છે. સીઆઈડી કાઠમ બ્રાંચે નિગમના એલડીસી શ્રી મયુર કૃષ્ણલાલ જોશીની છેતરપીંડીમાં સીધી સંડોવણી બદલ ધરપકડ કરી હતી. નિગમને સીઆઈડીના રિપોર્ટના આધારે ૦૫.૧૦.૨૦૦૯ ના રોજ શ્રી મયુર કૃષ્ણલાલ જોશી, એલડીસી ને સસ્પેન્ડ કર્યા છે. નોટ ૧૫ હેઠળ ₹ ૭૭.૫૮ લાખની બાકી રકમને “અન્ય વર્તમાન સંપત્તિ” તરીકે દર્શાવવામાં આવી છે. જો કે, આ ભંડોળનો એક ભાગ પોલીસ દ્વારા વસૂલવામાં આવ્યો છે અને નિગમ બાકીની રકમ વસૂલવાની અપેક્ષા રાખે છે, માટે હિસાબના ચોપડામાં તેની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. નિગમને હાઈકોર્ટના આદેશ / અપીલ ક્રમાંક ૪૫૦ ઓફ ૨૦૨૦ અન્વયે બાકી રકમના ૫૦% એટલે કે ₹ ૩૮.૭૯ લાખ મળવા પાત્ર થતાં હતાં પરંતુ અપીલના બંને પક્ષો એટલે કે, નિગમ અને ભારતીય સ્ટેટ બેન્ક એ સદર આદેશ સામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરેલ છે અને આ મામલો હજુ ચાલુ છે.
૮. નિગમે તેના કપાસના બિયારણ માટે બીટી ટેકનોલોજીના ઉપયોગ માટે માહિકો મોન્સેન્ટો બાયોટેક (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાણ કર્યું છે. કરારના ભાગ રૂપે, ₹ ૫૫.૬૭ લાખ બે હપ્તામાં લાયસન્સ ફી તરીકે ચૂકવવાના હતા. પ્રથમ હપ્તો ૨૬ / ૦૭ / ૨૦૧૧ ના રોજ અને બીજો હપ્તો ૧૯ / ૦૬ / ૨૦૧૩ ના રોજ ચૂકવવામાં આવ્યો હતો. ૧૯ / ૦૬ / ૨૦૧૩ ના રોજ સમગ્ર રકમનું મૂડીકરણ કરવામાં આવ્યું હતું અને ૧૦ વર્ષના કરારના સમયગાળાના આધારે ચાલુ વર્ષમાં તેના પ્રમાણમાં ઘસારો પૂરો પાડવામાં આવ્યો છે.
૯. વર્ષ દરમિયાન ₹ ૪.૪૫ લાખ (ગ.વ. ₹ ૩.૮૨ લાખ) ના શંકાસ્પદ દેવા માટે વધારાની જોગવાઈ પરત લખવામાં આવી છે.
૧૦. વર્ષ દરમિયાન ગુજરાત સરકારના પત્ર નં. પરચ /૧૧૨૧/૪૯૨/મ-૩ તા. ૨૦/૦૧/૨૦૨૨ દ્વારા એગ્રી પ્રી-વાઈબ્રન્ટ ગુજરાત ઇવેન્ટમાં ₹ ૨૦૦.૦૦ લાખનું યોગદાન આપવાનો ઓર્ડર મળ્યો હતો. ઉલ્લેખિત યોગદાન આદેશ મુજબ વર્ષ દરમિયાન કરવામાં આવ્યું છે અને નોંધ નંબર ૩૩ - અન્ય ખર્ચ હેઠળ દર્શાવવામાં આવ્યું છે. વધુમાં, કોર્પોરેશનને એગ્રી પ્રી વાઈબ્રન્ટ ગુજરાત ઇવેન્ટના વિવિધ ખર્ચ માટે ચૂકવણી કરવા માટે અન્ય વિવિધ સરકારી સંસ્થાઓ પાસેથી ₹ ૧૦૫.૪૭ લાખ પણ પ્રાપ્ત થયા છે અને તે ભંડોળનો ઉપયોગ વર્ષ દરમિયાન ગુજરાત સરકાર તરફથી મળેલા આદેશો અનુસાર કાર્યક્રમ માટે કરવામાં આવ્યો છે. જો કે, પ્રાપ્ત ભંડોળમાંથી, બાકી ₹ ૭૮.૮૩ લાખ (ગ.વ. ₹ ૮૫.૨૪ લાખ) નોંધ ૨૩ - અન્ય વર્તમાન જવાબદારીઓ હેઠળ જવાબદારી તરીકે દર્શાવવામાં આવ્યા છે. ગુજરાત સરકારશ્રી તરફથી પેમેન્ટ ઓર્ડર મળવા પર ચૂકવણી કરવામાં આવશે.

૧૧. સંબંધિત પક્ષોની જાહેરાત : -

ક. સંસ્થાના મુખ્ય વ્યવસ્થાપક અધિકારીઓએ : -

નામ	હોદ્દો
શ્રી મનીષ ભારદ્વાજ (૦૭.૧૧.૨૦૨૦ થી ૦૮-૦૩-૨૦૨૨ સુધી)	અધ્યક્ષ
શ્રી મુકેશ પુરી (૦૯-૦૩-૨૦૨૨ થી ૨૯-૦૪-૨૦૨૩ સુધી)	અધ્યક્ષ
શ્રી અમરેન્દ્ર કે. રાકેશ (૨૯-૦૪-૨૦૨૩ થી અત્યાર સુધી)	અધ્યક્ષ
શ્રી પી.એસ. રબારી	વહીવટી નિયામક
શ્રી કે.એમ. રાવલ	કંપની સચિવ
શ્રી એસ.એન. દેવડા	સંચાલક (નાણાં)

સંબંધિત પક્ષો સાથે વ્યવહારોનો ખુલાસો : -

ખ. મુખ્ય વ્યવસ્થાપક અધિકારીઓના વેતન : -

(₹ લાખમાં)

વિગત	વર્ષ ૩૧-૦૩-૨૦૨૩ ના અંત સુધી	વર્ષ ૩૧-૦૩-૨૦૨૨ ના અંત સુધી
શ્રી મનીષ ભારદ્વાજ (અધ્યક્ષ)	-	-
શ્રી મુકેશ પુરી (અધ્યક્ષ)	-	-
શ્રી અમરેન્દ્ર કે. રાકેશ (અધ્યક્ષ)	-	-
શ્રી પી. એસ. રબારી (એમ. ડી.)	૨૩.૪૧	૨૦.૨૫
શ્રી કે. એમ. રાવલ (કંપની સચિવ)	૧૮.૭૯	૧૪.૫૧
શ્રી. એસ. એન. દેવડા (મેનેજર (નાણાં))	૧૮.૫૪	૧૩.૯૮

ગ. કેએમપી ના મહેનતાણાની વિગત

(₹ લાખમાં)

વિગત	વર્ષ ૩૧/૦૩/૨૦૨૩ ના અંત સુધી	વર્ષ ૩૧/૦૩/૨૦૨૨ ના અંત સુધી
ટૂંકા ગાળાના કર્મચારી લાભો	૬૦.૭૪	૪૮.૭૪
રોજગાર પછીના લાભો	૯.૩૨	૮.૬૭
અન્ય લાંબા ગાળાના લાભો	-	-
રોજગાર સમાપ્તિ બાદના લાભો	-	-

ઘ. સરકારી સંસ્થાઓ સાથેના વ્યવહારો : -

(₹ લાખમાં)

વિગત	વર્ષ ૩૧/૦૩/૨૦૨૩ ના અંત સુધી	વર્ષ ૩૧/૦૩/૨૦૨૨ ના અંત સુધી
જીએસએફએસ		
જમા રકમ	૩૩,૩૨૬.૪૧	૩૫,૮૦૦.૦૦
ઉપાડેલી રકમ	૩૧,૩૧૮.૯૩	૩૪,૬૦૦.૦૦
વ્યાજની આવક	૭૦૦.૩૧	૪૪૨.૮૭

ઉપરોક્ત વ્યવહારો ઉપરાંત, નિગમે સરકાર સાથે સંકળાયેલી સંસ્થાઓ સાથે સામાન્ય પ્રવાહના અન્ય વ્યવહારોમાં પણ પ્રવેશ કર્યો છે. આ વ્યવહારો કિંફાયતી ભાવે સંમતિથી કરારની શરતો પર કરવામાં આવે છે.

૧૨. મેનેજમેન્ટના અભિપ્રાય મુજબ, શંકાસ્પદ દેવા અને એડવાન્સિસને બાદ કરતાં, જો વ્યવસાયમાં સામાન્ય રીતે વસૂલ કરવામાં આવે, તો વર્તમાન સંપત્તિ, લોન અને એડવાન્સિસ અંદાજિત મૂલ્ય જેટલી જ હોય છે, અન્ય જાણીતી જવાબદારીઓને બાદ કરતાં તમામ જાણીતી નિશ્ચિત જવાબદારીઓ હિસાબના ચોપડામાં સંપૂર્ણ રીતે સમાવિષ્ટ કરવામાં આવેલ છે.

૧૩. જૂના / માન્યતાની મુદતનાં કારણે અમાન્ય ચેક અને ખોટી બેંક વિગતોના કારણે આરટીજીએસ રિટર્નના કારણે નોડલ એજન્સી તરીકે પ્રાપ્ત સરકારી અનુદાનમાંથી, ₹ ૫૪૩.૯૬ લાખ (ગ.વ. ₹ ૪૧૨.૩૮ લાખ) ની રકમ અન્ય વર્તમાન જવાબદારીઓમાં આવરી લેવામાં આવી છે. (નોંધ: ૨૩ - અન્ય વર્તમાન જવાબદારીઓ). ચુકવણી ન થયેલ રકમની પુનઃ ચુકવણી માટે પ્રાપ્ત દાવાની યોગ્ય ચકાસણી બાદ ચુકવણી કરવામાં આવે છે.

૧૪. ઇન્ડ - એએસ - ૧૯ મુજબની જાહેરાત : -

ક. પ્રોવિડન્ટ ફંડ માટે વ્યાખ્યાયિત લાભો : -

(₹ લાખમાં)

વિગત	૩૧/૦૩/૨૦૨૩	૩૧/૦૩/૨૦૨૨
પ્રોવિડન્ટ ફંડમાં એમ્પ્લોયરનું યોગદાન	૭૦.૬૨	૬૦.૯૯
ફેમિલી પેન્શન ફંડમાં એમ્પ્લોયરનું યોગદાન	૧૦.૫૦	૧૧.૪૬
રાષ્ટ્રીય પેન્શન યોજનામાં એમ્પ્લોયરનું યોગદાન	૧૦.૨૮	૫.૫૮

ખ. ગ્રેચ્યુદટી માટે વ્યાખ્યાયિત લાભો : -

નીચેનું કોષ્ટક ૩૧ માર્ચ, ૨૦૨૩ ના રોજ ગ્રેચ્યુદટી યોજનાઓની સ્થિતિ દર્શાવે છે.

(₹ લાખમાં)

વિગત	ગ્રેચ્યુદટી (ફંડેડ)	
	૩૧-૦૩-૨૦૨૩ સુધી	૩૧-૦૩-૨૦૨૨ સુધી
વર્ષ દરમિયાન વ્યાખ્યાયિત લાભ જવાબદારીના વર્તમાન મૂલ્યમાં ફેરફાર		
વર્ષની શરૂઆતમાં જવાબદારીનું વર્તમાન મૂલ્ય	૫૫૫.૭૫	૫૧૧.૩૧
વ્યાજ ખર્ચ	૩૫.૦૦	૩૩.૮૯
વર્તમાન સેવા ખર્ચ	૪૩.૫૧	૪૫.૨૦
ચૂકવેલ લાભો	(૫૮.૦૬)	(૪૦.૨૫)
પાછલો સેવા ખર્ચ	૦.૦૦	૦.૦૦
વસ્તી વિષયક પરિવર્તનને કારણે નફો / નુકસાન	૦.૦૦	(૦.૪૪)
નાણાકીય અંદાજમાં ફેરફારથી ઉદભવેલ નફો / નુકસાન	(૨૩.૬૧)	(૨.૪૬)
નફો / અનુભવ ગોઠવણથી ઉદભવતા નુકસાન	(૩૯.૩૭)	૮.૫૦
વર્ષના અંતે જવાબદારીનું વર્તમાન મૂલ્ય	૫૧૩.૨૨	૫૫૫.૭૫
વર્ષ દરમિયાન યોજનાની સંપત્તિના વાજબી મૂલ્યમાં ફેરફાર		
વર્ષની શરૂઆતમાં આયોજિત સંપત્તિઓ વાજબી મૂલ્ય	૬૪૮.૫૪	૬૪૬.૪૯
વ્યાજની આવક	૪૨.૯૫	૪૩.૨૨
એમ્લોયર દ્વારા યોગદાન	૧૮.૪૨	૦.૦૦
ચૂકવેલ લાભો	(૫૮.૦૬)	(૪૦.૨૫)
અન્ય ખર્ચ	૦.૦૦	૦.૦૦
યોજનાની સંપત્તિ પર વળતર	૧.૬૨	(૦.૯૨)
વર્ષના અંતે આયોજિત સંપત્તિનું યોગ્ય મૂલ્ય	૬૫૩.૪૭	૬૪૮.૫૪
નેટ એસેટ/(જવાબદારી) બેલેન્સ શીટમાં નોંધાયેલ છે		
વર્ષના અંતે જવાબદારીનું વર્તમાન મૂલ્ય	(૫૧૩.૨૨)	(૫૫૫.૭૫)
યોજની સંપત્તિ/(જવાબદારી) - વર્તમાન	૧૪૦.૨૫	૯૨.૭૯
વર્ષ દરમિયાન નફા અને નુકસાનમાં નોંધાયેલા ખર્ચ		
વ્યાજ ખર્ચ	(૭.૯૫)	(૯.૩૩)
વર્તમાન સેવા ખર્ચ	૪૩.૫૧	૪૫.૨૦
પાછલો સેવા ખર્ચ	૦.૦૦	૦.૦૦
નાણાકીય અંદાજમાં ફેરફારથી ઉદભવેલ નફો /નુકસાન	૦.૦૦	૦.૦૦
નફો / અનુભવ ગોઠવણથી ઉદભવતા નુકસાન	૦.૦૦	૦.૦૦
કર્મચારી માટેના લાભોના ખર્ચમાં સમાવિષ્ટ ખર્ચ	૩૫.૫૬	૩૫.૮૭
વર્ષ દરમિયાન માન્યતા પ્રાપ્ત અન્ય વ્યાપક આવક		
સમયગાળા માટે જવાબદારી પર નફો /(નુકસાન)	(૬૨.૯૮)	૫.૫૯
આયોજિત અસ્કયામતો પરના વ્યાજને બાદ કરતા	(૧.૬૨)	૦.૯૨
વર્ષ દરમિયાન અન્ય માન્યતા પ્રાપ્ત વ્યાપક આવક	૬૪.૬૦	૬.૫૧

વ્યાખ્યાયિત લાભ યોજના માટે અપેક્ષિત લાભની ચુકવણી નીચે મુજબ છે.

(₹ લાખમાં)

વિગત	ગ્રેચ્યુઇટી (ભંડોળ પૂરું પાડવામાં આવેલ)	
	વર્ષ ૩૧ માર્ચ ૨૦૨૩ ના અંત સુધી	વર્ષ ૩૧ માર્ચ ૨૦૨૨ ના અંત સુધી
રિપોર્ટિંગ સમયગાળાના ૧૨ મહિનાની અંદર	૮૪.૪૧	૧૦૪.૧૨
૨ થી ૫ વર્ષ વચ્ચે	૧૮૦.૫૭	૧૮૦.૭૭
૬ થી ૧૦ વર્ષની વચ્ચે	૨૨૨.૪૫	૨૦૫.૧૩
૧૦ વર્ષથી વધુ	-	-

ઉપયોગમાં લેવામાં આવેલ ધારણાઓનો સારાંશ નીચેના કોષ્ટકમાં આપવામાં આવ્યો છે:

વિગત	ગ્રેચ્યુઇટી (ભંડોળ પૂરું પાડવામાં આવેલ)	
	૩૧-૦૩-૨૦૨૩ સુધી	૩૧-૦૩-૨૦૨૨ સુધી
ડિસ્કાઉન્ટ દર (વાર્ષિક)	૭.૪૫%	૬.૮૫%
પગારમાં ભાવિ વધારો	૮.૦૦%	૮.૦૦%
યોજનાની સંપત્તિ પર વળતરનો અપેક્ષિત દર	૭.૪૫%	૬.૮૫%
મૃત્યુ દર	અંતિમ ભારતીય ચોક્કસ જીવન મૃત્યુ દર (૨૦૧૨-૧૪)	અંતિમ ભારતીય ચોક્કસ જીવન મૃત્યુ દર ૨૦૧૨-૧૪

નોંધપાત્ર ધારણા માટે માત્રાત્મક સંવેદનશીલતા વિશ્લેષણ નીચે મુજબ છે:

(₹ લાખમાં)

વિગત	ગ્રેચ્યુઇટી (ભંડોળ પૂરું પાડવામાં આવેલ)	
	વર્ષ ૩૧ માર્ચ ૨૦૨૩ ના અંત સુધી	વર્ષ ૩૧ માર્ચ ૨૦૨૨ ના અંત સુધી
ડિસ્કાઉન્ટ રેટમાં એક ટકાનો વધારો	(૪૧.૫૩)	(૪૪.૮૧)
ડિસ્કાઉન્ટ રેટમાં એક ટકાનો ઘટાડો	૪૯.૪૨	૫૩.૯૦
પગાર વધારાના દરમાં એક ટકાનો વધારો	૧૦.૩૫	૧૨.૯૨
પગાર વધારાના દરમાં એક ટકાનો ઘટાડો	(૧૦.૮૧)	(૧૭.૪૩)
કર્મચારીના ટર્નઓવરના દરમાં એક ટકાનો વધારો	૧.૯૦	૧.૨૯
કર્મચારીના ટર્નઓવરના દરમાં એક ટકાનો ઘટાડો	(૧.૯૩)	(૧.૩૧)

આગામી રિપોર્ટિંગ અવધિ માટે અપેક્ષિત યોગદાન નીચે મુજબ છે : -

(₹ લાખમાં)

વિગત	ગ્રેચ્યુઇટી (ભંડોળ)	
	૩૧-૦૩-૨૦૨૩ સુધી	૩૧-૦૩-૨૦૨૨ સુધી
આગામી રિપોર્ટિંગ અવધિ (ગ્રેચ્યુઇટી) માટે વ્યાખ્યાયિત લાભ યોજનામાં અપેક્ષિત યોગદાન	૩૫.૩૯	૪૩.૦૯

ગ. લીવ એન્કેશમેન્ટ માટે અન્ય લાંબા ગાળાના લાભો:

નીચેનું કોષ્ટક ૩૧ માર્ચ, ૨૦૨૩ ના રોજ લીવ એન્કેશમેન્ટ યોજનાઓની સ્થિતિ દર્શાવે છે.

(₹ લાખમાં)

વિગત	લીવ એન્કેશમેન્ટ (ફંડેડ)	
	૩૧-૦૩-૨૦૨૩ સુધી	૩૧-૦૩-૨૦૨૨ સુધી
વર્ષ દરમિયાન વ્યાખ્યાયિત લાભ જવાબદારીના વર્તમાન મૂલ્યમાં ફેરફાર		
વર્ષની શરૂઆતમાં જવાબદારીનું વર્તમાન મૂલ્ય	૩૯૫.૦૯	૩૪૩.૪૧
વ્યાજ ખર્ચ	૨૬.૧૪	૨૩.૦૧
વર્તમાન સેવા ખર્ચ	૧૩.૧૪	૮.૭૮
ચૂકવેલ લાભો	(૩૮.૦૨)	(૧૯.૫૯)
પાછલો સેવા ખર્ચ	૦.૦૦	૦.૦૦
વસ્તી વિષયક પરિવર્તનને કારણે નફો / નુકસાન	૦.૦૦	૦.૦૪
નાણાકીય અંદાજમાં ફેરફારથી ઉદભવેલ નફો / નુકસાન	(૨૪.૧૮)	(૨.૩૩)
નફો / અનુભવ ગોઠવણથી ઉદ્ભવતા નુકસાન	૧૫.૬૮	૪૧.૭૭
વર્ષના અંતે જવાબદારીનું વર્તમાન મૂલ્ય	૩૮૭.૮૫	૩૯૫.૦૯
વર્ષ દરમિયાન યોજનાની સંપત્તિના વાજબી મૂલ્યમાં ફેરફાર		
વર્ષની શરૂઆતમાં આયોજિત સંપત્તિઓ વાજબી મૂલ્ય	૩૨૬.૨૪	૨૮૯.૧૦
વ્યાજની આવક	૨૧.૭૦	૨૦.૪૯
એમ્પ્લોયર દ્વારા યોગદાન	૪૧.૮૬	૩૫.૩૩
ચૂકવેલ લાભો	(૩૮.૦૨)	(૧૯.૫૯)
અન્ય ખર્ચ	૦.૦૦	૦.૦૦
યોજનાની સંપત્તિ પર વળતર	૨.૩૬	૦.૯૧
વર્ષના અંતે આયોજિત સંપત્તિનું યોગ્ય મૂલ્ય	૩૫૪.૧૪	૩૨૬.૨૪
નેટ એસેટ/(જવાબદારી) બેલેન્સ શીટમાં નોંધાયેલ છે		
વર્ષના અંતે જવાબદારીનું વર્તમાન મૂલ્ય	(૩૮૭.૮૫)	(૩૯૫.૦૯)
યોજની સંપત્તિ/(જવાબદારી) - વર્તમાન	(૩૩.૭૧)	(૬૮.૮૫)
વર્ષ દરમિયાન નફા અને નુકસાનમાં નોંધાયેલા ખર્ચ		
વ્યાજ ખર્ચ	૪.૪૪	૨.૫૩
વર્તમાન સેવા ખર્ચ	૧૩.૧૪	૮.૭૭
પાછલો સેવા ખર્ચ	૦.૦૦	૦.૦૦
નાણાકીય અંદાજમાં ફેરફારથી ઉદભવેલ નફો /નુકસાન	(૨૪.૧૮)	(૨.૩૩)
અનુભવ ગોઠવણથી ઉદ્ભવતા નફો / નુકસાન	-	૦.૦૪
યોજના અસ્કયામતો પર વળતર	૧૫.૬૮	૪૧.૭૬
આયોજિત અસ્કયામતો પરના વ્યાજને બાદ કરતા	(૨.૩૬)	(૦.૯૧)
કર્મચારી માટેના લાભોના ખર્ચમાં સમાવિષ્ટ ખર્ચ	૬.૭૨	૪૯.૮૭

વ્યાખ્યાયિત લાભ યોજના માટે અપેક્ષિત લાભની ચુકવણી નીચે મુજબ છે.

(₹ લાખમાં)

વિગત	લીવ એન્કેશમેન્ટ (ભંડોળ પૂરું પાડવામાં આવેલ)	
	વર્ષ ૩૧ માર્ચ ૨૦૨૩ ના અંત સુધી	વર્ષ ૩૧ માર્ચ ૨૦૨૨ ના અંત સુધી
રિપોર્ટિંગ સમયગાળાના ૧૨ મહિનાની અંદર	૪૧.૫૧	૫૨.૮૭
૨ થી ૫ વર્ષ વચ્ચે	૯૯.૩૬	૯૧.૭૭
૬ થી ૧૦ વર્ષની વચ્ચે	૧૪૨.૦૭	૧૨૫.૦૫
૧૦ વર્ષથી વધુ	-	-

ઉપયોગમાં લેવામાં આવેલ ધારણાઓનો સારાંશ નીચેના કોષ્ટકમાં આપવામાં આવ્યો છે:

વિગત	લીવ એન્કેશમેન્ટ (ભંડોળ પૂરું પાડવામાં આવેલ)	
	૩૧-૦૩-૨૦૨૩ સુધી	૩૧-૦૩-૨૦૨૨ સુધી
ડિસ્કાઉન્ટ દર (વાર્ષિક)	૭.૪૫%	૬.૯૫%
પગારમાં ભાવિ વધારો	૮.૦૦%	૮.૦૦%
યોજનાની સંપત્તિ પર વળતરનો અપેક્ષિત દર	૭.૪૫%	૬.૯૫%
મૃત્યુ દર	અંતિમ ભારતીય ચોક્કસ જીવન મૃત્યુ દર (૨૦૧૨-૧૪)	અંતિમ ભારતીય ચોક્કસ જીવન મૃત્યુ દર ૨૦૧૨-૧૪

નોંધપાત્ર ધારણા માટે માત્રાત્મક સંવેદનશીલતા વિશ્લેષણ નીચે મુજબ છે:

(₹ લાખમાં)

વિગત	લીવ એન્કેશમેન્ટ (ભંડોળ પૂરું પાડવામાં આવેલ)	
	વર્ષ ૩૧ માર્ચ ૨૦૨૩ ના અંત સુધી	વર્ષ ૩૧ માર્ચ ૨૦૨૨ ના અંત સુધી
ડિસ્કાઉન્ટ રેટમાં એક ટકાનો વધારો	(૪૧.૮૬)	(૪૨.૦૦)
ડિસ્કાઉન્ટ રેટમાં એક ટકાનો ઘટાડો	૫૦.૮૯	૫૧.૩૭
પગાર વધારાના દરમાં એક ટકાનો વધારો	૪૮.૦૮	૫૦.૩૦
પગાર વધારાના દરમાં એક ટકાનો ઘટાડો	(૪૦.૪૧)	(૪૧.૯૮)
કર્મચારીના ટર્નઓવરના દરમાં એક ટકાનો વધારો	(૧.૩૫)	(૧.૬૫)
કર્મચારીના ટર્નઓવરના દરમાં એક ટકાનો ઘટાડો	૧.૩૬	૧.૬૬

આગામી રિપોર્ટિંગ અવધિ માટે અપેક્ષિત યોગદાન નીચે મુજબ છે : -

(₹ લાખમાં)

વિગત	લીવ એન્કેશમેન્ટ (ભંડોળ પૂરું પાડવામાં આવેલ)	
	૩૧-૦૩-૨૦૨૩ સુધી	૩૧-૦૩-૨૦૨૨ સુધી
આગામી રિપોર્ટિંગ અવધિ (ગ્રેચ્યુઇટી) માટે વ્યાખ્યાયિત લાભ યોજનામાં અપેક્ષિત યોગદાન	૯.૪૧	૧૦.૦૩

૧૫. લીઝ

ક. ઉપયોગનો અધિકાર અસ્કયામતો અને લીઝ જવાબદારીઓ (ઇન્ડ એએસ૧૧૬)

નિગમે અમુક ઓફિસ સ્પેસ લીઝ પર લીધી છે. આ લીઝમાં સામાન્ય રીતે લીઝની શરતો ૧ થી ૩ વર્ષની હોય છે.

તેના લીઝના સંદર્ભમાં સંશોધિત પૂર્વવર્તી પદ્ધતિનો ઉપયોગ કરીને ૧ એપ્રિલ, ૨૦૨૦ થી ઇન્ડ-એએસ ૧૧૬ “લીઝ” અપનાવી છે. નિગમે તેના માન્યતા પાત્ર લીઝ કોન્ટ્રાક્ટ માટે ‘ટૂંકા ગાળાની લીઝ’ અને ‘ઓછી કિંમતની સંપત્તિઓની લીઝ’ માન્યતા મુક્તિ લાગુ કરી છે.

ચાલુ નાણાકીય વર્ષમાં માન્ય રકમની વિગતો નીચે મુજબ છે :

૧. (ક) ઉપયોગનો અધિકારની અસ્કયામતો (આરઓયુ)ની માન્ય વહન રકમ છે : -

(₹ લાખમાં)

વિગત	રકમ
૧ એપ્રિલ, ૨૦૨૧ સુધી	૧૦.૫૫
ઉમેરો	૧૦.૬૦
અવમૂલ્યન ખર્ચ	(૧૧.૭૯)
૩૧ માર્ચ, ૨૦૨૨ સુધી	૯.૩૬

(ખ) ઉપયોગનો અધિકારની અસ્કયામતો (આરઓયુ)ની માન્ય વહન રકમ છે : -

(₹ લાખમાં)

વિગત	રકમ
૧લી એપ્રિલ ૨૦૨૨ સુધી	૯.૩૬
ઉમેરો	૨૧.૯૧
અવમૂલ્યન ખર્ચ	(૧૦.૬૪)
૩૧ માર્ચ, ૨૦૨૩ સુધી	૨૦.૬૩

૨. (ક) લીઝ જવાબદારીઓની નક્કી કરવામાં આવેલ વહન રકમ : -

(₹ લાખમાં)

વિગત	રકમ
૧ એપ્રિલ, ૨૦૨૧ સુધી	૧૧.૪૨
ઉમેરો	૧૦.૬૦
વ્યાજમાં વધારો	૧.૦૫
ચુકવણી	(૧૩.૪૮)
૩૧ માર્ચ, ૨૦૨૨ સુધી	૯.૫૯

(ખ) લીઝ જવાબદારીઓની નક્કી કરવામાં આવેલ વહન રકમ : -

(₹ લાખમાં)

વિગત	રકમ
૧લી એપ્રિલ ૨૦૨૨ સુધી	૯.૫૯
ઉમેરો	૨૧.૯૧
વ્યાજમાં વધારો	૨.૪૪
ચુકવણી	(૧૨.૨૧)
૩૧ માર્ચ, ૨૦૨૩ સુધી	૨૧.૭૩

નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૦૨૬ વચ્ચે પાકતી મુદત સાથે લીઝ જવાબદારીઓ માટે અસરકારક વ્યાજ દર ૯% છે.

નાણાકીય વર્ષ ૨૦૨૧ - ૨૨માં નફા અને નુકશાન ખાતામાં અસર આપેલ રકમ નીચે મુજબ છે : -

(₹ લાખમાં)

વિગત	રકમ
ઉપયોગ માટે અધિકારની સંપત્તિનું અવમૂલ્યન (નોંધ ૩)	૧૧.૭૯
લીઝ જવાબદારીઓ પર વ્યાજ ખર્ચ (નોંધ ૩૧)	૧.૦૫
ટૂંકા ગાળાના ભાડાપટ્ટો અને ઓછી કિંમતની મિલકતોની લીઝ સંબંધિત ખર્ચ (નોંધ ૩૪)	૫૨.૨૧

નાણાકીય વર્ષ ૨૦૨૨ - ૨૩માં નફા અને નુકશાન ખાતામાં અસર આપેલ રકમ નીચે મુજબ છે : -

(₹ લાખમાં)

વિગત	રકમ
ઉપયોગ માટે અધિકારની સંપત્તિનું અવમૂલ્યન (નોંધ ૩)	૧૦.૬૪
લીઝ જવાબદારીઓ પર વ્યાજ ખર્ચ (નોંધ ૩૧)	૨.૪૪
ટૂંકા ગાળાના ભાડાપટ્ટો અને ઓછી કિંમતની મિલકતોની લીઝ સંબંધિત ખર્ચ (નોંધ ૩૪)	૪૬.૩૧

નીચેનું કોષ્ટક ૩૧ માર્ચ, ૨૦૨૨ ના રોજ લીઝ જવાબદારીઓની કરારની પાકતી મુદતની વિગતો આપે છે.

ભાવી લીઝ ભાડાની આવક	(રકમ ₹ લાખમાં)	
	૩૧મી માર્ચ, ૨૦૨૩ સુધી	૩૧મી માર્ચ, ૨૦૨૨ સુધી
એક વર્ષથી ઓછું	૧૨.૨૨	૨.૬૪
એક થી પાંચ વર્ષની વચ્ચે	૧૧.૮૬	૮.૦૨
પાંચ વર્ષથી વધુ	-	-

ખ. ઓપરેટિંગ લીઝ : -

લીઝર તરીકે નિગમ : -

ભાવિ લીઝ ભાડાની પ્રાપ્તિ માસિક લીઝ ચૂકવણીના આધારે નક્કી કરવામાં આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માં નફા અને નુકસાનના અહેવાલમાં લીઝ આવક: ₹ ૨.૬૩ લાખ રૂપિયા (નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨: ₹ ૨.૬૩ લાખ) દર્શાવેલ છે.

તમામ ઓપરેટિંગ લીઝ હેઠળ ભાવિ લઘુત્તમ ભાડાની પ્રાપ્તિ નીચે મુજબ છે:

ભાવી લીઝ ભાડાની આવક	(રકમ ₹ લાખમાં)	
	૩૧મી માર્ચ, ૨૦૨૩ સુધી	૩૧મી માર્ચ, ૨૦૨૨ સુધી
એક વર્ષથી ઓછું	૨.૬૩	૨.૬૩
એક થી પાંચ વર્ષની વચ્ચે	-	-
પાંચ વર્ષથી વધુ	-	-

લીઝી તરીકે નિગમ : -

નિગમની અન્ય નોંધપાત્ર ઓપરેટિંગ લીઝિંગ વ્યવસ્થા ગોડાઉનના સંદર્ભમાં છે. આ લીઝ કરારોમાં મહત્તમ ૧૨ મહિના સુધીની લીઝ મુદત હોય છે અને સામાન્ય રીતે પરસ્પર સંમત શરતો પર પરસ્પર સંમતિ દ્વારા નવીનીકરણીય થાય છે. તેથી, ઉક્ત લીઝને ઇન્ડ-એસ ૧૧૬ મુજબ “ટૂંકા ગાળાની લીઝ” તરીકે ગણવામાં આવે છે અને તેને માટે ઉપયોગના અધિકાર (આરઓયુ) સંપત્તિ બનાવવામાં આવી નથી. આવા ટૂંકા ગાળાના લીઝના સંદર્ભમાં ચૂકવવાપાત્ર રકમ ₹ ૪૬.૩૧ લાખ (અગાઉનું વર્ષ: ₹ ૫૨.૨૧ લાખ) છે.

૧૬. વ્યુત્પન્ન સાધનો અને હેજ ન કરેલ એક્સપોઝર

૩૧.૦૩.૨૦૨૩ અને ૩૧.૦૩.૨૦૨૨ ના રોજ વેપારની પ્રાપ્તિ અને વેપારી દેવું ચૂકવવાના સંદર્ભમાં કંપની પાસે કોઈ વિદેશી ચલણ એક્સપોઝર નથી, તેથી વિદેશી મુદ્રા ડેરિવેટિવ્ઝ અને વિદેશી ચલણના એક્સપોઝરના સંદર્ભમાં બાકી એક્સપોઝર ૩૧.૦૩.૨૦૨૩ અને ૩૧.૦૩.૨૦૨૨ ના રોજ હેજ કરવામાં આવેલ નથી. અને તે લાગુ પડતું નથી.

૧૭. નાણાકીય સાધનો - હિસાબી વર્ગીકરણ અને યોગ્ય મૂલ્ય માપન

નાણાકીય અસ્કયામતો અને જવાબદારીઓના વ્યાજબી મૂલ્યો એ રકમ પર સમાવવામાં આવે છે કે જેના પર ઈન્સ્ટ્રુમેન્ટનું બે સંમતપક્ષો વચ્ચેના વર્તમાન વ્યવહારમાં વિનિમય થઈ શકે, બજારબંધીથી અથવા ફડચા વેચાણ સિવાય.

વ્યાજબી મૂલ્યોના અંદાજ માટે નીચેની પદ્ધતિઓ અને ધારણાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો:

૧. રોકડ અને ટૂંકા ગાળાની થાપણો, વેપાર અને અન્ય ટૂંકા ગાળાની પ્રાપ્તિઓ, વેપાર ચૂકવવાપાત્ર, અન્ય વર્તમાન જવાબદારીઓ આ સાધનોની ટૂંકા ગાળાની પરિપક્વતાને કારણે મોટે ભાગે તેમની વહન રકમ અંદાજિત કરે છે.

૨. વ્યાજ દરો અને સામાપક્ષની વ્યક્તિગત ધિરાણ યોગ્યતા જેવા પરિમાણોને આધારે કંપની દ્વારા નિશ્ચિત અને ચલ વ્યાજ દરો સાથે નાણાકીય સાધનોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. મૂલ્યાંકનના આધારે, આ લેણાંમાં અપેક્ષિત નુકસાન માટે જરૂરી જોગવાઈઓ કરવામાં આવે છે.

મૂલ્યાંકન તકનીક દ્વારા નાણાકીય સાધનોના વ્યાજબી મૂલ્યો નક્કી કરવા અને જાહેર કરવા માટે કંપની નીચેના પદાનુક્રમનો ઉપયોગ કરે છે:

સ્તર ૧: સમાન અસ્કયામતો અથવા જવાબદારીઓ માટે સક્રિય બજારોમાં અવતરણ (અસમાન) કિંમતો.

સ્તર ૨: અન્ય તકનીકો કે જેના માટે રેકોર્ડ કરેલા વ્યાજબી મૂલ્ય પર નોંધપાત્ર અસર ધરાવતા તમામ ઇનપુટ્સ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે અવલોકનક્ષમ છે.

(ii) ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધીના આંકડા

(₹ લાખમાં)

નાણાકીય સાધનો	નોટ નં.	વહન રકમ					યોગ્ય કિંમત			
		એફવીટીપીએલ	એફવીઓસીઆઇ	કુલ યોગ્ય મૂલ્ય	અણીકરણ	કુલ	સ્તર ૧	સ્તર ૨	સ્તર ૩	કુલ
ઊંચાઈ વર્તમાન સંપત્તિ										
નાણાકીય અસ્કયામતો										
(i) અન્ય નાણાકીય અસ્કયામતો	૭		-	-	૯.૫૦	૯.૫૦	-	-	-	-
વર્તમાન સંપત્તિ										
નાણાકીય અસ્કયામતો										
i) રોકાણ	૧૦	-	-	-	૨૩,૩૦૦.૦૦	૨૩,૩૦૦.૦૦	-	-	-	-
(ii) વેપાર લેણાં	૧૧	-	-	-	૩,૭૪૫.૩૩	૩,૭૪૫.૩૩	-	-	-	-
(iii) રોકડ અને રોકડ સમકક્ષ	૧૨	-	-	-	૧૦,૭૦૧.૦૩	૧૦,૭૦૧.૦૩	-	-	-	-
(iv) અન્ય નાણાકીય	૧૩	-	-	-	૬૮૫.૧૭	૬૮૫.૧૭	-	-	-	-
					૩૮,૪૪૧.૦૩	૩૮,૪૪૧.૦૩	-	-	-	-
ઊંચાઈ વર્તમાન જવાબદારીઓ										
નાણાકીય જવાબદારીઓ										
(i) અન્ય નાણાકીય જવાબદારીઓ	૧૯	-	-	-	૨૯૦.૨૯	૨૯૦.૨૯	-	-	-	-
વર્તમાન જવાબદારીઓ										
નાણાકીય જવાબદારીઓ										
(i) વેપાર લેણાં	૨૧	-	-	-	૨,૧૦૦.૩૨	૨,૧૦૦.૩૨	-	-	-	-
(ii) અન્ય નાણાકીય	૨૨	-	-	-	૯૩.૦૦	૯૩.૦૦	-	-	-	-
					૨,૧૯૩.૩૨	૨,૧૯૩.૩૨	-	-	-	-

(i) ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધીના આંકડા

(₹ લાખમાં)

નાણાકીય સાધનો	નોટ નં.	વહન રકમ					યોગ્ય કિંમત			
		એફવીટીપીએલ	એફવીઓસીઆઇ	કુલ યોગ્ય મૂલ્ય	ઝણીકરણ	કુલ	સ્તર ૧	સ્તર ૨	સ્તર ૩	કુલ
બિન વર્તમાન સંપત્તિ										
નાણાકીય અસ્કયામતો										
(ક) અન્ય નાણાકીય અસ્કયામતો	૭	-	-	-	૧૧.૬૫	૧૧.૬૫	-	-	-	-
વર્તમાન સંપત્તિ										
નાણાકીય અસ્કયામતો										
(ક) રોકાણ	૧૦	-	-	-	૨૫,૩૦૭.૪૮	૨૫,૩૦૭.૪૮	-	-	-	-
(ખ) વેપાર લેણાં	૧૧	-	-	-	૪,૩૬૭.૬૪	૪,૩૬૭.૬૪	-	-	-	-
(ગ) રોકડ અને રોકડ સમકક્ષ	૧૨	-	-	-	૬,૬૧૫.૧૪	૬,૬૧૫.૧૪	-	-	-	-
(ઘ) અન્ય નાણાકીય	૧૩	-	-	-	૪૩૪.૮૪	૪૩૪.૮૪	-	-	-	-
					૩૬,૭૩૬.૭૫	૩૬,૭૩૬.૭૫	-	-	-	-
બિન વર્તમાન જવાબદારીઓ										
નાણાકીય જવાબદારીઓ										
(ક) અન્ય નાણાકીય જવાબદારીઓ	૧૯	-	-	-	૨૯૭.૪૧	૨૯૭.૪૧	-	-	-	-
વર્તમાન જવાબદારીઓ										
નાણાકીય જવાબદારીઓ										
(ક) વેપાર લેણાં	૨૧	-	-	-	૧,૯૫૪.૫૯	૧,૯૫૪.૫૯	-	-	-	-
(ખ) અન્ય નાણાકીય	૨૨	-	-	-	૧૨૪.૭૫	૧૨૪.૭૫	-	-	-	-
					૨,૦૭૯.૩૪	૨,૦૭૯.૩૪	-	-	-	-

૧૮. નાણાકીય જોખમ સંચાલન

નિગમની મુખ્ય નાણાકીય જવાબદારીઓમાં વેપાર દેણા અને અન્ય નાણાકીય જવાબદારીઓ – ડીલરશીપ થાપણોનો સમાવેશ થાય છે. નિગમ પાસે કોઈ પણ પ્રકારનું ઉદ્યોગ નથી. ઊભી થતી નાણાકીય જવાબદારીઓનો ઉદ્દેશ નિગમની કામગીરીને નાણાં પૂરો પાડવાનો અને તેની કામગીરીને ટેકો આપવાની બાંધકામ આપવાનો છે. નિગમની નાણાકીય અસ્કયામતોમાં રોકાણ, વેપાર લેણાં, રોકડ અને રોકડ સમકક્ષ અને અન્ય નાણાકીય અસ્કયામતોનો સમાવેશ થાય છે જેમાં લેણાંપાત્ર સબસિડી, કર્મચારીઓ પાસેથી પુનઃપ્રાપ્તિ પાત્ર લેણાં અને અન્ય જે તેની કામગીરીમાંથી સીધી પ્રાપ્ત થાય છે. નિગમ નીચે દર્શાવ્યા મુજબ વિવિધ જોખમોનો સામનો કરી રહ્યું છે. નિગમની નાણાકીય જોખમ પ્રવૃત્તિઓ યોગ્ય નીતિઓ અને પ્રક્રિયાઓ દ્વારા સંચાલિત થાય છે અને તે નાણાકીય જોખમો નિગમની નીતિઓ અને જોખમના ઉદ્દેશો અનુસાર ઓળખવામાં આવે છે, માપવામાં આવે છે અને સંચાલિત થાય છે. નિદેશક મંડળ આ દરેક જોખમોના સંચાલન માટે નીતિઓની સમીક્ષા કરે છે અને સંમત થાય છે જેનો સારાંશ નીચે મુજબ છે:

બજાર જોખમ

બજારનું જોખમ એ જોખમ છે કે બજારના ભાવમાં ફેરફારને કારણે નાણાકીય સાધનના ભાવિ રોકડ પ્રવાહનું વ્યાજબી મૂલ્ય વધઘટ થાય છે. બજારના જોખમમાં બે પ્રકારના જોખમનો સમાવેશ થાય છે: વ્યાજ દર જોખમ અને ચલણ જોખમ. બજારના જોખમથી પ્રભાવિત નાણાકીય સાધનોમાં રોકાણનો સમાવેશ થાય છે.

માર્કેટ રિસ્ક મેનેજમેન્ટનો ઉદ્દેશ આપણા વિદેશી ચલણના વ્યવહારો અને વ્યાજ દરના જોખમને ટાળવાનો છે.

વ્યાજ દરનું જોખમ

વ્યાજ દરનું જોખમ એ જોખમ છે કે નાણાકીય સાધનનું વ્યાજબી મૂલ્ય અથવા ભાવિ રોકડ પ્રવાહ બજારના વ્યાજ દરોમાં ફેરફારને કારણે વધઘટ થાય છે. બજારના વ્યાજ દરોમાં ફેરફારના જોખમ માટે કંપનીનો સંપર્ક મુખ્યત્વે નિગમની નાણાકીય જવાબદારીઓ સાથે ચલ વ્યાજદર સાથે સંબંધિત છે. નિગમ સંતુલિત પોર્ટફોલિયો રાખીને તેના વ્યાજ દરના જોખમનું સંચાલન કરે છે. વધુમાં, નિગમ પાસે કોઈ નિશ્ચિત કે ચલ વ્યાજ દર ઉદ્યોગ નથી.

ચલણનું જોખમ

આમાં કોઈ ચલણનું જોખમ અસ્તિત્વમાં નથી કારણ કે નિગમની પ્રાથમિક વ્યાપારિક પ્રવૃત્તિઓ ભારતની અંદર છે અને તેમાં વિદેશી ચલણનો ઉપયોગ થતો નથી.

ક્રેડિટ જોખમ

ક્રેડિટ રિસ્ક એ કંપનીને નાણાકીય નુકસાનનું જોખમ છે જો ગ્રાહક અથવા નાણાકીય સાધનનો પ્રતિપક્ષ તેની કરારની જવાબદારીઓ પૂરી કરવામાં નિષ્ફળ જાય, અને મુખ્યત્વે ગ્રાહકો પાસેથી કંપનીના લેણાંમાંથી, ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ, બેંક બેલેન્સ, રોકાણ સિક્યોરિટીઝ અને અન્ય લેણાંમાંથી ઊભું થાય છે. ધિરાણ જોખમ ક્રેડિટ મંજૂરીઓ અને વ્યવસાયના સામાન્ય માર્ગમાં સતત ટેખરેખ દ્વારા સંચાલિત થાય છે. કંપની શંકાસ્પદ દેવા અને નબળાઈ માટે ભથ્થું સ્થાપિત કરે છે જે વેપાર અને અન્ય પ્રાપ્ય બાબતોમાં અપેક્ષિત ધિરાણ નુકશાનના અંદાજનું પ્રતિનિધિત્વ કરે છે. નીચે આવરી લેવામાં આવેલા તમામ નાણાકીય સાધનોના કિસ્સામાં ધિરાણ જોખમનો મહત્તમ સંપર્ક તેમની સંબંધિત વહન રકમ સુધી મર્યાદિત છે.

I. નાણાકીય સંપત્તિ કે જેના માટે નુકશાન ભથ્થું ૧૨ મહિનાની અપેક્ષિત ક્રેડિટ ખોટ (ECL) નો ઉપયોગ કરીને માપવામાં આવે છે (₹ લાખમાં)

વિગત	૩૧-૦૩-૨૦૨૩ ના રોજ	૩૧-૦૩-૨૦૨૨ ના રોજ
બિન -વર્તમાન નાણાકીય સંપત્તિ - અન્ય	૧૧.૬૫	૯.૫૦
વર્તમાન નાણાકીય સંપત્તિ - અન્ય	૪૩૪.૮૪	૬૮૫.૧૭
અન્ય વર્તમાન અસ્કયામતો	૩૩૫.૧૬	૩૭૪.૧૮
કુલ	૭૮૧.૬૫	૧,૦૬૮.૮૫

II. નાણાકીય સંપત્તિ કે જેના માટે નુકશાન ભથ્થું ૧૨ મહિના લાઇફ ટાઇમ અપેક્ષિત ક્રેડિટ લોસ (ECL) નો ઉપયોગ કરીને માપવામાં આવે છે. (₹ લાખમાં)

વિગત	૩૧-૦૩-૨૦૨૩ ના રોજ	૩૧-૦૩-૨૦૨૨ ના રોજ
વેપારી લેણાં	૪,૩૬૭.૬૪	૩,૭૪૫.૩૩
કુલ	૪,૩૬૭.૬૪	૩,૭૪૫.૩૩

આ બેંકોને સોંપવામાં આવેલી સારી ક્રેડિટ રેટિંગના કારણે બેંકો સાથેનું બેલેન્સ ઓછું ધિરાણ જોખમને આધીન છે.

III. આ લેણાંઓ (જોગવાઈની ચોખ્ખી) નું સામાયિક વિશ્લેષણ ઊંચ ચૂકવવાની તારીખથી ગણવામાં આવે છે (₹ લાખમાં)

વિગત	૩૧-૦૩-૨૦૨૩ના રોજ	૩૧-૦૩-૨૦૨૨ ના રોજ
૬ મહિના સુધી	૩,૫૪૩.૧૧	૧,૯૪૬.૫૩
૬ મહિનાથી ૧ વર્ષ	૪૬૨.૧૦	૧,૫૧૩.૫૦
૧ વર્ષ થી ૩ વર્ષ	૩૭૧.૪૩	૨૮૫.૩૦
૩ વર્ષથી વધુ	૦.૦૦	૦.૦૦
કુલ	૪,૩૭૬.૬૪	૩,૭૪૫.૩૩

IV. અપેક્ષિત ક્રેડિટ નુકસાન માટે ફરીથી “II” અને “III” ની જોગવાઈ

કંપની પાસે અસ્કયામતો છે જ્યાં પ્રતિ-પક્ષ જવાબદારીઓ પૂરી કરવા માટે પૂરતી ક્ષમતા ધરાવે છે અને જ્યાં ડિફોલ્ટનું જોખમ ઘણું ઓછું હોય છે. આથી પાછલા ડિફોલ્ટ દરો પર આધારિત, કંપની માને છે કે, ઉપર જણાવેલ નાણાકીય સંપત્તિના સંદર્ભમાં કોઈ અપેક્ષિત ધિરાણ નુકશાન જરૂરી નથી.

પ્રવાહિતા જોખમ

લિક્વિડિટી જોખમ એ જોખમ છે કે નિગમને તેની નાણાકીય જવાબદારીઓ સાથે સંકળાયેલી જવાબદારીઓ પૂરી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે જે રોકડ અથવા અન્ય નાણાકીય સંપત્તિ પહોંચાડીને સ્થાયી થાય છે. લિક્વિડિટીનું સંચાલન કરવા માટે નિગમનો અભિગમ, શક્ય હોય ત્યાં સુધી, તેની ખાતરી કરવા માટે છે. અસ્વીકાર્ય નુકસાન અથવા નિગમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યા વિના, સામાન્ય અને તણાવયુક્ત સ્થિતિમાં, જ્યારે તેઓ બાકી હોય ત્યારે તેની જવાબદારીઓ પૂરી કરવા માટે પૂરતી પ્રવાહિતા ધરાવે છે. નિગમ તેના ભંડોળની અછતના જોખમ પર નજર રાખે છે. નિગમોનો ઉદ્દેશ ઉપલબ્ધ ધિરાણ સુવિધાઓના ઉપયોગ દ્વારા ભંડોળની સાતત્યતા અને સુગમતા વચ્ચે સંતુલન જાળવવાનો છે. નિગમ પાસે પૂરતા પ્રમાણમાં ભંડોળના સ્ત્રોતોની ઉપલબ્ધતા છે અને ૧૨ મહિનાની અંદર પાકતી જવાબદારીઓ હાલના ધિરાણકર્તાઓને પૂરતી પ્રવાહિતા જાળવવામાં મદદ કરી શકે છે.

નાણાકીય જવાબદારીઓની પરિપક્વતા રૂપરેખા

નીચે આપેલ કોષ્ટક કરારની બિનહિસાબી ચુકવણીઓના આધારે રિપોર્ટિંગ તારીખે નાણાકીય જવાબદારીઓની બાકી કરારની પરિપક્વતા સંબંધિત વિગતો પ્રદાન કરે છે.

(₹ લાખમાં)

વિગત	૩૧-૦૩-૨૦૨૩ ના રોજ			૩૧-૦૩-૨૦૨૨ ના રોજ		
	એક વર્ષ કરતાં ઓછું	૧ થી ૫ વર્ષ	કુલ	એક વર્ષ કરતાં ઓછું	૧ થી ૫ વર્ષ	કુલ
બિન -વર્તમાન નાણાકીય જવાબદારીઓ - અન્ય	-	૨૯૭.૪૧	૨૯૭.૪૧	-	૨૯૦.૨૯	૨૯૦.૨૯
વર્તમાન નાણાકીય જવાબદારીઓ - ચૂકવવાપાત્ર	૧,૯૫૪.૫૯	-	૧,૯૫૪.૫૯	૨,૧૦૦.૩૨	-	૨,૧૦૦.૩૨
વર્તમાન નાણાકીય જવાબદારીઓ - વેપાર ચૂકવવાપાત્ર	૧૨૪.૦૦	-	૧૨૪.૦૦	૯૩.૦૦	-	૯૩.૦૦
કુલ	૨,૦૭૯.૩૪	૨૯૭.૪૧	૨,૩૭૬.૭૫	૨,૧૯૩.૩૨	૨૯૦.૨૯	૨,૪૮૩.૬૧

મૂડી વ્યવસ્થાપન

મૂડીનું સંચાલન કરતી વખતે નિગમોનો ઉદ્દેશ ચાલુ કામગીરીને સુનિશ્ચિત કરવાનો અને ઉદ્યોગની કિંમત ઘટાડવા, કોર્પોરેટ વ્યૂહરચનાને ટેકો આપવા અને શેરધારકોની અપેક્ષાઓ પૂરી કરવા માટે કાર્યક્રમ મૂડી માળખું જાળવવાનું છે. નિગમની નીતિ અપેક્ષિત ભંડોળ જરૂરિયાતોને પહોંચી વળવા માટે પ્રતિબદ્ધ ઉદ્યોગ સુવિધાઓ દ્વારા સમર્થિત બેન્કો / નાણાકીય સંસ્થાઓ દ્વારા ઉદ્યોગ લેવાની છે. જો કે, આવું કોઈ દેવું કરવાની જરૂરિયાત ઊભી થયેલ ન હતી. મૂડી માળખું નિયામક મંડળ દ્વારા મંજૂર નીતિઓ દ્વારા સંચાલિત થાય છે અને ભંડોળની જરૂરિયાતોની સમયાંતરે સમીક્ષા કરવામાં આવે છે.

કંપની ગિયરિંગ રેશિયોનો ઉપયોગ કરીને મૂડી પર નજર રાખે છે, જે કુલ દેવું છે જે કુલ મૂડી વત્તા દેવાથી વિભાજિત થાય છે.

કંપની પાસે કોઈ દેવું ન હોવાથી, ૩૧ માર્ચ, ૨૦૨૩ અને ૩૧ મી માર્ચ, ૨૦૨૨ ના રોજ ગિયરિંગ રેશિયો શૂન્ય છે.

(₹ લાખમાં)

વિગત	૩૧-૦૩-૨૦૨૩ ના રોજ	૩૧-૦૩-૨૦૨૨ ના રોજ
કુલ દેવું	-	-
ઈક્વિટી	૩૩,૮૫૦.૦૯	૩૧,૯૧૩.૧૪
મૂડી અને કુલ દેવું	૩૩,૮૫૦.૦૯	૩૧,૯૧૩.૧૪
ગિયરિંગ રેશિયો	૦.૦૦%	૦.૦૦%

૧૯. C&AG દ્વારા મેનેજમેન્ટ લેટર મારફત જારી કરવામાં આવેલ ટિપ્પણીઓ ધ્યાને લઈ હિસાબોમાં લાંબા સમયથી આગળ ધવાવવામાં આવતી અન્ય બિન-ચાલુ જવાબદારીઓ (નોંધ ૨૦) માંથી ₹ ૮.૭૨ લાખ (ગ.વ. શૂન્ય) ની રકમ અને અન્ય વર્તમાન જવાબદારીઓ (નોંધ ૨૩) માંથી ₹ ૧૯.૮૧ લાખ (ગ.વ. શૂન્ય) પાછી લખવામાં આવી છે.

૨૦. બેનામી મિલકતની વિગતો, જે કોઈ હોય તો અને તેના પર લેવાયેલી કાર્યવાહી

નિગમ પાસે કોઈ બેનામી અસ્કચામતો નથી અને તેથી રિપોર્ટિંગ તારીખ સુધી બેનામી ટ્રાન્જેક્શન્સ (પ્રોહિબિશન) એક્ટ, ૧૯૮૮ હેઠળ કોર્પોરેશન સામે કોઈ કાર્યવાહી શરૂ કે પેન્ડિંગ નથી.

૨૧. ધરાદાપૂર્વક ડિફોલ્ટર

નિગમને કોઈપણ બેંક અથવા નાણાકીય સંસ્થા અથવા અન્ય કોઈ ધિરાણકર્તા દ્વારા વિલક્ષુલ ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યું નથી.

૨૨. બંધ કંપનીઓ સાથે સંબંધ

નિગમે કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૨૪૮ અથવા કંપની અધિનિયમ, ૧૯૫૬ ની કલમ ૫૬૦ હેઠળ રદ કરેલ કંપની સાથે કોઈપણ વ્યવહારમાં પ્રવેશ કર્યો નથી અથવા વ્યવહાર બાકી નથી.

૨૩. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (ROC) સાથે ચાર્જની/પૂરા કરેલ ચાર્જની નોંધણી

નિયત સમયગાળા પછી રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (ROC) સાથે નોંધણી કરાવવાની બાકી હોય તેવી કોઈ ચાર્જ અથવા પૂરા કરેલ ચાર્જ નથી.

૨૪. કંપનીઓના બહુવિધ સ્તરોનું પાલન

નિગમે અન્ય કોઈ કંપનીમાં કોઈ રોકાણ કર્યું નથી અને તેથી કંપનીઝ (સ્તરોની સંખ્યા પર પ્રતિબંધ) નિયમો, ૨૦૧૭ સાથે વાંચવામાં આવેલા કાયદાની કલમ ૨ ની કલમ (૮૭) હેઠળ નિર્ધારિત નિયમો નિગમને લાગુ પડતા નથી.

૨૫. ઉદ્યોગ લીધેલા ભંડોળ અને શેર પ્રીમીયમનો ઉપયોગ

નિગમે વિદેશી સંસ્થાઓ (મધ્યસ્થીઓ) સહિત અન્ય કોઈપણ વ્યક્તિ અથવા એન્ટિટીને ઉદ્યોગ લીધેલા નાણાં અથવા શેર પ્રીમીયમ અથવા અન્ય કોઈ સ્રોત અથવા ફોર્મમાં કોઈપણ પ્રકારનું મળેલ ભંડોળ ઉદ્યોગ આપ્યું નથી અથવા ધિરાણ કર્યું નથી અથવા રોકાણ કર્યું નથી એ સમજણ સાથે કે મધ્યસ્થી:

(i) પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, કંપની (અંતિમ લાભાર્થીઓ) દ્વારા અથવા તેના વતી કોઈપણ રીતે ઓળખાયેલી અન્ય વ્યક્તિઓ અથવા સંસ્થાઓ માં ધિરાણ અથવા રોકાણ કરશે અથવા

(ii) કંપનીને અથવા તેના વતી કોઈપણ બાંધકારી, સુરક્ષા અથવા તેના જેવી પ્રદાન કરશે.

નિગમે વિદેશી સંસ્થાઓ (ફંડિંગ પાર્ટી) સહિત કોઈપણ વ્યક્તિ અથવા એન્ટિટી પાસેથી આ સમજણ સાથે કોઈ ભંડોળ પ્રાપ્ત કર્યું નથી કે કંપની:

(i) ફંડિંગ પાર્ટી (અંતિમ લાભાર્થી) દ્વારા અથવા તેના વતી કોઈપણ રીતે ઓળખાયેલી અન્ય વ્યક્તિઓ અથવા સંસ્થાઓને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ધિરાણ અથવા રોકાણ કરશે અથવા

(ii) અંતિમ લાભાર્થીઓને અથવા તેના વતી કોઈપણ ગેરંટી, સુરક્ષા અથવા તેના જેવી પ્રદાન કરશે.

૨૬. અધોષિત આવક સંબંધિત જાહેરાત

આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ હેઠળ કર આકારણીમાં વર્ષ દરમિયાન આવક તરીકે સરન્ડર કરવામાં આવ્યું હોય અથવા જાહેર કરવામાં આવ્યું ન હોય એવો કોઈ વ્યવહાર નથી.

૨૭. ક્રિપ્ટો કરન્સી અથવા વર્ચ્યુઅલ કરન્સીનું વર્ણન

નિગમે નાણાકીય વર્ષ દરમિયાન કોઈપણ ક્રિપ્ટો કરન્સી અથવા વર્ચ્યુઅલ કરન્સીમાં વેપાર કે રોકાણ કર્યું નથી.

૨૮. ગુણોત્તર

ગુણોત્તર	મીટર	છેદ	૨૦૨૨-૨૩	૨૦૨૧-૨૨	% માં તફાવત	જો ભિન્નતા ૨૫% થી વધુ હોય તો કારણ
વર્તમાન ગુણોત્તર (સમયમાં)	કુલ વર્તમાન સંપત્તિ	કુલ વર્તમાન જવાબદારીઓ	૩.૮૪	૩.૧૬	(૨૧.૫૧)%	-
ઋણ-ઘટ્ટિવટી રેશિયો (સમયમાં)	ઋણમાં ઉધાર અને લીઝ જવાબદારીઓનો સમાવેશ થાય છે	કુલ ઘટ્ટિવટી	૦.૦૦	૦.૦૦	-	-
ઋણ સેવા કવરેજ ગુણોત્તર (સમયમાં)	લોનની ચુકવણી માટેની કમાણી = કર પછીનો ચોખ્ખો નફો + નોન-કેશ ઓપરેટિંગ ખર્ચ વ્યાજ + અન્ય બિન-રોકડ ગોઠવણો	દેવું સેવા = વ્યાજ અને લીઝ ચુકવણી મુખ્ય ચુકવણીઓ	૦.૦૦૧૫૭	૦.૦૦૧૮૩	(૧૪.૨૭)%	-
ઘટ્ટિવટી ગુણોત્તર પર વળતર (% માં)	આ વર્ષનો નફો	સરેરાશ કુલ ઘટ્ટિવટી	૫.૮૮%	૭.૭૧%	(૨૩.૬૭)%	-
નેટ કેપિટલ ટર્નઓવર ગુણોત્તર (સમયમાં)	કામગીરીમાંથી આવક	સરેરાશ કાર્યકારી મૂડી (એટલે કે કુલ વર્તમાન સંપત્તિ બાદ કુલ વર્તમાન જવાબદારીઓ)	૦.૬૧	૦.૬૭	(૯.૯૨)%	-
ઈન્વેન્ટરી ટર્નઓવર ગુણોત્તર (સમયમાં)	વેચાયેલા માલની કિંમત	સરેરાશ ઈન્વેન્ટરી	૨.૫૪	૩.૧૬	(૧૯.૭૩)%	-
વેપાર પ્રાપ્તિપાત્ર ટર્નઓવર ગુણોત્તર (સમયમાં)	ચોખ્ખી ક્રેડિટ વેચાણ	સરેરાશ વેપાર પ્રાપ્ત્ય	૪.૮૫	૫.૧૩	(૫.૩૦)%	
ચોખ્ખો નફો ગુણોત્તર (% માં)	આ વર્ષનો નફો	કામગીરીમાંથી આવક	૯.૮૩%	૧૧.૫૨%	(૧૪.૬૮)%	
રોજગારી મેળવેલી મૂડી પર વળતર (% માં)	કર અને ફાઇનાન્સ ખર્ચ પહેલા નફો	કેપિટલ એમ્પ્લોઇડ = નેટ વર્થ+લીઝ જવાબદારીઓ + વિલંબિત કર જવાબદારીઓ	૭.૭૧%	૧૦.૩૨%	(૨૫.૨૪)%	લીઝ જવાબદારીઓમાં નોંધપાત્ર વધારો
રોકાણ પર વળતર (% માં)	રોકાણ કરેલા ભંડોળમાંથી પેદા થયેલી આવક	ટ્રેઝરી રોકાણોમાં રોકાણ કરેલ સરેરાશ રકમ	૫.૪૫%	૫.૩૦%	૨.૮૪%	-

૨૯. પાછલા વર્ષના આંકડાઓને ચાલુ વર્ષના આંકડાઓ સાથે સરખાવી શકાય તે માટે જરૂરી હોય ત્યાં ફરીથી જૂથબદ્ધ/પુનઃવર્ગીકૃત/પુનઃવ્યવસ્થિત કરવામાં આવ્યા છે. નીચેનું કોષ્ટક પાછલા વર્ષના આંકડાઓની વિગત રજૂ કરે છે જેને વર્તમાન વર્ષના વર્ગીકરણને અનુરૂપ જુથબદ્ધ/ પુનઃવર્ગીકૃત કરેલ છે.

(₹ લાખમાં)

નાણાકીય નિવેદન લાઇન આઇટમ અસરગ્રસ્ત	૩૧ માર્ચ, ૨૦૨૨ સુધીમાં		
(સરવૈયા)	અગાઉ રીપોર્ટ કરેલી રકમ	પુનઃવર્ગીકરણ / પુનઃવર્ગીકૃત રકમ	ચાલુ વર્ષમાં પુનઃરચના કરાયેલ રકમ
.આવક			
(ક)કામગીરીમાંથી આવક	૨૦,૯૦૨.૩૪	(૩૨૦.૮૬)	૨૦,૫૮૧.૪૮
(ખ) અન્ય નાણાકીય આવક	૧,૩૦૨.૧૯	૩૨૦.૮૬	૧,૬૨૩.૦૫

૩૦. દેવાદારો, લેણદારો, લોન અને એડવાન્સ, અનુદાન, સબસિડી વગેરેનું બેલેન્સ પુષ્ટિ અને સમાધાનને આધીન છે.

૩૧. ₹ ૦.૦૦ (ગ.વ. ₹ ૪.૦૩ લાખ) નું અગાઉના સમયગાળાનું એડજસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે. (નોંધ ૧૭ જુઓ)

આ સાથે જોડેલા સમાન તારીખના અમારા અહેવાલ મુજબ
મુકેશકુમાર જૈન એન્ડ કું. વતી
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ
(પેઠી રજી. નં. ૧૦૬૬૧૯W)

રાજીત તીલ્લાની
(ભાગીદાર)
સભ્યપદ નં. : ૪૦૫૬૬૨
યુડીઆઈએન : ૨૩૪૦૫૬૬૨BGUNPQ૨૨૦૭

સ્થળ : અમદાવાદ
તારીખ : ૨૬-૦૬-૨૦૨૩

નિયામક મંડળ અને એમના વતી

એ. કે. રાકેશ, IAS
અધ્યક્ષ
(DIN:૦૦૬૩૮૧૯)

એસ. એન. દેવડા
(મેનેજર નાણા)

પી. એસ. રબારી
વહીવટી નિયામક
(DIN:૮૯૯૬૭૬૫)

કે. એમ. રાવલ
(કંપની સેક્રેટરી)

સ્થળ : ગાંધીનગર
તારીખ : ૨૬-૦૬-૨૦૨૩



ગુરાબીનિ®

ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ

રજીસ્ટર્ડ કાર્યાલય : “બીજ ભવન”, સેક્ટર-૧૦-એ,
ગાંધીનગર - ૩૮૨૦૧૦, Email : info@gurabini.com
Website : www.gurabini.com

←

Government Report on functioning of Gujarat State Seeds Corporation Limited and Annual Accounts review for the year ended 31-03-2023.

- (1) This Corporation was incorporated on 16/04/1975 as per provisions of Companies Act. 1956 and commenced its business from 15/11/1975.
- (2) The main objective of the Corporation as set out in the Memorandum & Articles of Association is to develop the seed industry in the State of Gujarat and to provide quality seeds to the farming community in adequate quantities at reasonable rates.
- (3) During the period of review, the authorized share capital of the Corporation is of **Rs. 400 lacs** and paid up capital stood at **Rs. 393 lacs** out of which State Government is holding shares of **Rs. 375 lacs** and Central Government is holding shares of **Rs. 18 lacs**.
- (4) The Corporation has sold **2,49,322.99** quintals of various seeds during the year 2022-23.
- (5) The Corporation has earned net profit after tax of **Rs.1934.99** lacs during the financial year 2022-23.
- (6) The Balance Sheet, Profit & Loss Account, Audit Report etc. for the financial year ended on **31/03/2023** are annexed herewith.
- (7) M/s Mukeshkumar Jain & Co., Chartered Accountants, Ahmedabad have audited the accounts of the Corporation for the financial year ended on **31/03/2023**.




Additional Chief Secretary
Govt. of Gujarat
Agriculture, Farmers Welfare & Co-Operation Department
Sachivalay, Gandhinagar

47th

Annual Report & Accounts 2022-23



**GUJARAT STATE SEEDS
CORPORATION LIMITED**

ગુરાબીંતિ®

CONTENTS

Sr. No.	Particulars	Page No.
1.	Corporation Information	2
2.	Directors' Report	3
3.	Comments of the Comptroller and Auditor General of India	12
4.	Independent Auditor's Report	13
5.	Balance Sheet	26
6.	Statements of Profit & Loss	27
7.	Cash Flow Statement	29
8.	Notes to the Financial Statements	32

CORPORATION INFORMATION

(As on 31.03.2023)

Chairman :

Shri Manish Bharadwaj, IAS
Shri Mukesh Puri, IAS

07.11.2020 to 26.04.2022
26.04.2022 to Till Date

Managing Director :

Shri P. S. Rabari

05.12.2020 to Till Date

Directors :

Dr. P. M. Vaghasiya
Kum Kanan H. Pandya
Shri D. B. Nimavat
Dr. K. B. Kantharia
Shri S. J. Solanki
Shri Yamal Vyas (Independent Director)

12.01.2018 to Till Date
17.10.2020 to Till Date
27.10.2020 to Till Date
18.11.2021 to Till Date
22.01.2022 to Till Date
11.10.2022 to Till Date

Manager Finance :

Shri S. N. Deora

Company Secretary :

Shri K. M. Raval

Statutory Auditors :

Mukeshkumar Jain & Co, Chartered Accountants, Ahmedabad

Bankers :

Punjab National Bank

Registered Office :

“Beej Bhavan”, Sector-10-A,
Gandhinagar-382010, Gujarat

Website :

www.gurabini.com

Company Identification Number :

U65410GJ1975SGC002693

DIRECTORS' REPORT

To,
The Members,

The directors have pleasure in presenting the 47th Annual Report together with audited statement of accounts for the year ended 31st March 2023.

SHARE CAPITAL:

The paid up equity share capital as on 31st March 2023 stood at ₹ 393 lacs out of which Government of Gujarat have contributed ₹ 375 lacs and ₹ 18 lacs from Government of India.

FINANCIAL RESULTS:

(₹ in Lakhs)

Particulars	2022-2023	2021-2022
Profit before depreciation and taxation	2734.78	3444.61
Less : Depreciation	(150.71)	(176.58)
Profit before taxation & Dividend	2584.07	3268.03
Less : Provision for Taxation	(649.08)	(897.40)
Surplus available for appropriation	1934.99	2370.63
Less : Dividend & Dividend Distribution Tax	(39.30)	(39.30)
Less : Re-measurement of defined benefit plan	48.34	(4.87)
Transfer to General Reserve	1944.03	2326.46

DIVIDEND:

The Board of Directors of the Corporation pleased to recommends dividend @ ₹ 151/- (i.e. 151%) per equity shares on the paid up equity share capital of ₹ 393 lacs for the financial year ended on 31st March 2023.

PRODUCTION AND SALE:

The Corporation is organizing the production programs for more than 24 crops consisting approx 101 varieties of oil seeds, cereals, cash crops, pulses spices etc., on farmers field. The Corporation has produced / procured 2,71,276.02 qtls. of seeds amounting to ₹16,869.07 lacs during the year under report as against 2,90,991.49 qtls. of seeds produced / procured amounting to ₹ 16,098.62 lacs during the last year. The corporation has sold 2,49,322.99 qtls. of seeds amounting to ₹ 19,690.53 lacs during the year as against 2,85,882.12 qtls. of seeds amounting to ₹ 20,581.49 lacs sold during the last year.

QUALITY CONTROL:

GSSC has its own infrastructure to facilitate the testing of the seeds samples at a internal quality control mechanism. The quality control staff of the Corporation exercises the quality control measures at the field stage, processing / packing stage and also during storage period in order to ensure that only good quality seeds are supplied to the farmers.

MARKETING & PACKING:

During the period under report, the Corporation has sold seeds of value for ₹ 1.79 lacs in Out State as against ₹276.43 lacs during the previous year.

There is a network of more than 1481dealers for distribution of seeds in the State which includes village co-operative societies, Taluka &district co-operative Purchase and Sale Union, Private Agencies etc., besides 29 Distributors in Rajasthan, Madhya Pradesh, Haryana, Maharashtra, Bihar & West Bengal.

INFORMATION ABOUT SUBSIDIARY / JV / ASSOCIATE COMPANY:

Corporation does not have any Subsidiary, Joint Venture or Associate Company.

MATERIAL CHANGES AND COMMITMENTS:

No material changes and commitments affecting the financial position of the Corporation occurred between the ends of the financial year to which these financial statements relate on the date of this report.

THE EXTRACT OF ANNUAL RETURN:

The Extract of Annual Return as required under section 92(3) of the Companies Act, 2013 and rule 12(1) of the Companies (Management and Administration) Rules, 2014 is placed at www.gurabini.com for your kind perusal and information

MEETING OF THE BOARD OF DIRECTORS:

During the Financial Year 2022-23, the Corporation held 4 Board meetings of the Board of Directors as per Section 173 of Companies Act, 2013 which is summarized below. The provisions of Companies Act, 2013 were adhered to while considering the time gap between two meetings.

S No.	Date of Meeting	Board Strength	No. of Directors Present
01	27.04.2022	7	6
02	27.07.2022	7	7
03	15.09.2022	7	5
04	26.12.2022	8	7

DIRECTORS' RESPONSIBILITY STATEMENT:

Pursuant to Section 134(5) of the Companies Act, 2013 the Board of Directors of the Corporation confirms that-

- (i) that in the preparation of the annual accounts, the applicable accounting standards had been followed along with proper explanation relating to material departures;
- (ii) that the directors had selected such accounting policies and applied them consistently and made judgments and estimates that are reasonable and prudent so as to give a true and fair view of the state of affairs of the Corporation at the end of the financial year and of the profit or loss of the Corporation for the period;
- (iii) that the directors had taken proper and sufficient care for the maintenance of adequate accounting records in accordance with the provisions of this act for safeguarding the assets of the Corporation and for preventing and detecting fraud and other irregularities;
- (iv) that the directors had prepared the annual accounts on a going concern basis;
- (v) Corporation being unlisted sub clause (e) of section 134(5) is not applicable.

- (vi) The directors had devised proper systems to ensure compliance with the provisions of all applicable laws and that such systems were adequate and operating effectively.

EXPLANATION ON AUDITORS REPORTS' QUALIFICATION:

The explanation to the qualifications in the Auditors Report are as follows:

1. During the current year the company had a liability of ₹ 84.17 lacs towards CSR Expenditure under section 135 of the companies act. The company could only spend ₹ 67.43 lacs in the financial year ending 31 March 2023, there by leaving a shortfall of ₹ 16.74 lacs.

Explanation

The Corporation had allocated 84.17 lacs for F.Y. 2022-23, of which an amount of 16.74 lacs was sanctioned for F.Y. 2023-24 for an ongoing project. Hence, the same was not released till 31.03.2023. The same will be released in F.Y. 2023-24. Also, since the amount is already allocated for the project and the funds are to be released in F.Y. 2023-24, the same are not transferred to a separate bank account.

2. The company has adopted policy for booking of Interest on the funds received from Government for various schemes in profit and loss account. During the current year company has adopted same policy of crediting interest earned to profit & loss account. As explained by the management although the company is using PFMS for grant disbursement and transfer of interest, but in the absence of quantification of interest on earlier accumulated balances is not possible hence the effect on Statement of Profit and Loss could not be ascertained.

Explanation

The Corporation is working as a Nodal agency for disbursement of subsidies to the beneficiaries for various schemes of Directorate of Agriculture. Since, last two years, the PFMS platform is used for disbursal of subsidies through SNA for various Central Sector Schemes. Also, the interest credit is paid back to Central Government and State Government in the proportion of contribution. The funds in the other State Government Schemes are for the current year liabilities, which are to be paid on receipt of the payment instructions from the field offices of Director of Agriculture. The balances are not unspent scheme balances. The unspent balance at the end of the year is intimated to the Director of Agriculture. The decision as to surrender or revalidation of the schemes balance of the next year is taken by the Director of Agriculture. The balance fund remains deposited with Gujarat State Financial Services Limited along with own fund of the Corporation. The interest earned on total funds is recognized as the interest income. The said practice is being consistently followed by the Corporation.

Also no administrative charge is being collected by the Corporation for carrying out the activity of disbursing subsidy funds. The existing staff of the Corporation has to carry out the subsidy disbursement function apart from their regular work of the Corporation. The charge if any collected will be directly reduced from the scheme balance.

LOANS, GUARANTEES AND INVESTMENTS:

There were no loans, guarantees or investments made by the Corporation under Section 186 of the Companies Act, 2013 during the year under review and hence the said provision is not applicable.

RELATED PARTY TRANSACTIONS

There are no related party transactions made by the Company during the financial year 2022-23 which requires reporting under Companies Act 2013.

BENEFITS:

The activities of the Corporation in the State has assured the reasonable return to seed growing farmers and availability of quality seeds at reasonable rate to the seed using farmers at all times and throughout the state.

CONSERVATION OF ENERGY, TECHNOLOGY ABSORPTION AND FOREIGN EXCHANGE OUTGO:**(A) Conservation of energy and Technology absorption:**

Corporation has installed Solar Rooftop at Head Office Gandhinagar & Solar Street Light at Godhra and Nadiad Godown to conserve the Energy. Corporation has also installed latest Seed Processing Machinery at Nadiad Godown Complex to improve the seed quality during processing through adoption of new technology.

(B) Foreign exchange earnings and Outgo:

There were no foreign exchange earnings and outgo during the year under review.

RISK MANAGEMENT:

The Corporation has approved Risk Management Policy.

DIRECTORS:

During the period under review, the following directors constituted the Board of Directors of the corporation.

Sr. No.	Name of Director	Designation	From	To
1	Shri Manish Bharadwaj, I.A.S.	Chairman	07.11.2020	26.04.2022
2	Shri Mukesh Puri, I.A.S.	Chairman	26.04.2022	Till date
3	Dr. P. M. Vaghasiya	Director	12.01.2018	Till date
4	Kum Kanan H. Pandya	Director	17.10.2020	Till date
5	Shri D. B. Nimavat	Director	27.10.2020	Till date
6	Shri P. S. Rabari	Managing Director	05.12.2020	Till date
7	Dr. K. B. Kantharia	Director	18.11.2021	Till date
8	Shri S. J. Solanki	Director	22.01.2022	Till date
9	Shri Yamal Vyas	Independent Director	11.10.2022	Till date

(Status as on 31.03.2023)

DEPOSITS:

The Corporation has not accepted any deposits during the year.

CORPORATE SOCIAL RESPONSIBILITY:

As per Section 135(5) of the Companies Act, 2013 and Rule 8 of the Companies (Corporate Social Responsibility Policy) Rules, 2014 and schedule VII of the Companies Act, 2013, the Corporation has duly constituted CSR Committee and formulated the CSR Policy. CSR Committee has recommended ₹84.17 Lac for the financial year 2022-23 for CSR Activities in its meeting held on 28.11.2022. Board of Directors has also approved the funds of ₹84.17 lac and authorize the CSR Committee to spend the funds on CSR Activities in its meeting held on 26.12.2022. CSR Committee in its meeting dtd. 16.01.2023 sanctioned (1) ₹ 40.00 Lac to Institute of Kidney Disease & Research Centre for establishment of Dialysis Centre at Jasdan & Vichhiya in Rajkot District (2) ₹ 5.00 Lac to B. M. Institute of Mental Health for Rehabilitation Project for mentally Disturbed College Students program (3) ₹ 33.55 Lac to N. M. Sadguru Water & Development Foundation, Dahod for Fodder Production program using

hydroponic technology (4) ₹ 5.62 Lac to Commissioner of Health, Medical Services & Medical Education for Establishment of Special Newborn Care Unit at Morbi Dist. Hospital. The annual report on CSR activities to be included in Board's Report is placed as **Annexure 2** of Directors Report is forming part of this Report.

THE SEXUAL HARASSMENT OF WOMEN AT THE WORKPLACE:

There has been no such incidence in the corporation during the financial year.

ANNUAL EVALUATION:

The provision of section 134(3) (p) relating to Board evaluation is not applicable on the Corporation.

INDEPENDENT DIRECTORS:

Shri Yamal Vyas and Shri Vijay Paul Sharma has been appointed as the independent directors of the Company as per Section 149(10) of the Companies Act, 2013 on 11.10.2022 for a term of 5 consecutive years on the Board of the Company. However, Shri Vijay Paul Sharma being chairman of CACP has not accepted the appointment on the Board of the Corporation. Corporation has approached the Government of Gujarat for new appointment, which is awaited.

The Board of Directors of the Company hereby confirms that Shri Yamal Vyas duly appointed by the Company have given the declaration and they meet the criteria of independence as provided under section 149(6) of the Companies Act, 2013.

NOMINATION AND REMUNERATION COMMITTEE:

As per the section 178(1) of the Companies Act, 2013 the Corporation's Nomination and Remuneration Committee comprises of three Non-executive Directors. The table sets out the composition of the Committee:

Name of the Director	Position held in the Committee	Category of the Director
Shri P. S. Rabari	Chairman	Managing Director
Shri D. B. Nimavat	Member	Non Executive Director
Shri Yamal Vyas	Member	Non Executive Independent Director
Kum Kanan Pandya	Member	Non Executive Director

Terms of Reference

The terms of reference of the Nomination and Remuneration Committee is as per the scope defined in Section 178 of the Companies Act, 2013 as application to the corporation from time to time.

REMUNERATION POLICY:

Remuneration to Executive Director:

Corporation being a Govt. of Gujarat undertaking remuneration of the executive director namely Managing Director is as per the Govt. norms.

Remuneration to Non Executive Director:

Corporation being a Govt. of Gujarat undertaking remuneration to the Non-executive directors is being paid in the form of sitting fees which is decided by the Govt. from time to time. The Non-Executive directors are paid sitting fees for each meeting of the Board and committee of directors attended by them. The sitting fees of Govt. Nominee Non- Executive Director are deposited in treasury as per the Govt. Order.

AUDIT COMMITTEE:

According to Section 177 of the Companies Act, 2013 the Corporation's Audit Committee comprised of 3 directors. The Board has accepted the recommendations of the Audit Committee. The table sets out the composition of the Committee:

Name of the Director	Position held in the Committee	Category of the Director
Shri Yamal Vyas	Chairman	Independent Director
Shri S. J. Solanki	Member	Non Executive Director
Shri D. B. Nimavat	Member	Non Executive Director

STAFF WELFARE AND RELATIONS:

The Corporation has continued to grant House Building, Vehicle and other advances to employees to meet their requirements.

The performance of the Corporation during the year under review was the result of dedicated and sincere efforts of employees at all the levels and very cordial relations maintained with staff during the year. Progress of Corporation is due to sincere efforts of the employees.

AUDITORS:

The accounts of current year have been audited by M/s Mukeshkumar Jain & Co., Chartered Accountants, Ahmedabad who were appointed as statutory auditors by the Government of India in consultation with the Comptroller and Auditor General of India.

ACKNOWLEDGEMENTS:

Your Directors are grateful to the Government of India, Government of Gujarat, State Agricultural Universities, Director of Agriculture, Director of Horticulture, Director – Gujarat State Seed Certification Agency, Indian Council of Agricultural Research, Gujarat Biotechnology Research Centre, Gujarat Agro Industries Corp. Ltd., National Seeds Corporation Ltd., Maharashtra State Seeds Corporation Ltd, various Co-operative Societies, Dealers, Farmers and contract seed growers and seed consumers for their whole hearted co-operation and patronage. Your directors have great pleasure in acknowledging the sustained, dedicated and devoted service rendered by all the staff members of the Corporation throughout the year.

On behalf of the Board of Director's

Sd/-

A. K. Rakesh, IAS

Chairman

Place: **Gandhinagar**

Date: **26/09/2023**

[ANNEXURE - II]

**Format For The Annual Report on CSR Activities to be Included in the Board's Report
For Financial Year Commencing on or After 1st Day of April, 2020**

1. Brief outline on CSR Policy of the Company.

Gujarat State Seeds Corporation Limited (GSSCL) is engaged in the field of production, processing & distribution of quality seeds to the farmers at reasonable rate. GSSCL is committed to the cause of socio-economic development of farmers of Gujarat. GSSCL is committed to perform its social responsibility specially to the Rural Community of the State in the areas as prescribed in Schedule 7 of Companies Act 2013 Item No.1 to 10. The CSR Policy of the Corporation is also available on its web site:- www.gurabini.com

2. Composition of CSR Committee :

Sl. No.	Name of the Director	Designation / Nature of Directorship	Number of meetings of CSR Committee held during the year	Number of meetings of CSR Committee attended during the year
1	Shri Mukesh Puri, IAS	Chairman	2	2
2	Shri P. S. Rabari	Managing Director	2	2
3	Shri D. B. Nimavat	Director	2	2
4	Shri Yamal Vyas	Independent Director	1	0

3. Provide the web-link where Composition of CSR committee, CSR Policy and CSR projects approved by the board are disclosed on the website of the company. www.gurabini.com
4. Provide the details of Impact assessment of CSR projects carried out in pursuance of sub-rule (3) of rule 8 of the Companies (Corporate Social responsibility Policy) Rules, 2014, if applicable (attach the report). **NOT APPLICABLE**
5. Details of the amount available for set off in pursuance of sub-rule (3) of rule 7 of the Companies (Corporate Social responsibility Policy) Rules, 2014 and amount required for set off for the financial year, if any

Sr No.	Financial Year	Amount available for set off from proceeding financial years (in ₹.)	Amount required to be for set off for the financial year, if any (in ₹.)
1.	2021-2022	0.00	0.00
2.	2020-2021	0.00	0.00
3.	2019-2020	0.00	0.00
4.	Total	0.00	0.00

6. Average net profit of the company as per section 135(5). ₹ 42.08 Crore
7. (a) Two percent of average net profit of the company as per section 135(5) ₹ 84.17 Lacs
 (b) Surplus arising out of the CSR projects or programmes or activities of the previous financial years. ₹ 00.00
 (c) Amount required to be set off for the financial year, if any : ₹ 00.00
 (d) Total CSR obligation for the financial year (7a+7b-7c). ₹ 84.17 Lacs
8. (a) CSR amount spent or unspent for the financial year: (₹ in Lakhs)

Total Amount spent for the Financial year	Amount Unspent				
	Total Amount transferred to Unspent CSR Account as per section 135(6).		Amount transferred to any fund specified under Schedule VII as per second proviso to section 135(5).		
	Amount	Date of transfer	Name of the Fund	Amount	Date of transfer
67.43*	00.00	N.A.	N.A.	N.A.	N.A.

* The amount of ₹ 16.74 lacs was sanctioned for F.Y. 2023-24 for an ongoing project mentioned at Sr. No. 3 in below table, Hence the same was not released till 31.03.2023. The same will be released in F.Y. 2023-24.

(b) Details of CSR amount spent against ongoing projects for the financial year:

(₹ in Lakhs)

(1) Sr No.	(2) Name of the Project.	(3) Item from the list of activities in Schedule VII to the Act	(4) Local area (Yes/No).	(5) Location of the project.		(6) Project duration.	(7) Amount allocated for the project	(8) Amount spent in the current financial Year	(9) Amount transferred to Unspent CSR Account for the project as per Section 135(6)	(10) Mode of Implementation - Direct (Yes/No).	(11) Mode of Implementation - Through Implementing Agency	
				State	District.						Name	CSR Registration number.
1.	Establishment of Dialysis Centre	Point No. 1	Yes	Rajkot / Gujarat	2022-23 & 2023-24	40.00	40.00	0.00	No	Institute of Kidney Disease & Research Centre	-	
2.	Rehabilitation Project for mentally Disturbed College Students Program	Point No. 1	Yes	Ahmedabad/ Gujarat	2022-23 & 2023-24	5.00	00.00*	0.00	No	B. M. Institute of Mental Health	-	
3.	Fodder Production program using hydroponic technology	Point No. 4	Yes	Dahod/ Gujarat	2022-23 & 2023-24	33.55	00.00*	0.00	No	N. M. Sadguru Water & Development Foundation, Dahod	-	
4.	Establishment of Special Newborn Care Unit	Point No. 1	Yes	Morbi/ Gujarat	2022-23 & 2023-24	5.62	00.00*	0.00	No	Commissioner of Health, Medical Services & Medical Education	-	
	TOTAL					84.17	40.00	0.00				

* The funds were allocated to the implementing agencies, however the same are not utilised by the agencies as on 31.03.2023.

(c) Details of CSR amount spent against **other than ongoing projects** for the financial year:

(1) Sl. No.	(2) Name of the Project	(3) Item from the list of activities in schedule VII to the Act.	(4) Local area (Yes/ No).	(5) Location of the project.		(6) Amount spent for the project (in ₹.).	(7) Mode of implementation - Direct (Yes/No).	(8) Mode of implementation - Through implementing agency.	
				State	District			Name	CSR registration number.
1.	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil		
2.	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil		
	TOTAL								

(d) Amount spent in Administrative Overheads: ₹ 00.00

(e) Amount spent on Impact Assessment, if applicable **NOT APPLICABLE**(f) Total amount spent for the Financial Year (8b+8c+8d+8e): ₹ **84.17 Lacs**

(g) Excess amount for set off, if any

(₹ in Lakhs)

Sr.No.	Particular	Amount
(i)	Two percent of average net profit of the company as per section 135(5)	84.17
(ii)	Total amount spent for the financial year	67.43
(iii)	Excess amount spent for the financial year [(ii)-(I)]	00.00
(iv)	Surplus arising out of the CSR projects or programmes or activities of the previous financial years, if any	00.00
(v)	Amount available for set off in succeeding financial years [((iii)-(iv)]	00.00

9. (a) Details of unspent CSR amount for the preceding three financial years:

Sr No.	Preceding Financial Year	Amount transferred to Unspent CSR Account under section 135 (6) (in ₹)	Amount spent in the reporting Financial Year (in ₹).	Amount transferred to any fund specified under Schedule VII as per section 135(6), if any.			Amount remaining to be spent in succeeding financial years. (in ₹)
				Name of the Fund	Amount (in ₹).	Date of transfer.	
1.	2021-22	00.00	00.00	N.A.	00.00	N.A.	00.00
2.	2020-21	00.00	00.00	N.A.	00.00	N.A.	00.00
3.	2019-20	00.00	00.00	N.A.	00.00	N.A.	00.00
	TOTAL	00.00	00.00	N.A.	00.00	N.A.	00.00

- (b) Details of CSR amount spent in the financial year for ongoing projects of the preceding financial year(s):

(1)	(2)	(3)	(4)	(5)	(6)	(7)	(8)	(9)
Sr No.	Project ID.	Name of the Project.	Financial Year in which the project was commenced.	Project duration.	Total amount allocated for the project (in ₹).	Amount spent on the project in the reporting Financial Year (in ₹).	Cumulative amount spent at the end of reporting Financial Year. (in ₹)	Status of the project - Completed /Ongoing.
1.	N.A.	N.A.	N.A.	N.A.	N.A.	N.A.	N.A.	N.A.
2.	N.A.	N.A.	N.A.	N.A.	N.A.	N.A.	N.A.	N.A.
3.	N.A.	N.A.	N.A.	N.A.	N.A.	N.A.	N.A.	N.A.
	TOTAL	N.A.	N.A.	N.A.	N.A.	N.A.	N.A.	N.A.

10. In case of creation or acquisition of capital asset, furnish the details relating to the asset so created or acquired through CSR spent in the financial year: **NOT APPLICABLE**

(asset-wise details).

- (a) Date of creation or acquisition of the capital asset(s): **NOT APPLICABLE**
- (b) Amount of CSR spent for creation or acquisition of capital asset. **NOT APPLICABLE**
- (c) Details of the entity or public authority or beneficiary under whose name such capital asset is registered, their address etc. **NOT APPLICABLE**
- (d) Provide details of the capital asset(s) created or acquired (including complete address and location of the capital asset). **NOT APPLICABLE**
11. Specify the reason(s), if the company has failed to spend two per cent of the average net profit as per section 135(5). – As mentioned above, the Corporation had allocated ₹ 84.17 lacs for F.Y. 2022-23, of which an amount of ₹ 16.74 lacs was sanctioned for F.Y. 2023-24 for an ongoing project. Hence, the same was not released till 31.03.2023. The same will be released in F.Y. 2023-24.

Managing Director

Chairman CSR Committee

COMMENTS OF THE COMPTROLLER AND AUDITOR GENERAL OF INDIA UNDER SECTION 143(6)(b) OF THE COMPANIES ACT, 2013 ON THE FINANCIAL STATEMENTS OF GUJARAT STATE SEEDS CORPORATION LIMITED., GANDHINAGAR FOR THE YEAR ENDED 31 MARCH 2023

The preparation of financial statements of Gujarat State Seeds Corporation Ltd., Gandhinagar, for the year ended 31 March 2023 in accordance with the financial reporting framework prescribed under the Companies Act, 2013 (Act.) is the responsibility of the management of the Company. The statutory auditor appointed by the Comptroller and Auditor General of India under section 139(5) of the Act is responsible for expressing opinion on the financial statements under Section 143 of the Act based on independent audit in accordance with the standards on auditing prescribed under section 143(10) of the Act. This is stated to have been done by them vide their Audit Report dated **26 September 2023**.

I, on behalf of the Comptroller and Auditor General of India, have conducted a supplementary audit of the financial statements of Gujarat State Seeds Corporation Ltd., Gandhinagar, for the year ended 31 March 2023 under section 143(6)(a) of the Act. This supplementary audit has been carried out independently without access to the working papers of the statutory auditors and is limited primarily to inquiries of the statutory auditors and company personnel and a selective examination of some of the accounting records.

On the basis of my supplementary audit nothing significant has come to my knowledge which would give rise to any comment upon or supplement to Statutory auditors' report under section 143 (6)(b) of the Act.

**For and on behalf of the
Comptroller & Auditor General of India**

**Place : Rajkot
Date : 01/12/2023**

**(R. K. Solanki)
Accountant General (Audit-I)
Gujarat, Rajkot**

INDEPENDENT AUDITOR'S REPORT

To the Members

GUJARAT STATE SEEDS CORPORATION LIMITED

Report on the Audit of the Financial Statements

Opinion

We have audited the Ind AS Financial Statements of GUJARAT STATE SEEDS CORPORATION LIMITED (“the Company”), which comprise the Balance Sheet as at 31 March 2023 and the statement of Profit and Loss (including other comprehensive income), statement of changes in equity and statement of cash flows for the year then ended, and notes to the Financial Statements, including a summary of the significant accounting policies and other explanatory information (hereinafter referred to as “the Ind AS Financial Statements”).

In our opinion and to the best of our information and according to the explanations given to us, the aforesaid Ind AS Financial Statements give the information required by the Companies Act, 2013 (the “Act”) in the manner so required and give a true and fair view in conformity with the Indian Accounting Standards prescribed under Section 133 of the Act read with the Companies (Indian Accounting Standards) Rules, 2015, as amended, (“Ind AS”) and other accounting principles generally accepted in India, of the state of affairs of the Company as at 31st March 2023, and its profit and other comprehensive income, changes in equity and its cash flows for the year ended on that date.

Basis for Opinion

We conducted our audit in accordance with the Standards on Auditing (SAs) specified under section 143(10) of the Companies Act, 2013. Our responsibilities under those Standards are further described in the Auditor's Responsibilities for the Audit of the Ind AS Financial Statements section of our report. We are independent of the Company in accordance with the Code of Ethics issued by the Institute of Chartered Accountants of India (“ICAI”) together with the ethical requirements that are relevant to our audit of the Ind AS Financial Statements under the provisions of the Act and the Rules there under, and we have fulfilled our other ethical responsibilities in accordance with these requirements and the ICAI's Code of Ethics.

We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our qualified audit opinion on the financial statements.

Basis for Qualified Opinion

During the current year the company had a liability of ₹ 84.17 lacs towards CSR Expenditure under section 135 of the companies act. The company could only spend ₹ 67.43 lacs in the financial year ending 31 March 2023, there by leaving a shortfall of ₹ 16.74 lacs.

The company has adopted policy for booking of Interest on the funds received from Government for various schemes in profit and loss account. During the current year company has adopted same policy of crediting interest earned to profit & loss account. As explained by the management although the company is using PFMS for grant disbursement and transfer of interest, but in the absence of quantification of interest on earlier accumulated balances is not possible hence the effect on Statement of Profit and Loss could not be ascertained.

Emphases Matter

Without qualifying our opinion, we draw attention to:

- 1) Note No. 36(7) notes forming part of account with regard to misappropriation of funds by an employee of the Corporation involving alleged negligence on the part of State Bank of India in honoring the duplicate cheques. The matter is still under investigation by appropriate authority. Pending final outcome the Corporation has not made any provision in the books of account towards loss on misappropriation.
- 2) The payments made to the beneficiaries of the schemes for which the company is appointed as Nodal Agency for

payment, is failed on account of expiry of validity of cheque or failure of electronic transfer, the company as a consistent policy is crediting such amount to cheque / RTGS return account instead of crediting back to the scheme account. The payment as and when made is debited to the said cheque / RTGS return account. Total Balance outstanding in the account is ₹ 543.96 lakhs.

- 3) The balances including long-standing debit and credit balances at the yearend and same are subject to Confirmation and reconciliations as more particularly described in note no. 7, 11, 21, 22, and 23 of the financial statement. Impact, if any, of unreconciled amounts on the Statement of Profit and Loss and on respective accounts are unascertained. Attention is drawn towards Management letter issued by honourable C&AG in respect to;

Our opinion is not modified in respect of these matters.

Other Information

The Company's management and Board of Directors are responsible for the other information. The other information comprises the information included in the Company's annual report but does not include the Ind AS Financial Statements and our auditors' report thereon.

Our opinion on the Ind AS Financial Statements does not cover the other information and we do not express any form of assurance conclusion thereon.

In connection with our audit of the Ind AS Financial Statements, our responsibility is to read the other information and, in doing so, consider whether the other information is materially inconsistent with the Ind AS Financial Statements or our knowledge obtained in the audit or otherwise appears to be materially misstated. If, based on the work we have performed, we conclude that there is a material misstatement of this other information; we are required to report that fact. We have nothing to report in this regard.

Responsibility of Management and Those Charged with Governance for the Ind AS Financial Statements

The Company's management and Board of Directors are responsible for the matters stated in Section 134(5) of the Act with respect to the preparation of these Ind AS Financial Statements that give a true and fair view of the financial position, financial performance including other comprehensive income, changes in equity and cash flows of the Company in accordance with the accounting principles generally accepted in India, including the Indian Accounting Standards (Ind AS) specified under section 133 of the Act. This responsibility also includes maintenance of adequate accounting records in accordance with the provisions of the Act for safeguarding of the assets of the Company and for preventing and detecting frauds and other irregularities; selection and application of appropriate accounting policies; making judgments and estimates that are reasonable and prudent; and design, implementation and maintenance of adequate internal financial controls that were operating effectively for ensuring the accuracy and completeness of the accounting records, relevant to the preparation and presentation of the Ind AS Financial Statements that give a true and fair view and are free from material misstatement, whether due to fraud or error.

In preparing the Ind AS Financial Statements, management and Board of Directors are responsible for assessing the Company's ability to continue as a going concern, disclosing, as applicable, matters related to going concern and using the going concern basis of accounting unless management either intends to liquidate the Company or to cease operations, or has no realistic alternative but to do so.

The Board of Directors is also responsible for overseeing the Company's financial reporting process.

Auditor's Responsibilities for the Audit of the Financial Statements

Our objectives are to obtain reasonable assurance about whether the Ind AS Financial Statements as a whole are free from material misstatement, whether due to fraud or error, and to issue an auditor's report that includes our opinion. Reasonable assurance is a high level of assurance, but is not a guarantee that an audit conducted in accordance with SAs will always detect a material misstatement when it exists. Misstatements can arise from fraud or error and are considered material if, individually or in the aggregate, they could reasonably be expected to influence the economic decisions of users taken on the

basis of these Ind AS Financial Statements.

As part of an audit in accordance with SAs, we exercise professional judgment and maintain professional skepticism throughout the audit. We also:

- Identify and assess the risks of material misstatement of the Ind AS Financial Statements, whether due to fraud or error, design and perform audit procedures responsive to those risks, and obtain audit evidence that is sufficient and appropriate to provide a basis for our opinion. The risk of not detecting a material misstatement resulting from fraud is higher than for one resulting from error, as fraud may involve collusion, forgery, intentional omissions, misrepresentations, or the override of internal control.
- Obtain an understanding of internal control relevant to the audit in order to design audit procedures that are appropriate in the circumstances. Under section 143(3)(i) of the Act, we are also responsible for expressing our opinion on whether the Company has adequate internal financial controls with reference to Ind AS Financial Statements in place and the operating effectiveness of such controls.
- Evaluate the appropriateness of accounting policies used and the reasonableness of accounting estimates and related disclosures made by management.
- Conclude on the appropriateness of management's use of the going concern basis of accounting and, based on the audit evidence obtained, whether a material uncertainty exists related to events or conditions that may cast significant doubt on the Company's ability to continue as a going concern. If we conclude that a material uncertainty exists, we are required to draw attention in our auditor's report to the related disclosures in the Ind AS Financial Statements or, if such disclosures are inadequate, to modify our opinion. Our conclusions are based on the audit evidence obtained up to the date of our auditor's report. However, future events or conditions may cause the Company to cease to continue as a going concern.
- Evaluate the overall presentation, structure and content of the Ind AS Financial Statements, including the disclosures, and whether the Ind AS Financial Statements represent the underlying transactions and events in a manner that achieves fair presentation.

Materiality is the magnitude of misstatements in the Ind AS Financial Statements that, individually or in aggregate, makes it probable that the economic decisions of a reasonably knowledgeable user of the Ind AS Financial Statements may be influenced. We consider quantitative materiality and qualitative factors in (i) planning the scope of our audit work and in evaluating the results of our work; and (ii) to evaluate the effect of any identified misstatements in the Ind AS Financial Statements.

We communicate with those charged with governance regarding, among other matters, the planned scope and timing of the audit and significant audit findings, including any significant deficiencies in internal control that we identify during our audit.

We also provide those charged with governance with a statement that we have complied with relevant ethical requirements regarding independence, and to communicate with them all relationships and other matters that may reasonably be thought to bear on our independence, and where applicable, related safeguards.

From the matters communicated in with those charged with governance, we determine those matters that were of most significance in the audit of the Ind AS Financial Statements of the current period and are therefore the key audit matters. We describe these matters in our auditor's report unless law or regulation precludes public disclosure about the matter or when, in extremely rare circumstances, we determine that a matter should not be communicated in our report because the adverse consequences of doing so would reasonably be expected to outweigh the public interest benefits of such communication.

Report on Other Legal and Regulatory Requirements

1. As required by the Companies (Auditor's Report) Order, 2020 ("the Order") issued by the Central Government in terms of Section 143(11) of the Act, we give in "Annexure A" a statement on the matters specified in paragraphs 3 and 4 of the

Order.

2. The Comptroller and Auditor General have issued the directions and sub directions indicating the area to be examined in term of subsection (5) of Section 143 of The Companies Act, 2013. The compliance of which is set out in “**Annexure B**”.
3. As required by Section 143(3) of the Act, we report that:
 - (a) We have sought and obtained all the information and explanations which to the best of our knowledge and belief were necessary for the purposes of our audit.
 - (b) In our opinion, proper books of account as required by law have been kept by the Company so far as it appears from our examination of those books.
 - (c) The balance sheet, the statement of profit and loss (including other comprehensive income), the statement of changes in equity and the statement of cash flows dealt with by this Report are in agreement with the books of account.
 - (d) In our opinion, the aforesaid Ind AS Financial Statements comply with the Indian Accounting Standards prescribed under section 133 of the Act.
 - (e) On the basis of the written representations received from the directors of the Company as on March 31, 2023 taken on record by the Board of Directors, none of the directors is disqualified as on March 31, 2023 from being appointed as a director in terms of Section 164(2) of the Act.
 - (f) With respect to the adequacy of the internal financial controls over financial reporting of the Company and the operating effectiveness of such controls, refer to our separate Report in “**Annexure C**”. Our report expresses an unmodified opinion on the adequacy and operating effectiveness of the Company's internal financial controls with reference to Ind AS Financial Statements.
 - (g) With respect to the other matters to be included in the Auditor's Report in accordance with the requirement of section 197(16) of the Act, as amended:

As per notification number G.S.R. 463 (E) dated June 5, 2015 issued by Ministry of Corporate Affairs, Section 197 of the Act regarding remuneration to Director is not applicable to the Company, since it is a Government Company.
 - (h) With respect to the other matters to be included in the Auditor's Report in accordance with Rule 11 of the Companies (Audit and Auditors) Rules, 2014, as amended, in our opinion and to the best of our information and according to the explanations given to us:
 - (i) The Company has disclosed the impact of pending litigations on its financial position in its Ind AS Financial Statements - Refer Note 36(2).
 - (ii) The Company did not have any long-term contracts including derivative contracts for which there were any material foreseeable losses.
 - (iii) There were no amounts which were required to be transferred to the Investor Education and Protection Fund by the Company.
 - (iv) a. The management has represented that, to the best of its knowledge and belief, other than as disclosed in the notes to the accounts, no funds (which are material either individually or in the aggregate) have been advanced or loaned or invested (either from borrowed funds or share premium or any other sources or kind of funds) by the company to or in any other person(s) or entity(ies), including foreign entities (“Intermediaries”), with the understanding, whether recorded in writing or otherwise, that the Intermediary shall, whether, directly or indirectly lend or invest in other persons or entities identified in any manner whatsoever by or on behalf of the company (“Ultimate Beneficiaries”) or provide any guarantee, security or the like on behalf of the Ultimate Beneficiaries;

- b. The management has represented, that, to the best of its knowledge and belief, other than as disclosed in the notes to the accounts, no funds have been received by the company from any person(s) or entity(ies), including foreign entities (“Funding Parties”), with the understanding, whether recorded in writing or otherwise, that the company shall, whether, directly or indirectly, lend or invest in other persons or entities identified in any manner whatsoever by or on behalf of the Funding Party (“Ultimate Beneficiaries”) or provide any guarantee, security or the like on behalf of the Ultimate Beneficiaries;
- c. Based on audit procedures which we considered reasonable and appropriate in the circumstances, nothing has come to our notice that has caused us to believe that the representations under sub-clause (a) and (b) above contain any material mis-statement.
- (v) The dividend declared and paid during the year by the company is in compliance with section 123 of the Companies Act 2013.

For Mukeshkumar Jain & Co.
Chartered Accountants
(FRN: 106619W)

CA Rajit Tillani
Partner
Membership No. 405662
UDIN: 23405662BGUNPQ2207

Place: Ahmedabad
Date: 26/09/2023

ANNEXURE 'A' TO THE INDEPENDENT AUDITOR'S REPORT

(Referred to in paragraph 1 under 'Report on Other Legal and Regulatory Requirements' section of our report to the Members of GUJARAT STATE SEEDS CORPORATION LIMITED of even date)

To the best of our information and according to the explanations provided to us by the Company and the books of account and records examined by us in the normal course of audit, we state that:

- (i) In respect of the Company's Property Plant and Equipment and intangible asset under development:
 - a. The Company has maintained proper records showing full particulars, including quantitative details and situation of its Property, Plant and Equipment and relevant details of Right to use of Assets.
 - b. We were informed that all major items of fixed assets were physically verified by the Management at the end of the year and that no discrepancy was noticed on such verification which, on account of proper records being under compilation, could not be verified.
 - c. According to the information and explanations given to us and on the basis of our examination of the records of the Company, the title deeds of immovable properties are held in the name of the Company.
 - d. The Company has not revalued any of its Property, Plant and Equipment (including right- of-use assets) during the year.
 - e. No proceedings have been initiated during the year or are pending against the Company as at March 31, 2023 for holding any benami property under the Benami Transactions (Prohibition) Act, 1988 (as amended in 2020) and rules made there under.
- (ii)
 - a. According to information and explanation given to us, the Management of the Company has conducted physical verification of inventory at reasonable intervals and no material discrepancies were noticed on such physical verification during the year.
 - b. The Company has not been sanctioned any working capital at any point of time during the year from banks or financial institutions on the basis of security of current assets, Thus, clause 3(ii)(b) of the Companies (Auditor's Report) Order, 2020 is not applicable.
- (iii) During the year the company has not made any investments in, provided any guarantee or security or granted any loans or advances in the nature of loans, secured or unsecured, to companies, firms, Limited Liability Partnerships or any other parties. Therefore the provisions of clause 3(iii)(a), 3(iii)(b), 3(iii)(c), 3(iii)(d), 3(iii)(e), 3(iii)(f) of the said Order are not applicable to the company.
- (iv) In respect of loans, investments, guarantees and security the provisions of section 185 and 186 of the Companies Act, 2013 have been complied with.
- (v) In our opinion and according to the information and explanations given to us, the Company has not accepted deposits in the companies (Acceptance of Deposits) Rules, 2014. Accordingly, the provisions of Clause 3(v) of the Order are not applicable to the Company.
- (vi) According to information and explanations given to us, the Central Government has not prescribed maintenance of cost records under section (1) of Section 148 of the Companies Act, 2013.
- (vii) According to the information and explanations given to us, in respect of statutory dues:
 - (a) The Company has generally been regular in depositing undisputed statutory dues, including Provident Fund, Employees' State Insurance, Income Tax, Goods and Services Tax, and other material statutory dues applicable to it with the appropriate authorities and no undisputed amounts payable in respect of same were in arrears as at March 31, 2023 for a period of more than six months from the date they become payable.
 - (b) According to the information and explanations given to us, the company has no disputed outstanding statutory dues as at 31st March, 2023 except following. **As on the date of the report the same were adjusted against refund due to the company, hence as on date of report there are no outstanding disputed amount.**

Name of Statute	Nature of dues	Amount (₹ in lakhs)	Period of to which amount relates	Forum where the dispute is pending
Income Tax Act, 1961	Income Tax	22.54	2016-17	CIT (A)
	TOTAL	22.54		

- (viii) There were no transactions relating to previously unrecorded income that have been surrendered or disclosed as income during the year in the tax assessments under the Income Tax Act, 1961 (43 of 1961).
- (ix) a. The Company has not defaulted in repayments of loans or borrowings to banks and financial institution during the year.
- b. The Company has not been declared willful defaulter by any bank or financial institution or government or any government authority.
- c. The Company has not taken term loan from any bank and financial institution during the year hence, reporting under clause 3 (ix)(c) of the Order is not applicable.
- d. On an overall examination of the financial statements of the company, we report that no funds raised on short term basis by the company. Accordingly, reporting under clause 3(ix)(d) of the order is not applicable.
- e. On an overall examination of the financial statements of the Company, the Company has not taken any funds from any entity or person on account of or to meet the obligations of its subsidiaries, associates or joint ventures.
- f. The Company has not raised any loans during the year on the pledge of securities and hence reporting on clause 3(ix)(f) of the Order is not applicable.
- (x) a. The Company has not raised moneys by way of initial public offer or further public offer (including debt instruments) during the year and hence reporting under clause 3(x)(a) of the Order is not applicable.
- b. During the year, the Company has not made any preferential allotment or private placement of shares or convertible debentures (fully or partly or optionally) and hence reporting under clause 3(x)(b) of the Order is not applicable.
- (xi) a. No fraud by the Company and no material fraud on the Company has been noticed or reported during the year.
- b. No report under sub-section (12) of section 143 of the Companies Act has been filed in Form ADT-4 as prescribed under rule 13 of Companies (Audit and Auditors) Rules, 2014 with the Central Government, during the year and up to the date of this report.
- c. According to the information and explanations given to us, there is no whistle blower complaint has been received by the company during the year.
- (xii) In our opinion and according to the information and explanations given to us, the Company is not a Nidhi Company and hence reporting under clause 3(xii) of the Order is not applicable to the Company.
- (xiii) In our opinion and according to the information and explanations given to us, the Company is in compliance with Section 177 and 188 of the Companies Act, 2013 where applicable, for all transactions with the related parties and the details of related party transactions have been disclosed in the notes to Ind AS Financial Statements as required by the applicable Indian Accounting Standard (AS) 24, Related Party Disclosure.
- (xiv) a. In our opinion the Company has an adequate internal audit system commensurate with the size and the nature of its business.
- b. We have considered the internal audit reports for the year under audit, issued to the Company during the year and till date, in determining the nature, timing and extent of our audit procedures. **Please Refer our report on Annexure C-To Independent Auditor Report for Internal Financial Control**
- (xv) In our opinion and according to the information and explanations given to us, during the year the Company has not entered into any non-cash transactions with its Directors or persons connected to its directors hence provisions of Section 192 of the Companies Act, 2013 is not applicable.
- (xvi) a. The Company is not required to be registered under section 45-IA of Reserve Bank of India Act, 1934. Hence reporting under clause 3(xvi)(a) is not applicable.

- b. In our opinion and according to the information and explanations given to us, the clause 3(xvi) (b) is not applicable to the company.
- c. In our opinion and according to the information and explanations given to us, the company is not a Core Investment Company (CIC) as defined in the regulations made by the Reserve Bank of India.
- d. According to the information and explanations provided to us during the course of audit, the Group does not have any Core Investment Company (CIC). Accordingly, the requirements of clause 3(xvi) (d) are not applicable.
- (xvii) The Company has not incurred cash losses during the financial year covered by our audit and the immediately preceding financial year.
- (xviii) There has been no resignation of the statutory auditors of the Company during the year.
- (xix) On the basis of the financial ratios, ageing and expected dates of realization of financial assets and payment of financial liabilities, other information accompanying the financial statements and our knowledge of the Board of Directors and Management plans and based on our examination of the evidence supporting the assumptions, nothing has come to our attention, which causes us to believe that any material uncertainty exists as on the date of the audit report indicating that Company is not capable of meeting its liabilities existing at the date of balance sheet as and when they fall due within a period of one year from the balance sheet date. We, however, state that this is not an assurance as to the future viability of the Company. We further state that our reporting is based on the facts up to the date of the audit report and we neither give any guarantee nor any assurance that all liabilities falling due within a period of one year from the balance sheet date, will get discharged by the Company as and when they fall due.
- (xx) (a) There are no unspent amounts towards Corporate Social Responsibility (CSR) on other than ongoing projects requiring a transfer to a Fund specified in Schedule VII to the Companies Act in compliance with second proviso to sub-section (5) of Section 135 of the said Act. Accordingly, reporting under clause 3(xx)(a) of the Order is not applicable for the year. Refer Note 36(1). Also Refer to our Basis of Qualified Opinion.
- (b) In respect of ongoing projects, the Company has not transferred unspent Corporate Social Responsibility (CSR) amount as at the Balance Sheet date to a special account, within a period of thirty days from the end of the financial year in compliance with Section 135(6) of the Companies Act. Refer Note 36(1). Also Refer to our Basis of Qualified Opinion.

For Mukeshkumar Jain & Co.
Chartered Accountants
(FRN: 106619W)

CA Rajit Tillani
Partner
Membership No. 405662
UDIN: 23405662BGUNPQ2207

Place: Ahmedabad
Date: 26/09/2023

ANNEXURE - B TO THE INDEPENDENT AUDITORS REPORT

(Referred to in our Report of even date GUJARAT STATE SEED CORPORATION LIMITED)

Report pursuant to directions issued by office of C&AG u/s. 143(5) of the Companies Act, 2013

A. DIRECTIONS

Sr. No.	Particulars	Comments
1	Whether the company has system in place to process all the accounting transactions through IT system? If Yes, the implications of processing of accounting transactions outside IT system on the integrity of the accounts along with the financial implications, if any, may be stated.	<p>Yes, the company has Tally software based accounting system in place to process all the accounting transactions through IT system except in case of valuation of inventories at the end of the year.</p> <p>The Inventory Valuation is not integrated with Tally Accounting Software & same is prepared on the basis of data maintained in MS office – xls file. The financial implications if any cannot be ascertained for the same.</p> <p>Further the company is maintaining stock records in the physical form. We draw attention towards our report of “Internal Financial Controls Over Financial Reporting” in this regard.</p>
2	Whether there has been any restructuring of an existing loan or cases of waiver/write off of Loans/Interest etc. made by lender to the company due to the company's inability to repay the loan? If yes, the financial impact may be stated. Whether such cases are properly accounted for?	As per information given to us there are no cases of restructuring of an existing loan or cases of waiver/write off of debts/loans/interest etc. during the year under audit.
3	Whether funds received/receivable for specific schemes from Central/State agencies were properly accounted for/utilised as per its term and conditions? List the cases of deviation.	As per information given to us funds received/receivable for specific schemes from Central/State agencies were properly accounted for/utilised as per its term and conditions during the year under audit.

B. SUB DIRECTIONS**(i) General**

Sr. No.	Particulars	Comments
1	Whether the land owned by the Company is encroached, under litigation, not put to use or declared surplus. Details may be provided.	According to explanation given to us there is no encroachment and litigation over the land owned by the company. Details of land owned by the Company and not put to use are as under: 1. Plot of land at Sector 13 – 5500 Sq. Meter There is no surplus land.
2	Whether physical verification and valuation of standing crops / trees was done at the end of the Financial Year in accordance with the standard industry practices?	Not Applicable
3	Whether the stock of seeds packing / certification materials and other items has been taken on basis of stock records after adjustment of shortage / excess found on physical verification and whether due consideration has been given for deterioration in the quality of old stocks which may result into overvaluation of stock?	As per explanation given to us the stock of seed packing / certification materials is taken on basis of stock records verified by Internal Auditors/Branch Managers and due considerations are given to relevant adjustments.
4	Whether all the agriculture produce procured are properly stored and adequately insured. If any insurance claims are rejected, the details may be reported.	Based on records produced before us and examining the same, it is observed that agricultural produce purchased by the corporation are properly stored and insured.
5	Whether the Company has an effective mechanism for disbursement of loans/subsidies / agro inputs and agriculture machineries to beneficiaries and recovery thereof (loans) along with interest, if any, from beneficiaries?	Not Applicable
6	That grant / subsidies received for implementation various schemes are accounted for as per the accounting standard and utilized for intended purpose.	Please refer main audit report under Basis for Qualified Opinion.
7	Whether the cost incurred on abandoned projects has been written off?	As informed to us no project was abandoned during the period.

(ii) Agro Based Industries

Sr. No.	Particulars	Comments
1	Report the cases of diversion of grants / subsidies received from Central / State Government or their agencies for performing certain activities.	No cases of Diversification were found.
2	Cases of wrong accounting of interest earned on account of non-utilization of amounts received for certain projects / schemes may be reported.	Please refer main audit report para (a) under basis of qualification.
3	Examine pricing policy framed by the Company to ensure that all cost components are covered.	<p>As explained to us the marketing department of the Company is responsible for framing the pricing policy with approval of management & appropriate authorities.</p> <p>During the course of audit, we have been informed that the Corporation does not have any formal written policy with regard to pricing of the products, however while verification pricing of the products it has been observed that Corporation generally do cover all the cost components in pricing the products so as to recover the same.</p>
4	Report on the extent of utilization of Plant & Machinery and its obsolescence, if applicable.	As informed to us all processing Plant & Machinery are utilized during the year.

For Mukeshkumar Jain & Co.
Chartered Accountants
 (FRN: 106619W)

CA Rajit Tillani
 Partner
 Membership No. 405662
 UDIN: 23405662BGUNPQ2207

Place: Ahmedabad
 Date: 26/09/2023

ANNEXURE “C” TO THE INDEPENDENT AUDITOR'S REPORT

(Referred to in paragraph 3(f) under 'Report on Other Legal and Regulatory Requirements' section of our report to the Members of GUJARAT STATE SEEDS CORPORATION LIMITED of even date)

Report on the Internal Financial Controls Over Financial Reporting under Clause (i) of Sub-section 3 of Section 143 of the Companies Act, 2013 (“the Act”)

We have audited the internal financial controls over financial reporting of GUJARAT STATE SEEDS CORPORATION LIMITED (“the Company”) as of March 31, 2023 in conjunction with our audit of the Ind AS Financial Statements of the Company for the year ended on that date.

Management's Responsibility for Internal Financial Controls

The Board of Directors of the Company is responsible for establishing and maintaining internal financial controls based on the internal control over financial reporting criteria established by the Company considering the essential components of internal control stated in the Guidance Note on Audit of Internal Financial Controls over Financial Reporting issued by the Institute of Chartered Accountants of India. These responsibilities include the design, implementation and maintenance of adequate internal financial controls that were operating effectively for ensuring the orderly and efficient conduct of its business, the safeguarding of its assets, the prevention and detection of frauds and errors, the accuracy and completeness of the accounting records, and the timely preparation of reliable financial information, as required under the Companies Act, 2013.

Auditor's Responsibility

Our responsibility is to express an opinion on the internal financial controls over financial reporting of the Company based on our audit. We conducted our audit in accordance with the Guidance Note on Audit of Internal Financial Controls Over Financial Reporting (the “Guidance Note”) issued by the Institute of Chartered Accountants of India and the Standards on Auditing prescribed under Section 143(10) of the Companies Act, 2013, to the extent applicable to an audit of internal financial controls. Those Standards and the Guidance Note require that we comply with ethical requirements and plan and perform the audit to obtain reasonable assurance about whether adequate internal financial controls over financial reporting was established and maintained and if such controls operated effectively in all material respects.

Our audit involves performing procedures to obtain audit evidence about the adequacy of the internal financial controls system over financial reporting and their operating effectiveness. Our audit of internal financial controls over financial reporting included obtaining an understanding of internal financial controls over financial reporting, assessing the risk that a material weakness exists, and testing and evaluating the design and operating effectiveness of internal control based on the assessed risk. The procedures selected depend on the auditor's judgment, including the assessment of the risks of material misstatement of the Ind AS Financial Statements, whether due to fraud or error.

We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our audit opinion on the Company's internal financial controls system over financial reporting.

Meaning of Internal Financial Controls over Financial Reporting

A company's internal financial control over financial reporting is a process designed to provide reasonable assurance regarding the reliability of financial reporting and the preparation of Ind AS Financial Statements for external purposes in accordance with generally accepted accounting principles. A company's internal financial control over financial reporting includes those policies and procedures that:

- (1) Pertain to the maintenance of records that, in reasonable detail, accurately and fairly reflect the transactions and dispositions of the assets of the company;
- (2) Provide reasonable assurance that transactions are recorded as necessary to permit preparation of Ind AS Financial Statements in accordance with generally accepted accounting principles, and that receipts and expenditures of the company are being made only in accordance with authorizations of management and directors of the company; and

- (3) Provide reasonable assurance regarding prevention or timely detection of unauthorized acquisition, use, or disposition of the company's assets that could have a material effect on the Ind AS Financial Statements.

Inherent Limitations of Internal Financial Controls Over Financial Reporting

Because of the inherent limitations of internal financial controls over financial reporting, including the possibility of collusion or improper management override of controls, material misstatements due to error or fraud may occur and not be detected. Also, projections of any evaluation of the internal financial controls over financial reporting to future periods are subject to the risk that the internal financial control over financial reporting may become inadequate because of changes in conditions, or that the degree of compliance with the policies or procedures may deteriorate.

Emphasis of matter

Emphasis is drawn towards the following,

1. During the course of audit it was noted that stock items are not regularly routed through accounting software. The control over stock is maintained in physical records. Such a control may have impact on the Financial Statements.
2. During the course of audit it was noted that the internal control in respect of timely reconciliation and confirmation of year end balances could be strengthened. The unreconciled amounts could have a potential impact on the financial statements.

Our report is not qualified for the same.

In our opinion, except for the effects/possible effects of the material weaknesses described above on the achievement of the objectives of the control criteria, the Company has, in all material respects, an adequate internal financial controls system over financial reporting and such internal financial controls over financial reporting were operating effectively as at 31st March, 2023, based on the internal control over financial reporting criteria established by the Company considering the essential components of internal control stated in the Guidance Note on Audit of Internal Financial Controls Over Financial Reporting issued by the Institute of Chartered Accountants of India

For Mukeshkumar Jain & Co.
Chartered Accountants
(FRN: 106619W)

CA Rajit Tillani
Partner
Membership No. 405662
UDIN: 23405662BGUNPQ2207

Place: Ahmedabad
Date: 26/09/2023

Balance Sheet as at 31st March, 2023

(₹ in Lakhs)

Sr. No.	Particulars	Note No	As at 31st March 2023	As at 31st March 2022
I	Assets			
1	Non-Current Assets			
	(a) Property, Plant and Equipment	3	4,470.97	4,721.25
	(b) Capital work-in-Progress	4	-	23.44
	(c) Investment Property	5	4.41	4.63
	(d) Other Intangible Assets	6	7.09	7.09
	(e) <u>Financial Assets</u>			
	(i) Other Financial Assets	7	11.65	9.50
	(f) Deferred Tax Assets (Net)	8	-	13.93
2	Current Assets			
	(a) Inventories	9	6,664.50	5,438.05
	(b) <u>Financial Assets</u>			
	(i) Investment	10	25,307.48	23,300.00
	(ii) Trade Receivables	11	4,367.64	3,745.33
	(iii) Cash and Cash Equivalents	12	6,615.14	10,701.03
	(iv) Other Financial Assets	13	434.84	685.17
	(c) Current Tax Assets (Net)	14	19.59	70.47
	(d) Other Current Assets	15	335.16	374.18
	Total Assets		48,238.47	49,094.07
II	EQUITY AND LIABILITIES			
1	Equity			
	(a) Equity Share Capital	16	393.00	393.00
	(b) Other Equity	17	33,457.09	31,520.14
2	Liabilities			
(I)	Non-Current Liabilities			
	(a) Capital Grant received from Government	18	2,546.87	2,690.10
	(b) <u>Financial Liabilities</u>			
	(i) Lease Liabilities		11.04	7.74
	(ii) Other financial liabilities	19	297.41	290.29
	(c) Other Non-Current Liabilities	20	132.72	185.38
	(d) Deferred Tax Liabilities (Net)	8	6.41	-
(II)	Current Liabilities			
	(a) <u>Financial Liabilities</u>			
	(i) Trade Payables	21	-	-
	Total outstanding dues to Micro and Small Enterprises		-	-
	Total outstanding dues to other than Micro and Small Enterprises		1,954.59	2,100.32
	(ii) Lease Liabilities		10.69	1.85
	(iii) Other financial liabilities	22	124.75	93.00
	(b) Other Current Liabilities	23	9,228.48	11,589.81
	(c) Provisions	24	75.41	222.43
	Total Equity and Liabilities		48,238.47	49,094.07
-	Significant Accounting Policies	1-2		
-	Notes forming part of the Financial Statements	36		

As per our report of even date annexed
For, Mukeshkumar Jain & Co.
Chartered Accountants
Firm No. 106619W

Rajit Tilani (Partner)
Membership No. 405662
UDIN: 23405662BGUNPQ2207
Place : Ahmedabad
Date : 26/09/2023

For and on behalf of Board of Directors

A. K. Rakesh, I.A.S
Chairman
(DIN : 0063819)

S. N. Deora
Manager (Finance)

P. S. Rabari
Managing Director
(DIN : 8996765)

K. M. Raval
Company Secretary

Place : Gandhinagar
Date : 26/09/2023

Statement of Profit and Loss for the Year ended 31st March 2023 (₹ in Lakhs)

Sr. No.	Particulars	Note No	Year Ended 31st March 2023	Year Ended 31st March 2022
	Revenue :			
I	Revenue from Operations	25	19,690.53	20,581.48
II	Other Income	26	1,461.46	1,623.05
III	Total Income (I+II)		21,151.99	22,204.53
IV	Expenses :			
	Cost of Materials Consumed	27	554.86	417.55
	Purchase of Stock-in-Trade	28	16,869.07	16,098.62
	Changes in inventories of finished goods, Work-in-Progress and Stock-in-trade	29	(1,522.68)	(413.65)
	Employee Benefit Expenses	30	1,028.06	967.17
	Finance Costs	31	28.57	25.02
	Depreciation and Amortisation Expenses	32	150.71	176.58
	Other Expenses	33	1,459.33	1,665.21
	Total Expenses (IV)		18,567.92	18,936.50
V	Profit before exceptional items and Tax (III-IV)		2,584.07	3,268.03
VI	Exceptional Items (Income/Expenses)		-	-
VII	Profit/(Loss) before Tax (V+VI)		2,584.07	3,268.03
VIII	Tax Expenses:			
	1 Current Tax			
	- For the year		645.00	911.00
	- For the earlier years(Net)		-	-
	2 Deferred Tax (Net)		4.08	(13.60)
	Total Tax Expenses:		649.08	897.40
IX	Profit/(Loss) for the period from continuing operation(VII-VIII)		1,934.99	2,370.63
X	Profit/(Loss) from discontinued operations		-	-
XI	Tax Expenses of discontinued operations		-	-
XII	Profit/(Loss) from discontinued operations (after tax)(X-XI)		-	-
XIII	Profit/(Loss) for the period (IX+XIII)		1,934.99	2,370.63
XIV	Other Comprehensive Income			
	A Items that will not be reclassified to profit and loss			
	- Re-measurement losses on defined benefit plans	34	64.60	(6.51)
	- Income Tax on Re-measurement losses on defined benefit Plans		(16.26)	1.64
	B Items that will be reclassified to profit and loss		-	-
			48.34	(4.87)
	Total Comprehensive Income for the period (XIII+Xiv)		1,983.33	2,365.75

XV	Earning per Equity Share:(for continuing Operation)			
	1 Basic (Face Value ₹ 100 per share)	35	505.00	602.00
	2 Diluted (Face Value ₹ 100 per share)	35	505.00	602.00
XVI	Earning per Equity Share:(for discontinued Operation)			
	1 Basic (Face Value ₹ 100 per share)	-	-	-
	2 Diluted (Face Value ₹ 100 per share)	-	-	-
XVII	Earning per Equity Share (for discontinuing and continuing Operation)			
	1 Basic (Face Value ₹ 100 per share)	35	505.00	602.00
	2 Diluted (Face Value ₹ 100 per share)	35	505.00	602.00
-	Significant Accounting Policies	1-2		
-	Notes forming part of the Financial Statements	36		

As per our report of even date annexed
For, Mukeshkumar Jain & Co.
Chartered Accountants
Firm No. 106619W

Rajit Tilani (Partner)
Membership No. 405662
UDIN: 23405662BGUNPQ2207

Place : Ahmedabad
Date : 26/09/2023

For and on behalf of Board of Directors

A. K. Rakesh, I.A.S
Chairman
(DIN : 0063819)

S. N. Deora
Manager (Finance)

P. S. Rabari
Managing Director
(DIN : 8996765)

K. M. Raval
Company Secretary

Place : Gandhinagar
Date : 26/09/2023

Statement of Cash Flow for the Year ended 31st March, 2023

(₹ in Lakhs)

Sr. No.	Particulars	Note No	Year Ended 31st March 2023	Year Ended 31st March 2022
A	Cash Flow from Operating Activities			
	Profit Before Tax for the year		2,584.07	3,268.03
	Adjustments for :-			
	Depreciation		150.71	176.58
	Interest Income		(1,323.43)	(1,202.00)
	Excess Provision for Doubtful Debts Written Back		(4.45)	(3.82)
	Employee Benefit Expense		64.60	(6.51)
	Sundry Balance Written Back		(28.97)	(0.10)
	Sundry Balance Written Off		0.01	0.01
	Lease Rent for Land		0.01	0.01
	Rental Income - Investment Property		(2.63)	(2.63)
	Provision for Doubtful debts		25.04	0.14
	(Profit)/ Loss on sale of Fixed Assets		(1.74)	(0.15)
	Adjustment on Account of Fair Valuation (Ind AS)		26.19	26.19
	Finance Cost		28.57	25.02
	Operating Profit before changes in working capital	(1)	1,517.96	2,280.76
	Adjustment to :			
	Decrease/(Increase) in Inventories		(1,226.45)	(946.74)
	Decrease/(Increase) in Trade Receivables		(646.44)	518.71
	Decrease/(Increase) in Other Assets		270.01	35.23
	(Decrease)/Increase in Payables		(116.77)	545.61
	(Decrease)/Increase in Provisions		(147.02)	14.54
	(Decrease)/Increase in Other current liabilities		(2,319.50)	3916.93
	(Decrease)/Increase in Other Non current liabilities		(61.50)	24.85
		(2)	(4,247.66)	4,109.13
	Cash (Used)/Generated from Operations	(1+2)	(2,729.70)	6,389.89
	less: Income Tax Paid		(594.12)	(937.07)
	Total Cash (Used)/Generated from Operating Activities		(3,323.82)	5,452.82
B	Cash Flow from Investing Activities			
	Sale/Disposal of Property, Plant and Equipment and Other Intangible Assets		9.10	0.72
	Purchase of Property, Plant and Equipment and Other Intangible Assets (including CWIP)		(39.07)	(237.87)
	Rental Income - Investment Property		2.63	2.63
	Interest Receivable		1,340.62	1,318.81
	Investments in Deposits (GSFS)		(2,007.48)	(1,200.00)
	Net Cash (Used)/Generated in Investing Activities		(694.20)	(115.71)
C	Cash Flow From Financing Activities			
	Dividend Paid (including Tax on Dividend)		(39.30)	(39.30)
	Finance Cost		(28.57)	(25.02)
	Net Cash (Used)/ Generated from Financing Activities		(67.87)	(64.32)
	Net Increase/(Decrease)in Cash and Cash Equivalents (A+B+C)		(4,085.88)	5,272.80
	Opening Cash and Equivalents		10,701.03	5,428.25
	Closing Cash and Equivalents		6,615.14	10,701.03
	Reconciliation of Cash & Cash Equivalents			
	Cash and Cash equivalent Comprises of Cash on hand			
	Balance with Banks :			
	On Current Accounts		6,614.67	10,700.63
	Cheques, drafts and stamps on hand		0.47	0.40
			6,615.14	10,701.03

Notes:

- The Statement of Cash Flow has been prepared under the Indirect Method as set out in Ind-AS 7 on Cash Flow Statement issued by The Institute of Chartered Accountants of India.
- Previous year's figures are reclassified/ regrouped to confirm and make them comparable with those of current year.

As per our report of even date annexed
For, Mukeshkumar Jain & Co.
Chartered Accountants
Firm No. 106619W

Rajit Tilani (Partner)
Membership No. 405662
UDIN: 23405662BGUNPQ2207

Place : Ahmedabad
Date : 26/09/2023

For and on behalf of Board of Directors

A. K. Rakesh, I.A.S
Chairman
(DIN : 0063819)

S. N. Deora
Manager (Finance)

P. S. Rabari
Managing Director
(DIN : 8996765)

K. M. Raval
Company Secretary

Place : Gandhinagar
Date : 26/09/2023

A. Equity share Capital

(₹ in Lakhs)

	No of Share	Amount
Balance as 1st April, 2021	3,93,000.00	393.00
Changes in equity share capital during the year	-	-
Restated Balance as at 1st April, 2021	3,93,000.00	393.00
Changes in equity share capital during the year	-	-
Balance as 31st March, 2022	3,93,000.00	393.00
Change in equity share capital during the year	-	-
Restated Balance as at 1st April, 2022	3,93,000.00	393.00
Change in equity share capital during the year	-	-
Balance as 31st March, 2023	3,93,000.00	393.00

B. Other Equity

(₹ in Lakhs)

Particulars	Capital Subsidy Grant against Non Depreciable Asset	Reserve & Surplus		Total
		Retained Earnings	Other items of Other Comprehensive Income (Remeasurement of Defined Benefit plan)	
Balance as at 1st April, 2021	7.08	29,182.31	-	29,189.39
Changes in accounting policy / prior period errors		4.30	-	4.30
Restated Balance as at 1st April, 2021		29,186.61		29,193.69
Profit for the year		2,370.63		2,370.63
Dividend and Dividend Distribution Tax		(39.30)		(39.30)
Re-measurement of defined benefit plan		(4.87)		(4.87)
Transfer to / from retained earning		-		
Addition / (deduction) during the year (Net)		-	(4.87)	(4.87)
Transfer to Retained earnings		-	4.87	4.87
Balance as at 31st March, 2022	7.08	31,513.06		31,520.14
Changes in accounting policy / prior period errors		-	-	-
Restated Balance as at 1st April, 2022	7.08	31,513.06		31,520.14
Profit for the year	-	1,934.99	-	1,934.99
Dividends and Dividend Distribution Tax	-	(39.30)	-	(39.30)
Re-measurement of defined benefit plan	-	48.34	-	48.34
Transfer to / from retained earning	(7.08)	-	-	(7.08)
Addition / (Deduction) during the year (Net)	-	-	48.34	48.34
Transfer to retained earnings	-	-	(48.34)	(48.34)
Balance as at 31st March, 2023	-	33,457.09	-	33,457.09

Nature and purpose of Reserves**(i) Retained Earnings**

Retained Earnings represents undistributed accumulated earnings of the company as on the balance sheet date.

(ii) Remeasurement of Defined Benefit Plan

Differences between the interest income on plan assets and the return actually achieved and any changes in the liabilities over the year due to changes in actuarial assumptions or experience adjustments within the plans, are recognised in other comprehensive income and are adjusted to retained earnings.

(iii) Capital Subsidy (Grant against Non Depreciable Assets)

The corporation had received this subsidy for the purpose of acquisition of site and its development. The site acquired from this grant has been disclosed as a separate item of asset under Note 3 for Property, Plant and Equipment.

As per our report of even date annexed**For, Mukeshkumar Jain & Co.**

Chartered Accountants

Firm No. 106619W

Rajit Tilani (Partner)

Membership No. 405662

UDIN: 23405662BGUNPQ2207

Place : Ahmedabad**Date : 26/09/2023****For and on behalf of Board of Directors****A. K. Rakesh, I.A.S**

Chairman

(DIN : 0063819)

S. N. Deora

Manager (Finance)

P. S. Rabari

Managing Director

(DIN : 8996765)

K. M. Raval

Company Secretary

Place : Gandhinagar**Date : 26/09/2023**

Notes to the Financial Statements

Note 1: Corporate Information:

Gujarat State Seeds Corporation Ltd. was established in April, 1975 and popularly known by its brand name “GURABINI” (hereafter referred to as “Corporation”). The Corporation is serving in the larger interest of farmers for more than three decades with farmer's faith, brand loyalty, quality assurance, dedicated service and sustainable contribution for upliftment of farmers with glorious achievements.

The Corporation is primarily engaged in production, processing and marketing of seeds of more than 24 crops and 101 varieties and hybrids in almost all categories i.e., Cereals, Pulses, Oilseeds, Fibre Crops, Fodder, Green Manuring Crops and so on.

The Corporation is having its Head office at Gandhinagar and 14 Branches across the Gujarat and one Sales Depot. The Chairman of the Corporation is Additional Chief Secretary (Agriculture) to Government of Gujarat and Managing Director is Additional Director (Agriculture) to Government of Gujarat.

The authorized share capital of Corporation as on year ended is ₹ 4 Crore equally divided into shares of ₹ 100 each. As against that, the paid-up share capital is ₹ 3.93 Crores. The shares have been held by following categories of shareholders:

Government of Gujarat: 95.42 % shares

Government of India: 4.58 % shares

Note 2 : Significant Accounting Policies

2.1 Basis of Preparation: -

i) Statement of Compliance

These financial statements have been prepared in accordance with the Indian Accounting Standards (referred to as “Ind AS”) as prescribed under Section 133 of the Companies Act, 2013 read with the Companies (Indian Accounting Standards) Rules as amended from time to time. Further, Guidance Note/ Announcement issued by The Institute of Chartered Accountants of India (ICAI) are also considered wherever applicable. The Corporation has uniformly applied the accounting policies during the period presented.

ii) Basis of preparation:-

The financial statements have been prepared on a historical cost convention on accrual basis, except for the followings assets and liabilities which have been measured at fair value amount:

- Certain financial assets and liabilities measured at fair value
- Defined benefit plans – plan assets measured at fair value

Historical cost is generally based on the value of the consideration given in exchange for goods and services. Fair value is the price that would be received to sell an asset or paid to transfer a liability in an orderly transaction between market participants at the measurement date. All assets and liabilities have been classified as current and non-current considering operating cycle period of 12 months.

These financial statements have been prepared in Indian Rupee (INR/₹) which is the functional currency of the Corporation and all values are rounded to the nearest lakhs (₹ 1,00,000), except when otherwise indicated.

Accounting policies have been consistently applied except where a newly issued accounting standard is initially adopted or a revision to an existing accounting standard required a change in the accounting policy hitherto in use. The Corporation has generally followed the policy and best practices as prevalent in the industry.

The significant accounting policies used in preparation of the financial statements have been discussed in the respective notes.

The financial statements were authorised for issue in accordance with a resolution of the meeting of Board of Directors dated **26/09/2023**.

iii) Use of Estimates and judgement: -

The preparation of the financial statements are in conformity with Ind AS which requires the management to make estimates, judgements and assumptions that affect the reported amounts of revenues and expenses during the reported period and the reported amount of assets and liabilities (Including contingent liabilities) as on the date of financial statement.

Management believe that the estimates used in preparation of financial statements are prudent and reasonable. Future results could differ from these estimates. Difference between actual results and estimates are recognised in the period in which results are crystallised.

Estimates and underlying assumptions are reviewed on an ongoing basis. Revisions to the accounting estimates are recognised in the period in which the estimates are revised and in any future periods affected.

This note provides an overview of the areas that involved a higher degree of judgement or complexity, and of items which are more likely to be materially adjusted due to estimates and assumptions turning out to be different than those originally assessed. Detailed information about each of these estimates and judgements is included in relevant notes together with information about the basis of calculation for each affected line item in the financial statements.

Information about assumptions and estimation uncertainties that have a significant risk of resulting in a material adjustment within the next financial year are included in the following notes:

- Note 8 and 14 Current/deferred tax expense
- Note 36(3) Contingent liabilities and assets
- Note 36(14) Measurement of defined benefit obligations

2.2 Summary of Significant Accounting Policies: -

i) Statement of Cash flow: -

The Cash flow statement is prepared in accordance with Indian Accounting Standard 7, using indirect method, whereby profit/(loss) before tax is adjusted for the effects of transactions of non- cash nature and any deferrals or accruals of past or future cash receipts or payments. The cashflows from operation, Investing and financing activities of the Corporation are segregated based on the available information.

For the purpose of cashflow statement, cash and cash equivalents include cash on hand, cash at banks and on hand and demand deposits with an original maturity of three months or less and highly liquid investments that are readily convertible into known amounts of cash and which are subject to an insignificant risk of changes in value net of outstanding bank overdrafts as they are considered an integral part of the Corporation's cash management.

ii) Functional and presentation currency

The financial statements are presented in Indian Rupee (INR), which is functional as well as presentation currency of Corporation.

- a. Transactions in foreign currency are recorded at the rate of exchange prevailing at the time of transactions are affected. Exchange differences arising on settlement of foreign currency transactions are recognized in the Statement of Profit and Loss.
- b. Monetary items denominated in foreign currency are converted into Indian rupees using the exchange rate prevailing at the date of the Balance Sheet and the resulting exchange difference is recognized in the Statement of Profit and Loss.

iii) Property, Plant and Equipment: -

- a. Property, Plant and Equipment are stated at Cost, less accumulated depreciation/amortization and impairment loss, if any.
- b. In case of Additions or deletions to the assets, depreciation is provided pro-rata from the date of use or disposal except in case of assets costing ₹ 5000/- or less in each case, where depreciation for the full year is provided at the rate of 100% in the year of acquisition.
- c. In case of assets for which the Corporation has received grants from the government, depreciation is adjusted proportionately out of the “Capital Grants received from Government Grants” and only the balance amount of depreciation in respect of the proportion of assets financed by the Corporation is debited to Profit & Loss Account.
- d. The cost of an item of property, plant and equipment comprises:
 - i. Its purchase price, including import duties and non-refundable purchase taxes, after deducting trade discounts and rebates.
 - ii. Any costs directly attributable to bringing the asset to the location and condition necessary for it to be capable of operating in the manner intended by management.
 - iii. The initial estimate of the costs of dismantling and removing the item and restoring the site on which it is located, the obligation for which an entity incurs either when the item is acquired or as a consequence of having used the item during a particular period for purposes other than to produce inventories during that period.
- e. Premium paid on acquisition of leasehold land, is treated as cost.
- f. Capital work-in-progress is carried at cost, comprising direct cost, related incidental expenses and interest on borrowing extent attributed to them.
- g. All expenditure incurred during construction/implementation stage of the project as shown under the head Project and Pre-operative expenditure has been capitalized on pro-rata basis to the cost of various Fixed Assets on commissioning of the Project.
- h. Cost of replacement, major inspection, repair of significant parts and borrowings costs for long-term construction projects are capitalized if the recognition criteria are met.
- i. The gain or loss arising from the derecognition of an item of property, plant and equipment shall be included in profit or loss when the item is derecognized (unless Ind AS 116- Leases requires otherwise on a sale and leaseback).

iv) Intangible Assets

An Intangible Asset is recognized where it is probable that the future economic benefits attributable to the assets will flow to the Corporation and cost of the asset can be measured reliably. Intangible assets are stated at historical cost less accumulated amortization and impairment loss, if any.

v) Investment Property: -

- a. Investment property comprises of completed property, property under construction, property held under finance lease that is held to earn rentals or capital appreciation or both, rather than for sale in ordinary course of business or for the use in production or administrative functions.
- b. Investment properties are stated at cost, net of accumulated depreciation and accumulated impairment losses, if any.
- c. The Corporation depreciates building component of investment property over 60 years from the date of original purchase.
- d. Investment properties are derecognised either when they have been disposed of or when they are permanently withdrawn from use and no future benefit is expected from disposal. Difference between net disposal proceeds and the carrying amount of the asset is recognised in profit and loss account in the period of de-recognition.

vi) Provisions: -

Provisions are recognised in the respect of liabilities which can be measured only by using substantial degree of estimates when:

- a. The Corporation has present obligation as a result of a past event.
- b. Probable outflow of resources embodying economic benefits will be required to settle the obligation; and
- c. The amount of obligation can be reliably estimated. Provisions are reviewed at each balance sheet date.

Discounting of Provisions:

Provisions which are expected to be settled beyond 12 months are measured at the present value by using pre-tax discount rate that reflects the risk specific to the liability. The increase in the provision due to passage of time is recognised as interest expenses.

vii) Revenue**Revenue from Contracts with Customers:**

- a. Revenue from sales is recognised when the same is measurable at the time of rendering of the service and no significant uncertainty exists regarding the amount of the consideration that will be derived from the sale or rendering of services.
- b. Transactions involving sales are based on transfer to the buyer, of all significant risks and reward of ownership in the goods and, in the case of rendering of service, of the eligible performance.
- c. Recognition of revenue is postponed due to the effect of uncertainties of ultimate collection, and revenue is recognised in the period when such uncertainties cease to exist.

Other Revenue Recognition:

Interest income is recognised on time proportion basis taking into account the amount of outstanding at the interest rate applicable and by using Effective Interest Rate Method, wherever required in accordance with Ind-AS.

viii) Lease**a. As a lessee**

- I. The Corporation recognizes a Right-of-Use (ROU) asset and a lease liability at the lease commencement date. The Right-of-Use asset is initially measured at cost, which comprises the initial amount of lease liability adjusted for any lease payments made at or before the commencement date, plus any initial direct cost incurred and an estimate of costs to dismantle and remove the underlying asset or to restore the underlying asset or the site on which it is located, less any lease incentives received.
- II. The Right-of-Use asset is subsequently depreciated using the straight-line method from the commencement date to the earlier of the end of the useful life of the right-of-use-asset or the end of the lease term. The estimated useful life of the right-of-use asset is determined on the same basis as those of property, plant and equipment. In addition, the right-of-use asset is periodically tested for impairment and reduced by impairment losses, if any, and adjusted for certain remeasurements of the lease liability.
- III. The lease liability is initially measured at the present value of the lease payments that are not paid at the commencement date, discounted using the interest rate implicit in the lease or, if that rate cannot be readily determined, the Corporation's incremental borrowing rate.
- IV. The lease liability is measured at amortized cost using the effective interest method, it is remeasured when there is a change in future lease payments from a change in an index or rate. When the lease liability is remeasured in this way, a corresponding adjustment is made to the carrying amount of the Right-of-Use asset, or is recorded in the profit and loss if the carrying amount of the right-of-use asset has been reduced to zero.
- V. The Corporation presents Right-of-Use asset that do not meet the definition of Investment property in the "Property, Plant and Equipment" and lease liabilities in "Financial Liabilities" in the Balance Sheet.
- VI. Short-term Lease and Leases of Low value assets: -The Corporation has elected not to recognize Right-of-

Use asset and lease liabilities for short term leases that have lease term of 12 months or less and Leases of Low value assets. The Corporation recognizes the lease payments associated with these leases as an expense on a straight-line basis over the lease term.

a. As a Lessor

When the Corporation acts as a lessor, it determines at lease inception whether each lease is a finance lease or an operating lease. To classify each lease, the Corporation makes an overall assessment of whether the lease transfers substantially all the risk and rewards incidental to the ownership of the underlying asset. If this is the case, then the lease is a finance lease, if not then it is an operating lease. As part of the assessment, the Corporation considers certain indicators such as whether the lease is for the major part of the economic life of the asset. The Corporation recognizes lease payments received under operating lease as income on a straight-line basis over the lease term as part of "Other Income".

ix) Depreciation and amortization: -

Property Plant and Equipment:

- a. Depreciation on property, plant and equipment(except Right to Use Assets) is provided on Written down value method (WDV) over the useful life of the assets as specified in Schedule II of the Companies Act, 2013.
- b. Depreciation on assets purchased/sold during the year is charged on prorata basis as per Companies Act, 2013.

The estimated useful life of assets for current and comparative period of significant items of property, plant and equipment's are as follows –

Particulars	Useful life
Building	up to 60 years
Plant and Machinery	15 years
Computers	3 years
Office Equipment	5 years
Furniture and Fixtures	10 years
Vehicles	8 years
Right-of-Use Assets	Lease Term

- c. Leasehold improvements are amortised over the lower of estimated useful life as computed under schedule-II and lease term from the year in which such improvements are capitalized.
- d. Depreciation methods, useful lives and residual values are reviewed at each reporting date.
- e. Premium on leasehold land, other than on perpetual lease, is amortized over the period of the lease.

Intangible Assets

Intangible assets are amortized over their respective estimated useful lives on a straight-line basis from the date that they are available for use.

The estimated useful life of intangibles are as follows:

Intangible Assets	Useful Life
Software	up to 5 years
BT Cotton License	10 years

Amortization methods, useful lives and residual values are reviewed at each reporting date.

x) Impairment of non-financial assets

- a. In accordance with Ind AS-36 Impairment of Assets, the carrying amount of Corporation's assets are reviewed at each Balance Sheet date to determine whether there is any indication of impairment.

- b. An asset is treated as impaired when the carrying cost of assets exceeds its recoverable value and impairment loss is charged to the Statement of Profit and Loss in the year in which an asset is identified as impaired.
- c. At each reporting date Corporation assesses the estimate amount of impairment loss. The impairment loss recognized in prior accounting period(s) is reversed if there has been a change in the estimate of recoverable amount and such losses either no longer exist or has decreased. Reversal of impaired loss is recognized in the Statement of Profit and Loss.

xi) Inventory

- a. Stock of Seeds, packing material and other material, is taken into account on the basis of physical verification and as certified by the management.
- b. Stock of seeds is valued at cost or market price whichever is lower. Cost includes cost of conversion and other costs incurred in bringing the inventories to their present location and condition.
- c. Stock of mixture of seeds is valued at estimated realizable value.
- d. Packing materials issued to the farmers under seed production programmes have been treated as consumed and have not been considered for inventory valuation. Realizable/scrap value thereof is credited to miscellaneous receipt in the year of sale as per the consistent practice followed by the Corporation.
- e. Stock of stores, packing and processing materials, is valued at cost except in case of recycled gunny bags which are valued at estimated realizable value.
- f. Low value items of dead stock like calculators etc., which are minor in nature, are directly expensed in Profit & Loss Account in the year of purchase.

xii) Borrowing Cost

- a. Borrowing costs that are attributable to the acquisition or construction of qualifying assets are capitalized as part of the cost of such assets. A qualifying asset is one that necessarily takes a substantial period of time to get ready for its intended use or sale.
- b. All other borrowing costs, as incurred, are charged to the Statement of Profit and Loss.

xiii) Government Grants

General:

- a. All subsidies, whether capital or revenue, under various schemes are accounted for on accrual basis when there is a reasonable assurance that the Corporation will comply with the conditions attached to the grant and where such benefits have been earned by the Corporation and the ultimate collection of the grant is reasonably certain.
- b. The Corporation has also received government grants as a Nodal Agency for disbursement of various kinds of subsidies under the schemes announced by the Central and State Governments from time to time. In such cases, the Corporation receives in advance the monies ear-marked for subsidies which are accounted for as liability and are disclosed separately under the head "current liabilities". The amounts disbursed out of these funds are adjusted by debiting to this head and crediting to unpaid subsidy on the basis of sanctions made by the competent authority till the end of the financial year. However, the amounts of subsidy receivable by the Corporation under various scheme, which are eligible to be adjusted against such grants, are adjusted on the basis of claims made by the Corporation which are eligible for adjustments against the schemes up to the end of the year. Adjustments if any consequent upon the actual receipt of sanction are made and as when sanction is received. However, ordinarily there are no such adjustments required to be made.

Capital Grants:

Grants received against creation of fixed assets are disclosed separately below the head "Reserves and Surplus". The capital grants which are against non-depreciable assets are treated as reserves and are disclosed separately whereas the grant received against depreciable fixed assets is credited under the head "Capital Grant received from Government" and the entire gross block and net block of fixed assets irrespective of quantum of grant received against them, is shown at aggregate values in the schedule of fixed assets. Every year, an amount is withdrawn from the "Capital Grant received from Government" in proportion to the grant financed component of the fixed assets, on pro-rata basis on the current depreciation, and is adjusted against the current depreciation charge debited to the Profit and Loss account. This accounting treatment is in conformity with the requirements of Indian Accounting Standard 16 -Property, Plant and Equipment and Indian Accounting Standard 20 -Accounting for Government Grants

Revenue Grants:

Revenue grants are recognized on the basis of accrual, as and when Corporation becomes eligible to receive the grants, in the manner as mentioned above. The same are disclosed separately under the head "Other Operating Revenue" in Profit and Loss account.

xiv) Employee Benefits**Post employee benefits and other long term benefits plans:****Gratuity:**

To meet its liability towards gratuity covering eligible employee in compliance of Ind-AS 19 Employee Benefits, Corporation has taken a Group Gratuity Policy with the Life Insurance Corporation of India through an irrevocable trust to cover full accruing liability of Gratuity, as per the Gratuity Rules framed by the Corporation, under The Payment of Gratuity Act, 1972 as amended from time to time, under Cash Accumulation Scheme.

Leave Encashment:

Corporation has taken a Group Leave Encashment Scheme Policy with Life Insurance Corporation [LIC] to cover the full accruing liability on actuarial valuation of earned leave, which is accounted for as per statement of LIC, as per Ind-AS 19.

Provident Fund:

The Corporation makes contributions to a statutory provident fund in accordance with the Employee Provident Funds and Miscellaneous Provisions Act, 1952. The Corporation's contributions to Provident Fund is considered as defined contribution plan and are charged as an expense in the Statement of profit and loss account based on the amount of contribution required to be made and when service is rendered by the employees.

Short Term Employee Benefits

The undiscounted amount of short-term employee benefits expected to be paid in exchange for the services rendered by the employees, is recognized as an expense during the period when the employees rendered those services.

xv) Taxes**Current income tax**

- a. Tax expense for the year comprises of current income tax and deferred tax.
- b. Current tax is measured at the amount expected to be paid to the tax authorities using the applicable tax rates.
- c. The tax rates and tax laws used to compute the amount are those that are enacted or substantively enacted, at the reporting date in the countries where the Corporation operates and generates taxable income.
- d. Current tax related to OCI Items is recognized in Other Comprehensive Income (OCI).

Deferred tax

In accordance with the Indian Accounting Standard (Ind-AS 12) "Income Taxes" issued by the Institute of Chartered Accountants of India.

- a. Deferred income tax assets and liabilities are recognized for temporary differences which is computed using the tax rates and tax laws that have been enacted or substantively enacted at the reporting date.
- b. Deferred income tax assets are recognized to the extent that it is probable that taxable profit will be available against which the deductible temporary differences, and the carry forward of unused tax credits and unused tax losses can be utilized.
- c. The carrying amount of deferred income tax assets is reviewed at each reporting date and reduced to the extent that it is no longer probable that sufficient taxable profit will be available to allow all or part of the deferred income tax asset to be utilized.
- d. Deferred tax related to OCI Item are recognized in Other Comprehensive Income (OCI).

xvi) Earnings Per Share

- a. Basic earnings per share are calculated by dividing the net profit or loss for the period attributable to equity shareholders by the weighted average number of equity shares outstanding during the period. The weighted

average number of equity shares outstanding during the period are adjusted for events of bonus issue and share split.

- b. For the purpose of calculating diluted earnings per share, the net profit or loss for the period attributable to equity shareholders and the weighted average number of shares outstanding during the period are adjusted for the effects of all dilutive potential equity shares.

xvii) Provision, Contingent Liabilities and Contingent Assets

- a. A provision is recognized for a present obligation as a result of past events and it is probable that an outflow of resources will be required to settle the obligation, in respect of which a reliable estimate can be made. Provisions are not discounted to its present value and are determined based on management estimates required to settle the obligation at the balance sheet date
- b. Contingent Liabilities are disclosed in either of the following cases:
1. A present obligation arising from a past event, when it is not probable that an outflow of resources will be required to settle the obligation; or
 2. A reliable estimate of the present obligation cannot be made; or
 3. A possible obligation, unless the probability of outflow of resource is remote.
- c. Contingent assets are disclosed where an inflow of economic benefits is probable.
- d. Provisions, Contingent Liability and Contingent Assets are reviewed at each Reporting date and adjusted to reflect the current management estimates.
- e. Contingent Liability is net of estimated provisions considering possible outflow on settlement.

xviii) Fair Value Measurement

The Corporation measures certain financial instruments at fair value at each balance sheet date.

Fair value is the price that would be received to sell an asset or paid to transfer a liability in an orderly transaction between market participants at the measurement date. The fair value measurement is based on the presumption that the transaction to sell the asset or transfer the liability takes place either:

- In the principal market for the asset or liability
- Or
- In the absence of a principal market, in the most advantageous market for the asset or liability.

The principal or the most advantageous market must be accessible by the Corporation.

The fair value of an asset or a liability is measured using the assumptions that market participants would use when pricing the asset or liability, assuming that market participants act in their economic best interest.

A fair value measurement of a non-financial asset takes into account a market participant's ability to generate economic benefits by using the asset in its highest and best use or by selling it to another market participant that would use the asset in its highest and best use.

The Corporation uses valuation techniques that are appropriate in the circumstances and for which sufficient data are available to measure fair value, maximising the use of relevant observable inputs and minimising the use of unobservable inputs.

All assets and liabilities for which fair value is measured or disclosed in the financial statements are categorised within the fair value hierarchy, described as follows, based on the lowest level input that is significant to the fair value measurement as a whole:

- Level 1 - Quoted (unadjusted) market prices in active markets for identical assets or liabilities.
- Level 2 - Valuation techniques for which the lowest level input that is significant to the fair value measurement is directly or indirectly observable.
- Level 3 - Valuation techniques for which the lowest level input that is significant to the fair value measurement is unobservable.

For assets and liabilities that are recognised in the financial statements on a recurring basis, the Corporation determines whether transfers have occurred between levels in the hierarchy by re-assessing categorisation (based

on the lowest level input that is significant to the fair value measurement as a whole) at the end of each reporting period.

The Corporation's management determines the policies and procedures for both recurring fair value measurement and for non-recurring measurement. External valuers are involved for valuation of significant assets. Involvement of external valuers is decided upon by the management after discussion with and approval by the Corporation's Audit Committee. Selection criteria include market knowledge, reputation, independence and whether professional standards are maintained. Valuers are normally rotated every three years. The management decides, after discussions with the Corporation's external valuers, which valuation techniques and inputs to use for each case.

At each reporting date, the management analyses the movements in the values of assets and liabilities which are required to be re-measured or re-assessed as per the Corporation's accounting policies. For this analysis, the management verifies the major inputs applied in the latest valuation by agreeing the information in the valuation computation to contracts and other relevant documents.

The management, in conjunction with the Corporation's external valuers, also compares the change in the fair value of each asset and liability with relevant external sources to determine whether the change is reasonable on yearly basis.

For the purpose of fair value disclosures, the Corporation has determined classes of assets and liabilities on the basis of the nature, characteristics and risks of the asset or liability and the level of the fair value hierarchy, as explained above.

This note summarises accounting policy for fair value. Other fair value related disclosures are given in the relevant notes.

- Disclosures for valuation methods, Significant accounting judgements, estimates and assumptions
- Quantitative disclosures of fair value measurement hierarchy
- Financial instruments (including those carried at amortised cost)

xix) Dividend to equity holders

Dividend paid/payable is recognized in the year in which the related dividends are approved by shareholders or Board of Directors as appropriate.

xx) Financial instruments: -

Initial Recognition:

Financial Assets and Liabilities are recognized when the Corporation becomes a party to the contractual provisions of the instrument. Financial assets and liabilities are initially measured at fair value. Transaction costs that are directly attributable to the acquisition or issue of financial assets and financial liabilities (other than financial assets and financial liabilities at fair value through profit or loss) are added to or deducted from the fair value measured on initial recognition of financial asset or financial liability.

Subsequent measurement

a. Financial Assets

Financial assets are classified in following categories:

I. At Amortized Cost

Financial assets are subsequently measured at amortized cost if these financial assets are held within a business whose objective is to hold these assets in order to collect contractual cash flows and the contractual terms of the financial asset give rise on specified dates to cash flows that are solely payments of principal and interest on the principal amount outstanding.

II. At Fair Value through Other Comprehensive Income

- i. Financial assets are measured at fair value through other comprehensive income if these financial assets are held within a business whose objective is achieved by both collecting contractual cash flows and selling financial assets and the contractual terms of the financial asset give rise on specified dates to cash flows that are solely payments of principal and interest on the principal amount outstanding.
- ii. The Corporation has made an irrevocable election to present in other comprehensive income subsequent changes in the fair value of equity irrevocable not held for trading.

III. At Fair Value through Profit and Loss

Financial assets are measured at fair value through profit or loss unless it is measured at amortized cost or at fair value through other comprehensive income on initial recognition. The transaction costs directly attributable to the acquisition of financial assets and liabilities at fair value through profit or loss are immediately recognized to profit or loss.

b. Financial Liabilities

Financial Liabilities are classified as follows:

I. At Amortized Cost

Financial liabilities at amortized cost represented by trade and other payables, dealer deposits etc. are initially recognized at fair value, and subsequently carried at amortized cost using the effective interest rate method.

II. At Fair Value Through Profit and Loss (FVTPL)

The Corporation has not designated any financial liabilities at Fair Value Through Profit and Loss (FVTPL).

De-recognition

a. Financial Asset

A financial asset (or, where applicable, a part of a financial asset or part of a group of similar financial assets) is derecognized only when the contractual rights to the cashflows from the asset expires or it transfers the financial assets and substantially all risks and rewards of the ownership of the asset.

b. Financial Liability

A financial liability is derecognized when the obligation under the liability is discharged or cancelled or expires. When an existing financial liability is replaced by another from the same lender on substantially different terms, or the terms of an existing liability are substantially modified, such an exchange or modification is treated as a derecognition of the original liability and the recognition of a new liability, and the difference in the respective carrying amounts is recognized in the statement of profit and loss.

Impairment of financial assets: -

Corporation applies expected credit loss (ECL) model for measurement and recognition of impairment loss. The Corporation follows simplified approach for recognition of impairment loss allowance on trade receivable and other financial assets. The application of simplified approach does not require the Corporation to track changes in credit risk. Rather, it recognizes impairment loss allowance based on lifetime ECLs at each reporting date, right from its initial recognition.

Corporation assesses on a forward-looking basis the expected credit losses associated with its assets carried at amortized cost and FVTOCI debt instruments. The impairment methodology applies on whether there has been significant increase in credit risk.

ECL impairment loss allowance (or reversal) recognized during the period is recognized as income/expense in the statement of profit and loss.

Dues under trade receivables, loans and advances and other Current Assets against the parties for a period of equal to or less than three years are considered good and accordingly provision is made for doubtful debt.

Reclassification of financial assets:

The Corporation determines classification of financial assets and liabilities on initial recognition. After initial recognition, no reclassification is made for financial assets which are equity instruments and financial liabilities. For financial assets which are debt instruments, a reclassification is made only if there is a change in the business model for managing those assets. Changes to the business model are expected to be infrequent. The Corporation's senior management determines change in the business model as a result of external or internal changes which are significant to the Corporation's operations. If the corpora reclassifies financial assets, it applies the reclassification prospectively from the reclassification date which is the first day of the immediately next reporting period following the change in business model as per Ind AS 109.

Offsetting of financial instruments:

Financial assets and financial liabilities are offset and the net amount is reported in the balance sheet if there is a currently enforceable legal right to offset the recognised amounts and there is an intention to settle on a net basis, to realise the assets and settle the liabilities simultaneously.

xxi) Current versus non-current classification

The Corporation presents assets and liabilities in the Balance Sheet based on current/non-current classification.

An asset is current when it is:

- Expected to be realised or intended to be sold or consumed in the normal operating cycle;
- Held primarily for the purpose of trading;
- Expected to be realised within twelve months after the reporting period; or
- Cash or cash equivalent unless restricted from being exchanged or used to settle a liability for at least twelve months after the reporting period.

All other assets are classified as non-current.

A liability is current when:

- It is expected to be settled in the normal operating cycle;
- It is held primarily for the purpose of trading;
- It is due to be settled within twelve months after the reporting period; or
- There is no unconditional right to defer the settlement of the liability for at least twelve months after the reporting period.

Operating cycle of the Corporation is the time between the acquisition of assets for processing and their realisation in cash or cash equivalents. As the Corporation's normal operating cycle is not clearly identifiable, it is considered to be twelve months.

The Corporation classifies all other liabilities as non-current.

xxii) New Accounting standards, amendments and interpretations adopted by the Corporation effective from April 1, 2023:

Ministry of Corporate Affairs (“MCA”) notifies new standard or amendments to the existing standards under Companies (Indian Accounting Standards) Rules as issued from time to time. On March 31, 2023, MCA amended the Companies (Indian Accounting Standards) Amendment Rules, 2023, applicable from April 1, 2023, as below:

A. Ind AS 1 – Presentation of Financial Statements

The amendments require companies to disclose their material accounting policies rather than their

significant accounting policies. Accounting policy information, together with other information, is material when it can reasonably be expected to influence decisions of primary users of general purpose financial statements. The company does not expect this amendment to have any significant impact in its financial statements.

B. Ind AS 12 – Income Taxes

The amendments clarify how companies account for deferred tax on transactions such as leases and decommissioning obligations. The amendments narrowed the scope of the recognition exemption in Paragraphs 15 and 24 of Ind AS 12 (recognition exemption) so that it no longer applies to transactions that, on initial recognition, give rise to equal taxable and deductible temporary differences. The company is evaluating the impact, if any, in its financial statements.

C. Ind AS 8

The amendments will help entities to distinguish between accounting policies and accounting estimates. The definition of a change in accounting estimates has been replaced with a definition of accounting estimates. Under the new definition, accounting estimates are “monetary amounts in financial statements that are subject to measurement uncertainty”. Entities develop accounting estimates if accounting policy requires items in financial statements to be measured in a way that involves measurement uncertainty. The company does not expect this amendment to have any significant impact in its financial statements.

xxiii) New Amendments not yet adopted by the Corporation:

A. Code on Social Security, 2020:

The Indian Parliament has approved the Code on Social Security, 2020 which would impact the contributions by the Corporation towards Provident Fund and Gratuity. The Ministry of Labour and Employment had released draft rules for the Code on Social Security, 2020 on November 13, 2020, and invited suggestions from stakeholders which are under consideration by the Ministry. The Corporation will assess the impact and its evaluation once the subject rules are notified. The Corporation will give appropriate impact in its financial statements in the period in which, the Code becomes effective and the related rules to determine the financial impact are published.

Notes on Financial Statement for the year ended 31st March 2023

Note:- 3

Property, Plant and Equipment

(₹ in Lakhs)

Particulars	Freehold Land	Site Development	Leasehold Land	Land at Rajkot for Godown	Building	Plant and Machinery	Furniture and Fixtures	Office Equipment	Computer	Vehicles	Laboratory Equipment	Right of Use Assets (Building)	Total
Gross Block													
As at 31st March, 2021	52.04	7.08	0.31	850.01	4,719.32	635.34	253.02	233.40	117.60	152.29	6.12	32.44	7,058.97
Additions	-	-	-	-	345.98	0.23	-	29.63	5.94	-	-	10.60	392.38
Disposals / Adjustments	-	-	(0.01)	-	-	-	-	-	(8.11)	(3.06)	-	(32.44)	(43.62)
As at 31st March, 2022	52.04	7.08	0.30	850.01	5,065.30	635.57	253.02	263.03	115.43	149.23	6.12	10.60	7,407.73
Additions	-	-	-	-	7.08	0.77	16.30	3.13	-	8.69	-	21.91	57.88
Disposals/Adjustments	-	(7.08)	(0.01)	-	-	-	-	-	-	(5.44)	-	-	(12.53)
As at 31st March, 2023	52.04	-	0.29	850.01	5,072.38	636.34	269.32	266.16	115.43	152.48	6.12	32.51	7,453.08
Accumulated Depreciation and Impairment													
At 31st March, 2021	-	-	-	-	1,367.10	507.16	120.53	147.46	108.91	118.20	5.88	21.89	2,397.13
Depreciation charge for the year	-	-	-	-	202.02	22.12	33.91	49.71	4.02	8.83	-	11.79	332.40
Disposal/Adjustments	-	-	-	-	-	-	-	-	(7.70)	(2.91)	-	(32.44)	(43.05)
As At 31st March, 2022	-	-	-	-	1,569.12	529.28	154.44	197.17	105.23	124.12	5.88	1.24	2,686.48
Depreciation charge for the year	-	-	-	-	196.89	23.48	28.93	34.15	-	6.71	-	10.64	300.80
Disposal/Adjustments	-	-	-	-	-	-	-	-	-	(5.17)	-	-	(5.17)
As At 31st March, 2023	-	-	-	-	1,766.01	552.76	183.37	231.32	105.23	125.66	5.88	11.88	2,982.11
Net Carrying Values													
As At 31st March, 2023	52.04	-	0.29	850.01	3,306.37	83.58	85.95	34.84	10.20	26.82	0.24	20.63	4,470.97
As At 31st March, 2022	52.04	7.08	0.30	850.01	3,496.18	106.29	98.58	65.86	10.20	25.11	0.24	9.36	4,721.25

Note :-

- 1) All the immovable properties owned by the corporation are in its own name as on 31st March, 2023.
- 2) During the F.Y. 2022-23, there is no acquisition of any item of Property, plant and equipment as a result of business combination.
- 3) The Corporation follows cost model of recognition for all the items of Property, Plant and equipment and hence no revaluation is undertaken during F. Y. 2022-23

Note : 4 : Capital Work in Progress

(₹ in Lakhs)

Particulars	As at 31st March, 2023	As at 31st March, 2022
Balance as on beginning of the year	23.44	182.25
Additions	5.81	182.87
Deductions	(4.63)	(4.30)
Capitalized	(24.62)	(337.38)
Balance as on end of the year	-	23.44
Total :	-	23.44

Note 4.1 Capital Work-in-Progress ageing**a) For Projects in progress and Projects temporarily suspended**

Ageing for capital work-in-progress as at March 31, 2023 is as follows:

(₹ in lakhs)

Particulars	Amount in capital work-in-progress for a period of				Total
	Less than 1 year	1-2 years	2-3 years	More than 3 years	
Projects in progress	-	-	-	-	-
Projects temporarily suspended	-	-	-	-	-
Total Capital work in progress	-	-	-	-	-

Ageing for capital work-in-progress as at March 31, 2022 is as follows :

(₹ in lakhs)

Particulars	Amount in capital work-in-progress for a period of				Total
	Less than 1 year	1-2 years	2-3 years	More than 3 years	
Projects in progress	18.81	-	4.63	-	23.44
Projects temporarily suspended	-	-	-	-	-
Total Capital work in progress	18.81	-	4.63	-	23.44

b) For projects whose completion is overdue or has exceeded its cost compared to its original plan

As on March 31, 2023

(₹ in lakhs)

Particulars	To be completed in				Total
	Less than 1 year	1-2 years	2-3 years	More than 3 years	
Projects whose completion is overdue	-	-	-	-	-
Project whose cost has exceeded as compared to its original plan	-	-	-	-	-

As on March 31, 2022

(₹ in lakhs)

Particulars	To be completed in				Total
	Less than 1 year	1-2 years	2-3 years	More than 3 years	
Projects whose completion is overdue	-	-	-	-	-
Project whose cost has exceeded as compared to its original plan	-	-	-	-	-

Note : 5 : Investment Property

(₹ in lakhs)

Particulars	Building	Total
Gross Block		
As at 1st April, 2021	15.70	15.70
Additions -	-	-
Disposals -	-	-
As at 31st March, 2022	15.70	15.70
Additions -	-	-
Disposals -	-	-
As at 31st March, 2023	15.70	15.70
Accumulated Depreciation and Impairment		
As at 1st April, 2021	10.82	10.82
Depreciation charge during year	0.25	0.25
Disposals -	-	-
As at 31st March, 2022	11.07	11.07
Depreciation charge during year	0.22	0.22
Disposals -	-	-
As at 31st March, 2023	11.29	11.29
Net Carrying Amount		
At 31st March, 2023	4.41	4.41
At 31st March, 2022	4.63	4.63

Information regarding Income and Expenditure of Investment property

(₹ in lakhs)

Particulars	Year Ended 31st March, 2023	Year Ended 31st March, 2022
Rental Income derived from Investment property	2.63	2.63
Direct operating expenses (Including repairs and maintenance) generating rental income	-	-
Direct operating expenses (Including repairs and maintenance) that did not generating rental income	-	-
Profit arising from Investment properties before depreciation	2.63	2.63
Less : Depreciation	(0.22)	(0.25)
Profit arising from Investment properties	2.41	2.38

Note:-

Contractual commitment for purchase, construction or development of investment property or for its repair maintenance or enhancement are Nil.

Estimation of Fair Value

The Corporation has not obtained independent valuation for its investment properties. The best evidence of fair value is current prices in active market for similar properties.

Note : 6 Other Intangible Assets

(₹ in Lakhs)

Particulars	Computer Software	B.T.Cotton Licence Fees	Total
Gross Block			
As at 1st April, 2021	6.31	55.67	61.98
Additions -	-	-	-
Disposal/Adjustments	-	-	-
As at 31st March, 2022	6.31	55.67	61.98
Additions -	-	-	-
Disposal/Adjustments	-	-	-
As at 31st March, 2023	6.31	55.67	61.98
Accumulated Depreciation and Impairment			
As at 1st April, 2021	5.98	43.34	49.32
Depreciation charge for the year	-	5.57	5.57
Disposal/Adjustments	-	-	-
As at 31st March, 2022	5.98	48.91	54.89
Depreciation charge for the year	-	-	-
Disposal/Adjustments	-	-	-
As at 31st March, 2023	5.98	48.91	54.89
Net Carrying Values			
As at 31st March, 2022	0.33	6.76	7.09
As at 31st March, 2023	0.33	6.76	7.09

Note:- 7 : Other Financial Assets - Non Current

(₹ in Lakhs)

Particulars	As at 31st March, 2023	As at 31st March, 2022
Security Deposit		
Unsecured, Considered Good	11.65	9.50
Total :	11.65	9.50

Note:- 8 : Deferred Tax Assets/(Liabilities) [Net]

The balance comprises temporary differences attributable to :

(₹ in Lakhs)

Particulars	As at 31st March, 2023	As at 31st March, 2022
Deferred Tax Liabilities		
Disallowance under section 43B of Income Tax Act, 1961	(26.82)	(6.03)
Total	(26.82)	(6.03)
Deferred Tax Assets		
Provision for Doubtful debts & Advances	12.14	6.96
Impact of Ind AS 116	0.27	0.06
Related to Property Plant and equipment	8.00	12.94
Total	20.41	19.96
Deferred Tax Assets/(Liabilities)	(6.41)	13.93

Note:- 8.1 : Movement in Deferred Tax Assets/Liabilities :

(₹ in Lakhs)

Particulars	PPE and Intangible Assets	Provision u/s 43B	Impact of Ind AS 116	Provisions for Doubtful Debts	Total
At 1st April, 2021	10.93	(20.36)	0.22	7.88	(1.32)
Charged/ (Credited)	-	-	-	-	-
To Profit & Loss	2.00	12.69	(0.16)	(0.93)	13.60
To Other Comprehensive Income	-	1.64	-	-	1.64
At 31st March, 2022	12.93	(6.03)	0.06	6.96	13.92
Charged/ (Credited)	-	-	-	-	-
To Profit & Loss	(4.94)	(4.53)	0.22	5.18	(4.08)
To Other Comprehensive Income	-	(16.26)	-	-	(16.26)
At 31st March, 2023	7.99	(26.82)	0.27	12.14	(6.42)

Income Tax & Deferred Tax**a) Income Tax Expenses**

(₹ in Lakhs)

Particulars	Year Ended 31st March, 2023	Year Ended 31st March, 2022
Current Tax on Profit of the years	645.00	911.00
Adjustments in respect of current income tax of Previous year	-	-
Total Current Tax Expenses	645.00	911.00

b) Deferred Tax

(₹ in Lakhs)

Particulars	Year Ended 31st March, 2023	Year Ended 31st March, 2022
Deferred Tax recognition	4.08	(13.60)
Total Deferred Tax recognition	4.08	(13.60)
Income tax Expenses attributable to continuing operations	649.08	897.40

Note:- 8.2 : Tax related to items recognised in OCI during the year:

(₹ in Lakhs)

Particulars	Year Ended 31st March, 2023	Year Ended 31st March, 2022
Re- measurement of defined benefit plan	(16.26)	1.64
Income tax charged to OCI	(16.26)	1.64

Note:- 8.3 : Reconciliation of tax expenses and the accounting profit multiplied by**India's domestic tax rate for 31st March 2022 and 31st March 2021 :**

(₹ in Lakhs)

Particulars	Year Ended 31st March, 2023	Year Ended 31st March, 2022
Accounting Profit before tax from continuing operations	2,584.07	3,268.03
Profit/(loss) before tax from a discontinued operations	-	-
Accounting Profit before income tax	2,584.07	3,268.03
At Indian Statutory income tax rate of 25.17% (31st March 2021: 25.17%)	650.36	822.50
	-	-
Tax Effect due to Non taxable Income / Other deductible Expenses		
Depreciation	(36.91)	(39.44)
Other Admissible Deduction	(11.22)	(10.95)
Deduction under Chapter VI-A	(15.94)	-
Tax Effect due to Non deductible Expenses		
Depreciation	37.93	44.44
Retired Employee Welfare	20.79	14.33

Particulars	Year Ended 31st March, 2022	Year Ended 31st March, 2021
Other Items including rounding off of tax provision	-	80.12
Impact of Change in rate and other Items	-	-
	645.00	911.00
At Effective Income Tax Rate	24.96%	27.88%

Note:- 8.4 : Tax Expenses for current year reported in statement of profit and loss

(₹ in Lakhs)

Particulars	Year Ended 31st March, 2023	Year Ended 31st March, 2022
Current tax on profit of the year	645.00	911.00
Deferred tax	4.08	(13.60)
Deferred Tax in OCI for re- measurement	(16.26)	1.64
Total tax expense for Current year charged to statement of profit and loss	632.82	899.04

Note : 9 : Inventories

(₹ in Lakhs)

Particulars	As at 31st March, 2023	As at 31st March, 2022
Finished Goods (Refer Note 9.1)	6,005.41	4,482.73
Certificaton, packing and Treatment Materials (At Cost Value)	659.09	955.32
Total :	6,664.50	5,438.05
Note : Valuation is as per taken and certified by the Management.		

Note : 9.1 : Finished Goods

(₹ in Lakhs)

Particulars	As at 31st March, 2022	As at 31st March, 2021
1. Seeds Breeder (At lower of Cost or Net Realisable Value)	0.27	4.12
2. Seeds Foundation (At lower of Cost or Net Realisable Value)	2,243.78	811.20
3. Seeds Certified and General (At lower of Cost or Net Realisable Value)	3,730.37	3,628.92
4. Seeds Mixture (At Net Realisable Value)	30.99	38.50
Total :	6,005.41	4,482.73

Note:- 10: Current Investment

(₹ in Lakhs)

Particulars	As at 31st March, 2023	As at 31st March, 2022
a) Investment in Deposits recognised at Amortized cost Deposits with GSFS*	25,307.48	23,300.00
Total of Current Investment	25,307.48	23,300.00
*Note: For related party transactions - Refer Note: 36(11.D)		

Note : 11 : Trade Receivables

(₹ in Lakhs)

Particulars	As at 31st March, 2023	As at 31st March, 2022
Receivable from Others		
Outstanding for period exceeding six months	805.90	2,043.82
Outstanding for period less than six months	3,609.97	1,729.15
Less: Receivables - Credit Impaired	(48.23)	(27.64)
Unsecured Considered good	4,367.64	3,745.33
Unsecured Considered Doubtful	48.23	27.64
Less: Credit loss allowance	(48.23)	(27.64)
Total Trade Receivables	4,367.64	3,745.33

Note : 11.1 Ageing of Trade Receivables

Ageing for trade receivables - current outstanding as at March 31, 2023 is as follows:

Particulars	Outstanding for following periods from due date of payment					
	Less than 6 Months	6 Months - 1 year	1 - 2 years	2-3 years	More than 3 years	Total
a) Undisputed Trade Receivables						
(i) Considered good	3,534.11	462.10	359.61	12.08	-	4,367.90
(ii) Which have significant increase in credit risk	-	-	-	-	48.23	48.23
(iii) Credit impaired	-	-	-	-	-	-
b) Disputed Trade Receivables						
(I) Considered good	-	-	-	-	-	-
(ii) Which have significant increase in credit risk	-	-	-	-	-	-
(iii) Credit impaired	-	-	-	-	-	-
	3,534.11	462.10	359.61	12.08	48.23	4,416.13
Less : Allowance for Doubtful Debts	-	-	-	-	(48.23)	(48.23)
Total:	3,534.11	462.10	359.61	12.08	-	4,367.90

Ageing for trade receivables - current outstanding as at March 31, 2022 is as follows:

(₹ in Lakhs)

Particulars	Outstanding for following periods from due date of payment					
	Less than 6 Months	6 Months - 1 year	1 - 2 years	2-3 years	More than 3 years	Total
a) Undisputed Trade Receivables						
(i) Considered good	1,946.53	1,513.50	282.49	2.81	-	3,745.33
(ii) Which have significant increase in credit risk	-	-	-	-	27.64	27.64
(iii) Credit impaired	-	-	-	-	-	-
b) Disputed Trade Receivables						
(I) Considered good	-	-	-	-	-	-
(ii) Which have significant increase in credit risk	-	-	-	-	-	-
(iii) Credit impaired	-	-	-	-	-	-
	1,946.53	1,513.50	282.49	2.81	27.64	3,772.97
Less : Allowance for Doubtful Debts	-	-	-	-	(27.64)	(27.64)
Total:	1,946.53	1,513.50	282.49	2.81	-	3,745.33

Note : 12 : Cash and Cash equivalents

(₹ in Lakhs)

Particulars	As at 31st March, 2023	As at 31st March, 2022
(a) Balances with Banks in Current Account	6,614.67	10,700.63
(b) Cash on hand	0.47	0.40
Total :	6,615.14	10,701.03

Note : 13 : Other Financial Assets-Current

(₹ in Lakhs)

Particulars	As at 31st March, 2023	As at 31st March, 2022
a) Accured		
Interest accured on Deposits	425.67	442.87
b) Other receivables (Recoverable from Govt of Gujarat against subsidy)		
Unsecured, Considered Good	9.52	242.19
c) Recoverable from staff		
Unsecured, Considered Good	(0.35)	0.12
Sub Total (a)	(0.35)	0.12
Unsecured, Considered Doubtful	0.98	0.98
Less : Allowances for Doubtful claims	(0.98)	(0.98)
Sub Total (b)	-	-
Total (a+b)	(0.35)	0.12
Total :	434.84	685.17

Note : 14 : Current Tax Assets (Net)

(₹ in Lakhs)

Particulars	As at 31st March, 2023	As at 31st March, 2022
Advance Tax and Tax Deducted At Source (a)	4,018.59	3,424.47
Less:		
Balance as at the beginning of the year	3,354.00	2,443.00
Additions for the year	645.00	911.00
Amounts utilized during the year	-	-
Current Tax Liabilities (b)	(3,999.00)	(3,354.00)
Total : (a-b)	19.59	70.47

Note : 15 : Other Current Assets

(₹ in Lakhs)

Particulars	As at 31st March, 2023	As at 31st March, 2022
a) Other Advances		
Advance to Producers		
Unsecured, Considered Good	40.80	146.16
Advance to Others		
Unsecured, Considered Good	57.21	35.09
b) Others		
Prepaid Expenses	19.32	22.56
Advance Payment for Plan Assets of Gratuity & Leave Encashment	140.25	92.80
Other receivable (Refer Point 36(7) in Notes forming part of accounts)	77.58	77.58
c) Advance to Staff		
Unsecured, Considered Doubtful (Refer Note 36(4))	6.15	6.15
Less : Allowance for Doubtful Advances	(6.15)	(6.15)
Sub Total (b)	-	-
Total :	335.16	374.18

Note : 16 : Equity Share Capital

(₹ in Lakhs)

Particulars	As at 31st March, 2023	As at 31st March, 2022
	Authorised Share Capital 400000 (previous year 400000) Equity Shares of 100 each	400.00
	400.00	400.00
Issued/Subscribed and Paid up Capital 393000 (previous year 393000) Equity Shares of 100 each	393.00	393.00
	393.00	393.00

(I) Reconciliation of the number of equity shares and share capital outstanding

(₹ in Lakhs)

Particulars	As at 31st March 2023		As at 31st March 2022	
	No of Shares	Amount	No of Shares	Amount
Shares outstanding at the beginning of the year	3,93,000	393.00	3,93,000	393.00
Add : Shares issued during the year	-	-	-	-
Issued/ Subscribed and Paid up equity Capital outstanding at the end of the year	3,93,000	393.00	3,93,000	393.00

(ii) Terms/Rights Attached to Equity Shares

The Corporation has one class of equity shares having a par value of ₹ 100 per share. Each shareholder is eligible for one vote per share held. The dividend proposed/ to be proposed by the Board of Directors is subject to approval of the shareholders in the ensuing Annual General Meeting.

(ii) Disclosure of Promoter holding

Name of Promoter	As at 31st March 2023		
	No of Shares	Amount	Change During the year
Government of Gujarat	3,75,000	95.42%	-
Total:-	3,75,000	95.42%	-

Name of Promoter	As at 31st March 2022		
	No of Shares	Amount	Change During the year
Government of Gujarat	3,75,000	95.42%	-
Total:-	3,75,000	95.42%	-

(iii) Details of share held by each shareholder holding more than 5% Shares in the company

(₹ in Lakhs)

Name of Promoter	As at 31st March 2023		As at 31st March 2022	
	No of Shares	Amount	No of Shares	Amount
The Governor of Gujarat and his Nominees on behalf of the Government of Gujarat	3,75,000	95.42%	3,75,000	95.42%
Total:	3,75,000	95.42%	3,75,000	95.42%

- (iv) a. The corporation has issued equity shares with face value of ₹100/- each fully paid up.
b. No preference shares have been issued by the corporation.
c. No convertible debentures, bonds, Convertible term loan, share warrants has been issued by the corporation.
d. No forfeiture of shares have been done by the corporation and Consequently there is no reissue of forfeiture shares.
e. The corporation did not buy back its own shares so far.

(v) Aggregate number of equity shares issued for consideration other than cash, bonus shares issued and shares bought back during the year:-

Particulars	As at 31st March, 2023	As at 31st March, 2022
Equity shares issued for consideration other than cash	-	-
Equity shares issued as full paid up bonus shares	-	-
Equity bought back	-	-

Note : 17 : Other Equity

(₹ in Lakhs)

Particulars	As at 31st March, 2023	As at 31st March, 2022
(a) Retained Earnings		
Balance as at the beginning of the year	31,513.06	29,182.31
Add: Prior Period Adjustment	-	4.30
Restated Balance as at the beginning of the year	31,513.06	29,186.61
Add : Net Profit / (Loss) for the year	1,934.99	2,370.63
Less : Dividend paid	(39.30)	(39.30)
Add/Less : Re-measurement of defined benefit plans (Net of tax effect)	48.34	(4.87)
Balance as at the end of the year	33,457.09	31,513.06
(b) Remeasurement of Defined Benefit Plans		
Opening Balance	-	-
Add/Less : Movement during the year	48.34	(4.87)
Less : Transfer to retained earnings	(48.34)	4.87
Closing Balance	-	-
(c) Other Reserves		
(i) Capital Subsidy (Grant against Non Depreciable Assets):		
Balance as at the beginning of the year	7.08	7.08
Add : Addition during the year	-	-
Less : Utilized during the year	(7.08)	-
Balance as at the end of the year	0.00	7.08
(Total (a+b+c):	33,457.09	31,520.14

Note : 18 : Capital Grant received from Government

(₹ in Lakhs)

Particulars	Under Grant							NSP - III				Grant Unused	Total
	Buildings	Plant and Machinery	Office Equipments	Computer	Laboratory Equipments	Furniture and Fixtures	Buildings	Plant and Machinery	office Equipments	Quality Control Lab			
Balance as on 31st March, 2021	2,727.00	28.07	0.23	1.14	0.24	0.06	6.62	0.76	0.09	0.15	87.63	2,851.99	
Additions	-	-	-	-	-	-	-	-	-	-	-	-	
Disposals/ Adjustments	-	-	-	(0.25)	-	-	-	-	-	-	-	(0.25)	
Sub Total	2,727.00	28.07	0.23	0.89	0.24	0.06	6.62	0.76	0.09	0.15	87.63	2,851.74	
Adjusted against Depreciation	(156.63)	(4.14)	-	-	-	-	(0.87)	-	-	-	-	(161.64)	
Balance as on 31st March, 2022	2,570.37	23.93	0.23	0.89	0.24	0.06	5.75	0.76	0.09	0.15	87.63	2,690.10	
Additions	-	-	-	-	-	-	7.08	-	-	-	-	7.08	
Disposals / Adjustments	-	-	-	-	-	-	-	-	-	-	-	-	
Sub Total	2,570.37	23.93	0.23	0.89	0.24	0.06	12.83	0.76	0.09	0.15	87.63	2,697.18	
Adjusted against Depreciation	(147.25)	(3.06)	-	-	-	-	-	-	-	-	-	(150.31)	
Balance as on 31st March, 2023	2,423.12	20.87	0.23	0.89	0.24	0.06	12.83	0.76	0.09	0.15	87.63	2,546.87	

Note : 19 : Other Financial liabilities - Non Current

(₹ in Lakhs)

Particulars	As at 31st March, 2023	As at 31st March, 2022
Dealership Deposit*	297.41	290.29
Total :	297.41	290.29

*Note: Above Dealership Deposits represent deposits which are renewed for more than 3 years as on the date of approval of financial statements. Such deposits have been duly recognised at its fair value in accordance with principles of Ind AS 109.

Note : 20 : Other Non current Liabilities

(₹ in Lakhs)

Particulars	As at 31st March, 2023	As at 31st March, 2022
Revolving Fund for strenghtening of Corporation	90.00	90.00
Other Long Term Liabilities	42.72	60.47
Grant / Subsidy Refundable	-	8.72
Deferred Dealership Deposit	-	26.19
Total :	132.72	185.38

Note : 21 : Trade Payables

(₹ in Lakhs)

Particulars	As at 31st March, 2023	As at 31st March, 2022
Total outstanding dues to Micro and Small Enterprises	-	-
Total outstanding dues to Other than Micro and Small Enterprises	1,954.59	2,100.32
Total :	1954.59	2,100.32

Note 21.1 Disclosure under Section 22 of Micro, Small and Medium Enterprise Development (MSMED) Act, 2006.

(₹ in Lakhs)

Particulars	As at 31st March, 2023	As at 31st March, 2022
(a) Principal amount and the interest due thereon remaining unpaid to any suppliers as at the end of accounting year;	-	-
(b) Interest paid during the year	-	-
(c) Amount of payment made to the supplier beyond the appointed day during accounting year;	-	-
(d) Interest due and payable for the period of delay in making payment;	-	-
(e) Interest accrued and unpaid at the end of the accounting year; and	-	-
(f) Further interest remaining due and payable even in the succeeding years, until such date when the interest dues above are actually paid to the small enterprise;	-	-

Note 21.2 : Ageing of Trade Payables

Ageing for trade payables - current outstanding as at March 31, 2023 is as follows :

(₹ in Lakhs)

Particulars	Not Due	Outstanding following periods from the due date of payment				Total
		Less than 1 year	1-2 years	2-3 years	More than 3 years	
Trade Payables MSME*	-	-	-	-	-	-
Others	-	1,823.60	76.49	11.21	43.29	1,954.59
Disputed due - MSME*	-	-	-	-	-	-
Disputed due - Others	-	-	-	-	-	-
Accrued Expenses						
Total:	-	1,823.60	76.49	11.21	43.29	1,954.59

*MSME as per Micro, Small and Medium Enterprises Development Act, 2006

Note 21.2 : Ageing of Trade Payables

Ageing for trade payables - current outstanding as at March 31, 2022 is as follows :

(₹ in Lakhs)

Particulars	Not Due	Outstanding following periods from the due date of payment				Total
		Less than 1 year	1-2 years	2-3 years	More than 3 years	
Trade Payables MSME*	-	-	-	-	-	-
Others	-	2,000.59	21.55	13.26	64.92	2,100.32
Disputed due - MSME*	-	-	-	-	-	-
Disputed due - Others	-	-	-	-	-	-
Accrued Expenses						
Total:	-	2,000.59	21.55	13.26	64.92	2,100.32

*MSME as per Micro, Small and Medium Enterprises Development Act, 2006

Note : 22 : Other Financial liabilities - Current

(₹ in Lakhs)

Particulars	As at 31st March, 2023	As at 31st March, 2022
Dealership Deposit*	124.75	93.00
Total :	124.75	93.00

*Note: Above Dealership Deposits represent deposits which are not renewed as on the date of approval of financial statements.

Note : 23 : Other Current Liabilities

(₹ in Lakhs)

Particulars	As at 31st March, 2023	As at 31st March, 2022
Statutory dues	12.71	17.62
Unpaid due to employees	2.00	31.34
Outstanding Liabilities for Expenses	24.19	54.03
Tender Deposit	17.22	19.71
Rashtriya Krushi Vikas Scheme Cell	4.54	13.02
Govt. Subsidy (Grant fund received as Nodal Agency)	4,490.57	8,643.73
Other Subsidy for infrastructure and others	19.27	33.46
Unpaid Subsidy (Grant as Nodal Agency)	2,882.80	1,494.65
Other Payable Liabilities	1,205.04	823.80
Other Payable (Cheque, DD and RTGS Return)	543.96	412.38
Security Deposit	-	19.89
Deferred Dealership Deposit	26.19	26.19
Total:	9,228.48	11,589.81

Note : 24 : Provisions

(₹ in Lakhs)

Particulars	As at 31st March, 2023	As at 31st March, 2022
Provision for Employees benefits		
Provision for Salary*	41.71	153.58
Provision for Leave Encashment	33.71	68.85
	75.41	222.43

*Note: Provision for salary includes amount of ₹ 19.58 Lakhs provided towards salary payable to employee which is subject matter of litigation. As the corporation does not hold any contractual right to defer this payment and is due on order of court, the same has been classified as current.

Note : 25 : Revenue From Operations

(₹ in Lakhs)

Particulars	Year Ended 31st March, 2023	Year Ended 31st March, 2022
Revenue From Operations		
Sale of Products (Sale of Seeds)	19,690.53	20,581.48
Total :	19,690.53	20,581.48

Note : 26 : Other Income

(₹ in Lakhs)

Particulars	Year Ended 31st March, 2023	Year Ended 31st March, 2022
Interest Income	1,323.43	1,202.00
Grant Income	46.99	320.86
Other Non- Operating Income		
Dealership Application form fees	0.87	0.67
Tender Application form fees	0.15	0.68
Miscellaneous Income	26.03	31.73
Office Rent - Nadiad	2.63	2.63
Profit on sale of fixed assets	1.74	0.25
Sale of others	-	34.12
Sundry Balance Written Back	28.97	0.10
Adjustment on Account of Fair Valuation (Ind AS)	26.19	26.19
Allowances / Provision for :		
Provision Written back for Doubtful Debts	4.45	3.82
Total :	1,461.46	1,623.05

Note : 27: Cost of Materials consumed

(₹ in Lakhs)

Particulars	Year Ended 31st March, 2023	Year Ended 31st March, 2022
Opening Stock		
Packing Processing Materials	955.32	422.23
Add : Purchases		
Packing Processing Materials	258.64	950.64
Less : Closing Stock		
Packing Processing Materials	(659.09)	(955.32)
Total :	554.86	417.55

Note : 28 : Purchase of Stock in Trade

(₹ in Lakhs)

Particulars	Year Ended 31st March, 2023	Year Ended 31st March, 2022
Breeder Seeds	788.52	202.63
Foundation Seeds	2,810.11	1,552.73
Certified Seeds	13,016.30	13,640.01
General/ Label / Truthful Seeds	254.14	333.25
Notified Seeds	-	370.01
Total :	16,869.07	16,098.62

Note : 29 : Changes in Inventories of Finished goods, Work-in-Progress and Stock-in-trade

(₹ in Lakhs)

Particulars	Year Ended 31st March, 2023	Year Ended 31st March, 2022
Opening stock of seeds	4,482.73	4,069.08
Less :		
Closing Stock of Seeds	6,005.41	4,482.73
Total :	(1,522.68)	(413.65)

Note : 30 : Employee Benefit Expenses

(₹ in Lakhs)

Particulars	Year Ended 31st March, 2023	Year Ended 31st March, 2022
Salaries and Wages	866.18	777.59
Provident fund and other fund	111.93	98.40
Gratuity Expenses	35.56	35.87
Leave Encashment Expenses	6.72	49.87
Staff Welfare Expenses	7.66	5.44
Total :	1,028.06	967.17

Note : 31: Finance Costs

(₹ in Lakhs)

Particulars	Year Ended 31st March, 2023	Year Ended 31st March, 2022
Others:		
Interest expense on lease liabilities (Ind AS)	2.44	1.05
Interest expenses on Dealership Deposit (Ind AS)	26.13	23.97
Total :	28.57	25.02

Note : 32: Depreciation and Amortisation Expenses

(₹ in Lakhs)

Particulars	Year Ended 31st March, 2023	Year Ended 31st March, 2022
Total Depreciation	301.02	338.22
Less : Depreciation adjusted against deferred income Government Grant	(150.31)	(161.64)
Total :	150.71	176.58

Note : 33: Other Expenses

(₹ in Lakhs)

Particulars	Year Ended 31st March, 2023	Year Ended 31st March, 2022
A. Operational Expenses		
Carriage Inward including inter godown transfer & Others	215.49	205.90
Processing inspection and seed testing	142.75	222.36
Contractual Labour (Casual Labour)	119.80	118.97
Production Promotion Expenses	127.55	2.23
Rent for Godwon	46.31	52.21
Rent for Office and Sale Depot. Lease Rent for Land	0.03	0.51
Insurance Expenses- Seeds	44.32	53.74
Total (A)	696.24	655.92
B. Administration Expenses		
Rate and Taxes	5.36	5.42
Insurance Expenses - Others	14.89	2.45
Travelling Expenses	4.78	5.15
Repairs and Maintainance		
-Building	31.99	64.71
-Plant and Machinery	9.44	2.35
-Others	20.03	8.49
Vehicle Expenses (Including Vehicle hire, insurance and Repairing)	39.86	46.72
Director Sitting Fees	3.36	3.27
Electricity Expenses	23.57	19.48
Security Expenses	83.23	97.93
Outsource (Manpower Supply Services)	179.50	164.38
Loss on Sale of Fixed Assets	-	0.10
Donations	-	-
Remuneration to Auditors (Including GST)		
- Auditor fees	2.10	2.10
- Out of pocket expense	-	-
Internal Audit Fees (Including Out of Pocket expenses)	2.36	2.00
Pre Audit Fees (Including Out of Pocket expenses)	0.02	0.28
Bank Charges	0.36	-
Contribution towards Agri Pre-Vibrant Gujarat Event	-	200.00
Miscellaneous	99.10	111.43
Total (B)	519.93	736.27
C. Selling Expenses		
Freight Charges (Outward)	148.43	162.55
Advertisement & Publicity Expenses	2.25	2.92
Other Selling Expenses	-	18.51
Royalty Expenses	-	-
TDS Expenses	-	0.19
GST Expenses	-	-
Total (C)	150.68	184.18
D. Allowances and Write Off		
Allowances for bad and doubtful		
Trade Receivables	25.04	0.14
Total (D)	25.04	0.14
E. Expenses on Corporate Social Responsibility		
CSR Expenses	67.43	88.69
Total (E)	67.43	88.69
Total : (A+B+C+D+E)	1,459.33	1,665.21

Note : 34 : Remeasurement of Defined Benefit Plan - Other Comprehensive Income (OCI)

(₹ in Lakhs)

Particulars	Year Ended 31st March, 2023	Year Ended 31st March, 2022
Items that will not be reclassified to Profit and Loss		
Re-measurement losses on defined benefit plans	64.60	(6.51)
Income Tax on Re-measurement losses on defined benefit Plans	(16.26)	1.64
Total :	48.34	(4.87)

Note : 35 : Earnings per shares (EPS)

In determining Earnings per share, the company considers the Net profit after Tax. The number of shares used in computing Basic earnings per share is the weighted average number of equity shares outstanding during the year. The Dilutive Earnings per share is computed in case there is potential equity share involved during the year.

Particulars	Year Ended 31st March, 2023	Year Ended 31st March, 2022
Basic EPS (Amt in ₹)	505.00	602.00
Diluted EPS (Amt in ₹)	505.00	602.00

The following reflects the income and share data used in the basic EPS computations :

(₹ in Lakhs)

Particulars	Year Ended 31st March, 2023	Year Ended 31st March, 2022
Profit attributable to Equity Holders of the Corporation :		
Continuing operation	1,983.33	2,365.75
Discontinued operation	-	-
Profit attributable to equity holders for Basic Earning per shares	1,983.33	2,365.75
Interest on Convertible preference shares	-	-
Profit attributable to equity holders for the effect of dilution	1,983.33	2,365.75

The following reflects the weighted average No of shares used in the Basic EPS computation

Particulars	Year Ended 31st March, 2023	Year Ended 31st March, 2022
Weighted average number of Equity shares for basic EPS	3,93,000	3,93,000
Effect of dilution:	-	-
Share Options	-	-
Convertible preference charges	-	-
Weighted average number of Equity shares adjusted for the effect of dilution	3,93,000	3,93,000

NOTE: 36 NOTES FORMING PART OF ACCOUNTS, 2022-23**1. CSR Expenditure:**

- i) Gross Amount required to be spent by the Corporation during the year ₹ 84.17 lakhs (Previous Year ₹ 88.69 lakhs).
 ii) Amount spent during the year on: (₹ in Lakhs)

Description	Expenditure Incurred In Cash					
	2022-23			2021-22		
	In Cash	Deposited in unspent CSR Account	Total	In Cash	Deposited in unspent CSR Account	Total
(i) Construction/acquisition of any asset	0.00	0.00	0.00	0.00	0.00	0.00
(ii) On purposes other than (i) above	67.43*	0.00	67.43	88.69	0.00	88.69
TOTAL	67.43	0.00	67.43	88.69	0.00	88.69

* The amount of ₹ 16.74 lacs was sanctioned for F.Y. 2023-24 for an ongoing project mentioned at Sr. No. 3 in below table, Hence the same was not released till 31.03.2023. The same will be released in F.Y. 2023-24.

(b) Details of CSR amount spent against ongoing projects for the F.Y.. 2022-23:

(1)	(2)	(3)	(4)	(5)	(6)	(7)	(8)	(9)	(10)	(11)		
Sr No.	Name of the Project.	Item from the list of activities in Schedule VII to the Act	Local area (Yes/ No).	Location of the project.		Project duration..	Amount allocated for the project (in ₹.).	Amount spent in the current financial Year (in ₹.).	Amount transferred to Unspent CSR Account for the project as per Section 135(6) (in ₹.).	Mode of Implementation - Direct (Yes/No).	Mode of Implementation - Through Implementing Agency	
				State	District.						Name	CSR Registration number
1.	Establishment of Dialysis Centre	Point No. 1	Yes	Rajkot / Gujarat	2022-23 & 2023-24	40.00	40.00	0.00	No	Institute of Kidney Disease & Research Centre	-	
2.	Rehabilitation Project for mentally Disturbed College Students Program	Point No. 1	Yes	Ahmedabad/ Gujarat	2022-23 & 2023-24	5.00	00.00*	0.00	No	B. M. Institute of Mental Health	-	
3.	Fodder Production program using hydroponic technology	Point No. 4	Yes	Dahod/ Gujarat	2022-23 & 2023-24	33.55	00.00*	0.00	No	N. M. Sadguru Water & Development Foundation, Dahod	-	
4.	Establishment of Special Newborn Care Unit	Point No. 1	Yes	Morbi/ Gujarat	2022-23 & 2023-24	5.62	00.00*	0.00	No	Commissioner of Health, Medical Services & Medical Education	-	
	TOTAL					84.17	40.00	0.00				

* The funds were allocated to the implementing agencies, however the same are not utilized by the agencies as on 31.03.2023.

2. Contingent liabilities not provided for due to uncertainties of measurement and litigation outcome

(₹ in lakhs)

Sr. No.	Particulars	2022-23	2021-22
1	Estimated amount of contracts remaining to be executed on capital account (Net of Advance paid)	-	3.69
2	Claims against Corporation by suppliers and other constituents.	69.19	69.19
3	Disputed demand of Income tax as the Corporation expects to succeed in the appeal.	22.54*	22.54
4	Claims of certain employees as to the reinstatement, back wages and allowance etc. are pending against the corporation.	See Note No. 4	

* The amount of disputed demand of ₹ 22.54 lakhs is already adjusted by Income Tax Dept. from the refund of succeeding assessment years.

3. There are certain court cases against the Corporation filed by the employees/ex-employees. The amount payable, if any, can be ascertained only after the final outcome of the court case. Necessary adjustments in the accounts, if required, will be made based on the outcome of such cases in the respective year.
4. Other current assets – Advance to staff include an amount of ₹ 6.00 lakhs (P.Y. ₹ 6.00 lakhs) misappropriated by an employee (on 18.06.2001) of the Corporation in the financial year 2001-2002 against which Court case is pending. The amount is fully provided for.
5. In the opinion of the management no provision is required to be made for impairment of assets in accordance with the provisions of Indian Accounting Standard 36 on impairment of assets issued by The Institute of Chartered Accountants of India.
6. The Company has only one business and geographical segment. Hence, disclosure of segmental figures as required to be disclosed as per Indian Accounting Standard 108 on Segmental Reporting as issued by The Institute of Chartered Accountants of India is not applicable.
7. Some persons have withdrawn an amount of ₹ 96.78 lakhs from Corporation's Current Bank Account No. 56228049169 with State Bank of India, Gandhinagar during the period from 21.08.2009 to 29.08.2009 by issuing 8 differences duplicate cheques with forged signatures of officers of the Corporation. The Corporation has filed FIR No. 481/09 dated 02.09.2009 with Navrangpura Police Station, Ahmedabad. The crime Branch Ahmedabad has taken up the investigation. ₹ 19.20 lakhs have been recovered from the Accounts where the funds were diverted and the matter is still under investigation. The Corporation has launched a claim against the State Bank of India for re-instatement of funds i.e., an amount of ₹ 96.78 lakhs as prima facie it is noticed that there has been negligence on the part of the bank in honouring duplicate cheques. CID Crime branch had arrested Shri Mayur Krushnalal Joshi, LDC of the Corporation for his direct involvement in the fraud. Corporation has suspended Shri Mayur Krushnalal Joshi, LDC on 05.10.2009 based on CID crimes report. The difference amount of ₹ 77.58 lakhs is shown under Note 15 as "Other Current Assets". However, since a part of these funds have been recovered by the police and the Corporation is hopeful of recovering the balance amount, no provision for the same has been made in the books of account. The Corporation vide High Court Order/ Appeal No. 450 of 2020 Dated 04.02.2020 was awarded 50% of amount outstanding, i.e., ₹ 38.79 lakhs. However, both the parties to the appeal, i.e., the Corporation and State Bank of India had made a further appeal to this order and the matter is still in further litigation.
8. The Corporation has entered into agreement with Mahyco Monsanto Biotech (India) Pvt. Ltd. for use of BT technology for its Cotton Seeds. As part of the agreement ₹ 55.67 lakhs was to be paid as license fee in two instalments. The first instalment was paid on 26.07.2011 & the second instalment was paid on 19.06.2013. The whole amount was capitalized on 19.06.2013 and proportionate depreciation is provided in the current year based on the tenure of the agreement of 10 years.
9. During the year the excess provision for doubtful debts of ₹ 4.45 lakhs (P.Y. ₹ 3.82 Lakhs) has been written back.
10. During the financial year 2021-22 order have been received from Government of Gujarat vide Letter No. ૫૨૨૫/1121/492/ M-3 dt. 20/01/2022 to contribute ₹ 200.00 lakhs towards Agri Pre-Vibrant Gujarat Event. The said contribution has been made during the financial year 2021-22 as per the Government order and which have been shown under Note No. 33 - Other Expenses. Further, the Corporation has also received ₹ 105.47 lacs from other various government institutions for payment towards various expenses of the Agri Pre Vibrant Gujarat Event in financial year 2021-22 and said funds have been utilized for the event as per order received from Government of Gujarat during the year. However, ₹ 78.83 Lakhs (P.Y: ₹ 95.24 lakhs) remaining unspent out of funds received are shown as liability under Note 23 – Other Current Liabilities. The same is payable on receipt of the payment order from the Govt. of Gujarat, as and when payment order is received.

11. Related Party Disclosures

A. Key Managerial Personnel of the entity

Name	Position
Shri. Manish Bharadwaj (from 07.11.2020 to 08.03.2022)	Chairman
Shri. Mukesh Puri (from 09.03.2022 to 29.04.2023)	Chairman
Shri Amarendra K. Rakesh (from 29.04.2023 till date)	Chairman
Shri P. S. Rabari	Managing Director
Shri K.M. Raval	Company Secretary
Shri S.N. Deora	Manager (Finance)

Disclosure of transaction with related party**B. Compensation of key managerial personnel**

(₹ In Lakhs)

Particulars	Year ended 31/03/2023	Year ended 31/03/2022
Shri. Manish Bharadwaj (Chairman)	-	-
Shri. Mukesh Puri (Chairman)	-	-
Shri. A.K. Rakesh (Chairman)	-	-
Shri P.S. Rabari (MD)	23.41	20.25
Shri K.M. Raval (Company Secretary)	18.79	14.51
Shri S.N. Deora (Manager (Finance))	18.54	13.98

C. Details of remuneration to KMP

(₹ In Lakhs)

Particulars	Year ended 31/03/2023	Year ended 31/03/2022
Short-term employee benefits	60.74	48.74
Post-Employment Benefits	9.32	8.67
Other long-term benefits	-	-
Termination Benefits	-	-

D. Transaction with government entities

(₹ In Lakhs)

Particulars	Year ended 31/03/2023	Year ended 31/03/2022
GSFS		
Funds Deposited	33,326.41	35,800.00
Funds Withdrawn	31,318.93	34,600.00
Interest Received	700.31	442.87

Apart from the above transactions, the corporation has also entered into other transactions in ordinary course of business with government related entities. These are transacted at arm's length prices on agreed contractual terms.

12. In the opinion of the management, the current assets, loans and advances are approximately of the value stated, if realized in the ordinary course of business except doubtful debts & advances. All known ascertainable liabilities have been accounted for in full, in the books of account except those stated otherwise.
13. An amount of ₹ 543.96 lakhs (P.Y. ₹ 412.38 lakhs) remaining unpaid out of government grants received as nodal agency, on account of stale/date bar cheques and RTGS return due to incorrect bank details, is shown under Other Current Liabilities (Note 23 - Other Current Liabilities). The same is paid after due verification of the claim received for repayment of the unpaid amount.
14. **Disclosure as per Ind-AS-19:**

a. Defined benefit towards Provident Fund:

(₹ in lakhs)

Particulars	31/03/2023	31/03/2022
Employer's Contribution to Provident Fund	70.62	60.99
Employer's Contribution to Family Pension Fund	10.50	11.46
Employer's Contribution to National Pension System	10.28	5.58

b. Defined contribution towards Gratuity:

The following table sets out the status of gratuity scheme plans as at 31st March, 2023.

(₹ in lakhs)

Particulars	Gratuity (Funded)	
	As at 31-03-2023	As at 31-03-2022
Change in present value of the defined benefit obligation during the year		
Present value of obligation as at the beginning of the year	555.75	511.31
Interest Cost	35.00	33.89
Current Service Cost	43.51	45.20
Benefits Paid	(58.06)	(40.25)
Past Service Cost	0.00	0.00
Actuarial (Gain)/Loss on arising from Change in Demographics	0.00	(0.44)
Actuarial (Gain)/Loss on arising from Change in Financial Assumption	(23.61)	(2.46)
Actuarial (Gain)/Loss on arising from Experience Adjustment	(39.37)	8.50
Present value of obligation as at the end of the year	513.22	555.75
Change in fair value of plan assets during the year		
Fair Value of plan assets at the beginning of the year	648.54	646.49
Interest Income	42.95	43.22
Contributions by the employer	18.42	0.00
Benefits paid	(58.06)	(40.25)
Other Cost	0.00	0.00
Return on plan assets	1.62	(0.92)
Fair Value of plan assets at the end of the year	653.47	648.54
Net Asset/ (Liability) recorded in the Balance Sheet		
Present value of obligation as at the end of the year	(513.22)	(555.75)
Net Asset/ (Liability) - Current	140.25	92.79
Expenses recorded in the Statement of Profit & Loss during the year		
Interest Cost	(7.95)	(9.33)
Current Service Cost	43.51	45.20
Past Service Cost	0.00	0.00
Actuarial (Gain)/Loss on arising from Change in Financial Assumption	0.00	0.00
Actuarial (Gain)/Loss on arising from Experience Adjustment	0.00	0.00
Total expenses included in employee benefit expenses	35.56	35.87
Recognized in Other Comprehensive Income during the year		
Actuarial Gain/(Loss) on obligation for the period	(62.98)	5.59
Return on plan assets Excluding Interest	(1.62)	0.92
Recognized in Other Comprehensive Income	64.60	6.51

The following are the expected benefit Payments for the defined benefit Plan:

(₹ in lakhs)

Particulars	Gratuity (Funded)	
	For the year ended 31st March, 2023	For the year ended 31st March, 2022
Within 12 months of the reporting period	84.41	104.12
Between 2 and 5 years	180.57	180.77
Between 6 and 10 years	222.45	205.13
More than 10 years	-	-

The assumptions used are summarized in the following table:

(₹ in lakhs)

Particulars	Gratuity (Funded)	
	As at 31-03-2023	As at 31-03-2022
Discount rate (per annum)	7.45%	6.95%
Future salary increases	8.00%	8.00%
Expected rate of return on plan assets	7.45%	6.95%
Mortality Rates	Indian Assured Lives Mortality (2012-14)	Indian Assured Lives Mortality (2012-14)

Quantitative Sensitivity Analysis for significant assumption is as below:

(₹ in lakhs)

Particulars	Gratuity (Funded)	
	For the year ended 31st March, 2023	For the year ended 31st March, 2022
One percentage point increase in discount rate	(41.53)	(44.81)
One percentage point decrease in discount rate	49.42	53.90
One percentage point increase in salary increase rate	10.35	12.92
One percentage point decrease in salary increase rate	(10.91)	(17.43)
One percentage point increase in rate of employee turnover	1.90	1.29
One percentage point decrease in rate of employee turnover	(1.93)	(1.31)

The expected contribution for next reporting period is as under:

(₹ in lakhs)

Particulars	Gratuity (Funded)	
	As at 31-03-2023	As at 31-03-2022
Expected contribution to the defined benefit plan for the next reporting period (Gratuity)	35.39	43.09

c. Other long term benefit towards Leave encashment :

The following table sets out the status of Leave encashment as at 31st March, 2023.

(₹ in lakhs)

Particulars	Leave Encashment (Funded)	
	As at 31-03-2023	As at 31-03-2022
Change in present value of the defined benefit obligation during the year		
Present value of obligation as at the beginning of the year	395.09	343.41
Interest Cost	26.14	23.01
Current Service Cost	13.14	8.78
Benefits Paid	(38.02)	(19.59)
Past Service Cost	0.00	0.00
Actuarial (Gain)/Loss on arising from Change in Demographics	0.00	0.04
Actuarial (Gain)/Loss on arising from Change in Financial Assumption	(24.18)	(2.33)
Actuarial (Gain)/Loss on arising from Experience Adjustment	15.68	41.77
Present value of obligation as at the end of the year	387.85	395.09
Change in fair value of plan assets during the year		
Fair Value of plan assets at the beginning of the year	326.24	289.10
Interest Income	21.70	20.49
Contributions by the employer	41.86	35.33
Benefits paid	(38.02)	(19.59)
Other Cost	0.00	0.00
Return on plan assets	2.36	0.91
Fair Value of plan assets at the end of the year	354.14	326.24
Net Asset/ (Liability) recorded in the Balance Sheet		
Present value of obligation as at the end of the year	(387.85)	(395.09)
Net Asset/ (Liability) – Current	(33.71)	(68.85)
Expenses recorded in the Statement of Profit & Loss during the year		
Interest Cost	4.44	2.53
Current Service Cost	13.14	8.77
Past Service Cost	0.00	0.00
Actuarial (Gain)/Loss on arising from Change in Financial Assumption	(24.18)	(2.33)
Actuarial (Gain)/Loss on arising from Change in Demographic assumption	-	0.04
Actuarial (Gain)/Loss on arising from Experience Adjustment	15.68	41.76
Return on plan assets	(2.36)	(0.91)
Total expenses included in employee benefit expenses	6.72	49.87

The following are the expected benefit Payments for the defined benefit Plan:

(₹ in lakhs)

Particulars	Leave Encashment (Funded)	
	For the year ended 31st March, 2023	For the year ended 31st March, 2022
Within 12 months of the reporting period	41.51	52.87
Between 2 and 5 years	99.36	91.77
Between 6 and 10 years	142.07	125.05
More than 10 years	-	-

The assumptions used are summarized in the following table:

(₹ in lakhs)

Particulars	Leave Encashment (Funded)	
	As at 31-03-2023	As at 31-03-2022
Discount rate (per annum)	7.45%	6.95%
Future salary increases	8.00%	8.00%
Expected rate of return on plan assets	7.45%	6.95%
Mortality Rates	Indian Assured Lives Mortality (2012-14)	Indian Assured Lives Mortality (2012-14)

Quantitative Sensitivity Analysis for significant assumption is as below:

(₹ in lakhs)

Particulars	Leave Encashment (Funded)	
	For the year ended 31st March, 2023	For the year ended 31st March, 2022
One percentage point increase in discount rate	(41.86)	(42.00)
One percentage point decrease in discount rate	50.89	51.37
One percentage point increase in salary increase rate	48.08	50.30
One percentage point decrease in salary increase rate	(40.41)	(41.98)
One percentage point increase in rate of employee turnover	(1.35)	(1.65)
One percentage point decrease in rate of employee turnover	1.36	1.66

The expected contribution for next reporting period is as under:

(₹ in lakhs)

Particulars	Leave Encashment (Funded)	
	As at 31-03-2023	As at 31-03-2022
Expected contribution to the defined benefit plan for the next reporting period (Leave Encashment)	9.41	10.03

15. Leases**A. Right-of-Use Assets and Lease Liabilities (Ind-AS 116)**

The Corporation has taken on lease certain office spaces. These leases generally have lease terms between 1 to 3 years.

The Corporation has adopted Ind-AS 116 "Leases", effective 1 April, 2020 using the modified retrospective method in respect of its leases. The Corporation has applied the 'Short-term lease' and 'Lease of Low-value assets' recognition exemptions for its eligible lease contracts.

Details of amount recognized in the financial for the year are as follows:

- a. (i). Set out are the carrying amounts of right-of-use assets (RoU) recognised:

		(₹ in Lakhs)
Particulars	Amount	
As at 1st April, 2021	10.55	
Additions	10.60	
Depreciation expense	(11.79)	
As at 31st March, 2022	9.36	

- (ii). Set out are the carrying amounts of right-of-use assets (RoU) recognised:

		(₹ in Lakhs)
Particulars	Amount	
As at 1st April, 2022	9.36	
Additions	21.91	
Depreciation expense	(10.64)	
As at 31st March, 2023	20.63	

- b. (i). Set out are the carrying amounts of lease liabilities:

		(₹ in Lakhs)
Particulars	Amount	
As at 1st April, 2021	11.42	
Additions	10.60	
Accretion of interest	1.05	
Payments	(13.48)	
As at 31st March, 2022	9.59	

- (ii). Set out are the carrying amounts of lease liabilities:

		(₹ in Lakhs)
Particulars	Amount	
As at 1st April, 2022	9.59	
Additions	21.91	
Accretion of interest	2.44	
Payments	(12.21)	
As at 31st March, 2023	21.73	

The effective interest rate for lease liabilities is 9%, with maturity between financial years 2021-2026.

The following are the amount recognised in the profit and loss account in F.Y. 2021-22:

(₹ in Lakhs)

Particulars	Amount
Depreciation of Right-to-Use assets (Note 3)	11.79
Interest expense on lease liabilities (Note 31)	1.05
Expense relating to short-term leases and leases of low value assets (Note 33)	52.21

The following are the amount recognised in the profit and loss account F.Y. 2022-23:

(₹ in Lakhs)

Particulars	Amount
Depreciation of Right-to-Use assets (Note 3)	10.64
Interest expense on lease liabilities (Note 31)	2.44
Expense relating to short-term leases and leases of low value assets (Note 33)	46.31

The Table below provides details regarding the contractual maturities of lease liabilities as at March 31, 2023 on an undiscounted basis :

Undiscounted lease payable	(Amount in ₹ Lakhs)	
	As at 31st March, 2023	As at 31st March, 2022
Less than one year	12.22	2.64
Between one and five years	11.96	9.02
More than five years	-	-

B. Operating Leases

Corporation as Lessor:

Future lease rental receivables are determined on the basis of monthly lease payments. Lease income recognised in the Statement of Profit and Loss in FY 2022-23: ₹ 2.63 lakhs (FY 2021-22: ₹ 2.63 lakhs).

The future minimum lease rental receivables under all operating leases are as follows:

Future minimum lease receivable	(Amount in ₹ Lakhs)	
	As at 31st March, 2023	As at 31st March, 2022
Less than one year	2.63	2.63
Between one and five years	-	-
More than five years	-	-

Corporation as Lessee:

Other significant operating leasing arrangements of Corporation is in respect of godowns. These lease agreements are having lease term of up to a maximum of 12 months and is usually renewable by mutual consent on mutually agreeable terms. Therefore, the said lease is accounted for as "Short term lease" as per Ind AS 116 and no Right-to-use (ROU) asset is created thereto. The amount payable in respect of such Short-Term Lease is ₹ 46.31 Lakhs (Previous Year: ₹ 52.21 Lakhs).

16. Derivative Instruments and Exposure Not Hedged

The company does not have any foreign currency exposure in respect of trade receivable and trade payables as on 31.03.2023 and 31.03.2022, hence outstanding exposure in respect of foreign exchange derivatives and foreign currency exposure not hedged as on 31.03.2023 and 31.03.2022 is not applicable.

17. Financial Instruments - Accounting Classifications and Fair Value Measurement

The fair values of the financial assets and liabilities are included at the amount at which the instrument could be exchanged in a current transaction between willing parties, other than in a forced or liquidation sale.

The following methods and assumptions were used to estimate the fair values:

1. Fair values of cash and short term deposits, trade and other short term receivables, trade payables, other current liabilities approximate their carrying amounts largely due to short-term maturities of these instruments.
2. Financial instruments with fixed and variable interest rates are evaluated by the Company based on parameters such as interest rates and individual credit worthiness of the counterparty. Based on the evaluation, allowances are taken to account for the expected losses of these receivables.

The company uses the following hierarchy for determining and disclosing the fair values of financial instruments by valuation technique:

- Level 1:** Quoted prices (unadjusted) in active markets for identical financial instruments that the entity can access at the measurement date.
- Level 2:** The fair value of financial instruments that are not traded in an active market is determined using valuation techniques which maximize the use of relevant observable market input and minimize use of unobservable inputs.
- Level 3:** If one or more of the significant inputs is not based on observable market input, the instrument is categorized in level 3 of fair value hierarchy

II. Figures as at March 31, 2022

(₹ in Lakhs)

Financial Instrument	Note No.	Carrying Amount					Fair value			
		FVTPL	FVOCI	Total Fair Value	Amortised Cost	Total	Level 1	Level 2	Level 3	Total
Non-Current Assets										
Financial Assets										
(i) Other Financial Asset	7	-	-	-	9.50	9.50	-	-	-	-
Current Assets										
Financial Assets										
(i) Investment	10	-	-	-	23,300.00	23,300.00	-	-	-	-
(ii) Trade Receivables	11	-	-	-	3,745.33	3,745.33	-	-	-	-
(iii) Cash and Cash Equivalents	12	-	-	-	10,701.03	10,701.03	-	-	-	-
(iv) Other financial assets	13	-	-	-	685.17	685.17	-	-	-	-
					38,441.03	38,441.03	-	-	-	-
Non-Current Liabilities										
Financial Liabilities										
(i) Other Financial liabilities	19	-	-	-	290.29	290.29	-	-	-	-
Current Liabilities										
Financial Liabilities										
(i) Trade Payables	21	-	-	-	2,100.32	2,100.32	-	-	-	-
(ii) Other Financial Liabilities	22	-	-	-	93.00	93.00	-	-	-	-
					2,193.32	2,193.32	-	-	-	-

I. Figures as at March 31, 2023

(₹ in Lakhs)

Financial Instrument	Note No.	Carrying Amount					Fair value			
		FVTPL	FVOCI	Total Fair Value	Amortised Cost	Total	Level 1	Level 2	Level 3	Total
Non-Current Assets										
Financial Assets										
Other Financial Asset	7	-	-	-	11.65	11.65	-	-	-	-
Current Assets										
Financial Assets										
(i) Investment	10	-	-	-	25,307.48	25,307.48	-	-	-	-
(ii) Trade Receivables	11	-	-	-	4,367.64	4,367.64	-	-	-	-
(iii) Cash and Cash Equivalents	12	-	-	-	6,615.14	6,615.14	-	-	-	-
(iv) Other financial assets	13	-	-	-	434.84	434.84	-	-	-	-
					36,736.75	36,736.75	-	-	-	-
Non-Current Liabilities										
Financial Liabilities										
(i) Other Financial liabilities	19	-	-	-	297.41	297.41	-	-	-	-
Current Liabilities										
Financial Liabilities										
(i) Trade Payables	21	-	-	-	1,954.59	1,954.59	-	-	-	-
(ii) Other Financial Liabilities	22	-	-	-	124.75	124.75	-	-	-	-
					2,079.34	2,079.34	-	-	-	-

18. Financial Risk Management

The corporation's principal financial liabilities comprise of Trade payables and other financial liabilities - dealership deposits. The corporation does not have any borrowings in any form. The purpose of financial liabilities incurred is to finance operations of the corporation and provide guarantees to support its operation. The corporation's financial assets comprise of Investments, Trade Receivables, Cash and Cash equivalents and other financial assets which include subsidy receivable, recoverables from staff and other receivables that directly derive from its operations. The corporation is exposed to various risk as enumerated below. The corporation's financial risk activities are governed by appropriate policies and procedures and that financial risks are identified, measured and managed in accordance with corporation's policies and risk objectives. The Board of Directors reviews and agrees policies for managing each of these risk which are summarised as under:

Market risk

Market risk is the risk that the fair value of future cash flows of a financial instrument will fluctuate because of changes in market prices. Market risk comprises two types of risk: interest rate risk and currency risk. Financial instruments affected by market risk include investments.

The objective of market risk management is to avoid exposure in our foreign currency transactions and interest rate risk.

Interest rate risk

Interest rate risk is the risk that the fair value or future cash flows of a financial instrument will fluctuate because of changes in market interest rates. The Company's exposure to the risk of changes in market interest rates relates primarily to the Corporations' financial liabilities with floating interest rates.

The Corporation manages its interest rate risk by having a balanced portfolio. Further, the corporation has no fixed nor variable interest rate borrowings.

Currency Risk

There exists no Currency Risk as the Corporations' primary business activities are within India and does not have any exposure in foreign currency.

Credit risk

Credit risk is the risk of financial loss to the Company if a customer or counterparty to a financial instrument fails to meet its contractual obligations, and arises principally from the Company's receivables from customers, counterparties to the derivative contract, bank balances, investment securities and other receivables. Credit risk is managed through credit approvals and continuous monitoring in the normal course of business. The Company establishes an allowance for doubtful debts and impairment that represents its estimate of expected credit losses in respect of trade and other receivables.

The maximum exposure to credit risk in case of all the financial instruments covered below is restricted to their respective carrying amount.

I. Financial assets for which loss allowance is measured using 12 months Expected Credit Losses (ECL) (₹ in Lakhs)

Particulars	As at 31.3.2023	As at 31.3.2022
Non-current financial assets - Others	11.65	9.50
Current financial assets - Others	434.84	685.17
Other current assets	335.16	374.18
Total:-	781.65	1,068.85

II. Financial assets for which loss allowance is measured using 12 months Life Time Expected Credit Losses (ECL) (₹ in Lakhs)

Particulars	As at 31.3.2023	As at 31.3.2022
Trade Receivables	4,367.64	3,745.33
Total:-	4,367.64	3,745.33

Balances with banks are subject to low credit risks due to good credit ratings assigned to these banks.

III. The ageing analysis of these receivables (net of provision) has been considered from the date the invoice falls due (₹ in Lakhs)

Particulars	As at 31.3.2023	As at 31.3.2022
Up to 6 months	3,543.11	1,946.53
6 months to 1 year	462.10	1,513.50
1 year to 3 years	371.43	285.30
More than 3 years	0.00	0.00
Total:-	4,367.64	3,745.33

IV. Provision for expected credit losses again "II" and "III" above

The company has assets where the counter- parties have sufficient capacity to meet the obligations and where the risk of default is very low. Hence based on historic default rates, the Company believes that, no expected credit loss is necessary in respect of above mentioned financial assets.

Liquidity Risk

Liquidity risk is the risk that the Corporation will encounter difficulty in meeting the obligations associated with its financial liabilities that are settled by delivering cash or another financial asset. The Corporation's approach to managing liquidity is to ensure, as far as possible, that it will have sufficient liquidity to meet its liabilities when they are due, under both normal and stressed conditions, without incurring unacceptable losses or risking damage to the Corporation's reputation.

The Corporation monitors its risk of shortage of funds. The Corporations' objective is to maintain a balance between continuity of funding and flexibility through the use of available credit facilities. The Corporation has access to a sufficient variety of sources of funding and liabilities maturing within 12 months can be rolled over with existing lenders helping it maintain adequate liquidity.

Maturity profile of financial liabilities

The table below provides details regarding the remaining contractual maturities of financial liabilities at the reporting date based on contractual undiscounted payments.

Particulars	As at 31-03-2023 (₹ In lakhs)			As at 31-03-2022 (₹ In lakhs)		
	Less than 1 year	1 to 5 years	Total	Less than 1 year	1 to 5 years	Total
Non-current financial liabilities - Others	-	297.41	297.41	-	290.29	290.29
Current financial liabilities - Trade Payables	1,954.59	-	1,954.59	2,100.32	-	2,100.32
Current financial liabilities - Others	124.00	-	124.00	93.00	-	93.00
Total:-	2,079.34	297.41	2,376.75	2,193.32	290.29	2,483.61

Capital management

The corporation's objective when managing capital is to ensure the going concern operation and to maintain an efficient capital structure to reduce the cost of borrowings, support the corporate strategy and meet shareholder expectations. The policy of the Corporation is to borrow through banks / financial institutions supported by committed borrowing facilities to meet anticipated funding requirements. However, no such borrowings were required to be raised.

The capital structure is governed by policies approved by the Board of Directors and funding requirements are reviewed periodically.

The company monitors capital using gearing ratio, which is total debt divided by total capital plus debt.

As the company does not have any Debt, gearing ratio is NIL as on 31st March, 2023 and 31st March, 2022. (₹ in Lakhs)

Particulars	As at 31.3.2023	As at 31.3.2022
Total Debt	-	-
Equity	33,850.09	31,913.14
Capital and Total debt	33,850.09	31,913.14
Gearing ratio	0.00%	0.00%

19. An amount of ₹ 8.72 lakhs (P.Y. NIL) from other non-current liabilities (Note 20) and ₹ 19.81 lakhs (P.Y. NIL) from other current liabilities (Note 23) are written back since the same were carried forward since long in the books of accounts and the comments being issued by C&AG through Management Letter.

20. Details of Benami Property, if any, held and proceedings thereon

There are no benami properties held by the Corporation and therefore no proceeding has been initiated or pending against the Corporation under Benami Transactions (Prohibition) Act, 1988 as on reporting date.

21. Wilful Defaulter

The Corporation has not been declared a wilful defaulter by any bank or financial institution or any other lender.

22. Relationship with struck off companies

The Corporation has not entered into any transaction or having any pending transaction with company whose name is struck off under Section 248 of Companies Act, 2013 or Section 560 of Companies Act, 1956.

23. Registration of charges or satisfaction with Registrar of Companies (ROC)

There are no charges or satisfaction which is yet to be registered with Registrar of Companies (ROC) beyond the prescribed period.

24. Compliance with number of layers of companies

The Corporation has not made any investment in any other company and therefore the rules prescribed under clause (87) of section 2 of the Act read with the Companies (Restriction on number of Layers) Rules, 2017 are not applicable to the company.

25. Utilisation of borrowed funds and share premium

The Corporation has not advanced or loaned or invested funds - either borrowed funds or share premium or any other sources or kind of funds to any other person or entity, including foreign entities (Intermediaries) with an understanding that the Intermediary shall:

- (i) directly or indirectly lend or invest in other persons or entities identified in any manner whatsoever by or on behalf of the company or
- (ii) provide any guarantee, security or the like to or on behalf of the company.

The Corporation has not received any fund from any person or entity, including foreign entities (Funding Party) with the understanding that the company shall:

- (i) directly or indirectly lend or invest in other persons or entities identified in any manner whatsoever by or on behalf of the Funding Party (Ultimate Beneficiaries) or
- (ii) provide any guarantee, security or the like to or on behalf of the Ultimate Beneficiaries.

26. Disclosure in related to undisclosed income

There is no transaction that has not been recorded in the books of accounts and has been surrendered or disclosed as income during the year in the tax assessments under the Income Tax Act, 1961.

27. Details of Crypto currency or Virtual Currency

The Corporation has not traded or invested in any crypto currency or virtual currency during the financial year.

28 : Ratios

Ratio	Numerator	Denominator	2022-23	2021-22	Variaton in %	Reason if variation exceeds 25%
Current Ratio (in times)	Total Current Assets	Total Current liabilities	3.84	3.16	(21.51)%	-
Debt-Equity Ratio (in times)	Debt consists of Borrowing and lease liabilities	Total Equity	0.00	0.00	-	-
Debt Service Coverage Ratio (in times)	Earning for debt servies = Net Profit after taxes + Non cash operating expenses+Interest+ Other than non-cash adjustments	Debt service = Interest and lease payments+ Principal Repayments	0.00157	0.00183	(14.27)%	-
Return on equity ratio (in %)	Profit for the year	Average total equity	5.88%	7.71%	(23.67)%	-
Net Capital turnover ratio (in times)	Revenue from operations	Average working capital (i.e Total Current assets less Total current liabilities)	0.61	0.67	(9.92)%	-

Inventory turnover sold Ratio (in times)	Cost of Goods	Average Inventory	2.54	3.16	(19.73)%	-
Trade receivables turnover ratio (in times)	Net credit sales	Average Trade receivables	4.85	5.13	(5.30)%	-
Net Profit Ratio (in%)	Profit for the year	Revenue from operations	9.83%	11.52%	(14.68)%	-
Return on capital employed (in%)	Profit before tax and finance costs	Capital employed= Net worth+Lease liabilities+Deferred tax liabilities	7.71%	10.32%	(25.24)%	Significant increase in lease liabilities
Return on Investment (in%)	Income generated from invested funds	Average invested funds in treasury investments	5.45%	5.30%	2.84%	-

29. Previous year's figures have been regrouped/re-classified/re-arranged, wherever necessary, to make them comparable with those of the current year. The following table presents details of previous year figures regrouped or reclassified to conform current year's classification.

(₹ in Lakhs)

Financial Statement Line Item Affected (Profit and Loss)	As per 31st March, 2022		
	Earlier presented amount	Reclassification / regrouped amount	Restated Amount in current year's comparative
Revenue			
(I.) Revenue from Operations	20,902.34	(320.86)	20,581.48
(II) Other Income	1,302.19	320.86	1,623.05

30. Balance of debtors, creditors, loans and advances, grants, subsidies, etc. are subject to confirmations and reconciliations.

31. A prior period adjustment of ₹0.00 (P.Y. ₹ 4.03 lakhs) has been made. (Refer Note 17)

**As per our report of even date annexed
For, Mukeshkumar Jain & Co.**

Chartered Accountants
Firm No. 106619W

Rajit Tilani (Partner)
Membership No. 405662
UDIN: 23405662BGUNPQ2207

**Place : Ahmedabad
Date : 26/09/2023**

For and on behalf of Board of Directors

A. K. Rakesh, I.A.S
Chairman
(DIN : 0063819)

S. N. Deora
Manager (Finance)

P. S. Rabari
Managing Director
(DIN : 8996765)

K. M. Raval
Company Secretary

**Place : Gandhinagar
Date : 26/09/2023**



ગુરાબીનિ®

Gujarat State Seeds Corporation Limited

**Registered Office : "Beej Bhavan" Sector-10/A,
Gandhinagar-382 010 Email : info@gurabini.com
Website : www.gurabini.com**